


for R 15580


SUPP. GO224/e
Part 2

HITO PADEEA

LIS 39197

Githa for + R
36 SW + T
2 part
8 Aug 28





HITOPADESAS

ID EST

INSTITUTIO SALUTARIS.

TEXTUM CODD. MSS. COLLATIS RECENSUERUNT
INTERPRETATIONEM LATINAM ET ANNOTATIONES CRITICAS

ADIECERUNT

AUGUSTUS GUILELMUS A SCHLEGEL
ET
CHRISTIANUS LASSEN.

PARS II.

COMMENTARIUM CRITICUM TENENS.

BONNAE AD RHENUM

TYPIS REGIIS

MDCCCXXXI.

PROSTAT APUD EDUARDUM WEBER.
BIBLIOPOLAM BONNENSEM.




CHRISTIANI LASSENII

COMMENTARIUS CRITICUS

IN

HITO PADESAM.



CHRISTIANUS LASSEN

LECTURIS

S. P. D.

Editurus demum hoc criticarum in Hitopadesam annotationum volumen non citra necessitatem lectores morabor neque ea repetam, quae accurate et eleganter, ut solet, de suppellectili critica, qua instructi ad textum recensendum nos accinximus, in praefatione ad primam nostrae editionis partem disseruit SCHLEGELIUS, vir summus, cui socium in hoc opere exsequendo adiunctum memet fuisse, gloriarer sane, nise ipse sentirem, quam multum in hac consociatione eius humanitati et erga me benevolentiae sit tribuendum, quam parum dignitati meae. De codicibus igitur, editionibus et interpretationibus fabularum Anglicis verba denuo facere supersedeo; neque opus est hic ea repetere, quae isto loco in universum disputata sunt de criticis, quas in

textu emendando secuti sumus, rationibus. Id significantum est, quo equidem consilio in hoc annotandi negotio usus sim.

Ac potissimum quidem hoc mihi erat propositum, ut plene exhiberem et accurate scripturae discrepantiam, tum in editis libris, tum in manuscriptis obviam, ne levissimis quidem varietatibus aut manifestis sive librariorum lapsibus sive editorum erroribus silentio praetermissis. Quam legem in codicibus religiosius tenui, quam in editionibus, siquidem magnopere interest inter utriusque generis varias lectiones. Quanta cum incuria atque inscientia in negotio suo versatus sit editor Calcuttensis pariter atque Hayleyburiensis, nunc ex enotatis et hoc commentario consignatis utriusque peccatis satis superque apparebit; menda autem e sola negligentia orta nil fere habent ponderis in vera scriptura e depravata quadam lectione elicienda, neque ita magnopere refert scire, quae inscitiae specimina edere non vitaverit editor quidam in monumentis antiquitatis summa diligentia et religione quasi quadam tractandis leviter et, ut ita dicam, impie versatus. Aliter autem res se habet in varia codicum scriptura quamvis vitiosa. In hac enim saepenumero comparent vestigia, e quibus genuina scribendi ratio elici et textui redi tuto potest. Sunt deinde quidam constantes librariorum errores, aut e corrupta profecti hodierna pronuntiatione, qua litterae nonnullae probe distinguendae con-

funduntur inter se et permuntantur, aut orti e laxiore et rationes linguae obscurante ac paene evertente recentiorum grammaticorum doctrina, si doctrinae nomine ita abutit licet *). Hos autem probe cognoscere admodum refert, si aut libros manuscriptos evolvere velis, aut uti editionibus in ipsa India a Panditis quos dicunt profectis. Operae pretium igitur et summopere e litteris Indicis severiore philologica ratione tractandis esse existimavi, si negotio molesto sane et taedii aerumnosi pleno haud exiguam curam adhiberem. Quam fastidient fortasse ii, qui neglectis hisce minutis statim ad altioris indaginis quaestiones evolare et speciosae eruditionis laudes facili conatu arripere cupiunt; laudabunt ii, qui didicerint, philologicam disciplinam et quae ab ea pendeat, antiquitatis scientiam, permultis minutulis quaestionibus carere neutiquam posse.

Explicare oportuit rationes, propter quas tantum diligentiae posui in mendis librorum repetendis. Verum aliud genus est variae scripturae, mendosum vel id quoque, sed quod diligenter excutere et ego debui et omnes debent, qui iustum textus cuiusdam editionem adornare aggrediuntur. Saepius nimirum aut substituunt libri singula vocabula,

*) Qualis est regula ista a Wilstone in praefat. ad Lexic. Sanscr. p. XLII laudata:
रुलयोडलयोस्तद्यथयोर्बक्योरुपि । प्रस्तयोर्मनयोश्चान्ते सविर्सागाविर्सायोः ॥ सविन्दुकाविन्दुक्योः ख्या-
दभेदेन कल्पनं ।

quae eiusdem fere significatus esse videntur, cuius ea, quorum loco posita reperiuntur; aut, eadem yerba servantes, ordine collocant alio. Utrumque genus mendo sum appellare liceat, si recte tecum reputaveris, quid mendosa sit scriptura, quid vera. Mendose igitur alius vocabuli loco substitui assevero id, quod eandem rem quidem dicat, sed non ea vi, quae prototius orationis tenore requiratur. Mendosam eam dico verborum collocationem, qua vis orationis non eis vocabulis tribuatur, in quibus re vera versetur. De utralibet autem huiuscemodi scripturae varietate iudicium pendet ab accurata synonymarum vocum scientia et constructionis cuique linguae propriae norma bene intellecta. Neutro cognitionis genere carere potest, qui litterata antiquitatis monumenta a corruptelis, quibus per temporis decursum negligentia hominum et iniqua sors ea foedari passae sint, vindicare et ad genuinam formam, pristinumque nitorem restaurare instituit. Ad istam autem linguae cognitionem acquirendam nil omnino magis facit, quam diligenter instituta et iudicio acuto temperata variae scripturae comparatio. Quae quum instituatur, ad varias vocum significations diligentius perpendendas et innatas linguae loquendi leges altius indagandas et ipsi attentiores reddimur, et alios attentiores reddimus. Litteras autem Indicas si respicimus, id infitias minime ituros esse opinor eos, qui tantum in illis profecerint, ut sciant, se non omnia scire, quae debeant

sciri, vim et rationem permultarum dictionum nondum satis nos habere compertas, neque ea, qua par est diligentia, exploratas esse syntaxis Indicae leges, quarum magna pars in verbis recte collocandis posita est. Viris itaque, qui in hasce res inquirere non gravantur, variarum hancce copiam lectionum utilitatis aliquid allaturam esse spero. Valde idoneus autem liber est Hitopadesas, qui huic usui inservire possit, utpote qui magnam partem soluta conscriptus sit oratione, quae, metri vinculis non obstricta, naturalem et nativam loquendi sequitur normam aut certe eo collocat vocabula ordine, qui ad loci cuiusvis tenorem potissimum sit accommodatus. Neque alias hucusque *critice* editus est Sanscriticus liber, soluta oratione concinnatus.

Postremo denique loco id commemorabo, quod nostri consilii postremum minime fuit, sed ita primarium, ut disertis verbis ea de re dicturus non fuisse, nisi praevidisset, a silentio meo quaesituros fuisse homines quosdam ansam nostri reprehendendi. Nimirum exhibenda erat scripturae discrepantia, ut legitime iudicare possent huius rei curiosi, utrum meliorem scripturam quoque loco praetulerimus, an secus. In textu recensendo quamvis neutiquam leviter, sed diligentissime nos versatos esse asseverare non dubitamus, ab inhumana tamen ista arrogantia, quasi errare non potuissemus, quam longissime sumus remoti. Quod ipsi declaravimus eo, quod locos quosdam, de quibus minus

PRAEFATIO.

recte a nobis antea constitutum fuerat, nunc retractavimus.
Alios fortasse alii invenient.

Interpretes Anglos ubique eo consilio contulimus, ut ex eis certiores fieremus, quam scripturam utervis eorum in codice suo invenerit; sed varias lectiones e verbis eorum Anglicis reconcinnare nec tutum erat, nec multum bonae frugis attulisset, quia coniectando magis, quam certa proferendo Sanscrita fuissent ex Anglicis restituenda. Neque cupidus equidem fui virorum optime de Indicis litteris merritorum irridendi. Cui rei qui inhiat, ei amplam messem reliqui.

Receptae a nobis scripturae patrocinium non ubique suscipere necessarium est visum, nec multis verbis significare rationes, quas habuerimus reiectas lectiones condemnandi. Peritiores enim vel sine mea admonitione videbunt, quid quamque scripturam commendet, quidve cuique obstet. Minus peritorum caussa institui debuisse disputatio longior, et quae egressura fuisset fines huic volumini praescriptos; verum enim vero tirones admonendi interdum erant breviter de scripturae cuiusdam pravitate, ne in vitiosis verbis enucleandis oleum et operam perderent. Uberiori utendum erat sermone, ubi vocabulum nos in textum receperamus minus usu frequentatum difficiliusve intellectu, aut constructionem exhibueramus a vulgata loquendi consuetudine paullo remotionem; ne, nullis allatis ad nostram rationem stabiliendam

argumentis, textui inaudita vocabula, illegitimasve constructiones obtrusisse videremur.

Dicendum denique est de consilio, quod in enarrandi munere secutus sum. Spopondit SCHLEGELIUS, se interpretatione Hitopadesae Latina hanc editionem esse adornaturum et mox vota exsolvet. Quae species commentarii, ut ipse recte ait, brevitati maxime est accommodata. Ad quam quum confidenter ablegare liceret eos, qui sine tali auxilio Hitopadesam legere non possint, in facilitioribus locis, in quibus nil insolentius dictum invenirem, non operae pretium mihi videbatur chartam consumere. Difficilioribus malui explicandis operam strenuam navare. Consilium significavi, vereor tamen summopere, ne minus quam vellem sim executus. Est autem omnino haec Indicae philologiae pars, hermeneuticam dico, ex mea quidem sententia non ea qua debet ratione tractata. Solent enim nonnulli, abieco paene omni proprio iudicio, in explicationes scholiastarum iurare, qui consuli sane debent et in artificiosis recentioris aevi poematis et obscuris admodum philosophorum scriptis maxime sunt auctoritatis; in antiquioribus autem linguae monumentis haud ita sine iudicio sequendi. Alienam esse hanc viam a philologia vera, quae in critica ratione tota est posita, demonstratione eget nulla. Neglexerunt praeterea scholiastae permultos quum integros libros, tum locos singulos; quos si intelligere velimus, et volumus haud dubie, a nobismetipsis

petamus explicationem necesse est. Aut vocabula sunt singula, quorum vis ignota nobis sit, aut sententiae constructionem praebent, quae difficilius expediatur. Vocabula interpretari ignota aggredientes, ad *etyma* confugiunt quidam. Quae via ad veritatem perducere potest, sed utrum ducat, necne, nescitur, nisi evictum fuerit, eodem *usurpari* vocabulum sensu, qui ex etymo eius eruitur. Explorandus est igitur *usus*, ad quem definiendum nil magis facit, quam comparatio diversorum locorum, quibus idem legitur vocabulum, eo consilio ut indagetur non solum quod quidque vocabulum significet, sed etiam qua vi quidque significetur quoque vocabulo. In quantos enim errores detrudere possit etymologica vocum interpretatio, si sola adhibeatur, facile perspicias, si a sola origine repetiveris vim dictionum व्याजः, उष्मपा, गोचर्, sexcentarum aliarum.

In constructione difficiliore enucleanda non multum proficiemus, nisi casuum, temporum, modorum usum, particularum tum simplicium, tum compositarum vim ac naturam, et quae hisce quaestionibus sint similia, ad vivum resecta habuerimus. Quos locos non ea qua decet ratione tractavere grammatici indigenae; Sanscritam syntaxin nondum delibarunt Europaei. Nam pauperculae quaedam regulae, omnibus fere linguis cum Indica communes, hoc nomine vix dignae iudicabuntur. Totam Indicam syntaxin in hoc commentario docere nec potui, nec debui; singulas quasdam

huius generis observationes data hac opportunitate V.V. D.D. iudicio submittere volui; plures conscripseram, sed mox, increscente nimis libri mole, omisi; omissas desiderari a lectoribus vellem.

Omnes notas diligenter mecum pertractavit SCHLEGELIUS ipse, qui commentarii critici in Hitopadesam condendi consilium iam ante aliquot annos inierat, mox autem, nobilioribus studiis redditus, absoluta textus editione, hanc provinciam mihi concredidit. Religiose, ut debui, omnes ab eo conscriptas annotationes conservavi eiusque nomine distinxi, alacriter quas, dum consociato studio librum a lapsibus operarum vindicandum perlustrabamus, mecum communicavit, meis inserui. In quibus qui ingeniosum dilectissimi viri in corruptis locis emendandis acumen, in difficilibus explicandis doctrinam, iudicium, sagacitatem probe intellexerit, is mecum optabit, eum enarratoris munere quam saepissime per huncce librum functum fuisse.

Desiderabunt fortasse quidam in hoc commentario locorum explicationem nonnullorum, qui haud ita intellectu faciles per se videri possint. Difficillimum sane fuisset, etiamsi voluissem, omnium desideriis satisfacere; atque id diserte moneo, me operaे pretium non existimasse, tironum gratia exponere, quae notissima aut sint aut sane esse debeant. Peritioribus deesse nolui, vereor, ne defuerim.

Indicavi fontem distichorum fabulis insertorum, ubi indagaveram; quibus indicationibus utiliter uti possunt, qui in historiam Indorum litterariam inquirere instituent.

Video ortas esse inter viros Indicarum litterarum cultores dissensiones quasdam de vera scribendi ratione; de quibus quae sit mea quidem sententia, nunc exponere in animo non est. Quod hic dicendum habeam, brevibus expediri potest. Observavi in ceteris easdem leges, quas in textu typis describendo nobis praescripsimus; sed usus sum signo nasalis mutabilis, tanquam scripturae compendio, quemadmodum utuntur Indi ipsi, magis pro commodo tum meo, tum operarum, quam iuxta certam quandam regulam. Quo facto incurram, credo, in reprehensionem nonnullorum. Sed libenter fateor, rem totam non tanti mihi fuisse visam, ut propter eam libri mei editionem differrem; quod non potuissem, quin facerem, si ubique quinque definitarum nasalium litterarum signis secundum eam legem, quam alias et ipse secutus sum et sequendam esse arbitror, uti voluissem. Brevitatis caussa interdum initia tantum vocabulorum exhibui, addito a latere circulo, qualem ad hunc usum usurpatum praebent saepius codices. Sedes syllabarum inter varias distichorum scripturas non repetendarum punctis indicavi, ubi necessarium videbatur.

Qui in SCHLEGELII nota ad dist. 2. prooem. memoratur commentator Herfordensis, idem est vir, qui editionem

Londinensem molitus est. Commentarius iste, in usum scholarum Hayleyburii habendarum conscriptus, continet pp. LXXII analysis grammaticam Hitopadesae usque ad Lib. I, dist. 33. extensam, sed nunquam, quod sciam, publici iuris factus est. Quod optime factum esse vel uno specimine demonstrare suffecit. Laudavi semel bisve libellum *Bernstenii*, profess. Vratislaviensis, eo potissimum consilio, ne eum ignorasse viderer *). Iustis auxiliis non instructus editionem vere criticam adornare non potuit vir clarissimus, neque hoc titulo reprehendendus, neque utilis instituti laude privandus; sed critici praesidii inde nobis nil accrevit. Librorum Sanscrite editorum, quorum mentio iniecta est, indices huc apponere, supervacaneum esse reor; neque ignoti esse debent inediti, e quibus exempla quaedam protuli. Bhavabhûtis drama Mâlatîmâdhava laudavi secundum paginas meae editionis nondum absolutae; Gîtagôvindam ex ea recensione, quam ego codicum òpe institui.

Glossarium aut omnium vocabulorum, quae in Hitopadesa leguntur, aut eorum, quae in Wilsonis opere desiderantur, conficere utile sane fuisset et confecisset, nisi eo accidente nimis aucta fuisset libri huius moles. Indicem in commentarium omittere non decuit.

*) Index libri hic est: *Hitopadaesi particula*. Edidit Georgius Henricus Bernstenius. Vratislaviae MDCCCXXIII. 4to.

Sed haec hactenus. Exscriptus est hic liber Devanagariis typis formae minusculae, quibus Regia munificentia Academiam nostram ditavit. Qua donatione quantum favoris et patrocinii specimen in studia nostra editum sit, sentire maxime licet mihi, qui primus experientia sum edocitus, quamvis optassem sane, inauguratum fuisse praeclarum istud beneficium edito quodam opere, quod meo et gravius fuisse et limatus. At spero fore, ut voluntatem magis quam ipsum opus respiciant tum studiorum meorum fautores, tum harum litterarum aequi existimatores.

Scribebam Bonnae mense Iunio 1831.

COMMENTARIUS CRITICUS
IN
HITO PADESA M.

P. 3. init. शिवाय नमः । Sic Cod. P. Similiter Pp. ते नमः शिवाय । Sed P. 5. minus apte praemittitur monosyllabum mysticum libro, qui delectationis et pueritiae instituendae gratia scriptus, inter sacros referri nequit. Ed. Lond. श्रीविष्णुराय नमः । quod ad idem redit: praetulimus tamen lectionem simpliciorem. J. et W. legerunt in exemplaribus suis: गणेशाय नमः । W. porro addit सरस्वत्यै नमः । quae et ipsa habent quo se tueantur: nam Ganesae ingeniosa quaeque tribuuntur; Sarasvatis eloquentiae praesidet, eique dedicatus est liber, cui superstructus est Hitopadesas, PANCHATANTRUM (cf. *Trans. of the Royal As. Soc. of Gr. Br.* Vol. I, p. 157). Variant eiusmodi salutationes pro libito fere librariorum, attamen ipsum auctorem librum suum Sivae dedicasse crediderim; nam et huius numen primo disticho adorat, et cum peculiari quadam proprietate commendari poterat fabularum liber Sivae, utpote qui पशुपतिः *animalium dominus* dicitur. S.

Dist. 1. Sententia egregie illustratur alio versu libr. II, dist. 13. b. add. IV, dist. 98.

— 2. a. हितोपदेशोऽयं । Ed. Lond. - देशायं । Portentosam lectionem silentio praetermissem, nisi commentator Hertford. eius rationem reddere conatus esset; venditat nimirum istud pro vocabulo composito, quale nunquam formari potuit. S.

— 4. a. किञ्चित् । Consentunt in hac scriptura libri editi et Mscripti, quam ob caussam manus a mutando abstinuimus, quanquam lenissima medela in promptu foret, emendando किञ्चिं हि; in sequenti dist. recte legitur किञ्चित्, unde huc illatum esse videtur. Esse tamen potest oratio recta et आहुः parenthesis loco haberī: »omnibus bonis praestat scientia, ita aiunt.« Eodem modo peculiari quadam vi affirmandi orationi directae inseritur मन्ये, *credo*.

P. 5. *Ibid.* b. Pro अन्नयत्वात् Cod. Pp. अव्ययत्वात्, quod ad idem reddit.

Dist. 5. b. दुर्धृष्टिं Cod. P. et edd.: दुर्धृष्टिं; Pp. दुर्धृष्टिं, unde aliquis suspicari posset, legendum esse दुर्धृष्टिं (difficilem visu regem, pro fastu nimirum aulae Asiaticae), littera द् repetita per द् pro द्, quemadmodum saepius peccant librarii. Sed altera ex parte librarii Bengalici, neque ii indocti, pro libito fere ponunt sibilantes श् एत् ष, in errorem inducti hodierna pronuntiatione, apud Bengalos potissimum obtinente, qua eodem paene modo efferuntur ambae litterae. (cf. *Carey Gramm.* p. 6. *Forster Gr.* p. 3.) दुर्धृष्टिं saepius quidem usurpatur de viro forti, qui haud facile superatur; sed hoc non obstat, quo minus de rege, ad quem difficilis sit आदित्, h. l. dicatur. Alia porro est caussa, cur hanc vocem huic contextui accommodatiorem esse censeam; nam *sicuti नौचगा*, quod proprie ad ज्ञानं pertinet, ita positum est, ut quodammodo etiam ad विद्या referri possit, ita दुर्धृष्टिं simili positione ad ज्ञानं quodammodo trahi potest, quamvis proprie epitheton sit regis; दुर्धृष्टिं autem inepte dictum foret de oceano, qui दुर्धृष्टिं dicitur Rām. II, 34, 45. ed. Schl.

Dist. 5. 6. Interiectum est in editis distichon hocce:

विद्या ददति विनयं विनयाद्याति पात्रतां ।
पात्रवाद्वनमाप्नोति धनाद्वर्म् ततः सुखं ॥

quod exulare iussimus. Omittitur in utroque codice. Omissiones codicum singulorum alioquin non magnopere curo, sed gravior hic accedit caussa. Doctrina, quae his versibus traditur, non solum est improbanda, sed plane ridicula. Quid enim, quaeso, pietati cum divitiis? Mire se torserunt interpretes, ut sensum tolerabilem inde elicerent. Cl. Wilkins monet, cultum numinis apud Indos in rebus externis poni, in sacrificiis magnisfiscis, aliisque id genus, quae sine magno impendio parari nequeant. Haec sane est vulgi opinio, a Brachmanis lucri cupidis sedulo propagata, sicuti etiam Christianorum antistites extiterunt, qui hominum superstitionum opibus inhiantes, largitiones pro remedio animae Ecclesiae, i. e. sibi, factas, tanquam certissimam salutis viam post vitam facinorosam commendarent. Sed sapientes utrobique meliora docuerunt. Cf. Bhag. Git. XVII, 11. 17. 20. et infra I, dist. 173. Haud facile mihi persuaderi patiar, auctorem nostrum, qui complures fabulas finxit, multos versus libro suo inseruit, quibus aperte vana sanctitatis simulatio deri-

deatur, hanc doctrinam probasse. Profert ille quidem etiam alias sententias, nec probandas, neque ab ipso probatas; sed semper id significat aut refutatione subiecta aut delectu personarum, quibus eas tribuit. Hic autem in prooemio e sua persona loquitur. S.

Dist. 6. a. विद्या श्राव्यस्य । Haec est lectio cod. Pp. ceteri: श्राव्यं च प्राप्त्वं च । quae nimis dura foret appositio, ut ipsa arma, ipsi libri disciplina dicantur. Postulatur genitivus et numerus sing. collective est positus. Ceterum ludit poeta in similitudine verborum. . S.

Incredibilis admodum est error commentatoris Hertford. qui प्रतिपत्तये accipi vult pro nom. dual. ita ut praedicatum sit ad विद्ये referendum. Tironum gratia moneo, dativum hic indicare usum, cui res quaedam inserviat; quod grammatici Indici plerumque sic exprimunt: तादर्थे चतुर्थी. Ex. gr. scholiastes ad hunc locum dramatis Mālatī - Mādhava inscripti (Act. I, sl. 16.): संतापसंतानिमहाव्यसनाय तत्यां । आकृतमेतद् चेतः । ubi व्यसनाय explicatur per व्यसनार्थं, addita definitione technica, quam mox laudavi. Aliud exemplum huius dativi est Bhag. Gīt. IV, 23. Vid. infr. Lib. I, 5.

Sequitur in ed. Lond. hoc distichon:

पणिते च गुणाः सर्वे मूर्खे दोषाश्च केवलं ।
तस्मान्मूर्खसद्वेषु प्राज्ञ एको विशिष्यते ॥

Abest ab ed. Ser. et codd., neuter interpres id in suo exemplari legit. Agitur hic de scientiae pretio, non de stultorum importunitate; alieno loco itaque intrusa est sententia. Cui si quis locum commodiorem quaerit, interponat eam sermoni regis Sudarsanae post dist. 16. infra. S.

Dist. 7. Dubitari potest, utrum vocabulum संस्कारः intelligendum sit P. 4. de figuris ornandi gratia operi fictili impressis, an de aromate quo perfusa argilla nondum exsiccata vel cocta bonum odorem deinde perpetuo servat. Mihi posterius placet, quo et लग्नं deducit. Plerumque संस्कारं ad ornamenta externa refertur; attamen usurpatur etiam de puritate interna, v. c. in Manūs legibus de initiatione. S. (Mān. Sāstr. II, 66).

Lin. 6. प्रासादाङ्गः पथि गङ्गता e cod. Pp. Quibus verbis narratio egregie illustratur. Quomodo enim homo privatus ausus foret recitare coram rege versus, quibus reprehensio filiorum eius subesse videri debebat? Sed quemadmodum solent istarum regionum incolae tempore matutino vel vespertino, ut a nimio calore sese reficiant, ascenderat rex

P. 4. in solarium domus sua, ubi a praetereunte, casu has sententias recitante, conspici non poterat. S.

De situ urbis Pātaliputrae supervacuum foret dicere post ea, quae disputata sunt in libro: *Ind. Biblioth.* II, p. 395. Alio nomine dicitur *Kusumapura*, i. e. *Anthopolis*. *HEMACH.* IV, 42. Etiam *Pushpāpura*; *TRIK.* *SESH.* sl. 16. किमपि idem valere atque किंचित्, किंचन, in vulgus iam notum esse debet; interdum etiam किंच dici, alio loco observavi. De *PENTAP.* *INDIC.* p. 87.

Dist. 9. b. दर्शकं editi; meliorem scripturam debemus Cod. Pp.

— 10. d. किसु । Operae pretium erit paucis vim huius particulae exponere, quam iusto brevius expedivit cl. Wilso, sive potius is, ex quo sua hausit, *AMARASINHAS* p. 368, v. 5. Dicit enim किसु poni विकल्पे i. e. interprete cl. Colebrookio «*indicating deliberation*». Quam significacionem non negabo quidem, quanquam nullum in promptu habeo locum, quo egomet eam confirmare possim; alium sensum huic particulae nostro loco esse attribuendum, solis luce est clarus. Composita est ex किं et उ, quae vocula in libris, quos usu quotidiano conterimus, rarissime sane appetit; veruntamen a grammaticis agnoscitur et non semel in *UPANISHADIS* adhuc editis reperitur. Primaria eius significatio adversativa esse videtur: *KATHAK.* Up. p. 4. अयन्नेयोऽन्यद् उत्तैव प्रेयः । तयोः श्रेय आद्धानस्य साधु भवति हीयतेऽर्थाय उ प्रेयो वृणीते ॥ *ISA* Up. p. 1.: अन्धं तमः प्रविश्नान्ति वे श्रविष्यामुपासते । ततो भूय इव ते तमो य उ विद्यायां रत्नाः ॥ Altera deinde significatio est continuandi, atque *etiam* valet: *MUND.* Up. II, 2. p. 5: तदेतदक्षरं ब्रह्म स प्राणस्तद् उ वाचनः । *KATH.* Up. p. 9. उद् उ नात्येति कश्चन । »hoc etiam non exsuperat quispiam« i. e. neque hoc exs. q. Eodem sensu legitur *KENA* Up. p. 1. उ उ, »ille etiam« et *RIGVED.* *Spec. ed.* *Rosen* I, 1. b. अभूद् उ »fuit etiam.« Tertio denique loco pono significationem, quam in quibusdam Rigvedae locis observavi: *iam.* I, 1. a. उद् उ श्रिय उषसो रोचमाना श्रस्युः । »*Iam* luces Auroraë fulgentes exsurgunt.« *Ibid.* in not. उद् उ तिष्ठ सवितः । »*Exsurge iam*, Sol.« Interpretari omisit particulam Rosenius meus. Ab उ derivata est particula उत्, quae in loco mox laudato ex *KATH.* Up. *etiam* valet; eodem significatu ter in *Bhag. Gita* legitur (I, 40. XIV, 9. 11. Adde *Rigv. Spec.* p. 8. 1. 1. p. 10. 1. 5. p. 12. 1. 4. p. 16. 1. 6.) Aliis locis उत् affirmat; cuius rei testem adhibeo Grammaticae Indicae principem, *PANINEM*: (III, 3, 152. p. 324.) उतायोः समर्थयोर्लिङ्गं ॥ उत् । अपि । इत्येतयोः समानार्थकयोः प्रयोगे धातोर्लिङ्गं स्यात् । उता-

धीयोते । अप्यग्रीयोते । वाढमथेष्वते इत्यर्थः । वाढमित्यर्थं तुल्यार्थवेतौ । समर्थयोः किं । उत दण्डः पतिष्ठति । P. 4.

अपि धास्यति द्वारं ॥ Nimirum ab utraque particula incipere etiam potest interrogatio affirmativa. उ एव एवं eandem esse voculam docent prorsus similes contractiones: उवाच pro वाच cet.; उ in derivatis autem solum superstes est: वत् (in अहोवत्) इव (praeposita littera इ, quae radix est pronominis इहं) et एव (praefixa diphthongo ए, quae eadem एतद् et एतावत् formandis inservit.) Neque absurdum erit suspicari उ ab origine coniunctum esse cum वा; littera V etiam in vocibus Latinis *ve*, *vel*, et in India praepositione उ disiungendi et discriminandi vim habet.

His expositis ad किम् revertor, cui particulae inest vis disiungendi, sed ita tamen, ut ea res, quae hac particula disiungatur ab aliis, maior et gravior esse dicatur, quam ceterae, quae prius iam fuerint memoratae; nam किम् in altera tantum positionis parte poni posse, per se patet. Valet igitur, ut uno verbo dicam, πῶς οὐ, vel si interrogationem omitterimus, quanto magis, nedum, et vehementer est affirmantis. Eodem sensu frequentius usurpatur किं पुनः; किम् autem a किम् haud differre opinor. Alia est ratio particulae किम् in hoc *Amarū - Satacae* disticho; in hunc enim locum re vera quadrat definitio Amarasiniae:

न ज्ञाने संसुखायाते प्रियाणि वदति प्रिये । सर्वाएषङ्गानि मे यान्ति श्रोत्रतां किम् नेत्रतां ॥

“Vix novi, quum coram me adstet amicus et dulce loquatur, utrum in auditum tota abeam, an in visum.”

Lin. 12. 13. Verba नित्यमुन्मार्गामिनां a neutro codice agnoscantur, recurrent infra suo loco in sermone regis, unde huc translata esse suspicor. — Ed. Ser. et cod. Pp. अनुष्टानेन, - omissa negatione; Cod. P. substituit ज्ञानोपादानेन; neutrum bene; nam rex उद्दिग्नमनः est sollicitus propter rem, cui mederi vult, non de re consequenda. Ceterum observavit Vir illustr. SCHLEGELIUS vocabulum अनुष्टान desiderari in lex. Wilsoniano, neque explicari significatum verbi स्था praefixa praepositione अनु; enotatum autem esse nomen in cl. *Haughtonis* Gloss. Bengalico s. v.; ubi haec leguntur: अनुष्टान, nomen verbale, *the following, attending to or searching*. Cf. praeterea *Rosenium* s. v. et Bhag. Git. III, 31. 32. 35. XVIII, 47. Notat अनु+स्था etiam *petere*, quae significatio omissa est a Rosenio. MUDR. RAX. Prolog. संगीतकम्पनुतिष्ठामि, «musicos arcesso.”

Addit idem vir cl. उपादान in varia lectione, ex cod. P. enotata, habere

P. 4. significatum a Wilsone silentio praetermissum: *suppeditatio*, et ablegat lectorem ad eundem Haughtonem s. v. उपादेय.

Dist. 12. 13. Cod. P. horum distt. ordinem invertit; Pp. prius omittit; J. duodecimum decimo quarto subiungit. Prius e Panchatantra hoc translatum est; cf. Wils. l. l. p. 158; alterum BHARTRIHAREM habet auctorem; cf. ed. Ser. p. 58.

His distichis sola ed. Ser. interponit hosce versus:

वरं गर्भावो वरमपि च नैवाभिगमनं ।
वरं ज्ञातः प्रेतो वरमपि च कन्यावज्जनिता ।
वरं बन्धा भार्या वरमपि च गर्भेषु वसतिर् ।
न वाविद्वान् द्वयद्विणगणयुक्तोऽपि तनयः ॥

„Toleranda res est abortus; tolerandum quoque, quando mulier omnino non concipit; tolerandum, quando natus moritur; tolerandum quoque, quando puella nascitur; toleranda uxor sterilis, toleranda quoque graviditas ultra terminum protracta; non vero tolerandus filius insipiens, quamvis forma et divitiarum copia sit instructus.” In ultimo versu emendandum est न चाविद्वान्. His versibus quos neuter interpres in exemplari suo legit, sine ullo damno textus carebit. S.

Dist. 14. Deditus lectionem cod. Pp. Ed. Lond. et Cod. P. exhibent ससंभ्रमात् quod plane stare nequit; nam praeposita particula च substantivum संभ्रम in adiectivum convertitur, quod non habet, quo referatur. Melius igitur Ed. Ser. ससंभ्रमा, quod cum कठिनै iungi debet. S. In fine dist. cod. P. कौटूशी नाम, haud obstante metro. Pp. कौटूशी नाम भवति । utramque vocem haud patitur versus.

Priorem huius sententiae versum satis obscurum parum expedivit Jonesius et interpres Hayleyb. Ludere videtur poeta in dupli sensu vocabulorum गुण et गुणिन्, quae tum de virtute, tum de multiplicatione usurpanatur; v. c. त्रिगुण, चतुर्गुण, triplex, quadruplex. Erit itaque dilogia, ut गुणिण signifiet simul coetum virorum virtute praeditorum et seriem numerorum qui multiplicando efficiuntur. Desumta videtur metaphora a tabula arithmeticā sive abaco, quo pueri utuntur. Sed haereo in verbo पतति,

utrum sit: *excidit* e manu rubrica prae nimio studio, an *incidit* in P. 4. locum aliquem? Si hoc ultimum, expectabam potius गुणितम्; atqui refragatur metrum. Hoc sibi vult, mulierem, cuius filius matura virtutis aemulatione non excitatur, pro sterili esse habendam. Neminem fugit alliteratio, initio versus sedulo quaesita. S.

Non habeo, quod hisce addam, nisi hoc unum, sine dubio metaphoram desumptam esse a re Indorum arithmeticā, sed latere nos aliquid, quo impediāmūr, quo minus vim et proprietatem orationis intelligamus. Coniecturis nihil in hoc versu efficitur, nisi fortasse quis pro गणन legere mavult गुणन्, quod vocabulum est arithmeticorū; vid. Colebrook. Ind. Algebr. p. 5. गुणन्, *multiplicatio*; गुण्य, *multiplicandus*; गुणक, *multiplicator*. Sed गणन etiam ad arithmeticā pertinet; व्यक्तगणित nomen est ipsius numerorum scientiae; cf. Coleb. I. l. p. 1. atque tuetur hanc scripturam distichon, quod solus cod. P. subiungit ad versus, de quibus sermo noster institutus erat, illustrandos:

किं तेन भुवि ज्ञातेन मातृयैवनहारिणा । सतां गणाने यस्य न भवेद्गृह्णमङ्गलिः ॥

Deest syllaba in tertio hemistichio; in quarto corruptela inest, cui tamen facile est mederi; nam nullum exstat vocabulum मङ्गलिः, et aequē inauditum est मङ्गलिः । Legendum videtur अंगुलिः । Sensum totius distichi hunc esse coniicio: filium, qui quum hominum virtute praeditorum nomina laudari et celebrari audiverit, prae admiratione digitum non tollat, nulli esse usui. अंगुलिः praeclara est SCHLEGELII coniectura; admirantis enim est istud scenicorum अंगुलिमाकाशे बद्धा.

Dist. 15. 16. Deest utrumque distichon in cod. Pp. prius in P. p. 5. Praebet dist. 16. anacoluthiam constructionis satis memorabilem; sequi enim debebat in altero utriusque versus hemistichio nominativus, sed mutata est constructio, quasi antecesserit casus tertius et dictum fuerit: वर्षमेकेन पुत्रेण । एकेन चन्द्रेण तपो हन्यते । च cum न iunctum saepius habet vim adversativam et valet न तु.

Dist. 18. b. प्रियशः । Sic scripsi repugnantibus codicibus, qui in प्रिया च cum editis consentiunt. Sed plane fuit necessaria emendatio. Etenim si utrumque epitheton प्रिया et प्रियबादिनी ad भार्या referas, enumerantur quinque tantummodo vitae bona; quod interpretes haud animadvertisse miror; amicam autem postulari praeter uxorem legitimam eam-

P. 5. que blandiloquam, neutiquam decet. Quis porro patietur, amicum inter praecipua vitae bona omitti? S. *Ibid.* d. Pro राज्ञः edd. तात् ।

— 19. b. कुश्लापूरणाठ्कैः । Utraque editio: कूशल, quale vocabulum non exstat. Interpr. Hayleyb. tentaverat कूशल; frustra. In codd. nihil erat praesidii, quippe qui disticha 19 — 23. omittunt. Praeclaram emendationem debeo viro clar. *Haughton*. Mendose excusum est in editione nostra पूरण pro आपूरण, uti habent edd. Errorem vel metrum arguit: evadunt enim quatuor iambi continui, quem numerum slocus non admittit. S.

Ibid. c. कुलालम्बी ed. Ser. quod, nisi operarum culpa editum sit pro ea scriptura, quam nos dedimus, a particula अलं addito affixo विन् derivandum foret; sed dubito, an tale vocabulum formari omnino possit.

Dist. 20 — 23. Quatuor haec distt. tum in ed. Ser. tum in codd. desiderantur, sed cl. Wilkins singula in libro suo legit, Jonesius cetera praeter 22. — *Dist.* 20. Exhibuit hanc sententiam Halhedus inter specimina scripturae Devanagaricae p. XXXV. praef. ad cod. leg. Indic. cum varietate lectionis in versu priore: पिता च क्रणवान् शत्रुमाता शत्रुरशीलिनी । quae doctae sunt lectiones, nec tamen praeferendae. Hiatus ante vocalem अ tolerari potest. S.

— 22. Luditur iterum in verbis; वक्ष एt prosapiam sive genus significat et arundinem durissimam (*Bambu*), unde arcus conficiuntur; गुण virtutem et nervum. S. यज्ञत् significat *quodlibet*, *quocunque* et pronomen est compositum; alia exempla invenies Bhag. Git. XVIII, 37. 58. VI, 21. Monendi autem sunt tirones, ne hoc pronomen compositum statuant, ubi re vera यत् ad antecedentem, तत् ad sequentem positionem sit referendum, sicuti Bhag. Git. XVIII, 23; ubi melius seiungitur यत् तत्. — यज्ञत् idem fere valet atque यज्ञत् sed distribuit et servat naturam pron. relativi; unde plerumque excipitur a pron. demonstrativo तत्; vid. Bhag. Git. III, 21. VI, 26. VII, 21. VIII, 6. X, 41; attamen ponitur etiam absolute; vid. infr. dist. 33. Man. II, 136. तत्, nullo sequente aut antecedente यज्ञत् parum differt a यत् किंचित् cf. Bhag. Git. II, 57. et infr. IV, dist. 70.

Dist. 23. b. Perperam interpres Hayleyb. सुगतैतासु pro composito accipit, cuiusmodi non datur. सुगत् est vocativus, referendus ad पुत्रक. S.

L. 20. तत् कयं Haec addidimus ex utroque codice et sic legit W.

Edd. incipiunt ab इदानीः; sed res a rege consilii incerto melius per inter- p. 5. rogationem effertur, et eiusmodi usum imperativi admittit grammatica Sanscrita, ex. gr. in formulis: किं ददानि ते । किं कर्वाणि । S.

Dist. 24. 25. Quanquam horum distt. neque in codd. neque apud interpp. ullum vestigium appareat, libenter recepimus ex Edd. nobilissimas sententias. In dist. 24. a. particula copulativa otiosa est; nam antecedens compositum eam respuit, nec probabilis foret coniectura aut मैथुनानि legere, aut in bina composita dissolvere aggregativum quadripartitum; vetat enim sequens एतत्. Credendum est, च suo loco positum fuisse in libro, unde desumtum hoc distichon, nimirum ut copula id cum alio similis argumenti praecedente coniungeret; quod semel sit monitum de hac particula ad speciem otiose posita.

Dist. 25. c. Ed. Ser. अन्ना; minus recte. Nam caprorum propriae P. 6. sunt verrucae, e collo pendulae, inutiles lacti emulgendo, etsi papillarum speciem prae se ferunt. S.

— 26. अच्छोच्यते । Haec verba versui praemissa arcto vinculo iuncta sunt cum oratione soluta, qua terna distt. proxima excipiuntur, quandoquidem in eis rex opinionem suaे contrariam proponit, deinde refutandam. Quod non satis animadverterunt interpp. S.

Ibid. c. De neutro plur. एतानि cf. not. ad Bhag. Git. p. 125. ed. Bonnens. Alia eiusdem constructionis exempla leguntur Man. I, 48. II, 64. 136. III, 101. etc.

— 28. b. Formula चेत् न ita semper est accipienda, ut चेत् ad primam referatur periodi partem, quam conditionalem esse absque negatione, hac ipsa coniunctione declaratur, a न autem incipiat apodosis. Sic in loco nostro et *Vēdānta - Sārae* p. 15. l. 15. प्रार्थे पतिषेऽप्रार्थेत्वं स्याद् इति चेत् । न ॥ ibid. l. 18. et 25. p. 19. l. 3. Sic etiam in hoc versu, a quo incipit brevis expositio philosophiae Sankhyae: (*Sāṅkhyā-Sūtra* 1.)

दुःखत्रयाभियाताऽङ्गज्ञासा तदपवातके हेतौ । दृष्टे सापार्था चेन्नैकान्तात्यन्ततोऽभावात् ॥

In hoc loco vel caesura protasin ab apodosi seiungit. Alia est ratio formulae नो चेत्, de qua suo loco dicetur.

P. 6. l. 9. कार्याज्ञमाणां male abest a cod. P.

— 10. Subiunxi e codd. orationi solutae particulam caussalem यतः minime otiosam, quandoquidem sequitur hinc refutatio sententiarum praecedentium alieno nomine prolatarum. S.

P. 6. *Dist.* 29. 30. Desunt haec distt. in codd., prius etiam in interpr. Jonesii et ed. Seram.

— 30. 31. Invertit horum distt. ordinem ed. Ser.

— 32. c. P. अतः पुरुषकारेषु, perperam.

— 34. b. P. दृढ़ा तु; male. — Affixum इय solenne esse videtur in formandis substantivis, quibus appellantur, tanquam nominibus propriis, narrationes in vulgus notae et omnium ore decantatae. Aliud exemplum est प्र्येनकपोतीय, Ram. II, 12, 40. ed. Schl., tertium addit Wilso e Panchatantri, l. l. p. 173. काकोलूकौय. Propria horum nominum vis est *comparandi*; काकतालीयवत्, quod pro adverbio est accipendum, est: *veluti* in ista fabula de cornice et palma. Quam rem a *Panine* edocemur. V, 3, 106.
समासाच्च तद्विषयात् ॥ इवार्थविषयात् समासाद् इवार्थे इः स्यात् ॥ काकतालीयो देवदत्तस्य वधः । अज्ञाकृपापीयः । Priori vocabulo dicitur, mortem contigisse Devadattae, sicuti cornici in ista fabula de cornice et palma. Nominis notionem accuratius enarrat *Patanjalis*: द्वाविवर्तैः । काकागमनमिक्त तालपतनमिक्त काकतालं । काकतालमिक्त काकतालीयं । Ceterum vel ex hisce verbis colligi potest, fabulam istam in eo versari, quod cornix palma ex arbore decidente occidatur; cum cuius morte comparatur letum Devadattae a latronibus occisi.

P. 7. *Dist.* 35. 36. desunt in utroque cod. Jonesius tamen ambo expressit, neque aliter W. Ed. Ser. alterum omisit, in priore vitiouse सुखे dedit pro सुखे; correxerat iam *Bernstenius*.

— 38. 39. Omittuntur in utroque codice et ab Jonesio; 39 etiam in ed. Ser. quae hoc substituit, ab editore Lond. receptum:

पुस्तकेषु च नाधीतः नाधीतः गुरुसंनिधौ ।
 न शोभते सभामध्ये जारगर्भा इव स्त्रियः ॥

»Libris non eruditus, neque eruditus magistri contubernio, non splendet in aula media, sicuti mulieres ex adultero gravidae.« Ed. Ser. habet contra grammaticam in priore versu नाधीतं, in posteriore नार्भः, quum istic nominativus, hic pluralis requiratur: mallem tamen ubique pluralem. Prius mendum tollere aggressus est ed. Lond. sed pro more suo novum peccatum admisit; scribi enim debet utroque loco नाधीते. At hanc sententiam neque codices neque interpretes agnoscent; conflata videtur e praecedentium imitatione; exit in comparationem nimis claudicantem; missam igitur feci. S.

Dist. 39. Cf. Gr. Yatesii p. 331. ubi tribuitur Chânakyae, qui auctor P. 7. dicitur fuisse libri de rebus prudenter gerendis (नीति). Cf. Wils. l. l. p. 158. Et fuit sane नीतिक्रित्वम्, si fides habenda est auctori dramatis Mudrâ-Râxasi.

L. 12. — 15. Castigavimus hunc locum auctoritate librorum Mscptorum, in plerisque egregie eodem conspirantium. परिउत 1. 12. omisit P. l. 13. idem praebet: परिउतास्तावन्मय वचनं शूयन्तां । deinde: एवंकृतः । Pp. ut nos, peccat tantummodo in शूयन्तां । Edd. hunc in modum se habent: भो भोः परिउताः शूयन्तां मम वचनं अस्ति कश्चित् एवंभूतो विद्वान् यो मम पुत्राणां नित्यमुन्मार्गानिनामनधिगतशास्त्राणामिदानीं नीतिशास्त्रोपदेशेन पुर्वान्मय कारण्यितुं सर्वयः ॥

Corrigendum est plur. imper. cum nomin. sing. vitiose positus; melius tamen regiae maiestati convenit शूयन्तां absolute positum, et saepe sic usurpatum. विद्वान् glossematis speciem prae se fert, quo quis एवंभूतः accuratius definire voluerit. अनधिगतशास्त्राणां e primo regis sermone huc translatum videatur, sicuti vice versa hinc नित्यमुन्मार्गं eo migrasse monuimus. इदानीं παρέλκετ. कारण्यितुं सर्वयः est scholion margini adscriptum ad declarandam vim futuri करिष्यति, deinde in textum irreprimit. Hisce additamentis omnis concinnitas orationis perierat, iisdem electis prodit slocus elegans, ad metri leges probe exactus, quem cod. Pp. etiam interpunctione distinguit. Quod tanto magis placet, quia etiam ceteri interlocutores fabularum argumenta versibus praecipere solent. S.

Dist. 41. अतः praemittit P. mendose. — b. मारकतीर्थुतौः । Ser. minus bene.

— 42. a. तातः Pp. absurde; idem c. याति pro एति; nil refert.

L. 20 — 22. Cod. Pp. post शास्त्र् omittit तत्त्व. — समुद्रवाः e cod. Pp. — P. संभवाः । edd. संभूताः, corrigi debet संभूताः, uti iam monuerat Bernstenius. Pp. omittit महा ante कुल; nec male; saepe enim कुल simpliciter pro nobilitate ponitur. Porro ed. Lond. राजपुत्रास्तव मया; paullo melius ed. S. तत्त्वमया; sed मया arroganter foret additum a Vishnusarmane. नीतिक्रियां e cod. P. edd. नीतिं; Cod. Pp. नीतिशास्त्रं. S.

Dist. 43. a. नादव्यनिहिता Pp.

P. 8.

— 44. a. b. Exhibui versum, qualis in utroque codice legitur. Edd. अस्मिंस्तु निर्गुणं गोत्रे नापत्यमुपजायते । quae videtur esse emendatio grammatici cuiusdam, quem hiatus offenderat; intrusit itaque particulam adversativam loco alieno, et negationem inconcinne transposuit. At saepius contra grammaticorum praecepta vocalem अ aut elidendam aut contrahendam

P. ४. tuetur caesura. Vid. Bhag. Git. XI, ५४, a. XII, ८, c. infra I, dist. 205.
II, १४. ११६. IV, ५७. S.

L. 5. अहं abest ab utroque codice. Deinde P. तव पुत्राणां नौति . . ज्ञानं करिष्यामि । Pp. पुत्रान् नौति . . ज्ञानं करोमि । mendose. Lin. 6. Pp. राजा सक्रिनयं पुनराव् । P. रा० पु० सक्रिनयमाह ।

Dist. 46. c. सत्सनिकर्षेण Pp. minus eleganter repetito vocabulo.

— 47. Desideratur in utroque cod., sed expresserunt interpres.

L. १३ — १५. Castigavimus haec ope cod. P. quocum in plerisque consentit Pp. nisi quod ante उपच्ये perperam omittit ज्ञान et otiose अभ्युना subiicit. Pro ज्ञानोपच्ये exhibent edd. नौतिश्चात्मेष्टेशाय, in quo inest ingrata repetitio; melius praeterea convenit casus septimus quam dativus rei, in qua peragenda auctoritas alicui tribuitur. Pp. प्रणामामि इत्युक्ता corrupte, sed operae pretium erit, corruptelae originem indagare. Interpunctione sublata praecedenti vocabulo adhaeserat vocalis इ, unde particula incipit. Hinc transpositis syllabis मा et ए effictum est verbum, quod sensui non nimis male convenit; sed postulabat illud accusativum भवतः. Nimirum non intellexerat librarius usum ellipticum vocabuli प्रणामा, de quo egi ad Bhag. Git. p. 122. Porro edd. omittunt स राजा et exhibent: बहुमानपुरःसं पुत्रान्, nullo sensu. Pro पुरस्तान् ponunt codd. अमे, quod ad idem reddit. S. — De क्लृm dicetur ad p. 9. l. 8.

Dist. 48. Ante hoc distichon duo alia inserit ed. Lond.

विद्या नाम नरस्य दृपमधिकं विद्यातिगुप्तं धनं ।

विद्या बन्धुरसौ विदेशगमने विद्याक्षयं संबलं ।

विद्या कीर्तिकरी सभावशकरी विद्या परं लोचनं ।

विद्या जीवनद्वेतुरत्र भुवने विद्याविद्वीनः पशुः ॥

गङ्गाव्याहीनो रूतो देशो विद्याव्याहीनं रूतं कुलं ।

अप्रसूता रूता नारी रूतो वृष्टस्वदक्षिणः ॥

„Doctrina profecto summum viri decus; doctrina bene custoditus thesaurus; doctrina comes eadem in peregrinatione; doctrina inexhaustum viaticum. Doctrina laudis et publici assensus est conciliatrix, doctrina clarissimum lumen; doctrina vitae praesidium in hoc mundo; doctrina destitutus homo est pecus.“

„Gange carens cassa est regio; doctrina carens cassum genus; steri- P. 8.
lis foemina cassa; cassum sacrificium sine largitione.“

Hos versus nullo alio ex fonte in Ed. Lond. fluxisse, quam e cod. Wilk. inde probabile fit, quod V. cl. eosdem iam antea Anglice expre-
serat; codd. nostri, ed. Ser., Jonesius denique pariter eos ignorant. Quapropter exulare iussimus sententias nulla fere re praeter vanam verborum
pompam notabiles et inepte huc intrusas. Si Vishnusarman hunc in
modum exorsus fuisset, iure quaeri poterat: quid dignum proferet tanto
promissor hiatu? — Enimvero is sedulo dissimulat magistri supercilium,
et nihil aliud adolescentibus pollicetur, quam delectationem e lepidis fa-
bulis percipiendam. S. Prius distichon Bhartriharis est; cf. ed. Ser.
p. 57. Laudatur etiam in gramm. Yatesiana p. 330, primo et tertio he-
mist. omisso, secundo et quarto hunc in modum variato: *b. . . अंधुडनो . . .*
. . . . परं देवतं । *d. . . राजसुपूजिता शुचि धनं*“

— 48. c. तु e cod. Pp. pro च; postulatur particula adversativa.
विनोद् proprie est depulsio curarum (radix तुः enim dimissionem notat),
sed usurpatur plerumque de delectatione, quae libris eleganter scriptis
legendis vel audiendis animo percipitur. Sic de fabula audienda Mâl.
Mâdh. prolog.: आदिष्टोऽस्मि परिषदा यथा केनचिद्पूर्वप्रकरणोन वर्यं विनोदितव्या इति ।

L. 18 — 20. P. तद्य सांप्रतं भवतां etc. Pp. तद्वतु भवतां etc. quibus addita- P. 9.
mentis commode carebit textus. — काककूममृगाखूनां Pp. quod e dist. proxime
seq. huc migrasse videtur. अथ praemittit P. verbis राजपुत्रैरुन्तः । — आर्य e P.,
Pp. minus apte देव, qui titulus regum est proprius. Post शृणुत addunt
edd. शूद्रं, otiose. Cod. P. विष्णुशर्मणोऽन्तः । संप्रति मित्रलाभः शूद्रतां यस्य etc.

Dist. 1. d. Codd. et ed. Ser. मृगालवः quae scriptura per se genuina
est, sed minus in hunc locum convenit. Enumerantur enim exempla,
quibus comprobetur positio generalis. Quae vis est propria syllabae वत्,
adverbia formandi gratia affixa. Cf. Wilk. Gr. §. 1038. Plane similem
eius usum vidimus supra; prooem. dist. 34. S.

L. 3. In commate secundo edd. सोऽब्रवीत् । Sequimur omnino in hisce
formulis, quibus introducitur quaeque narratio, auctoritatem codd. nisi
ubi aliud suadeat perspicuitas orationis, cui ab editoribus aequa ac li-
brariis saepius male consulitur; silentio igitur praetermisimus huiuscen-
modi varietatem scripturae; quod idem valet de fine fabularum, ubi
ante repetitum hemistichium primum distichi, quo unicuique fabulae

P. 9. praeluditur, in solenni hac formula: अतोऽहं ब्रवीमि nonnunquam scriptum invenitur प्रब्रवीमि.

L. 4. प्रालमलिस्तरः P. — -लिः तद् Pp. quod mendum est in codd. haud raro obvium; sed ne cod. P. scriptura quidem in hunc locum quadrat; postulatur enim compositum. — आगच्य P. utraque forma legitima, neque ullam deprehendere mihi contigit legem, qua inter eas discriminem statui posset. — देशान्तराद् P. mira lectio nec solito sensu hic accipi potest अन्तर्, quod nominis more additur et *aliud* valet, qua de re infra; statuenda est potius h. l. alia vocis significatio: *pars interior*; sed vel haec parum convenit et reiicienda potius omnino est lectio.

L. 5. रजन्यां e codd. — Edd. राजौ, minus ornate. चरमाचल, e cod. P. id. voluit Pp. sed omisit अचल. Edd. अस्ताचल eodem sensu, sed tritum. Praetulit in hac descriptione auctor verba poetica hoc, nisi fallor, consilio, ut sesquipedalia quorundam magniloquorum poetarum verba rideret.

L. 6. लघुपतनकनामा. Ed. L. vitiōse नाम; hoc vocabulum enim aut componitur cum nomine proprio et secundum personae cuiusque genus inflectitur; aut nomini declinato additur adverbii more: *nomine*; sed posterior ratio, si bene animadverti, ad nominativum est restringenda. प्रबुद्धः सन् codd., quem loquendi usum, quanquam recentiorem, suadentibus libris Mscptis, in seqq. saepius conservavimus, quippe qui haud alienus sit a genere sermonis, quod per totum hunc librum obtinet. — द्वितीयकृतां P. minus bene. आयान्ते e codd. — Edd. अटन्ते quod verbum parum hoc convenit; non enim fortuito sylvam *pervagatur* venator, sed certo consilio retia tendendi advenit.

L. 7. आलोक्य codd. Discrimen est inter आलोक et अवलोक; prius est necopinato et de repente conspicere, posterius consulto et accurate contemplari; cf. schol. ad Mâl. M. I, 20. cuius discriminis ignari saepissime unum pro altero male ponunt librarii, neque qui hoc ignoret probe intelliget hunc Valmicens versum (Râm. II, 47, 2.) शोकताशुपरिघृता वीक्षणास्तततः। आलोकमपि रामर्य न पश्यन्ति स्म दुःखिताः ॥ जाते deest in codd., iusto brevius. Post comma तद् e codd. additum.

L. 8. जाने किमनिः दर्शयिष्यतीत्यालोच्य तद् etc. in quibus verbis अनिः ineleganter repetitum est, neque placet h. l. आलोच्य, de cuius verbi vi propria alio loco dicam.

L. 9. यतः e codd. et ed. Ser.

L. 8. तदनुसरणक्रमेण । Illustrabo breviter haec verba, quorum prius P. 9. a Wilsone omissum, alterum haud satis est explicatum. अनुसरण et अनुसार उत्रumque indicat actum insequendi, hoc tamen discrimine, ut prius actum in universum designet et notionem infinitivi contineat, posterius de singulo et definito sequendi actu ponatur. Sic infra p. 98, l. 21. p. 99, 2. et Mêgh. Dût. v. 83. अनुसरण; contra Mâl. M. p. 28, l. 1. पादानुसार, Râm. II, 47, 13 सर्वानुसार. In loco infr. p. 68. l. 13. accedit notioni insequendi sensus quaerendi. Alienâ vero est a rad. ए cum praep. अनु composita significatio obsequendi, neque in hoc *Véddânta-Sârae minoris* loco (p. 4. l. 5.) aliud quid significat, quam sequi: जन्ममरणादिसंसारानलसंतप्तो दीक्षाशिरा जलराशिमिक उपहारपाणि: श्रोत्रियं ब्रह्मनिः गुरुसुपूर्वत्य तमनुसरति ॥ quod ideo moneo, ne quis suspicetur, cadere in hoc verbum, sicuti in alia verba *eundi*, quae praep. अनु praefixam sibi habeant, significationem *parendi*, *observandi* regulam vel *praecepta*, et si qua alia huic sit similis. तद् ut nemo non videt, est pro तद्य, sc. व्याख्या. Ad क्रम quod attinet, id nunc non ago, ut omnes vocis significations eruam, de instrumentalî casu क्रमेण tantum hic est sermo. क्रम a rad. क्रम्, incedere, est *incessus*, deinde *ordo*, quo inceditur, *series*; hinc fluxit sensus, quo क्रमेण plerumque ponitur, *consilium*, ex quo oritur quidam ordo quasi actionum; consilium autem si simulatur, est *praetextus*. Prior significatio cernitur in loco nostro, atque infra p. 92, 1. supra p. 8, l. 15. प्रस्तावक्रमेण, praelusionis consilio i. e. praeludii caussa: altera Mâl. M. p. 25, l. 2. Tertius casus ponitur eadem ratione, iuxta quam Sanscrite diciunt गद्धति पथा. Vides igitur vim vocabuli क्रमेण alii voci additi haud multum differre a praepositione *propter*, quem sensum tri-buas verbis वचनक्रमेण p. 25, l. 10. necesse est.

Dist. 2. a et b. स्थानं utroque hemist. ed. Ser. sensu cassum.

Lin. 11. Sic cod. Pp. — Edd. अन्यच्च commate seiungunt a seqq. quod recte fit, quando duobus distichis similis argumenti interponitur; hic autem est ipsius sententiae pars; deinde ante अवश्यं inserunt edd. et P. इदं cuius vice elegantius fungitur अन्यत्. Pro विषयिणां P. praebet विषयैषिणां, quod glossae speciem prae se fert. Idem mox अवश्यकर्तव्यं । S.

Dist. 3. c. श्रोकानि Pp., sed praferendus est genitivus pendens a किं.

Lin. 14. Pro अय P. अनन्तरं, Pp. अग्रे च. Post व्याख्येन in cod. P. additur: अरण्यमध्ये. Post विस्तोर्ण ed. Ser. inserit कुत्वा, perperam.

P. 9. — 15. Verba स स्थितः male in utroque cod. desiderantur. Pro तस्मै
ed. Ser. अस्मिन्. P. अस्मिन्नेव प्रस्तावे.

P. 10. P. 10. l. 1. Codd. सर्पन् — l. 2. आलुधान् Pp. quod inusitatum certe est
atque haud scio, an omnino dici possit. कण omisit P. qui mox mutato
ordine: कपोतान् आह कपोतराहः ।

Lin. 3. तावन् e codd.- Edd. negationem collocant ante verbum; falso:
hoc enim foret: faustum hoc non conspicio; nostrum: video hoc non
esse faustum. Pp. भद्रकं. P. omittit इदं.

Lin. 4. Pp. आलोभेन, sed vid. supr. l. 2. Idem omittit तथा.

— 5. Versui praemittunt codd. यतः, qua particula adiecta diri-
mitur nexus, qui inter orationem solutam et versus intercedit. Con-
structio est, si simul ellipsis explemus: तथास्याभिर्वितव्यं यथा (अभवत्) पथिकः —
मानः — संप्राप्तः — मृतः ॥

Dist. 4. b. पंक्षुदुस्तरे, quod durius est. — d. संमृतो edd. Pessime.

Lin. 8. अपश्यत् Pp. vitiose. Ne in अपश्यत् quis haereat, monendum est,
पश्च saepius tales in modum poni, ut non sit *conspicere*, sed *interesse rei*,
praesentem esse; quod potissimum cadit in participium *praes.* huius verbi,
genitivo vel locativo consequentiae, ut dicunt, posito. Sic Rām. I, LIV,
18. विश्वामित्रस्य पश्यतः ॥

Ibid. एको om. P. et recte quidem. Alienus est enim a puriore
sermone Sanscrito hic usus nominis numeralis एक, quum eodem sensu
ponitur, atque in nostris linguis articulus quem vocamus indefinitum:
obtinet contra in hodierno Bengalorum sermone, forsitan etiam in aliis
cognatis dialectis; unde haud semel in libros Sanscrite quidem, sed
seriore aevo conscriptos, irrepsit. Vid. cl. Haughtonis Beng. Gram. §. 61.
p. 15. Sed servanda fuit a nobis hoc loco, sicuti in aliis quibusdam,
scriptura, quam et codices tuentur et totum dicendi genus, ad quod
pertinet fabularum liber.

Lin. 9. पान्धा Pp. quae scriptura valde mihi arridet; alloquitur enim
h. l. tigris non certum quendam viatorem, sed in universum omnes,
qui forte transirent. *Ibid.* मधेदं P. Verba inde a तद्वचं usque ad भजते ex
P. recepimus; optime enim illustrant narrationem.

Lin. 10. P. ततो लोभाकृष्ण चेतसा केनचित् पान्धेनावलोकितं आह च । in quibus
verbis nec placent duo casus tertii ineleganter sibi appositi, neque huc
quadrat अवलोकितं । आह minus bene positum est propter constructionem

mutatam et nullo prorsus orationis damno omitti potest; quae enim se- P. 10.
quuntur secum volvit viator. Post एतत् Pp. addit अपि.

Lin. 11. P. संभवतीति किंत्वस्मिन्यर्थे संदेहप्रवृत्तिर्थ विधिः ॥ quocum consentit Pp. nisi quod इति omittit et अर्थसंदेहे praebet. In quibus इति prorsus est otiosum, अर्थे vitiosum. अर्थसंदेहे et विधिः ferri possunt; nostra tamen lectio simplicior est, ideoque praefferenda.

Dist. 5. b. मतिः P. pro गतिः mendose. *Ibid. c.* यत्रास्ते edd. quod e scriptura Bengalica male lecta ortum esse videtur. De dativo यूत्वे supra dictum est ad dist. 6. prooem. यत्र idem est ac यस्मिन् et referendum ad अस्ति; particula enim haec et aliae huic similes saepissime usurpantur pro casibus pronominalium, a quibus derivatae sunt; qua de re si dubites, cf. hosce locos: तत्र pro तस्मिन् Bhag. Gīt. VIII, 18. XVIII, 4. 16. ततः pro तत्स्मात् Bhag. Gīt. II, 36. VI, 22. अत्र pro अस्मिन् infra 12, 10.

Lin. 14. Edd. प्रवृत्तिः inserunt ante संदेहः; sic etiam Pp. sed componit hoc vocabulum cum anteced. legendo: अर्जन — P. अर्थोपार्जनादौ संदेह एव; igitur omittit प्रवृत्तिः, recte; nam ex praeced. irrepsit; ceteris varr. lectt. nil frugis affertur textui.

Dist. 6. c. पुनः h. l. ut saepius non *iterum* valet, sed *altera ex parte, contra*; quam vim etiam servat in particula composita किपुनः.

Lin. 17. Pp. निवृत्यात्. — Ed. Ser. निरूपयामि, qualia menda plerumque silentio praetermitto, interdum designo, ut iudicent lectores, qua incuria instituta sit ista editio, et discant tirones, quam diffidenter utendum sit talibus editionibus; nam mendum istud p[re]fert speciem verbi या praefixis praep. निर् et उप.

प्रकाशं vocabulum est solenne rei scenicae et hunc in modum definitur in *apophthegmatis* Bharatae, fabularum, ut fertur, apud Indos inventoris: यत् तु सर्वजनश्राव्यं प्रकाशं तदिहोच्यते । oppositum est स्वगतं, quod ab eodem hisce verbis explicatur: यत् तु आव्यं न सर्वस्य स्वगतं तदिहोच्यते । *Ibid.* ते सुवर्णाकंकणं P.

Lin. 18. मारात्मके omittit P. male.

Lin. 19 — 21. Verba inde a शृणु usque ad इदानीं desunt in utroque cod. — 19. दुर्बृहोऽहं । ex coniectura; edd. दुर्बृहोऽस्मि । quod prorsus est absurdum. — 20. pro केनचिद् Ed. Lond. केन, inepte. धार्मिकेन addit Ed. Ser. quod recte scribendum erat per या; sed abundat.

Lin. 21. अहमपि Pp. sed otiosa est h. l. particula.

P. 10. *Lin.* 22. दाता च, omissio वृङ्; Pp. — गलितनवद्नहस्तनयमः P. ridicule. — कथं न e codd., edd. न कथं, quae positio dura est, immo h. l. vitiosa.

P. 11. *Dist.* 7. d. धर्मस्य, e coniect. quam deinde confirmavit Pp. Ceteri धर्मश्च.
— 8. a. पूर्व, Pp., idem mox: दमार्थाः पि हि, quod vix ferri potest, et particula हि est supervacua.

— — d. न महत्वपि Pp. महात्मसु च तिष्ठति P. Prius absurde, posterius eundem sensum ac nostra lectio praebet, sed male dictum est; च enim post तु prorsus abundat et एव unice huc convenit, cuius particulae praecipuus est usus, ut insignius reddat vocabulum, cui additur, atque significet, in quanam voce totus orationis quasi cardo sit positus. Cuius usus exempla permulta in quolibet libro peritiores deprehendent.

Lin. 5 — 7. स्व om. P. गतं pro स्व Pp. Facile est observatu, peculiari quadam vi positum h. l. esse pron. relativum येन, quod non simpliciter valeat: *propter quam* (cupiditatis absentiam), sed *ita ut propter eam*; continetur enim consecutionis notio vocabulo praecedente एतावत्. Eandem vim in relativam vocem exercet एतादृश vid. inf. p. 19, l. 3. ubi यत् 'fit coniunctio finalis. Neque aliter se habet pron. relat. in hac Ciceronis sententia: *talem te esse oportet, qui ab impiorum civium societate te seiungas.* Quae quum ita sunt, miror BOPPIUM, Vir. clar. in eum induci semetipsum passum esse errorem, ut contendat, nil omnino discriminis interesse inter potestatem vocabb. तद् et एतावत्. Vid. quae disputata sunt ad librum *Arjunas Reise* p. 110. At sententiam eius neque stabilient interpretationes locorum Sanscritorum vernaculae; nam male redditur necesse est quae male sunt intellecta; neque auctoritas WILKINSI, quem innocentum erroris sui participem facere studet Boppius. Levissima nimirum res est, quae professori Berolinensi fraudem fecit. W. definierat एतावत् : *this or thus much, many.* (Gr. §. 909.) quo nil verius esse potest; Anglicā vero verba Boppius mutavit in *this, thus, much, many,* negans duas ultimas a W. positas significationes usquam se invenire meminisse. Ipse, credo, negabit Wilkinsius, qui unam tantum posuit vocabuli एतावत् potestatem: *this much sive thus much, si singularis est; sin pluralis, thus many.* Si id dicere voluisset, quod dicere eum opinatus est Boppius, omisisset partic. disiunct. or et commate *this a thus* seiunxisset. A तावत्, unde fluxit, eadem ratione differt एतावत्, qua τοσοῦτος a τόσος: तावत् tantum correlativa est vox; praefixa diphthongo

ए, additur correlationi notio demonstrationis. Ad तावत् aut appositum P. 11. est यावत् aut cogitatione supplendum; ad एतावत् non facile apponitur, quia एतावत् refertur ad rem in conspectu positam et nulla ampliore definitione gentem, aut ad rem non comparatione cum alia, sed ex sui ipsius accidentibus metiendam. Quoties sermoni cuiusdam additur एतावदुक्ता, hoc valet: *tantum dictum esse, quantum praecedente sermone contineatur;* quod quantum differat a नद् mirum est dicere. Exempla huius vocis sunt infr. p. 24, l. 11. II, dist. 21. p. 60, l. 10. p. 71, l. 17. p. 98, l. 14. Alia alii libri praebent, quae omnia hic afferre non opus erit; unum addam, ex quo solo attente legens vim vocabuli perspiciet: अहमेवासमेवाये नायगत् सदसन् दरं । पश्चादहं यदेतच्च योऽवशिष्येत सोऽस्यहं ॥ क्रतेऽर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि । तद्विद्या-दात्मनो मायां यथा भासो यथा तमः ॥ यथा महान्ति भूतानि भूतेषूच्यावचेष्वनुः । प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहं ॥ एतावदेव जिज्ञास्यं तच्चिज्ञासुनात्मनः । अन्वयव्यतिरेकाणां यत् स्यात् सर्वत्र सर्वदा ॥ Verba a Jonesio ex Sri-Bhagavato excitata sunt As. Res. T. 1. p. 33. ed. Lond. Ut uno verbo dicam: aequalitas duarum rerum vocibus यावत् et तावत्, unius rei cum se ipsa aut cum attributis suis declaratur vocabulo एतावत्. LASS. — Operae pretium erat accuratius haec excutere, quam adhuc factum est, quoniam vocabulum एतावत् desideratur in Wilsonis lexico, utpote praetermissum in glossariis Indicis. Proxime huic cognata vocabula Amarasinghas luculenter et breviter, ut solet, definit: यावत् तावत्या साकल्ये वर्थौ मासे व्रथारणे । «Exprimunt, inquit, totum, terminum, quantitatem, affirmationem.» Affirmandi usus in voce तावत्, ut sit *sane, certe*, minus vulgatus est. Habemus tamen eius exempla. Hitop. pag. 15, lin. 18. — A तावत् formatur एतावत् sicuti एतत् a नत्, eadem plane ratione, eodemque sensus discrimine. Utrumque δεικτικῶς usurpat. Trium priorum significationum quas Amarasinghas vocabulo तावत् tribuit, vox inde deflexa quodammodo est particeps. In एतावदुक्ता aliisque eiusmodi locutionibus indicat *terminum*, quo progressus est sermo, ac reddi debet per *hactenus*. Quando simpliciter ponitur sine pronomine relativō, saepe habet emphasin et vim quandam peculiarem. Sic Hitop. p. 27. l. 18, 19: «Quomodo fieri potest, ut mus iste, animal imbecillum, *tam longe* prosiliat?» Invicem sibi respondentia vocabula तावत् — यावत्, secundum varias significaciones, quas assumunt, Latine redundunt per *tantus* — *quantus*, *tamdiu* — *quamdiu*, et in plurali numero per *tot* — *quot*. Quando एतावत् a pronomine यत् excipitur, similiter eius vice fungitur *tantus*, sequente

P. II. *qui cum coniunctivo verbi.* Ex. gr. in loco de quo nunc agitur: „*Tanta est abstinentia mea ab omni lucro, qua commotus cupiam dare armillam etc.*” Errorem suum vix credibilem nondum agnovisse videtur Boppius, quandoquidem in altera *Nali* editione, Cap. IV, sl. 31 pertinaciter *hoc pro hactenus* retinuit. — एतावता द्युज्ञानतमसावृतः कश्चिन्मूर्खः पणितमानी मुक्ष्याति धेन स तदेतावत्योर्विशेषः कोऽपि नास्तीत्याह । SCHL.

Lin. 6. किंतु omittunt edd., male; servit enim haec particula adversativa corrigendis et restringendis eis, quae iam dicta sunt et iungitur cum तथापि, sicuti Latini dicunt: *tamen nihilominus*. P. inserit हि ante दुर्भिवारः: male.

Dist. 9. c. धर्म P. vitiose. प्रमाणायति, *proponit tanquam exemplar*, verbum est nominale a प्रमाण derivatum, qualia permulta a poetis, praesertim senioribus, formantur. Quae occurrunt in Hitopadesa exempla, haec sunt:

- I, dist. 63. हुम्यायते, arborescit, arboris loco habetur, a हुम्, arbor.
- I, " 74. कृष्णायते, nigrum reddit, a कृष्ण, niger.
- I, " 90. सुखयति, delectat, a सुख, voluptas.
- II, " 25. दुःखोयति, dolore afficit, a दुःखिन्, dolore affectus.
- II, " 91. अमणायते, pauperatur, anachoretae instar, a अमण, anachoreta.
- II, " 96. राजायते, regem agit, a राजन्, rex.
- III, " 56. गोमयायते, fimum bubulum sapit, a गोमय, fimus bubulus.
- III, " 134. सिंहायते, leonis virtutem aemulatur, a सिंह, leo.
- IV, " 53. दोलायते, oscillat, a दोला, oscillum.

Frequentior est omnino, quam nonnulli V.V. D.D. opinati sunt, horum verborum usus apud recentiores Indicos poetas, in primis apud comicos, qui maxima in eis formandis licentiae indulgent, unde probabile fit, vel frequentiorem eorum fuisse usum in quotidiana familiaris sermonis consuetudine. Comicorum audaciam uno exemplo demonstret *Dhūrtasamādgamae* auctor (prooem. dist. 5.): कर्तृरन्ति सुधाद्वन्ति कमलाहासन्ति हंसन्ति च । प्रालेयन्ति हिमालयन्ति कर्कासारन्ति हारन्ति च । ब्रैलोक्याङ्गनरङ्गलङ्गिमगतिप्रागलभ्यसंभाविता । प्रीतांश्चोः किरणाङ्गा इव ज्यवन्येतर्हि तत्कीर्तयः ॥ Omne quam congressi exemplorum nubem huc afferre supersedeo; sufficient haec ex uno tantum libro, *Bhartriharis distichis*, temere collecta: p. 30. l. 3. विषयायते । p. 33. l. 8. कान्तायते । p. 41. lin. 4. infr. कर्त्तव्यस्ति । p. 53. l. 5. infr. वैरायते । p. 56. l. 6. inf.

कूपायते । स्वल्पशिलायते । कुरङ्गायते । माल्यगुणायते । पीयूषवर्षायते । p. 64. l. 5. infr. शिथि- P. 11.
लायते । तरुणायते । p. 94. l. 2. अमित्रायते ।

Lin. 10. मथा च ed. Ser. et Pp. — यथा शृणु P.

Dist. 10. Inserit ante hos versus Ed. Lond. aliud distichon, quod solus Wilkinsius agnoscit, sed alio loco, ante dist. 12, exhibet:

मरुस्थल्यां यथा वृष्टिः क्षुधार्ते भोजनं तथा ।
दरिद्रे दीयते दानं सफलं पाण्डुनन्दन ॥

Ed. L. vitiose praebet स्थल्यं; *Bernstenius* iam coniecerat स्थल्ये; sed veram emendationem indicavit *Bibliotheca Indica* II, p. 43. Vix probum est vocabulum मरुस्थल्य; et probabilius est vocalem आ culpa typothetae omis- sam esse, quam mutatum esse ए in *Anusvaram*. Desumti sunt hi versus sicuti seq. dist. 13. haud dubie e libro quodam Bharateae.

— 10. c. Pro सर्वत्र Ed. L. भूतेषु, S. भूतानां । prior lectio e codice Wilkinsiano fluxisse videtur; utraque autem posthabenda est nostrae, quae idem valet ac सर्वेषु भूतेषु । Verba hemistichii tertii ipsissima leguntur Bhag. Git. VI, 32.

— 12. b. द्रवेषु Ed. S. vitiose. Omisit dist. Pp.

Lin. 17. अतीव S. अति et mox तत् omittit Pp. — P. दुर्गतदरिक्षत्वं तेनाहं दातुं सप्रयत्नः । Aggregativum (*dvandva*) a quo incipiunt haec verba, ferri potest, sed inusitatius est in simplici prosa oratione.

Dist. 13. d. S. praebet नौरुजस्य quod alienum est ab hoc loco. Cf. *Wils.* s. h. v. In fine Pp. शौषधं । vitiose; constructio enim haec postulat genitivum personae, cui opus sit re quadam, et instrumentalem rei, qua sit opus. Cf. Bhag. Git. I, 32. Subintelligitur कर्तव्यं vel कार्यं; vid. ex. gr. Rām. ed. Ser. II, XII, 26. (Tom. II, p. 209.) Interdum etiam अर्थः, ex. gr. Bhartrih. p. 57, l. 2.

— 14. d. Pro स्मृतं ed. Ser. et P. विदुः । per se nil refert, sed tuetur prius liber, unde desumtum est distichon, Bhag. Git. XVII, 20.

Lin. 1. अत्र om. P. प्रति e Pp. असौ पान्यः स्नातुं लोभाकृष्णेन चेतसा सरप्रविष्टं तावन् etc. P. 12. P. in quibus पान्यः otiosum est, लोभाकृष्णेन चेतसा e margine invecta, ubi verba supra (p. 10, l. 10) obvia adscripta fuerant; सर् mendum vix annotatione dignum pro सरः, प्रविष्टं autem vitiosum pro — विषस्तावन् etc. — लोभात् abest a Pp. — Pro सरसि ed. Ser. सरः, quam scripturam Bernstenius ad hunc

P. 12. locum nequaquam spernendam esse arbitratur, in qua observatione accusatio rem constructionis Sanscritae (de prosa oratione loquor) cognitio nem desidero. प्रविश्य cum accusativo quidem construitur, verum si hoc loco hanc iuncturam p raeferendam censemus, transponenda sunt verba, ita ut सः nullo vocabulo interiecto a प्रविशति excipiatur; quod re vera facit Pp. In nostra lectione pendet सति a सातं.

Lin. 4. अहं ex ed. Ser., in ceteris conspirant edd. ex quibus hunc locum exhibuimus. Codd. brevius: - अक्षमः पंके निकानोऽसि त्वां पंकादुत्यापायामौत्युक्ता ततः श्रान्तैः श्रान्तैरुपाय व्याख्येण धृतोऽचिंतयत् । P. - अक्षमः श्रान्तैः श्रान्तैरुपाय तेन व्याख्येण धृतो Pp. etc. in quibus quae displiceant, haud egent mea expositione.

Dist. 15. c. अतिरिक्ते. De significatu huius verbi disputatum est in Bibl. Indic. II, p. 234. Locis ibi laudatis addi potest Ram. I, XVI, 14. Verbi huius cum अति compositi notio in universum est *praevalere*, quod in malam etiam partem nonnunquam accipitur; uti Bhag. Git. II, 54. et Bhartrihar. p. 37. ed. Ser. Constructio duplex est; aut cum ablativo rei, cui quid anteponatur; quod inde explicandum est, quod in hoc verbo lateat notio comparativi, qui ablativum requirit; aut cum accusativo, cuius rei in caussa esse videtur praepositio अति, cum qua composita pleraque verba eundem casum regunt. Activam et medianam huius verbi formam nullis in locis me legere memini. Primariam radicis vim *disiungere*, *miscere* esse statuunt grammatici; *purgandi* notionem ad septimam coniugationem restringunt; addit Rosenius *coniungere*; sed hoc suo periculo fecit, minus recte interpretatus संपर्कवियोगादः (नियोग ap. Rosenium peccatum est operarum). Hae tamen significaciones parum accommodatae videntur ad hosce Calidasi locos: (Urvasi - Vicrama Act. I, fol. 6. recto cod. Paris.) आविर्भूते प्रश्निनि तमसा रिच्यमानेव रात्रिः । Mêgh. Dût. 21. दिक्ः सर्वे भवति हि लघुः पूर्णतामौरवाय । Quos locos eo consilio laudavi, ut habeat Rosenius meus denuo radd. Sanscrit. illustratus momenta quaedam ad hanc radicem accuratius definiendam. Nil omnino in linguis difficilius est, quam primariam cuiusque verbi vim ita definire, ut inde perspiciatur, quomodo ab illa, veluti a capite, omnes ceterae significationes sint derivatae.

Dist. 16. b. हस्तिनैनामिव क्रिया Pp.; quae verba quid h. l. sibi velint, haud assequor; idem mox प्रायं, inepte.

Ibid. d. ज्ञानं भावक्रियां विना P. quae verba re vera a nostra scriptura haud sunt diversa; omissum enim est geminum punctum in fine voca-

buli भाव, ut sit in codd. Indicis saepissime; litterae autem श्वर् et रुप् in scriptura Bengalica facillime confunduntur. P. 12.

Lin. 10. तन्मया भद्रं etc. Pp. तन्मया न भद्रं P.

Dist. 17. Omittunt hos versus h. l. codd., neque aliter interpp.; omnes tamen eos agnoscunt, sed aliis in locis. Mutatio casuum, quae in hoc disticho comparet, ab omni suspicione immunis esse debet, quippe quae minime sit inaudita.

Excipitur distichon 18. in utraque editione ab hisce versibus, utriusque interpreti pariter ignotis:

स हि गगणविद्वारी कल्मषधंसकारी ।
दशशतकरधारी ज्योतिषां मध्यचारी ।
विधुरपि विधियोगाद्वस्थते रुद्रणास्तौ ।
लिखितमपि ललाटे प्रोङ्कितुं कः समर्थः ॥

Versus ab hoc loco alieni, neque enim de dura fati necessitate sermo fit, sed de ingenio unicuique animalium innato atque indelebili; cuius rei oblitum sese conqueritur viator, quum in falso et feroci animali fiduciam poneret. Ultimus versus ad notas, membris natura impressas, ex quibus hominis fortuna praedici posse credebatur, referendus esse videtur; लक्षणानि vocant Indi; quae indicia quum in manibus investigentur, Chiromantiam constituunt; *metopomantiam* etiam agnoverunt Indi.

Lin. 15. इति चिन्तयित्वैवासौ P. sed praesens multo praestantius. — l. 16. pro अथ edd. अतः, quod retinere debebamus. कर्म omittit P. male. In fine addunt edd. इति, quae particula innumeris paene locis inscite a librariis intruditur.

Dist. 19. d. -काले न च P.

Lin. 20. वचनं abest a codd. — P. mox: सर्वः कश्चिदाह, male omissos: कपोतः Pp. सर्वः कपोतः कश्चिदुवाच । ad idem redit.

Dist. 20. a. वृद्धर्य edd. — b. हि tuentur libri omnes, quanquam manifestum est, hiatus vitandi gratia insertam esse particulam hic otiosam. c. et d. ex Pp. quocum P. consentit, nisi quod भोजने न च मैयुने scribit. Edd. in ceteris ut Pp., sed pro एवं praebent एवं, quod iungendum foret cum विचारेण, «hunc in modum deliberando;» एवं, ut nemo non videt, ad वृद्धानां referendum est: deliberatio, qualem senes instituere so-

P. 12. lent. Scriptura P. difficilior est explicatu; in constructione haereo; nam unde pendet instrumentalis iste, si omittatur अप्रवर्तनं? Exposui supra (ad dist. 13.) constructionem, qua ex. gr. dicitur किं मम तेन, quid opus mihi hac re? quae constructio si omissa interrogatione (ignoro enim) legitima esset, penderet किंचारेण a कर्त्ता subintellecto et hic evaderet sensus: in esu et venere haud opus (nil proficitur) deliberatione, qualem in omnibus rebus instituunt isti (senes).

P. 13. Dist. 21. c. निवृत्तिः codd. — d. कुतो न वा । Pp. Utrumque, nisi fallor, reiiciendum.

— 22. a. ईर्ष्यो edd. et P. Exquisitiorem lectionem debemus Pp. — Omnes deinde त्वसंतुष्टः, sed particula हु h. l. prorsus intoleranda. — d. P. . . . निलयदुःखिताः ॥

Lin. 5. एतत् श्रुत्वा Pp. quam scripturam nullo alio consilio enotavi, quam ut observarem, haud infreuerter in libris Mscptis negligi regulam mutationis incommodam sane et ad nostrum sensum auribus ingratam, cui tamen obtemperare necesse est, Panine auctore. Lect. VIII, 4. §. 40.

Dist. 23. a. शुभहन्ति Pp. — — d. P. किञ्चयन्ते ये हि लोभिताः; minime spernenda lectio; ये हि, quippe qui. De हु class. 10. cf. Rosen s. v.

Dist. 24 deest in codd., interpretati sunt Jonesius et Wilkins. — Sola deinde ed. Lond. inserit hosce versus:

अन्यच्च । असंभवं हेममृगस्य जन्म तथापि रामो लुलुभे मृगाय ।

प्रायः समापनविपत्तिकाले धियोऽपि पुंसां मलिना भवति ॥

«Haud probabilis est dorcadis aureae generatio: nihilominus talem dorcadem appetivit Rāmas; appropinquante adversae fortunae tempore saepius mentes virorum contaminantur.»

Interpretatus est W. sed male intellexit vocabulum मृगाय, quod per venationem reddidit, quasi scriptum fuisset मृगाय, quod respuit metrum atque grammatica. Spectant versus ad narrationem de raptu Sitae, in tertio Rameidos libro obviam; quae quodammodo in proverbium abiit, ut dicatur de conatu irrito, venari dorcadem auream. Alludit eo in fabularum collectione *Vetāla-Panchavins'atī* dicta, ignotus poeta, cuius verba miserrime foedaverunt librarii. Propter similitudinem argumenti apponam tamen quae intellectu sunt facilia: रामो हेममृगं न वेत्ति..प्रायः सत्पुरुषो विनाशस्तमये बुद्ध्या परित्यजते ॥

Lin. 10. क्योताः ante सर्वे add. Pp. — निबद्धाः Ser. — बभूः in fine comma- P. 13. tis addunt edd. quod omisimus, auctoritate codicum, inter quos Pp. praebet सूत्रगालेन, quod legisse videtur Jonesius, vertens: *in the meshes of the net*, sed hoc potius foret: जालसूत्रेण । P. सूत्रसंचारितगालेन; quae verba ab alio loco (p. 65. l. 13.) mutuata esse videntur. ततो omittunt codd. — Pro अबलंबिताः P. उपविदाः, quod repetitum est ex linea 5. — Pp. विलम्बिताः, male; hoc enim est *cunctati*; L. अबलम्भिताः, quod retinuit Bernstenius; mendose. mox सर्वे omittit P.

Dist. 25. c. कार्ये P., quod ferri potest.

Subiungunt deinde edd. hunc slocum, a neutro interprete expressum:

तथा चोक्तं । आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः ।

तज्जयः संपदां मार्गी येनेष्टं तेन गम्यतां ॥

«Impotentia sensuum calamitatum dicitur trames; eorundem coercitio via est felicitatum. Qua desiderabile sit, eam sequere.»

Dist. 27. b. आपदुद्वरणे चनः P. उद्धारण Pp. sed nomini a forma causativa derivato hic nullus est locus.

— c. Pp.: न त्वतीतपरित्राणः । — Paulo obscurior est alter distichi versus propter ambiguitatem verborum. Nam भौति pro adiectivo positum, est *pavidus*, pro substantivo generis neutrius, istud ipsum, quod timeatur; परित्ति tum virum doctum, sapientem significat, tum sollerterem: quo sensu in malam partem accipi potest, de inepta ingenii affectatione et importuna sedulitate; उपालम्भ, aut *cunctatio* est, aut *vituperatio*. Quomodo intelligendum sit utrumque vocabulum, docet nos totius narrationis tenor. Palumbes socium obiurgant, cuius consilio freti in rete inciderant. Rex eorum, nil attinet, inquit, huius culpam coarguere; cogitandum est potius, quomodo hinc nos extricemus. Emendatione omnino eget versus. Sufficeret mihi lectio cod. Pp. ad sensum legitimum eliciendum, si वस्तु de personis, sive de animantibus, quales sunt fabularum personae, dici posset. Sed desunt exempla. Cf. infra p. 14, l. 4, et p. 53, l. 22. Si pro वस्तु substituas बन्धु, ceteris haud mutatis: न त्वतीतपरित्राणाबन्धूपालम्भपरित्तिः । evadet sententia satis ad rem accommodata: «Is demum verus est socius, qui malo oppressos extrahere e calamitate valet; non autem is, qui sollers est in obiurgandis sociis, tempore periculi avertendi praetermisso laborantibus.» — Si vocabula prioris hemistichii

P. 15. septimo casu absoluto separatim ponantur, substitui poterit हेतु. Cf. dist. proxime praecedens, b. — Tentabam quoque, insistens vestigiis lectionis vulgatae: न तु भीतः परिचाणे वस्त्रूपालम्बयपितः । Displacet repetita particula तु, sed quodammodo defendi potest, quoniam ad diversa refertur: «non vero is, qui pavidus in auxilio ferendo, contra sollers est in vituperando. S.

Lin. 19. एव om. P. — Pp. विपक्तालविस्मयमेतत् कापुरुषस्य लक्षणं । vitiose; pervertitur enim omnino loci sensus, et subiectum positionis विस्मय in praedicatum mutatur; neque dicere vult auctor, ignavi hominis esse admirari de adverso tempore, sed eius esse obstupesceri, instante tempore adverso.

Dist. 28. Auctor distichi est Bhartrihareś; cf. ed. Ser. p. 43. Inserunt deinde edd. hosce versus:

संपदि यस्य न वृष्टो विपदि विषादो [न] रणे च धीरतं ।
तं भुवनत्रयतिलकं जनयति जननी सुतं विश्वलं ॥

न metrum foedat, et expungi debet; quod haud animadvertisse editorem Londin. miror, vel potius non miror; nam supra eius ingenium tales sunt quisquiliae: विश्वलं, adverb. *raro*, oppositum est अविश्वलं, i. e. continuo, nullo interiecto tempore. Eadem significatio est adiectivis विश्वल् et अविश्वल्. Vid. Bhartrih. p. 55. Mâl. Mâdh. p. 18. Vétâl. Panchav. III, 3.

P. 14. *Dist. 29. a.* पुरुषेणैव P. minus bene.

Lin. 3. जालमिदसपाक्रियतां Pp. cetera bene se habent, sed haud scio an dici possit अपाकरोति, in quo verbo praepositioni आ locus non esse videtur. Voluit fortasse अपाहियतां

Dist. 30 et 31. Ordinem horum distichorum invertunt P. et W., 31 omittit Pp. In ultimo hemistichio 30 Pp. हस्तिनः । — Edd. et W. मत्तदत्तिनः, omissis एवि हि; sed nostra scriptura praestantior.

— 31. c. d. P. . . . परित्यक्तस्तप्तुलो न प्ररोहति ॥

Lin. 8. विचिन्त्य edd. स om. Pp. —

— 9. सुदूरात् om. P. — अप om. Pp. — तांश्च, male P. haud enim habet istud च, quo referatur. धावितो Pp. et S. minus bene; inter currendum enim cogitat, non postquam cucurrerat.

Dist. 32. a. हस्तन्येते Pp. — c. निपदिष्वन्ते id. vitiose. — तु in primo hemistichio omnium librorum consensu gaudet, quanquam certissimum sit, huic particulae heic nullum esse locum; neque ad praecedens quod-

dam distichon, quocum coniunctum fuerit slocus noster, referri potest; P. 14. patet enim his versibus nullum alium esse auctorem, quam ipsi Hitopadesae; cuius rei exempla haud pauca exstant. Certam emendationem in promptu non habeo; quod quibusdam mirum fortasse videbitur, neque habeo tamen.

Post hoc distichon solus Pp. hunc in modum pergit: इति विचिन्त्य पश्चादति (sic; lege: पश्चादावति) वेगेन । धावनं व्याधमवलोक्य चित्रघोषोऽवदत् । इदर्मोभेतस्य चक्षुर्विषयमतिक्रम्य मूर्द्धरुड्डीयतां सर्वैः । ततश्चक्षुर्विषयातिक्रान्तेषु etc. quae per se minime mala sunt; sed repetitione eorundem verborum laborant et brevitati studet noster. — l. 12. स व्याधो edd. — अथ mox deest in Pp.

Lin. 13. निवृत्तं repetunt edd. Pro दृष्ट्वा codd. अवलोक्य — कर्तुमुचितं edd.

Lin. 16. तदस्मिन्नरप्ये असम्भितं . . . — राजो प्रतिवर्तति P. omisso fluminis aequae ac sylvae nomine; nos secuti sumus Pp. quocum consentiunt edd. nisi quod अस्माकं scribunt; retinuimus tamen cum edd. et P. मूषिकराजः pro मूषिकः — गणितकी mendum est Londinense.

— 17. दनबलेन सो etc. L. idem vocabulum in suo exemplari legit W. magis accommodato loco sine dubio positum. — ते सर्वे P.

— 18. तत्र e codd. प्रतं द्वारं P. vitiose. Post verbum निवर्तति inserunt W. et L. hunc slocum:

अनागतभयं दृष्टा नीतिशास्त्रविशारदः ।
अवसन्मूषिकस्तत्र वृद्धः शतमुखं विलं ॥

qui versus nil habent quo se magnopere commendent, et sine ullo narrationis damno omittentur. Desumpti sunt fortasse e narrationum collectione, cui inscribitur *Vrihatkathā*, cuiusque auctor Somadevas in versus rededit plures Panchatantri fabulas. Cf. Wilsonem l. l. p. 160.

— 19. हिरण्यकः om. codd. Mox. भवेन चकितं P. — -पतो भयाच्चकितः S. Utrumque mendosum.

— 20. कं pro किं edd. ततो om. codd. Mox P. तस्मान्माकर्ण्य परिज्ञाय, quod ferri possit, mode correxeris स्वरं; articulata enim voce usus est Chitragrivas; sed praestat omnino प्रत्यभिज्ञाय; cuius verbi vis colligi potest ex Rām. I, 1, 72. legitur praeterea in scholl. ad Kāthaka Upan. p. 19.: haud enotavit Rosenius. Dixerat (l. 16.) Chitragrivas, se iam antea familiaritate Hiranyaci usum fuisse.

P. 14. Lin. 22. समायातः om. Pp.; P. समानत्वं मिलितः । Deinde (post समायातः) edd. et W. praebent sequens distichon:

यस्य मित्रेण संभाषो यस्य मित्रेण संस्थितिः ।

यस्य मित्रेण संलापस्ततो नास्तीकु पुण्यवान् ॥

Adscripti fuerant versus ad vocem पुण्यवान् in textu obviam, nec prorsus inepte, quanquam eis haud aegre carebimus. ततो idem est ac तस्मात् qua de re iam dictum est ad dist. 5. neque offendere debet positivus iunctus more comparativorum; exempla enim ubique obvia. संलापः mendum est; quo enim differt a संभाषः? Interpretatione Wilkinsii fretus (*a friend to embrace*) optime iam olim emendaverat SCHLEGELIUS संश्लेषः । Omisit Rosenius सं + श्लेषः; legitur Ram. I, 10, 28.

— 22. अथ initio commatis Sr. एतान् edd. दृष्टा iidem, qui mox संक्षिप्तयः scribunt; haud magnopere refert, adverbium tamen magis placet.

P. 15. Lin. 1. मित्र किमस्माकं प्राक्तनज्ञन्मदुष्कृतविचेष्टितमिदं । P. sic etiam Pp., inserto अन्यद् post किं, et omisso इदं; displicet summopere विचेष्टिं, quod sensum huic loco accommodatum me iudice praebet nullum.

Dist. 34. om. P. — Pp. omittit in hem. a. यथा च et hem. c. तथा, sed utrumque postulat metrum. — L. in hem. b. omittit च post यत्र, vetante versu.

Dist. 35. a. परिताप ed. Lond. minus bene. d. फलान्येक हि देहिनां । P.

Lin. 7. एतच्छुत्वा om. S. तत् pro एतत् P. — Pro हिरण्यकः S. मूर्खिकः — चिन्नग्रीववर्वनं Pp. — सत्वरं om. codd. — Pro उपर्यप्ति Pp. उथाः..

Lin. 8. Prius ना desideratur in edd. कुरु post एवं addit ed. Ser. — किं चास्त्रद् etc. edd. Sed particulae किं च, quae continuativa est et saepius distichis laudandis in hoc libro praemittitur, hic nullus est locus. — Transponunt codd. एषास्त्रद् etc. — Deinde inser. ed. Ser. comma hoc: तदा मम पाण्डं पश्चाच्छेत्यसि । in quibus, ne a vitiis essent immunia, editor Londin. पाण्डं mutavit in पाण्डां.

Lin. 9. एतान् pro एतेषां Pp.

Lin. 10. कथमहं समर्थे भवामि Pp. अहं haud male additum; verbum substantivum recentius aevum coarguit. दत्ता मे न हि etc. P. Mox pro भवतः edd. तव. P. भवतामेव पाण्डान्; hoc male; quia de unius tantum personae vinculis nunc sermo est; illud melius; est enim pluralis maiestatis neque otiosum est h. l. एव.

Lin. 11. तद् e codd. Mox यथाग्राहि P. qui et बन्धान् scribit. Edd. post P. 15. अनन्तरं perguntः अयेषां बंधनं यावच्चक्यं देत्यामि । ed. Lond. एतेषां. अपि male collocatum est, quia, si referatur particula ad adverbium temporis, tota sententia evertitur.

Lin. 12. Transponit Pp.: तथापि अस्येकं; male, nam अस्येकं protasis vice fungitur et nil aliud valet, quam magis usitatum: यथेकमस्ति । Mox edd. बंधनमेतेषां खण्डय । Pro एतेषां Pp. रुपामेव ।

Lin. 13. Pro यद् P. वा, male. यद् ad रूपां pertinet, et nota esse debet omnibus haec constructio, a qua rarissime disceditur, qua pronomen relativum nomen, a quo pendet, sibi adiungit; quo sit ut nomen eodem casu ac pronomen relativum ponatur, et addendum sit in altera positione demonstrativum, quod cum nomine in genere et numero consentiat, cuius autem casus pendeat a sententia, ad quam ipsum pertinet. Atque omnino magnum hac in re cernitur discrimen inter Indicam et plerasque alias linguas, in quibus positio relativa alii sententiae inseri solet; Indi autem plerumque praemittunt positionem relativam, subiungunt *principalem*. Quae constructio tam frequens est, ut aliae pro exceptionibus possint haberi. Neque difficile est demonstrare, cur a relativo attrahatur nomen; praemiso enim relativo, subsequente in altera sententia nomine, incertus haeret auditor, sive is sit lector, quo referat relativum; perspicui^t igitur caussa relativo adiicitur ipsum nomen, ad quod pertinet; quod facto necesse fit, ut in altera positione repraesentetur nomen, atque hanc ob caussam additur demonstrativum. His expositis revertor ad locum nostrum, ubi constructio est: यद् रूपां — तद् न संमतं । Superfluum erit alia addere exempla, ubicunque enim adsunt. Pro रूपां edd. परिरूपां. — आग्रित substantive hoc atque aliis huius libri locis ponitur. Vid. in primis dist. 40, ubi cum genitivo positum est; participium आग्रित, accusativum regit. Cf. loca a Rosenio s. v. *congesta*. न edd. pronomini तद् subiungunt; melius collocant codd. quam rem qui persperxerit, is demum aliquid profecit in hac lingua. Edd. mox नीतिवेदिनां. P. तत् किं नीतिविदां संमतं । sensus idem est, sed enuntiatur per interrogationem.

Dist. 36. दारां L. vitiose. — a. आपदर्थं P. आपदर्थं Pp. quod nihil est. Scriptura codicis P. minus placet, quippe quae dicat, custodiendas esse divitias ad res adversas excitandas; अर्थं enim hunc in modum adverbialiter positum, तादर्थे est intelligendum, अर्थे h. l. unice est verum: custo-

P. 15. diendae sunt divitiae *propter* res adversas, quae irruere possint, et *contra* quas tunc utendum sit divitiis. Quod discrimin inter अर्थं et अर्थं adverbialiter usurpata non leviter pono; sed reiterata multorum locorum consideratione, ita ut ab hac opinione non discedam, quamvis scripturां - अर्थं tueantur editiones codicis, unde detumtum est distichon. Vid. Man. VII, 213. Apparet quidem ex scholl. ad h. l. non nuperrimorum editorum culpae attribuendam esse scripturāं अर्थं, quippe quam ante oculos habuit *Cullucabhattas*, per आपन्निवारणार्थं locum interpretatus; verum respicit tum hic, tum alibi, magis tenorem loci, quam accuratam eius interpretationem grammaticam.

Dist. 37. c. तन्मित्वात् codd. vitiose; refertur enim ad. प्राणाः.

Lin. 18. हिरण्यक e codd. तावद् h. l. non est adverbium temporis, quo sensu saepius usurpatur et valet *interim*; sed particula concedentis. Deinde omittunt codd. अस्तद्; in fine P. न प्रक्तः, omisso सर्वया, quod facit etiam Pp. retinens tamen अस्तमर्थः। Addunt deinde edd. तेनेदं ब्रवीमि।

Dist. 38. Pp. सन्निधिंतं P. तन्मित्वात्. Repetitur in edd. et codd. distichon infr. p. 99, l. 13. q. l. cf.

P. 16. *Lin.* 22. असाधारणहेतुः Pp.

Dist. 40 et 41. Transponit haec disticha ed. Lond. nescio quam obcaussam.

41. b. . . . पुंकुले मम P. quod vocabulum, quamvis in lexicis non obvium, haud prorsus est reiiciendum. Abundat sane in nostra scriptura copula.

— c. . . . विहायास्यां edd. (Ser. mendose punctum in fine vocis आस्यां omisit) At magis accomodata est loco enuntiatio sententiae per interrogationem. Pp. . . . तथायास्या, quod non intelligo. Jonesius legit ut P.

Dist. 42. d. तदा लब्धं भवेन्त किं P. तत्र लब्धे भवेन्त किं Pp.

तन्न लब्धं भवेन्त किं S. तत्त्वलयं भवेन्त किं L.

Ex hac varietate apparent, in ultimis verbis omnes consentire libos; quo facto statim etiam patet, तदा लब्धं vel तदा लभ्यं esse legendum; hoc enim solum in antecedentia quadrat; rarius praeterea, यदि excipitur a तत्; Bhag. Git. I, 46. तत् pronomen est, non coniunctio. Iunctio यदि — तत् auctoritate codd. fruitur infr. p. 99, l. 14. Longius foret demonstrare, quo quaeque ceterarum scripturarum offendat; id tantummodo dicam, scripturam cod. Pp. sensum praebere haud malum, modo तत्र accipias

pro तस्मिन् (sc. अर्थे) et लब्धं subintelligas ad किं. Omitti enim potest in P. 16. apodosi तदा post यदि; vid. Bhag. Git. XI, 12. Ed. Sr. peccat in gemina negatione; voluerunt haud dubie नवेन्तु किं, quanquam durius est particulam interrogativam तु tali iunctura ponere.

Dist. 43. De दूर् observandum est hoc vocabulum de spatio tantum usurpari, चिरं de tempore, दीर्घं de utroque. स्थायिन् i. e. *perdurans*. Bhartriher. p. 75. कतिपयदिवसस्थायिनो यौवनश्चीः ।

Lin. 11. प्र om. P. पुलकितलोमाङ्गः P.

— 12. आच्छ्रितानां codd. sed nescio, an cum genitivo iungi possit वात्सल्य, eo sensu, ut sit amor erga aliquem. — Mox प्रसुद्यते sola ed. Lond. quod ut debuimus, ei reliquimus. — एतदूर् initio commatis P. qui in brevius contrahit seqq. . . . उक्ता सर्वेषां बन्धनानि छिन्ना हिरण्यकः सर्वान् etc. — तेन om. Pp. et mox l. 13. ततोः.

— 14. Pro सर्वथात् P. तदूर् male.

Dist. 45. c. गजतुरंगमयोरपि P. minus bene; difficilius enim est serpentes domare quam equos.

— 46. b. in निषुपौः peccat utraque ed. scribendo निषुपैः । in fine hemisticthii b. P. समुद्रालयात्; haud male; minus elegans enim est ista repetitio particulae अपि. — c. P. दुर्नीते हि किमस्ति दुर्लभतरं etc.; superscriptum P. 17. est postremo vocabulo सुचरितं, sed deinde deletum. Pp. in ceteris consenit cum P., sed pro दुर्लभतरं praebet: किं न चरितं. Ex interpretatione Jonesii haud divinaverim, quam scripturam ante oculos habuerit; ex verbis Wilkinsii: *when laws are ill enforced, where are their good morals? To whom is the mere glare of the fire a virtue?* — probable fit, eum legisse दुर्नीते किमिहास्ति किं सुचरितं; postrema in omnia diversa abeunt, neque haec valde curo, quippe in quibus nil variant libri; legit fortasse: को बह्निलोहे गुणः । In hac discrepantia librorum certi quid statuere si velimus, poetae mentem primum perspiciamus necesse est. Ostendere itaque vult, omnium rerum potentissimam esse fatum (काल enim saepius hanc habet significationem, quia temporis decursu patefiunt fati decreta) contra quod refugii nihil hominibus sit datum; ponit primum exempla; avibus libera aëris spatia praesidio non esse, neque piscibus maris profunda; tum ad homines transit, quibus ex vulgari opinione duo sint propugnacula ad infortunia a se propulsanda idonea; prudentia in agendo et opulentia; haec designatur voce स्थान, illa eis quae antecedunt verbis.

P. 17. Quid igitur, dicit, contra fatum iuvamur prudenter agendo (सुचरितं)? quid igitur est, quod dicatur, hoc vel illud imprudenter esse actum? praevalet quippe consiliis fatum. Obstat huic interpretationi solummodo id, quod सुचरितं ad prudentiam agendi refero; notat enim hoc vocabulum *pie factum*; verum significatio quam mox posui, contraposito हुन्नीति satis stabilitur. Sed iudicent peritiores; hisce autem ita expositis cetera brevius expediri possunt. स्थान vocabulum est ethicorum: continuatio status cuiusdam medii atque aequabilis. *Amaras* p. 186. II, VIII, I, 20. ed. Col. ज्ञयः स्थानं च वृद्धिश्च त्रिवर्गो नौतिवेदिनां ॥ Scriptura cod. P. nihil est; हुन्नीति ferri posset hoc sensu: quid est in imprudenter actis, quo se perdere dici possit homo? — इह est: in hac vita, ut saepius. Quod ad cetera pertinet, एकांतं h. l. solitudinem significat, nec adhibenda est notio vocabuli, qua in libris philosophicis usurpatur, quaque positum est in loco supra a me allegato. Cf. ad Proem. dist. 28. -व्यसनप्र० est, ut Indice loquar: व्यसनाय प्रसारितः करो येन सः । प्रसारित i. e. porrectus. Vid. infr. p. 114. l. 13.

Lin. 3. P. post आलिंग्य च pergit: प्रस्थापितश्चित्रग्रीवः सपरिवारः स्वदेशं ययोः । Similiter edd.: आलिंग्य च संप्रेषितश्चित्रग्रीवोऽपि सपरिवारो यदेष्टदेशान् ययोः । In utralibet scriptura hoc maxime displicet, quod gerundia, unde incipit sententia, quaeque ad Hiranyacum sunt referenda, sine ullo regimine posita sunt; inserendum certe ex coniectura fuisse तेन post आलिंग्य च. Otiosum est praeterea istud अपि, quod praebent edd. — Inserunt deinde post lin. 3. edd. hoc distichon, quod solus W. agnoscit, alio tamen loco (l. 5.) insertum:

यानि कानि च मित्राणि कर्तव्यानि शतानि च ।
पश्य मूषिकमित्रेण कपोता मुक्ताबन्धनाः ॥

De distichi origine cf. quae dicta sunt ad p. 14. l. 18.

Lin. 4. edd. अपि pro च. — Pro अथ P. अनन्तरं. Nomini cornicis addunt edd.: -- नामा काकः, quod supra iam prolatum est, p. 9. l. 6. — Obiter moneo vocabulum आश्र्वं derivatum esse a rad. चर् et praepositione आ, addita littera स् quae etiam praepositionibus अप, अब, परि et से, praefixis verbo कृ et vocabulis ab eo derivatis adiicitur; quam litteram qui euphoniae gratia insertam esse contendunt, valde errant; notat enim significationis diversitatē, quae inter vocabula, quibus inserta sit littera sibilans, et ea, quae hac littera careant, intercedit. Cuius rei omnis dubitatio re-

movebitur, si comparetur संस्कार् cum संकार्, अपस्कर् cum अपकार्, परिकर् cum P. 17. परिष्कार्, आश्र्य denique cum आचर्य et आचर्य (Pan. VI, 1, 147.); utrumque enim vocabulum significat id, quod adeundum, frequentandum sit vel quod adiri, frequentari soleat; hoc tamen discrimine, ut आश्र्य sit id, ad quod concurrent homines admirabundi: *miraculum*; आचर्य qui frequenter a discipulis descendit cupidis, *magister*; आचर्य, quod aggrediendum sit, tanquam negotium. Aliud exemplum huius त् praepositioni आ additi exstat: आस्पद्. Dicitur etiam अवस्तार् et अवतार् (Pan. III, 3, 120.) Sibilans sequente क vel ए, praecedente vocali अ, locum suum tenet haud aliter atque in vocibus दिवस्पति, बाचस्पति, बृहस्पति. Omnes autem hae voce documento sunt, sibilantem quondam etiam ante consonantes क et ए sonum suum haud in adspirationem finalem deformasse; cuius rei luculenta exempla ex vetustissimis Indorum voluminibus proferre possim; sed adeat, cuius intersit rem accuratius explorare, auctorem gravissimum, *Paninem.* VIII, 3, 8. seqq. et quae disputavi in libro: *Ind. Bibl.* III, p. 51. seqq. Nunc cursum tenebo.

Lin. 5. अष्टि desideratur in P.

— 6. मैत्रं Pp. utraque forma proba. — Mox P. मासपि मैत्रेण. Pro अतो Pp. ततो. — एतच्छुत्वा om. codd. अष्टि addunt edd. post हिर०.

— 7. विवरादाह Pp. — हिरण्यकेनोऽन् P. nil amplius. — 8. विहस्य om. Pp.

Dist. 48. b. विपत्तेरेव कारणं L. विपत्ते: कारणं यतः । S. Illud ferri possit; hoc absurdum est.

Lin. 13. मध्यदेशे Pp. docte, nec tamen convenienter. Antiquissimae enim illae Indicarum regionum divisiones, quas libro II. codicis exposuit Indorum legislator, ea aetate, qua haec fabularum collectio facta esse videtur, obsoleverant haud dubie. — Mox codd. चम्पकावली, haud male, neque tamen nostra scriptura melius. Ed. Ser. चंपकावती.

Lin. 15. अमन् P. — हृष्टपुष्टङ्गः edd. male; हृष्ट enim huc non facit. Mox addunt iidem केनचित्; deinde अवलोकितः male; vide quae supra de discrimine horum verborum dicta sunt. — Editum est h. l., forsitan etiam nonnullis aliis, शृगालेण pro शृगालेन; cuius rei culpa a me sustinenda est; dubitavi enim, num recte dictum fuerit, littera ल् interposita, nasalem dentalem न in cerebralem non esse convertendam ab antecedentibus tribus litteris caninis et sibilo ए; sed meliora posthac sum edoctus.

Ibid. edd. तं दृष्ट्वा शृगालोऽचिंतयत् । *Lin. 17.* आलोच्य om. Pp.

P. 17. — 18. Pro स Pp. जंडुकोः । P. शूगालेनोऽः । Mox जम्बूको Pp. utravis forma legitima; idem mox: अरण्ये त्र et मृगवन्; postremum haud idoneum.

— 19. भवन्तं e P.; ceteri त्वां, cui vocabulo copulam praemittit Pp. सबन्धः om. P.

— 20. सर्वदा om. Pp. सर्वदा substituunt edd., male. Idem in fine addunt इति, de cuius particulae incommoda insertione iam dictum est supra. — Omittunt mox codd. capreoli responsum. — ततः पश्चादस्तं edd. ततस्तावदस्तं P. गतो मरीचिमालिनि (sic) Pp. — आवासभूमिं P.

— 21. अत्र P. — l. 22. वृक्ष om. Pp. — सुबुद्ध L. — pro काको P. वायसो. Mox चिरमिं S. — प्रतिवसति Pp. — तौ दृष्टा om. Pp.

P. 18. Lin. 1. चित्राङ्ग e P., Pp. praebet मृगः; sed illud exquisitius.

— 2. मित्र om. P. — Ed. L. sola: आगतेन, quod ei reliquimus. Pro विश्वासो S: मैत्री न युक्ता; quod Panditi ob hanc caussam praetulisse videntur, quia insolentius sit dicere विश्वासः सह; sed विश्वास h. l. est familiaritas, quae ex confidentia oritur. Addit L. orationi cornicis: तत्र भद्रमाचरितं । Similia leguntur verba supra p. 12, l. 10.

— 7. दुर्दैवविपाकाद् P. — दैवदुर्विपाकाकुलितः नयनः (sic) P. गलितनवनयनो edd. Rescribe: आकुलितनयनो — 8. अथ कृपया om. codd.

— 9. Alterutrum किंचित् om. Pp. किंचिदुकृत्य S.

— 10. भज्जितुं L. S. minus usitata forma. — गतः P. minus bene. — तत्स् om. codd. — 11. भयातैः edd.

— 12. समयः, omissio आह Pp. Omittuntur sane interdum verba quibus colloquii vices declarantur, in primis post vocabula प्रकाशं, स्वगतं, alia similia, quod ex scena Indica assumptum est; in dramatis enim sicuti apud nos indicantur personae suis nominibus, uniuscuiusque orationi praemissis et extra sermonis nexus positis; sed h. l. iusto durior foret haec omissio.

Dist. 50. Dist. hoc omittunt h. l. codd. nec non interpp. Inserunt infr. p. 114, l. 13. codd. et S. Dubitari posset, utrum तावत् atque यावत् pro adverbii temporis essent habenda (*tamdiu* — *quamdiu*), an pro neutrī substantive positis (*tantum* — *quantum*); accuratius perpendenti prius tantum placebit; neque obstat genitivus भयस्य; construitur enim भी etiam cum hoc casu; vid. Rām. I, 1, 4.

Lin. 15. Initio commatis ततो edd., quod expunximus, codices sequuti; अस्य codici Pp. debemus. — Sequens comma ex edd. repetivimus;

verum emendavimus तथा pro तद्. Codd. aliter: — संनिधाने पलायनमध्यग्रक्यानुष्ठानं P. 18. तथा त्रातव्यं तद्वत्क्वेतत् । Pp; cum quo consentit in prioribus P. अनुष्ठानः solummodo vitiose genere masculino exhibens; sed deinde pergit: तथा प्राप्य भवतु । Utrumque ferri potest, modo in scriptura Pp. pro भवत्वेत् correxeris भवत्वेव ।

— 16. Verba inde a तद् usque ad अस्य om. Pp. neque aliter P. tantummodo pro अस्य substituit एतत्. Mox pro उपग्रहामि P. एव ग्रहामि.

— 17. Pro ऋब्रवोत् edd. repetunt ऋवदत्.

— 18. तदा pro तद् P. quod ferri potest; ellipsis enim est pro यदि मार्जीरोऽसि तदा etc. Sed nostra scriptura simplicior. तद् om. edd. recepi-
mus e Pp. a quo द्वारा abest. — Edd. deinde न चेत्; male; nam solennis est
haec formula, quae Latine reddenda est per: *sin minus*, *sin aliter*. Dif-
fert autem significatione et usu नो चेत् quum a न चेत् et यदि न, tum a चेत्;
de qua formula iam dictum est ad Pr. dist. 28. De ceteris hic breviter
dicam. नो चेत् semper elliptico more, omisso subiecto aequa ac praedicato,
ponitur et quidem post praegressam aliam positionem, ex qua supplenda
est ellipsis. Cf. infr. p. 58, l. 17. p. 76, l. 10. p. 93, l. 6. p. 105, l. 9.
p. 127, l. 11. Rarior usus est huius particulae apud poetas, quam apud
prosarios scriptores; enotavi tamen bis e distt. Bhartriharis; vid. p. 28,
l. 1. p. 90, l. ult. Usu magis quam significatione differt नो चेत् a न चेत्,
in qua formula plena enuntiatio deesse nequit: cf. infr. IV dist.
89. 90. Sacuntal. p. 6, l. 10. Man. VIII, 58. Apparet ex hisce locis
aeque bene dici posse न चेत् et चेत्- न, modo uno saltem verbo disiuncta
sit conditionalis particula a negativa; quod si non fieret, non distingui
posset haec formula a चेत्. न चेत् sive चेत्- न igitur est *nisi*; usurpari in ea
tantum potest sententia, cui praemissa fuerit alia, quam inter et conditio-
nalem intercedat continuatio argumenti. यदि न sive न यदि, est *si non*; nega-
tio ad verbum pertinet, conditio ad totam sententiam. Exempla leguntur:
Hitop. p. 54, l. 14. III, dist. 2. 10. p. 99, l. 14. Bhag. Gīt. III, 25. Man.
III, 61. VIII, 184. 189. Confunditur interdum utriusque coniunctionis
ratio; hanc autem quam breviter declaravi, differentiam amplius eis,
quae de यदि et चेत् dicenda habeam, stabilire studebo. Hoc nunc addam,
nescire me, cur in plena sententia dicatur न चेत्, in manca नो चेत्. Scio
equidem hoc interesse inter न et नो, quod prior particula in simplici
negatione ponatur, altera quum praegressa iam sit negatio, quemadmo-
dum Germani vocabulo *noch*, Angli *nor* utuntur. Bhag. Gīt. XVII, 28.

P. 18. न च तत् प्रेत्य नो इह «neque id valet post mortem, neque in hoc aevo.» Add. Hitop. IV, dist. 91. III, 61. Cuius rei caussa in promptu est; नो enim conflatum est ex न, non et त् etiam, i. e. neque. Sed neque hoc discrimen ubique servatur, neque in eo positum est id, quo नो चेत् discriminatur a न चेत्.

— 19. अस्मद् pro मद् edd. quod arrogantius est. Pro ततो L. यतो male. — अहं यदि Pp.

Dist. 51. a. किं om. Pp. vitiose. — *c.* व्यवहारन् P.

Lin. 22. Desunt in cod. P. verba, versus excipientia, usque ad अहं. Pp. cetera habet, omissis किम् — इसि.

P. 19. *Lin. 1.* ब्रह्मचारी edd., qui et mox आचरन्; utrumque dicitur. — च abest ab edd.

— 2. धर्मज्ञानम् (sic) Pp. qui et mox सर्वे omittit. इति subiungunt edd. vocabulo विश्वासभूमयः, qua particula omnis sententia pervertitur; hac enim vocula adiecta non potest non fieri, quin विश्वासभूमयः ad vulturem referatur: quo facto omnis oratio praecedens directa fieret et ponendus esset nominativus: यूँ - रता; quod quanquam ferri posset, minus bene huc quadrat. Praedicat enim feles adulatrix studium vulturis positum in cognitione legum, quarum oracula audiendi gratia se eum adiisse simulat. Dicere etiam posset feles se propter legum cognitionem, qua delectaretur vultur, in eo fiduciam collocasse, ita ut omni timore abiepto advenisset. Hunc sensum praebet cod. P., scribens: यूँ च धर्मज्ञा दयाकरन्तो विश्वासभूमय इति et quae seqq.; et praebherent edd. emendatione, quam supra indicavi, facta. In nostra scriptura pertinet epitheton ad aves, quos fide dignos vocat feles. Ceterum vel tironibus notum esse reor hunc usum vocis भूमि, quo *dignum* notet; eodem modo dicitur पात्र, quod etiam absolute ponitur pro homine digno, ex. c. supr. dist. 14. — सर्वदा om. P.

Lin. 2. pro अतो (अतः mendum est, ex editione Londinensi in nostram translatum) codd. ततो.

— 3. विद्यावयोवृद्धेयो om. Pp. — व्यवहृद्धेयो L. quod nihil est. Prorsus similis locutio legitur Rām. II, 1, 9. — इह om. Pp.

— 7. Abest a Pp. qui tamen post dist. 54, disticho 53 praemissum haec inserit verba: प्रीतेन वचसापि तावद्तिथिः पूज्यः । — S. in fine: पूज्यत एव । — P. यदि तावद्यन्नास्ति प्रीतेन वचसा तावद्तिथिः पूज्यः । lectio haud sernenda, modo prius तावद् omittatur.

Dist. 52. c. Suspicio: पार्श्वगताच्.

Dist. 53. b. च desideratur in L. — Legitur dist. Man. III, 101. ex P. 19. quo pro doctrina sua hosce versus laudare debuerat feles (III, 105.): अप्रणोयोऽतिथिः सायं सूर्योऽहो गृहमेधिना । काले प्रापुत्रवकाले वा नास्यानश्नन् गृहे वसेत् ॥

Dist. 54. desideratur in P. et S., neque interpretati sunt Jon. et W. Ellipsis est in priore versu pro: यो गृहमागतः । cuius, si opus sit, alia exempla adduci possint. In ultimo hemistichio coniicio: सर्वस्य त्यागतो गुरुः । desideratur enim aegre particula caussalis हि.

— 55. a. दुर्जनेष्वपि P. — c. ज्येष्ठां vitiose S. Addunt edd. distichon, quod nos infra No. 101. dedimus.

— 56. c. . . . किञ्चिव्यं दत्ता P. — Hoc et sequens dist. om. Pp. posterius etiam P. et uterque interpres.

Lin. 19. Ed. utraque: मर्तारो pessime. — पञ्चिबालकाः Pp. तेनाहं edd.

— 20. तच्छुद्धा om. codd. — Addunt edd.: सृष्टाति । कृष्ण कृष्ण च ब्रूते; sed absunt verba a codd. et interpp. et sunt additamentum, quo sine damno textus carebit. मया च P.

— 21. क्रं चान्द्रायणं edd., sed melius abest; dictum enim iam est supra l. 1.

— 22. Verba अपि — प्राख्याणां inscite om. Pp. — In fine P. इत्येकमेव सत्यं; idem voluisse videtur Pp. scribens: इत्येकसत्यं, quanquam vel ipsum hoc eundem praebet sensum. — अहिंसा परमो धर्मः hemistichium prius est sloci, nescio a quo auctore profecti.

Dist. 58. b. सर्वसहाया L. perperam.

P. 20.

— 59. d. . . अन्यत्र Pp. vitiose. अन्यद्दि P., particula caussalis h. l. ferri potest, praestat tamen तु. Sententia, quae hoc disticho exponitur, fusius, pulcerrimis autem verbis, inculcatur ab Indorum legislatore; vid. Codic. leg. IV, 258 seqq.

— 61. c. d. e P., edd.: प्राक्यते नानुमानेन परोऽपि परिवर्णितुं । Pp. in ceteris cum edd. consentit, sed in fine praebet: — रक्षितुं. Vides totum sententiae sensum obscuratum esse omissione litterae सू in fine vocabuli प्राक्य, hac enim omissa, in duas partes divisa est vox तेन; prior participio प्राक्य addita, unde in verbum finitum transivit; altera pars pro particula negativa न accepta est, quo facto prorsus contrarius prodit sensus, qui tamen nullus est; परः enim est aliis (sc. homo); qui ex scriptura ista corrupta dicitur non posse describi analogia angoris, quem sentit aliis, qui videat mortis necessitatem sibi instare; talem hominis descriptio-

P. 20. nem dedisset fortasse editor Londinensis, si stupendo suo ingenio ad hosce versus illustrandos se accinxisset. Sed res plana est, recepta scriptura quam exhibet P. Qui autem scripsit परिवर्णितुं, is non potuit non, quin scriberet शब्दं - परं हि; alius angor (illi similis) analogia potest describi; quod haud scio annon paullo sit durius. De अनुमाने, huius loci non est amplius disserere: est philosophorum vocabulum; notat conclusionem, quae ex praemissis stabilitis deducitur; atque opponitur duabus aliis demonstrandi rationibus, दृष्टि et शब्दः, quarum haec est *revelatio*, आपूर्णम् etiam dicta; illa *comprehensio* (Ciceronis utor verbo, Acad. I, §. 41.) rerum quae ante oculos obversantur atque visu, ceterisque sensibus, quasi manu, prehendi possunt. Cf. Colebrooke in doctis suis disputt. de philos. Indic. p. 28. p. 95. (ubi de schola Gautami dialectica disserit, quae quartum उपमान addit). Vid. praeterea Sankhya Sutr. §. 4. Man. XII, 105; ubi दृष्टि विषयम्, appellatur प्रत्यक्षं, ante oculos obversans.

Dist. 62. a. स्ववृद्धवनजातेन P. वृद्ध corrupte. — d. pro महत् Pp. ज्ञातः; P. नरः. Ceterum praebet hoc distichon aliud exemplum pronominis relativi omissi, de qua re ad dist. 54. diximus; praemitti enim debuerat यः प्रयुक्ते.

Lin. 11. Initio commatis Ed. S. एविश्वास्य; quod explicit Panditi, qui nullum vitium notatu dignum in ista editione non sustulisse dicuntur. स मार्जातः (iungi debet in nostra editione मार्जारस्त्वा) om. codd., P. tamen post स्थितः exhibit सः । - ततोऽपि P.

— 12. प्रावज्जैकान् (sic) आनीय तत्र खादति Pp. प्रावकानाक्रम्यानीय तत्र खादति P. — अय om. edd.

Lin. 13 — 17. P. brevius: — तैः शोकाकुलैर्विलपद्धिर्ज्ञासामितत्ततः कुर्वन्तस्तत्र (leg. कुर्वद्दिस्तत्र) तर्हुटे प्रावकास्योनि प्राप्तानि मार्जात्य पलायितः । अनन्तरं अनेन प्रावकाः खादिता इति निश्चियं पक्षिभिर्मेलकं कृत्वा स गृध्रे व्यापादितः ।

— 13. इतस्ततो om. Pp. — pro तत् Pp. तां, minus bene.

— 14. तैर्लच्यमाणः e cod. Pp. — वहि: पलायितः edd. sed post निःसृत्य otiosa est particula. Post पलायितः Cod. Pp. cetera iusto brevius expedit hunc in modum: इतस्ततो निह्यपायद्वः (sic) पक्षिभिर्मेलित्वा गृध्रे व्यापादितः ।

— 15. Accurati isti Sriramapurenses homines ediderunt: निरूपयद्वः et प्रावकास्योनि.

— 17. मेलकं कृत्वा recepimus e P., eo deducit etiam Pp.

— 18. स इन्द्रुकः edd. — सखे addit P. ante मृगस्य, inepte. प्रथमसंदेशनादिते Pp. प्रथमदर्शने P.

— 19. सह deest in Pp. — pro एतस्य P. अस्य. — Edd. तत् कथं भवता सह, P. 20. omisso statim sequente: अथयाकत्. Sed vis orationis versatur in भवता सह, quod ideo praemitti debet.

यावत् in hac positione adverbialiter positum significat: *usque ad*; praemittitur nonnunquam: Rām. I, XL, 14. यावत् तुरगद्धनं।

Dist. 63. Desideratur in codd., praemittit tamen Pp. sloco seq. अस्यच. Qmittunt etiam interpp. — Ser. confuso litterarum ordine निरस्तपाददेशेषे.

Lin. 3 init. यथा च uterque codex; Pp. tamen hisce verbis praemiti: पृष्ठालः पुनराह, quod additamentum prorsus est otiosum. — Edd. उत्तरेण; male; hoc enim est responsio simplex interrogationem excipiens; उत्तरीतरं continuatio interrogationum et responsionum invicem sese excipientium: प्रश्नोत्तरमाला, uti poema quoddam suum inscripsit Calidasus; cuiusmodi continuatio sane nonnunquam in *altercationem* abit.

— 4. विश्रम्भालापसुलिभिः P.

Dist. 65. abest a codd. et interpr. Jonesii.

Lin. 7. एवमस्तु यथाभिप्रेतं। प्रातः etc. P. — अथ omisit etiam Pp. -तेन om. P. — Edd. in hoc commate hunc in modum se habent: एकदा निमृतं पृष्ठालो छूते.

— 8. Pro अस्मिन् P. एतस्मिन्. idem voluit Pp. sed scripsit: एकस्मिन्नेव. — Edd: पूर्णज्ञेत्रं. — Pp. ज्ञेत्रमेत्रं; qua de re vid. ad p. 10, l. 8.

— 9. तत्र addidimus ex cod. Pp., in ceteris codd. paullum dissentiant: Pp. = अहं त्वां तत्र नयामि। P. = अहं त्वां नौत्वा तदूर्ध्ययामि; sed praemitti debebat तदू. — In altero commate तत्र omittunt codd.

— 10. अथ deest in codd. qui contra च addunt post - पतिना. Pro तदू Ser. ज्ञेत्रं, male. Mox edd. पाश्चो योजितः। Pp. तत्र ज्ञेत्रे.

— 11. पाशबद्धो P. mox idem nimis breviter: कालपाशात् त्राणुं.

— 12. समर्थः (sic) मित्रादन्यः edd. — अत्रान्तरे P. quod haud spernere debemus. Edd. अनन्तरं. Iidem mox: तत्रागत्वा उपस्थितो. P. iusto brevius तत्राचिन्तयत्.

— 13. In hisce verbis secuti sumus Pp. nisi quod - प्रबन्धेन cum ceteris scripsimus pro प्रबन्धं। quod ferri non potest; est enim masculinum. Ad scripturam cod. Pp. proxime accedit P., variat solummodo in मनो॒थ॑ सिद्धिस्तु. Edd. फलिता तावदू - प्रबन्धेन मनो॒थ॑ सिद्धिः। Correctum est ab inscio quodam librario, qui verba बाहुल्याम्भे haud intellexit. Scriptura codd. optime se habet: फल वर्बम् नेत्रम् est et notat *fruges proferre*, *fruges scere*, si verbo uti liceat Tertulliani. Neutralis significationis documentum est hic Calidasi locus, cui ex ipso Hitopadeso addi possunt nonnulli:

P. 21. Megh. Dut. sl. 19. फलति नचिरेणोपकारे महत्तु । Verba autem neutra in Indorum lingua saepissime passive ponuntur cum casu tertio iuncta neque alia est h. l. constructio, quam si dicitur: सर्वैः स्थीयतां (supr. l. 4.) atque noster locus active efferendus est: पकाल अस्माकं कपटप्रबन्धः ॥ प्रबन्ध arctioribus finibus circumscribitur a Wilsone, quippe qui hanc vocem per narrationem explicat; est potius omnis facti vel fictionis complexio verbis concepta, in qua singulæ partes arcto vinculo inter se sunt connexae; unde pro singulo poemate etiam ponitur. Git. Gôv. v. 2. श्रीवासुदेवरतिकेलिकथासमेतं । एतं करोति जयदेवकविः प्रबन्धः ॥ Ceterum haud fugiet accuratius legentes, quanta cum elegantia et vi h. l. plurali maiestatis usus sit thos, successu suo elatus. बाहुल्यात् adverbialiter est positum: *magnopere*.

Lin. 14. Pp. यत् एकत्योक्तृत्वमानस्य, vitiose. P. एतत्योक्तृष्टमांस etc. P. quod ferri potest. मया om. cod. P. अवश्यं cod. uterque. Post प्राप्तव्यानि addunt edd.: तानि बाहुल्येन भोगनानि भविष्यन्ति ।

Lin. 15. सृगस्तु तं solus P. — edd. उल्लासितो; codd. उल्लसितं । retinuimus formam factitivam, adverbium dedimus auctoritate codd. freti. — Mox P. द्विन्दि repetit haud male, सत्वरं omisit. — Edd. तावन्मम. — P. त्राहि; utraque forma legitima; cf. Rosen s. vv. त्रा et त्रै.

Dist. 66. Pp: यतः (sic) मित्रः । आपत्तु etc. Invenuste, quum idem statim vocabulum sequatur.

— 67. Omittunt h. l. codd. et interpp. Ponunt infr. p. 123. l. 19. In hemistichio b. utraque ed. विष्ववे; quod quum non ferri posset, opponuntur enim sibi contraria, ex coniectura petenda erat medela. Scripsimus संपुवे, quod vocabulum quanquam apud Wilsonem desideratur, sine ullo dubio formari potest; संप्लुत् habes Bhag. Git. II, 46. Sensus ex etymo erit eruendus: *affluentia*; राष्ट्रसंपुवे, in annonae affluentia, per totum regnum diffusa. Aut scribere etiam poteramus: सुभिज्ञे राष्ट्रविष्ववे । *Paninis* haec habet verba: (III, 3, 139.) सुवृष्टिश्चेदभिष्यत् तदा सुभिज्ञमविष्यत् ॥ Quae coniectura vel magis placet; सुभिज्ञ enim, magis inusitatum verbum, facile corrumpi potuit a librariis. तिष्ठति, h. l. ut saepius, *remanet*, haud *relinquit*.

Lin. 20. जम्बुकः vitiose editum est pro जम्बुकोः. — Edd. जम्बुकः पाण्डि विलोक्य मुहुरचिन्तयत् । quae scriptura cur nostrae sit posthabenda, supervacuum foret longius exponere. — Pro तावद् L. हु — च post ब्रूते om. Pp.

— 21. निर्मितपाण्डा: Edd. male; flagitat enim पाण्डा: praedicatum. — Pro

सखे P. मित्र — कथमहं P. sed अहं otiosum est, quia antea non dictum erat P. 21. pietatis speciem a thoë esse indutam.

— 22. चिन्हे post यदि addunt edd., sed otiosum est, ut nemo non videt, neque cum Indorum loquendi more consentaneum. यदि aequo ac तदा omittit Pp. Ponenda tum foret virgula post मन्यसे: *neque tu aliter sentis*; sed istud magis maligne est dictum.

— 22. Mox P. उच्चते pro वक्तव्यं, quod praestat. मया subiungunt pronomini तदू codd. haud male. Huic sententiae इति tantum addunt edd. et Pp. omissis seqq. usque ad सः verbis (p. 22. l. 1.) quae e P. inseruimus.

Lin. 1. प्राप्तुकाले ते मृग्यनायातं Pp. sed प्राप्तुकाले, quod per se ferri posset, P. 22. minime placet, cum nostra scriptura comparatum; atque अनायातं habet nescio quid ingrati. ते addit etiam P., qui praeterea अन्तरं च exhibit.

— 2. इत्स्ततो om. codd. — अन्विष्यन् edd. male.

— 3. P. मृगोऽवदत्। सखे किमन्यत्। अवधीरित etc. किमन्यत् formula est respondentis et mirantis, id quod dicturus sit, haud perspectum iam esse ab interrogatore. — एतत् in fine desideratur in codd.

Dist. 69 transtulimus huc propter orationis nexum; omittunt codd. et interpp., collocant edd. prorsus importuno loco post dist. 70. Ibi enim inculcatur cautio, in evitanda hominum malorum societate. Inest distichis, quae apud nos dorcadis tribuuntur, vituperatio sui ipsius, quod amici consilio surdas aures praebuerit; nexus utriusque distichi 68 et 69. demonstrat praeterea सुहृदाक्यं.

गतायुः i. e. quibus vitae spatium decursum est; cf. आयुः supr. sl. 26. prooem.

Lin. 8. Pp. स मृगालः कृ । P. मृगालः कृ । horum anctoritate freti expunximus आस्ते, quod interrogationi कृ addunt edd., वंचकः ex edd. dedimus. — In seqq. Edd. et Pp. optime consentiunt, पूर्वं tantummodo in Pp. omissio. P. variat: - कृ । अस्मन्मांसार्थी भूत्वा अत्रैव तिष्ठति । काकेनोक्तं । उक्तमेवैतत् ।

Dist. 71. d. Edd. विष्कुम्पयोमुखं । quod quanquam dici potest haud dubie, tamen emendavimus विष्कुम्बं । minus bene enim epitheta prorsus sibi opposita in unum bipartitum compositum funduntur. In codd. nil praesidii erat, quippe qui hoc dist. omittunt; alter interpres, Jonesius, id expressit.

Lin. 14. ततः काको हीर्षं omittunt codd. et sententiam incipiunt a निः प्रवर्त्य; — किं paullo post omittit Pp.

P. 22. *Dist. 72.* Operae pretium erit brevibus huius distichi constructio-
nem exponere, praesertim quum videam, prius hemistichium prorsus
falso intellectum esse a Rosenio, s. v. लप interpretante: «colloquentium
blandis verbis.» वंचयित्वं substantivum est, a quo pendet genitivus अर्थान्,
ad quod vocabulum referendi sunt ceteri genitivi; participiis fut. pass.
inest notio fieri 1em posse; quam h. l. servat nomen वंचयित्वं; sensus igitur
hic evadit: quid magni est decipere inopes, qui spe tenentur et
fidem nobis habent, qui blandis verbis capiuntur et falsa studii simula-
tione in potestatem rediguntur. संलापित् passivum est: is qui blandis
verbis sibi persuaderi patitur.

Dist. 73. b. सुमतौ et c. असत्यं pro असत्यसंथं Pp. refragante metro.

— 74. om. codd. — L. कृष्णायति qua lect. versus vitiatur.

— 75. Huc traximus, Wilkinsio auctore, hoc distichon, quod edd.
interponunt distt. 83. et 84., codd. utroque loco omittunt. Legitur ap.
Bhartrihar. p. 47. hac varietate: b. विद्ययापि समन्वितः । c. मणिनालंकृतः सर्वः । quo
uno exemplo discant critici, quam facile in distichis laxiori hoc metro
conceptis genuina auctoris verba vel sine magno sensus damno mutari
possint.

P. 23. *Lin. 1.* अयवा h. l. ut saepius non disiunctiva est particula, sed orationi
continuandae inservit.

Dist. 76. b. ननु विरैति Pp. quod, si metrum respicis, ferri potest; ad
sensum tamen minus commodum; ननु enim interrogativa est particula
nonne.

Dist. 77. Desideratur ap. Wilkins. et in cod. Pp. Hemist. b. iam
supra legitur 70. b.

Lin. 6. लगुडहस्तं देशं Pp. vitiose. — Pro तं edd. नत् et **mox** गङ्क् omissa
आ. — अवलोकितः काकेन । codd.

— 7. आलोक्याभिहितं । P. आलोक्य चौक्कं काकेन । Pp. Pro मित्र edd. सबे मृग । —
संप्रदर्श्य P. Quae seqq. a वातेन usque ad कृत्य omittunt codd. पादां edd. mendose. — Observavimus iam supra ad dist. 67, radicem स्था isto loco non
habere potestatem standi, sed permanendi; hinc derivata est significatio,
quae in nostro loco cernitur, quaue posita in naturam verbi auxilia-
ris quodammodo abit radix स्था; nemo enim est quin videat, diversam
inesse h. l. verbo vim ab originaria; nam nulli stant mortui. Ut bre-
vibus expediam, स्था hunc in modum additum designat continuationem

actus vel conditionis, quae tota sententia, ad quam pertinet स्या, descri- P. 23. bitur. Alius locus est infr. p. 128, l. 15. Hoc autem e doctoribus quaero, sitne eadem vis in antiquissimis etiam Indicae linguae monumentis huic radici attribuenda; ex. gr. Diluv. ed. Bopp. p. 74, sl. 30. प्रदाव वृष्टिं तस्युः सर्वमायोधनं प्रति । शरीराण्यश्चिरस्कानि विदेहानि शिरांसि च ॥ quid? Aliudne valet Bhag. Git. X, 16. व्याप्य तिष्ठति quam जहा व्याप्तोऽपि? cui loco prorsus similis exstat Man. XII, 14. nec non alii. Sed rem tanquam dubiam in medio relinquam, quamvis neminem fugiat, simili tralatione in linguis, quas ob corruptam pristinae originis nobilitatem Romanas vocamus, in verbi auxiliaris corruptionem abiisse Latinum stare. Cum Indico usu prorsus consentit antiquior Anglicismus: SPENSER, Faerie Queene I, III, 37. «Enough is, that thy foe doth vanquisht stand Now at thy mercy. Iacet is tamen humi. Cf. Uptonis notam ad h. l. p. 104.

Post तिष्ठ hoc comma inserunt edd. अहं तव चक्षुषो चंच्छामि । Sed leguntur prorsus similia verba infra p. 43, l. 15. loco magis opportuno, unde huc tracta esse videntur. De verbo चंच्छ autem valde dubito, an ulla omnino auctoritate fruatur.

Lin. 8. सत्वरसुत्याय transponit P.

— 9. Pro अपसरिष्यति edd. पलायिष्यति.— इति in fine addunt codd., omissa commate proxime sequente.

— 10. - लोचनेनालोकितं तथाविदं मृगमवलोक्य आः etc. P. - लोचनेनावलोकितस्तथाविदो मृग आः etc. Pp. Secuti sumus edd. correcto tantummodo तथाविदो pro - विध । neque multum differt Pp. अवलोकित tamen minus bene ad hunc locum quadrat, quam आलोकित. In P. constructio minus bene procedit. मृतोऽसि edd. — Pro मृतो P. पतितो.

— 11. बन्धनान् om. P. - संवरितुं Pp. गृहीतुं edd. - सत्वरो S. — ऋभूत् P. qui et mox काकस्य.

— 12. सत्वरसुत्याय omittunt codd. — In seqq. usque ad हतः secuti sumus Pp. qui tamen peccat in तेन व्याधेन quod pro क्षेत्रपतिना substituit. — Edd. तेन क्षेत्रपतिना ज्ञिष्वन् लगुडेन शृगालो हतः । P. तेन omittit et प्रतिक्षिप्तलगुडेन scribit, in ceteris autem cum edd. consentit. — Haud silentio denique praetermitendum est peccatum ed. Ser. उद्धिश्य.

Dist. 78. d. Pp. prima manu in fine उच्यते; secunda ut nos.

Lin. 16. Ed. utraque et Pp.: भक्ष; vitiose; sed peccant librarii In-

P. 23. dici innumeris locis in littera न्, cui pro lubito fere addunt vel demunt semivocalem न्; verum editores talis minime decet incuria.

Dist. 80. b. पुण्येन कर्मणा P. — In hemist. d. conspirant ed. Ser. et codd., L. praebet स्वभावो न निर्भावते। W. cum ed. L. consentit, Jones cum codd. — पुण्यैककर्मणां i. e. पुण्यं एककर्म येषां ते: quibus pietas est actio sola, qui nulli rei praeter pietatem operam dant. Minus bene W. in *whose every action there is innocence*, quod si dicere voluisset auctor, एकैकं pro एकं scripsisset. — हि paullo insolentius h. l. positum est neque tamen suspicionem movere debet; coniungit haec particula saepissime positionem caussalem cum antecedente; h. l. connectit intra eiusdem positionis fines caussalem casum, ablativum, cum ceteris: *nempe, videlicet*. Scriptura ed. L. nullam praebet difficultatem, si सत्तां ad स्वभावो trahitur; sed utitur cornix argumento, ut dicunt, ad hominem.

Dist. 81. a. - - प्रकोपितस्थापि edd. — b. मनो न याति P. — c. संतापयितुं omissa हि Pp.

P. 24. *Lin. 1.* सर्वथा स्त्रेहो inverso ordine P.

Dist. 82. a. मेषो pro मेषः ex colluvione ista mendorum Londinensi in nostram editionem irrepisit. b. कापुरुषास्तथा Pp. d. pro नोचितः S. et Pp. नो हितः, minus bene, quanquam eundem fere sensum praebet; verum नो facile quis pro pronomine accipere posset. — प्रभवंति rariorem h. l. significatum praebet, sed video huius verbi significationes amplius esse docendas, quippe in quibus constituendis minime feliciter versatus sit Rosenius noster s. v. Primam enim potestatem ponit eandem atque simplicis, in auxilium vocans locum Hitopadesi (proem. dist. 47.) sed ibi प्रभु retinet vim sibi propriam *oriri*, neque vertendum est: dulci aqua praediti *sunt* fluvii; sed dulci aqua praediti (a fonte) *proveniunt* fluvii. Quam secundo loco posuit Ros. significationem, ab hac prima omnino non est diversa; dicit enim *evadere, fieri*; quae vis simplici radici est propria; nec per *fieri* reddi posest प्रभु, nisi addita praepositione *ex*; fieri autem *ex* re quadam quid aliud est quam *oriri*, nasci? — Sed rem ab ovo repetam. प्रभु duas habet potestates; primam *fieri, evadere*; alteram magis abstractam et paene mere copulativam, *esse*, quanquam idem inter प्रभु hoc sensu et verbum substantivum intercedit discrimin, atque inter Bengalorum हय् (भवति) et आहे (अस्ति), auxiliaria verba a Sanscritis derivata et corrupta, inter Persarum نماد and بودن, Anglorum to *become* et to

be. — Utramque significationem retinet यु, praefixa praepositione तः; P. 24. primam et magis usitatam, *provenire, oriri, nasci, fieri ex;* quo pertinet locus Hitopadesi iam tractatus; Bhag. Git. VIII, 18. 19. Hitop. I, 24. alii innumeri; alteram *praeesse, praestare, praecedere, superare, antecellere, प्रयु एसे.* Huc referenda sunt significationes, quas recte ultimo loco posuit Rosenius, *abundare, excellere et imperare, dominari.* Ad hanc significationem pertinet प्रभाक, ad illam प्रभक. Exempla nunc addam: *potentem esse cum genit.* infr. in not. ad p. 39. l. 20. dist. 90. c. q. 1. cf. Rām. II, 24. 19. Cum *dativ.* *potentia antecedere* Bhartrih p. 46, l. 4. कर्तव्यो विद्धिर्पि न वेष्यः प्रभवति । *cum dat.* *valere ad rem* Rām. II, 23. 35. In nostro loco प्रभवन्ति valet *potentes* (प्रभकः) fiunt; sed caveas, ne ablativum a verbo pendere credas; est enim ablativus rationis, propter quam potentes fiunt.

Lin. 4. किं च Pp. किंचान्यत् edd. — Maxime arridet किं च, quae particula continuativa est

Dist. 83. a. Pro न हि Pp. सह, qua scriptura tota sententia pervertitur. Idem mox संदध्यां, quod nil est nisi peccatum manus nimis festinantis.

— — c. पाणीये edd., sed in tota sententia nil est, quod ad *manum* sit referendum.

Dist. 84. Praemittunt edd. huic sloco distichon nostrum 75, q. l. cf.

— — b. तच्छक्यं Pp. pro यच्छक्यं vitiose repetitis mox antecedentibus verbis. — c. शक्यो Pp. utrumque dicitur. — d. न नौर्बा Pp. न नौका P.

Dist. 85. a. महतायनुसारेण Pp. महतामनुसारेण P. — b. L. विश्वसति mendose. — c. नानुरक्तासु P. vitiose; न semper ad verbum est referendum. — d. जीवनं edd. nil refert. Omisit hosce versus W. prius hemistichium me non intelligere fateor; Jonesius vertit; *whoever from solemn treaty places confidence etc.*

Lin. 11. सर्वं om. P. male. — चैतावान् edd. expunximus च, iubente constructione, hortantibus codd. Mox corrigi: संकल्पो. — यत् omitt. edd. addita in fine post करणीयं particula इति; res ad idem redit; sed exquisitor est hic usus pronominis यद्; quando, secuti Latinum *quod*, coniunctionis vice fungitur. Vid. supr. ad p. 11. l. 5.

Lin. 12. सौहृदं Pp. utralibet forma proba. — कर्तव्यं codd. मया addit Pp. नो वा Pp. *quod* pro नो चेद् nisi fallor, omnino non dici potest. भवद्वक्तारे

P. 24. omittunt edd. — Pp. अत्र त्वद्द्वारि; अत्र haud male additum. — P. transponit: — द्वारि आत्मानं.

Dist. 86. Repetunt omnes infr. IV, dist. 99. q. l. cf. — c. कनक om. Pp. vetante metro pariter et sensu.

Dist. 87. a. इव्यत्वात् Pp. vitiose. — d. दर्शणात् edd. mendose. संगतिः P. — निमित्त quid h. l. sit, nescio. Voluitne मैथुनात्? Addunt edd. hosce versus, a codd. et interpp. pariter omissos:

नारिकेलसमाकारा दृश्यते ऽपि हि सङ्गनाः ।
अन्ये वदरिकाकारा बहिरेव मनोदूराः ॥

Lin. 18. Ex codd. additum est comma, nec non seq. यतः pro quo edd. अन्यच्च ।

Dist. 88. b. नो यान्ति P. मनो नायाति विक्रियां Pp. sed obversabatur nimirum memoriae librarii hemist. b. dist. 81. — c. भग्ने pro भड़े L. absurde. हेदे Pp. quod e versu antec. irrepsit. भड़ेनापि हि etc. S. Quo syllaba longius fit hemistichium. — अनुबध् h. l. verbi intransitivi indolem induisse videtur; cuius rei aliud exemplum excitavit Rosen. s. v.

Dist. 89. b. स्मानं सुखदुःखयोः edd. male; est enim adiectivum, quod referendum foret ad प्रीर्य. Voluere सामान्यं.

P. 25. *Lin.* 1. तदेतौर् P. sed particulae consecutivae hic nullus est locus. Pro भवदन्यो Pp. पुनरन्तः, quod per se minime est malum; omittit omnino haec verba P. — पुमान्, iocose dictum de mure, om. codd. qui praeterea transponunt को मया. — Omittunt iidem mox तदचनमाकर्ष, quibus verbis edd. praefigunt इत्यादि; exulare iussimus otiosum additamentum.

Lin. 2. अव्याख्यातो L. pessime; vid. Rosen. in addit. ad radic. Sanscr. p. 375. cf. praeter. Man. III, 203, भवतानेन Pp. minus bene. Ferri posset भवतोऽनेन.

Dist. 90. a. यम्मार्तं च तथा न श्रीतल — Pp. inscite. — c. प्रीत्या edd. qui et चेतसि. — d. सत्योक्त्या Pp. कृष्ण codd. — Ut hosce versus intelligamus, necesse est scire, Indos contra intolerabilem aestatis calorem, variis uti remediis, quibus eum mitigent; primum est lavatio; secundum margaritarum lineae; tertium sirium pulveratum atque humectatum, nec non varia unguenta odorifera inde praeparata. Quae omnia a poetis aestatem desribentibus saepissime commemorantur; sufficiat unum h. l. apponere

exemplum ex poemate Calidasi, Ritusanhâra inscripto, in quo singulis P. 25. capitibus sex anni horas, tot enim constituunt Indi binorum mensium unamquamque, elegantissimis versibus depingit. Ritusanh. descript. aestat. v. 1. प्रचण्डसूर्यः स्मृहणीयचन्द्रमाः । सदावगाहक्षतवार्षिसंचयः । . . . निदाधकालः समुपागतः प्रिये ॥ v. 2. मणिप्रकाराः सर्सं च चन्द्रन् । शुचौ प्रिये यांति ज्ञनस्य सेव्यानां ॥ In hemistichio tertio distichi nostri praetulimus scripturam codd. quae sensum magis commodum praebet. प्रीत्या referendum foret ad भाषितं, quo facto caret सुखयति vocabulo, quod sibi respondeat, et प्रभवति चेतसि nil dicit, nisi oritur in animo. Nostra scriptura recepta construendum est प्रभवति प्रीत्यै चेतसः quantum bonorum hominum colloquium praevaleret ad delectationem animi; प्रू॒ enim cum dativo construitur; vid. Bhag. Git. XVI, 9. et scholl. ad hunc locum laudata a Rosenio s. v. ध; add. not. ad dist. 82 supr.— Difficilius his est hemistichium ultimum in postremis praesertim verbis. सत्योल्लङ्घा corruptela est, quamvis minime indocta; neque enimvero probabile est, bis a poeta positum fuisse sermonem; पुरस्कृतं est id, quod in fronte sive loco primo ponitur, deinde simpliciter, quod praemittitur: sermo autem ipse praemitti solet amice factis, non vero facta praemitti sermoni. Ad ultima verba nunc pervenio, quibus inest haec difficultas, quod variis modis dividi possunt; सुकृतिं accipere licet pro nomin. neutrius; सुकृतिनां autem aeque bene est genit. plur. a सुकृतिन्; सुकृति si a seqq. seiungis, नाम ut saepius adverbialiter positum esse potest: *nempe, scilicet*; (cf. prooem. dist. 40.) sed idem vocabulum, pro substantivo acceptum, cum nomine proprio praecedenti coniunctum, in adiectivum abire solet. Tunc foret सुकृतिनाम, *Sucriti nomine*. Haec autem si quis nugas vult appellari, haud recusabo, modo culpam poetæ tribuas, qui tam male secum potius quam cum lectore egit, ut tales turbae excitari possent. Missis igitur quae sine fructu disputata forent, opinionem meam in medium proferam: पुरस्कृतं subiectum est, quod copula cum सज्जनभाषितं coniungitur; pertinet ad id vox praecedens सत्योल्लङ्घा ita ut unam tantum notionem exprimant; युक्ति est iunctio, सत्युक्ति est coniunctio cum bonis eo sensu, ut sit praestatio officiorum, beneficiorum, parumque differat hoc vocabulum a सत्युक्ति; huiusmodi autem praestationi quod praemittitur, est *comitas*; neque aliud vult poeta quam Tullius, quum II. Offic. 14. dicat: «*comitas, affabilitasque sermonis maxime conciliat animos hominum.*» Comitas autem haec, quam sequuntur beneficia, comparatur cum carmine magico, quo quid

P. 25. attrahi posse creditur. In सुकृतिनाम haereo utrum sit nomen, quo appelletur tale carmen; an seiungi debeat सुकृतिनाम् quod aut ad आकृष्टि referri possit, aut ad पुरस्कृतं; quam rem peritioribus diiudicandam relinquam. सुकृति autem pro subiecto haberri nequit; सुकृति enim सवृकृता पुरस्कृतं tautologia est haud ferenda, et de सुकृति सत्योक्त्या पुरस्कृतं iam dictum est, quod significo ne quis hanc viam a me omnino non tentatam esse credat.

Dist. 91. b. चैवर्व Pp. — *c.* मिस्त्रेता P.

Lin. 10. तदैकमपि Pp. male; sed peius edd. तदैकटूषणमपि; तदैकं *tatpurusha* est: तेषां एकं.

Dist. 92. a. कुरुतं Pp. male. — *c.* अलुब्धतं L. De प्रत्यक्ष vid. ad dist. 61.

— 93. *b.* Pro इव L: भवेत्. — *d.* साथ्योपहृत Pp. male. Haud satis assequor, quinam sensus tribuendus sit verbo: इवव्वान्तरामनः । quanquam verum invenisse videtur Jonesius, interpretatus: cuius animus purus est tanquam aqua. इव proprie est liquidum, nonnunquam ipsa aquae liquiditas: Sancar. Achary. in opusculo, quod inscribitur Vâkya-sudhâ sl. 44: माधुर्यद्वग्नैयादिजलर्घमाल्तरङ्गके । — Additur in edd. hic slocus, a ceteris libris omnibus alienus:

मनस्यन्यद्वचस्यन्यत् कार्यमन्यद् द्वरात्मनां ।
मनस्येकं वचस्येकं कर्मएयेकं महात्मनां ॥

In hemistichio secundo corrige: कर्मएय.

Lin. 15. एव deest in codd. — Deinde hunc in modum pergunt edd. इत्युक्ता हिरण्यको मैत्रं विधाय भोजन etc. — तथोः परस्परसत्यं P. — Pro अभवत् Pp. अभूत् — 16. Pro संतोष्य P. भोजयित्वा.

— 17. ततः प्रभृति edd. inelegans est repetitio. Vid. l. 15. प्रत्यहं om. edd. अन्यान्य S. neque corredit L. प्रदानेन edd. — विश्राम्भालापैः om. P.

— 18. Pro वायसो S. nomen cornicis exhibit. — वयस्य अस्माकं P. qui mox pro स्वानं praebet वनं. — Edd: कष्टतर्, atque usurpatur hunc in modum comparativus, uti etiam a Latinis.

— 19. तदेतत् om. S.

— 20. हिरण्यको ब्रूते । मित्र कृ गन्तव्यं । S. et Pp. omissis omnibus usque ad p. 26. l. 9.

P. 26. *Dist. 96.* Huc traximus hoc distichon, iubente orationis nexu; edd. codd. et interpp. exhibent prorsus inopportuno loco ante nostrum dist. 164. — *hem. a.* in fine pro सृतो edd. तथा. — *d.* L. रथित् pesime.

Dist. 97. c. edd. male seiungunt मा समीक्ष्य, quo facto sensus menti P. 26. auctoris contrarius et h. l. prorsus absurdus evadit. Aut omnino non separanda sunt vocabula aut secundum certas quasdam regulas; quam legem sibi non posuisse editorem Londinensem pro eius incuria minime miror; verum enim vero debuerant editores Serampurenses.

Lin. 11. Edd. अस्ति सुनिश्चिपितस्थानं minus bene. — P. = मित्र निश्चिपितमेव स्थानं वर्तते; quae non magis placent.

— 12. कर्षुर् L. quae editio in hac voce fere semper peccat. — गौरा-मिथानं edd.

— 13. मन्थराचिधानः L. absurde. — pro कूर्मः S. कवचो et mox धर्मिकः, omisso सहजः.

Dist. 98. c. स्वैयं S. falso. — d. pro तु P. तु.

Lin. 16. Pro मत्याहार् S. भोजन. — Pro विषेषैः P. विषयैः inscite. — Pergit tum S. मांसं वर्धयिष्यति। horror scripturae! Pp. मां समुद्रदृश्यते, quod nihil est nisi corruptela a calamo nimis festinanter currente profecta.

Lin. 17. मया verbo कर्तव्यं praemittunt edd. — अवस्थान् Pp.

Dist. 99. b. बान्धवः S. — P. transponit verba: न मित्राणि न बान्धवाः। न च विद्यांगमो वृत्तिसं etc.

— 100. b. pro च L. तु. Totum dist. om. S. Inserunt mox edd. haecce duo distt., quorum prius agnoscit etiam P., neutrum Pp. J. et W,

लोकयात्रा भयं लड्जा दक्षिणयं त्यागशीलता ।

पञ्च यत्र न विद्यते न कुर्यात् तत्र संस्थितिं ॥

pro विद्यन्ते L. वर्तते, haud male.

अन्यच्च । तत्र मित्र न वस्तव्यं यत्र नास्ति चतुष्टयं ।

ऋणदाता च वैद्यश्च श्रोत्रियः सुजला नदी ॥

Lin. 22. कथा omisso, S. विचित्रालापैः।

Lin. 1. Pro ज्ञाम् S. ययौ. — Pro ततो Pp. तत्र. — द्वादेवालोक्य P. quod P. 27. valde arridet.

— 2. लंयुपतनकसुत्यायातिथ्यं etc. codd. — अपि desideratur in edd.

Dist. 101. Pro uno hoc disticho tria exhibet ed. S. videlicet primum, quod apud nos supra legitur num. 54, deinde hoc, quod nobis nunc ante oculos versatur, tertium denique nostrum num. 57. insignitum. Duo priora praebet P., primum tantum Pp., omnia omittit ed. L.

P. 27. utpote quae supra exhibuerat. J. cum Pp. consentit; W. cum S. Emen-davimus in hemist. d. सर्वस्य pro सर्वत्र, iubente constructione.

Lin. 5. Pro वयस्य edd. सखे. — Pro सविशेषं P. विशेषेण. — Edd. सविशेषपूजामस्य.

— 6. गुरुपुण्यकर्मणां P. — धुरीणः om. Pp. inscite. — idem मूषक, quam formam agnoscit Wils. s. v. rarer tamen esse videtur.

— 7. In hac sententia contra librorum et editorum consensum scripsimus न कदाचित् pro यदि कदाचित्, hac ratione freti, quod exemplum ellipsis, qualis haec foret, prorsus nullum exstat; duorum remediorum lenius adhibuimus: aut enim mutandum erat यदि in न, ut fecimus, aut invenienda erat ex conjectura apodosis, quae positioni conditionali responderet. Ceterum S. = सहस्रद्येनापि यदि सर्पराजः कदाचित् कथितुं समर्थः स्यात्। — अपि om. L. et Pp. Scriptum fortasse fuerat नावि, posthac omissa erat a quodam librario ultima littera न adiectivi द्वितीयेन, नावि deinde contractum cum द्वितीये, et quum aliquid deesse vidisset aliis, intrusit यदि suum. — P. = सहस्रेणापि सर्पेश्वरः कर्तुं कदाचिच्छक्तः स्यात्। यदि omnino omissa; quibus verbis si न additur, omnia optime se habent.

— 8. चोपवर्षितबान् codd. — Expunximus otiosam copulam, retinuimus autem praepositionem उप, quam om. edd. — P. तत् शुत्वा मन्थरः संपूर्याह ।

— 9. P. incipit orationem testudinis ab hisce verbis: सखे हिरण्यक अत्र etc. edd. a भञ्ज ते, omisso अत्र. — Pp. तत्र pro अत्र. — निर्जन om. P. qui cum S. pro अवस्थान legit: आगमन.

— 10. चम्पकवती नाम नगरी यत्र etc. L. — नायं om. Pp.

— 11. परिव्राजका निवसन्ति L. et S. (ubi tamen नि deest.) Pp. अभिसाकः mendose pro आवस्थः। Mox S. et P. परिव्राज् et P. निवसति.

— 12. P. भोजनविशिष्टं मित्रान्नसहितं; pariter L., modo विशिष्ट praebet.

— 13. उत्सृत्य P. — प्रत्यहं om. codd. — विषय deest in Pp. —

— 14. तत्र ex P. - समायात् S. — pro तेन तह Pp. स च. Pro तह Pp. साङ्क. — नाना om. S. — अपि चूडाकर्णो recepimus ex P. Nomen agnoscit L. sed collocat post - खंडेन.

— 15. - खण्डमताउथत् P. - दण्डमताउथत् Pp. utrumque absurde. तसुवाच P.

— 16. Incipit comma in edd. a सखे; inepte, sequente भवान्. Pro किमिति Pp. कथं; illud praestat, est enim loquela mirantis et admodum indignabundi.

Subiicit ed. L. sermoni Vinācarni hosce versus, quos praeter W. ceteri omnes pariter ignorant.

यतः । मुखं प्रसन्नं विमला च दृष्टिः कथानुरागो मधुरा च वाणी ।
स्नेहोऽधिकः संब्रमदर्शनं च सदानुरक्तस्य जनस्य लक्ष्यं ॥

P. 27.

Emendavi स्नेहो - pro स्नेहाधिकः et लक्ष्यं pro लक्षणं, metro postulante. Mallem tamen चिङ्गं, quod exquisitus est vocabulum, a glossatore nisi fallor per लक्षणं explicatum; aut irrepsit लक्षणं e disticho, quod addit L:

अतुष्टिदानं कृतपूर्वनाशनं अमाननं इश्चरितानुकीर्तनं ।
कथाप्रसङ्गेन च नामविस्मृतिर्विरक्तभावस्य जनस्य लक्षणं ॥

Correxi विस्मृतिर् pro विस्मृतिः. L. — Lege प्रसङ्गेषु. SCHL.

Lin. 16. भक्त om. P.

— 17. पात्रमुत्प्लुत्य भिक्षान्तं खादति P. — Pp. et L. omittunt उत्प्लुत्य; cetera ut S. et nos.

— 18. अयो initio incisi P. नाक् pro नाग् Pp. inepte. — विलोक्य S. et P.

— 19. Pro अयं edd. अपि. — कारणोनात्र केनापि Pp., sic etiam P. omissio tamen केनापि.

Dist. 102. a. Edd. et P. अकस्माद्; nostram lectionem tuetur W. नाक्स्मात् haud sine caussa; अकस्मात् repente; res ipsa ad idem admodum reddit; sed nostra scriptura melius cum sententia anteced. convenit.

— 22. गौडिये S. गौडदेशे L.

Lin. 1. Pro तस्यां P. तत्र. — बणिक् प्रतिवासति । स च महाधनः Pp.

P. 28.

— 3. नान्मी S. voluit नान्मी. — In fine codd. omitt. इव. Similibus verbis usus est Bhavabhûtes (Mâl. et Mâdh. Act. 1.) मकरकेतोर्जगद्विजयवैजयन्तिका; quem locum noster imitari videtur.

Dist. 103. d. ज्ञोण e P. pro quo S. ज्ञोर्ण (scribit ज्ञीर्ण) male propter praecedens ज्ञा. Pp. paullo audacius: पीत, et mox घिये pro पतौ. L. = ज्ञया पीडिते पतौ.

— 104. a. पलितेषु च P. Offendit fortasse librarium अपि, cuius vim h. l. haud assecutus est. पलित *canus*, proprium est vocabulum de capillis seniliter decoloribus; Sancaras in Môhamudgara v. 7. अङ्गे गलितं पलितं मुण्डं. — b. कामामकामिता S. absurde.

Lin. 9. Edd. बृद्धपतिः

Dist. 106. c. Eepidam hanc sententiam foedissime vitiavit L. scribens: निर्देशनश्चैव. S. tantummodo omissione Visargi in fine vocabuli निर्देशन peccat.

P. 28. *Lin.* 14. - दर्पातिकान्ते Pp. vitiose; दर्पातिकान्त P. quod ferri potest.

Dist. 107. a. निवसति॒र्, omissio अपि edd., particulam om. etiam P. exhibens: मन्दिरेषु वसति॒र्. — संगतिः in fine hemistichii edd. vitiose; egreditur enim in omnibus metris Indicis coniunctio litterarum caesuram, qua bina versus hemistichia separantur. — b. गोष्टैपुरुष L. quibus verbis duo peccata commisit; sed excellit in hac re editor iste. पुरुष, producta prima syllaba, metro debetur. Cf. ex. gr. Bhag. Git. III, 36. — - संनिधामन्यमो वासो विदेशो तथा Pp. vitiose. — वासविदेशे P. et L. mendose. — c. पुश्चलिभिर् L. contra metrum et grammaticam. — d. इर्षितं प्रसवनं S. इर्षितं प्रवसनं P. इर्जितं प्रवसन Pp. इर्षितं प्रहसन L. *Sporting with the husband's infirmities* W. consentit igitur cum L., omisit haec verba omnino J. LASS.

Proxime insistentes vestigiis editionis Londinensis et interpretationis Wilkinsiana, expuncta modo in priore vocabulo casus et generis nota, rescriptsimus: इर्षितप्रहसनं. Ita exsistit compositum, quod cum वार्षकं tanquam adiectivum iungi debeat. Lenissima sane est coniectura, quippe qua nihil mutetur praeter unicum punctum sublatum. Attamen, loco secundis curis retractato, consilii nostri me poenitet. Vereor enim ut scriptura, qualem nos constituimus, significare possit: *mariti senium, libenter vel maligne derisui habitum.* इर्षा semper de invidia usurpatur; इर्षित igitur est is, cui invidetur, sive id, propter quod alicui invidetur. Insederat in animo praejudicium, ab interprete Anglo petitum, quod me prohibuit, quo minus in tanto librorum dissensu meliora eligerem. Nunc autem tanquam unice veram amplector lectionem Sriramapurensem, ad quam, transpositis modo litteris, et Codd. Pp. et P. alludunt. Sed ut clarius elucescat, quam accommodata sit huic loco scriptura, singula accuratius sunt explicanda. Quod ad nexum sententiarum cum' fabulis attinet, ante omnia tenendum est, sententias saepe laudari propter aliquam sui partem, interdum propter singulum vocabulum, etiamsi cetera nihil prorsus ad rem faciant. Hic agitur de senio mariti, quod adversata Lilavatis naufragium castitatis facit. Enumerat poeta caussas corruptae in feminis pudicitiae novem numero, hunc quidem in modum. 1) Vita sine custode vel tute peracta. Quaenam ea sit, optime nos docet legumlator. Cf. Man. Dh. Sâstr. IX, 3. 2) Commoratio in domo paterna, scilicet puellae innuptae, postquam nubilis facta est. Cuius periculi vitandi gratia patres familias in India filias impuberes despondere

solent; pubertatem nactae, statim sponso traduntur. Notes velim vim P. 28. particulae असि. Vel in ipsius patris domo castitati periculum imminet, nedum apud cognatos, quorum minor est auctoritas, cura remissior. 3) Egressus in publicum in pompis, quae diebus festis celebrantur. 4) Licentia non refrenata ab occurso virorum in populi coetibus. 5) Habitatio in terra peregrina; quia nimirum absentibus cognatis et familiaribus famae minus cavetur. 6) Frequens commercium cum feminis libidinosis. Inest singulis huius metri hemistichiis व्याप्तमुष्टिः quaedam post syllabam duodecimam, unde patet अस्तकृत् non ad sequentia, sed ad praecedentia esse trahendum. 7) Opum domesticarum iactura, qua mulier eo adduci potest, ut ex donis amantium novas opes sibi quaerat. 8) Mariti senium. 9) Fecunditas aliarum mulierum cum invidia spectata. Timendum est ne uxor, cui nulla supersit spes prolis ex marito sene vel infirmo suscipienda, adulterum in auxilium advocet. Diversa haec est caussa a praecedenti, quacum arcto tamen vinculo cohaeret. Vulgo autem notum est, quanto liberos procreandi studio Indorum natio flagret, ita ut nihil vehementius averruncet quam sterilitatem. प्रस्तवा dicitur tum de partu, (Am. Sinh. definit गर्भमोचने) tum de ipsa prole. Cf. *Colibr.* प्रस्तवा non legitur in lexicis nostris, sed est haud minus legitime derivatum vocabulum, quo aut idem significatur, aut in universum facultas pariendi, fecunditas. SCHL.

Dist. 108. c. स्वप्नमन्यगृहे etc. L. et P. — d. ह्यौणां संटूषणानि षट् Pp. prius mendose, posterius per se haud male.

— 109. b. प्रार्थयितो Pp. vitiouse.

— 110. Deest distichon in cod. Pp. Praemittunt edd. huic disticho versus qui apud nos leguntur infr. num. 189., quos S. bis habet, h. l. et infra, quosque omittunt codd. et Jones, qui quatuor disticha 109 — 112. Anglice omnino non reddidit.

— 111. Desideratur in utroque codice et ed. S. — Ed. L. addit praeterea hunc slocum, quem agnoscit etiam S. praemisso tamen nostro dist. 112.

न लङ्घा न विनीतावं न दक्षिणं न भीरुता ।

प्रार्थनाभाव एवैकं सतीवे कारणं स्त्रियाः ॥

Ed. L. praebet: प्रार्थकाभाव श्वेति, quae scriptura vix praeferenda est.

P. 29.

P. 29. 113. c. पुत्रस्तु P. स्थाविरे S. स्थाविरे काले Pp. Veram scripturam praebet Manus IX, 3. इतन्ति स्थाविरे पुत्रा; cetera conspirant. Addit sola ed. L. hunc Manus slocum (II, 215.)

मात्रा स्वस्त्रा दुहित्रा वा नो विविक्तासनो भवेत् ।
बलवान् इन्द्रियग्रामो विद्वांसमपि कर्षति ॥

Manus न pro नो et sic lege.

Lin. 11. कर्पूरे Pp. कर्वुर P.

— 12. P. = सुखासीनावतिष्ठति । अनन्तरं च उपस्थितं पतिं etc.

— 13. आकृष्य pro गृहौत्ता S. — pro निर्भरं S. गाहं; P. निर्दयं. — अत्रान्तरे desideratur in P. Substituit S. तेनावसरेण.

Dist. 114. Omittunt codd. et J. — In hemist. c. S. scribit: तच्छास्त्रं, quae repetitio minime placet.

Lin. 16. तत्स्त्रू etc. P. qui et आलोक्य तत्स्त्रौय etc. legit; pro कुदृष्टणी edd. कुदृष्टणी; codd. plerumque कुदृष्टनी, quam formam solam agnoscit Wilso; quae-nam scriptura vera sit, difficile est dictu, quum parum liqueat vocis deri-vatio. — — Incisum, quod incipit a नाक्तमाद्, S. debemus; abest a ceteris libris, sed postulatur a verbo अचिन्तयत्; addidimus negationem, quam propter hunc locum etiam supra inserere necesse erat. (Cf. ad dist. 102.)

— 17. ज्ञातं om. P. et S.

— 18. दण्डेन om. codd. et S., गुणेन etiam Pp. Poena autem quam h. l. vocabulo गुणेन दण्डेन indicat auctor, pecuniae sunt, quas pro silentio suo ex Līlavatide extorsit lena; quam explicationem Wilkinsio debemus p. 304.

— 19. Secuti sumus in hoc commate Pp. inserto tamen ex edd. केनापि, quod ille omittit. Edd. prorsus absurde: मूषिको विवरमालोक्य बलोपविष्टसेन इह केनापि etc., sed अत्र omissio; quae verba sanari possunt hunc in modum: मूषिकविवरमवलोक्याह । बलोपविष्टः स । तेनेह etc. — P. paullo melius: मूषिकबलोपविष्टसेन केनापि etc., corrige: मूषिको. Sed vel hac emendatione recepta haereo in verbo बलोपविष्ट, quod dubito an omnino dici possit; praebet haud dubie Pp. veram auctoris manum, quam librarii ignari variis modis depravarunt.

Lin. 20. परिव्राजकेनोक्तं desunt in codd. haec verba, neque sunt omnino necessaria, quanquam, uti supra iam observatum est, dramaticum genus potius sapit tales omittere locutiones. Sequens incisum ex P., omissio

tantum नूतं post कारणं, nescio an recte.— S. कारणं चात्र वाहुल्याङ्गनमेव भविष्यतीति । P. 29. quod per se haud male est dictum, praestat tamen nostra scriptura, धनमेव praemittendo, in quo verbo vis orationis vertitur. Pp. cum S. in prioribus consentit, sed tum धनं corrumpit in बलं et भविष्यतीति omittit. L. वाहुल्याङ्गनमेव भविष्यति.

Lin. 1. परिवारकेन om. S.— मम deinde om. S. et P. चिरकालोपार्जितं धनं L.— P. 30. S. ut nos, sed addito मम ante धने — Pp. मम विवरनिधानं.

— 2. pro प्रत्यहं S. प्रभृति. — आहारं Pp. निग्राहारं P. Recentior est usus adiectivi निज tanquam pronom. possessivi, quod pro subiecti diversitate, eodem modo atque स्वं et genit. nominis आत्मन्, ad omnes personas, primam dico et secundam, nec non tertiam referatur; quem usum per Hitopadesam haud semel observare licet. Eodem prorsus modo senior Graecitas utitur voce οἰκεῖος. Vid. *Classeni* nostri indic. ad. Dexippum s. v.

— 3. pro अप्रकृतः L. et S. अकृतः. — मन्दमन्दं P.— उपसर्पन् edd. — अवलोकिताहं L. corrigere: अवलोकितोऽहं.

Dist. 116. a. धनेन et b. धनाद् S. — Pro सर्वं S. et P. लोकः; cf. tamen dist. 115. a. — स्थायाद् P. sed hiatus in caesura tolerari potest. Vid. mox 121, c. — d. गतः L. et P. quod ceteris accusativis in nominativos mutatis admitti posset. पश्य enim et मन्ये inseruntur orationi parenthesis loco et constructionem non mutant.

Dist. 117. a. . . . तु विहीनस्य S. sic etiam P., sed pro तु substituit हि; neutra particula opus est, quam ob rem secuti sumus Pp. et L.

Dist. 118. d. स तु Pp. et L. स हि S.

Dist. 119. Recepimus ex P. Ceteri omitunt h. l. Omnes exhibent infr. Lib. II, 2. q. l. cf.

Dist. 120. d. सर्वशून्यं P.— Versus desumpti sunt e fabula, cui titulus est Mrichchhakati. vid. interpr. Wilsonis p. 14. — Expectabam: सर्वं शून्यं दरिद्रः Addit deinde sola ed. Lond. hunc slocum:

दारिद्रान्मरणाद्यापि दारिद्रं च वरं स्मृतं ।

अल्पलोकेन मरणं दारिद्रमतिङ्गसद्यं ॥

Plura insunt hisce versibus minus bene dicta; displicet च, displicet etiam वरं hoc sensu, ut sit *peius*; cuius significationis nescio, an ullum exstet exemplum; more bene Sanscrito positum habes hoc vocabulum infr. dist. 129.; displicet porro repetitio vocabuli दारिद्रं, neque fugere po-

P. 50. test lectorem priori versu dici paupertatem deteriorem esse paupertate; quod sensu cassum est. Ut breviter expediam, legendum est: दारिद्र्यम् एव-योर्हि दारिद्र्यवरं स्मृतं । अल्पकेशाय मरणं etc.

Dist. 121. a. इन्द्रियाणि विकलामि Pp. male.— d. P. योऽन्यः— Pp. वान्यः (in codice deest punctum geminum) *Utrumque est ex emendatione hominis quem offenderat hiatus in caesura एव-अन्यः, insolentior is quidem, cuius tamen aliud exemplum mox designavi dist. 116. Neutra vero emendatio admitti potest; disiunctioni nullus est locus, pronomine relativo autem intruso constructio prorsus evertitur; अन्यः enim praedicatum est ad पुरुषः pertinens; idem ille vir evadit diversus. एव rariorem h. l. praebet sensum: etiam: तदेव नाम, hoc etiam nomen, sc. अविकलं et sic porro तदेव वचनं. Prorsus similem vim habet तदेव infr. p. 121. 1. 5.*

Lin. 17. Pro आकर्ष्य Pp. आलोक्य male. — S. mox अवलोचितः; quod, nisi fallor, nunquam dicitur. मम ante अत्र om. P. Pro मम Pp. मया, sed is omnino corruptus est h. l. मयावस्थानमिदूनों etc.

— 18. तदू वृत्तान्तकथं Pp. एतदू वृत्तान्तकथं edd.

Dist. 122. c. Pro वंचने Pp. गञ्जने; idem scribere voluit P. ut videtur, quanquam media syllaba minus distinete sit exarata. Hanc coniecturam egregie confirmat Vētāla-Panchavinsatī, in cuius fabula prima hic slocus reperitur; legitur ibi गृजने, quod quum ab hoc versu prorsus alienum sit, non dubium est, quin corruptela sit pro गंजने. Quaenam autem significatio huic vocabulo, in lexicis non obvio, tribuenda sit, minus liquet; si radici गृ विम inepti recte tribuit Wilso, ebrietatem h. l. intelligere licebit; cf. Wils. s. v. गंजा, quod nomen *cauponam* notat. Sobrietatem in summis virtutibus ab Indis poni, notum est. वंचने hoc habet incommodi, quod contra usum *passive accipi* debeat: *fraus*, quam patimur, haud eam, quam ipsi concipimus.

Dist. 123. Desideratur in Pp.

P. 51. *Dist.* 124. b. व्यर्थे यते *edd.* male.

Dist. 125. b. . . . नैक Pp. per se haud male, praestat tamen न त.

Dist. 126. b. च pro तु Pp. minus bene. Idem hemist. c. सर्वलोकस्य वा
मूर्धि, paullo durius; nam विश्रीर्येत ad priorem huius versus partem non com-
mode trahi potest; supplendum igitur foret: स्यात्. In ultimo hemistichio
secuti sumus. Pp. — Edd. et P. विश्रीर्यदयवा वने male: passivum enim prae-
ferendum foret, etiamsi शृं secundum quartae classis normam inflecti

posset; quod fieri nequit. Quid multa? Bhartriharis sunt versus, ad P. 51.
quorum genuinam scripturam proxime accedit Pp. — Ed. Ser. p. 49:
सर्वलोकस्य वा मूर्त्ति विशीर्णत वनेऽथ वा । Ed. Ser. ibi vitoise: विशीर्णते.

Lin. 8. अत्र om. P. — याच्चया edd. sed praestat h. l. compositum. जीवं
Pp. quod sensu h. l. commodo (*vita*) agnoscitur a Wilsone quidem,
verum rarius reperitur. — Pro अतीव Pp. एव.

Dist. 127. c. नोपचारः Pp. mendose. — d. प्रार्थिते codd. et L. — Pp.
praeterea pro ज्ञनः exhibit नरः. Minus recte praetulimus scripturam ed.
Ser. प्रार्थिते; in iunctura enim hac: वरं — न वरं, posterius वरं interdum omit-
titur, veluti ex. gr. mox dist. 129, sed tunc verbum substantivum quod
subintelligendum est, ad utramque sententiam pertinet, neque alii
verbo locus est. प्रार्थिते: est is, qui ab aliis aditum auxilii impetrandi
caussa. L. —

Ne recepta quidem codicum lectione in expedienda secundi versus
sententia mihi ipse satisfacio. Mavult Lassenius noster participium, ut
supplere liceat: न च वरं भवति, quibus verbis, recepto passivo, nullus est
locus. Attamen non omnino necessaria est repetitio, sive expressa sive
intellecta, in eiusmodi sententiis, ubi binae sortes inter se comparantur,
altera tolerabilis, altera vehementer responda; imo elegantius in alter-
utro comparationis termino locutio variatur. Cf. Prooem. sl. 19. Sed
offendunt me nominativi continui, ad eandem personam referendi.
Sane qui ipsi opibus suis sunt exuti, non sollicitari solent ab aliis pe-
cuniae largiendae gratia. Exspectabam tertium casum, sic fortasse:
न चोपचारभ्रष्टेन. Emendatio variis modis tentari poterit; exspectandum est
auxilium codicum. SCHL.

Dist. 128. a. दास्त्रिक्षयाद् P. et S. Est forma aeque legitima. — हीयं P.
contra grammaticam et metrum. परिभ्रान्त्यते Pp. male. — a. et b. परिगतः
प्रश्नयते तेऽसः । निस्तेऽग्नाः परि - P. — b. pro आपचते Pp. आगच्छति. — c. श्रोकरहिते P. male. —
Nec melius ibidem Pp: बुद्ध्या न संयुज्यते. d. विधनता ex coniectura pro निधनता,
quod quanquam omnes libri tuentur, stare nequit; arbitrati sunt for-
tasse librarii et editores नि in compositis idem valere atque निर्; quod
fieri non posse, demonstravit editor Bibl. Indic. I, p. 350. Legitur hoc
distichon in fabula Mrichchhakatī. Vid. interpr. Wils. p. 21.

Dist. 129. a. वरं कार्यं मौनं Pp. — c. प्राणास्त्वकाः Pp. — वाक्येष्वभिरुचिः edd.
d. pro सुखं Pp. मलं.

P. 51. Subiungunt edd. hosce versus, qui in codd. pariter atque interpp. omittuntur, neque ipsi habent, quo magnopere sese commendent:

वरं शून्या शाला न च खलु वरो दुष्टवृषभो ।
वरं वेश्या पत्नी न पुनरानीता कुलबधूः ।
वरं वासोऽरथे न पुनरविवेकाधिपपुरे ।
वरं प्राणत्यागो न पुनरधमानामुपगमः ॥

Leviora nonnulla vitia tacite sustuli; restat unum, quod altius insedit, dico आनीता, quod vel metrum corruptelae arguit. Scripsissem न पुनरूपनीता, si probare potuissem, उपनी idem valere ac प्रणी et परिणी. Dicitur faemina, quae alii post maritum viro nubit, परपूर्वा. Man. V, 163:

पतिं हित्वापकुट्ठं स्वमुक्तुं या निषेकते । निन्यैव सा भवेल्लोके परपूर्वेति चोच्यते ॥

परपूर्वा optime loco nostro convenit, verum non sine artificiis quibusdam versui inseri potest. उपोठा legitur Ram. I, XIII, 37. quod vocabulum facile est h. l. introducere: न च पुनरूपोठा; sed est ipsum isto Rameidos loco ex coniectura, necessaria illa quidem et praeclara, positum. Rem in medio relinquam, neque enim tanti valent isti versus, ut in eis operam et oleum perdamus.

Lin. 21. इति om. Pp. — अहं om. P. — Pro भोजयामि Pp. योजयामि; P. संबर्धयामि; S. पोषयामि. — Pro भो codd. भोस्.

P. 52. *Dist. 131. b.* क्लेयक्रीतं S. minus bene. — पल्लवग्राहि insolita est dictio, cuius tamen sensum feliciter divinavit Jonesius, vertens: *superficial knowledge*. पल्लवग्राहि पारित्तयं eruditio est, quae surculos quasi tantummodo defringit de arbore scientiae, quae verba facit permulta, floridaque gaudet loquela, solidis autem fundamentis destituta est, neque bonae frugis quid producit. Quam interpretationem ne pro lubito a me propositam esse censeat lector, optima auctoritate stabiliam. Canit *Jayadevas* initio *Gitagovindae* (v. 4.), वाचः पल्लवव्यत्युमापतिधर्मः संदर्भशुद्धिं गिरां । ज्ञानोते ज्ञयदेव एव, et quae sequuntur; ad prima verba scholiastes: उमापतिधरनामा कविः पल्लवव्यति विस्तार्यति मात्रं न काव्यगुणयुक्ता वाचः करोति । पल्लवग्राही दोषोऽस्य. — Alius interpres haec habet: अल्पामपि वाणीं बाहुल्येन निबध्नाति. Ambae interpretationes facile inter se componi possunt; ex priori scholio patet, nisi fallor, technicorum vocabulum suisse पल्लवग्राह, quo nimiam eamque vanam et inanem verborum pompam designarent. L.— Cf. vocem simili modo formatam असदूयाह, Bhag.

Git. XVI, 10. Wilso, sequutus Trik. Sêsh. tertiam syllabam corripit, P. 32. recte interpretatur, sed peccat in derivatione. SCHL.

Dist. 132. b. पर्वासशायी च edd. refragante metro; च addit etiam Pp. mendose, in ceteris uti nos. — d. pro सोऽस्य L. तस्य; offenderat Hayleyburensem optimum virum fortasse haec pronominis attractio a nomine, quod in eadem sententia qua illud collocatum est; सोऽस्य enim est pro तदस्य; sed hoc pueri iam norunt.

Lin. 5. Edd. — अपि लोभात् पुनर्पर्यं ग्रहीतुं etc. Pp. अपि omissio sic pergit: लोभात् पुनरपि धनं ग्रहीतुं etc. quocum consentit P. in तदन्म pro धनं solummodo varians.

Lin. 9. Ed. Ser. ततोऽहं मन्दमन्दमुपसर्वस्तेन वीणाकर्णेन etc. Sed verba p. 30, l. 3. male huc sunt tracta. वीणाकर्णेनाहं L. — वीणाकर्णेन तेन Pp. — ताडितोऽचिन्तयं ex ed. L. — Ceteri hunc in modum variant: ताडितः । अथाहमचिन्तयं P. — ताडितः । तथाहमचिन्तयत् (sic) Pp. — ताडितश्चाचिन्तयत् (sic) S. In proxime seqq. maximas turbas excitant libri: L. — अचिंतयं । लुब्धे क्षुसंतुष्टो नियतमात्मद्वौही भवति; sequitur tum distichon ab eisdem verbis incipiens; eodem modo S. in soluta oratione, sed slocum haec verba excipientem omittit. — Codex P. ed. Ser. sequitur, sed आत्मद्वौहीति exhibit pro आत्मद्वौही. — Pp. denique prosam orationem omnino omittit et distichon nostrum 134 statim post verbum अचिन्तयं collocat, quem secuti sumus, ut haud dubie debebamus; facile enim appareret priorem distichi versum additamento quodam ex. gr. आत्मद्वौही, turbatum et deinde, quum is pro oratione soluta acceptus fuisse, alterum versum plane fuisse omissum; alias deinde ex alio codice adscripsit distichon, quo facto evadit constitutio textus, qualis in ed. Lond. comparet. — अनियतात्मा in dist. 134. satis notum est vocabulum, cuius vis tamen haud scio an ab omnibus plane perspiciatur. नियम् proprius est cohibere habenas equorum; cum equis autem regundis comparantur animus hominis atque sensus, ratione regundi: unde translatus est hic mos loquendi: नियतात्मा, नियतेन्द्रियः et aliae similes dictiones. Praecclare huc facit locus in Kâthakopanishat p. 7. obvius:

आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु । बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ॥

द्विन्द्रियाणि हयान् आहुर्विषयांस्तेषु गोचरान् । आत्मेन्द्रियमनो युक्तं भोक्तेत्याहुर्मनीषिणः ॥

Dist. 135. om. Pp. — d. न तु ex P. — edd. न तु, quo peius quidquam excogitari nequit.

Dist. 136. a. तप्तानां Pp. stulte.

P. 52. — 138. d. ज्ञौवनं edd. Ad idem redit.

— 139. b. ब्राथमानस्य S. sed nostra scriptura melius ad totius loci complexionem quadrat. — d. in fine ed. L. नारद् quo quid absurdius esse potest?

Lin. 22. उचितकार्ये Pp. — S. तद्वावस्थोचितकार्यं cet. L. तद्व द्वरस्थोचितकार्यं cet. — परिष्वेद् proprie est abscissio, unde et propter versus huic sententiae illustrandae subiunctos (cf. praecipue 141 त्यजेत्) suspicari posses sensum esse loci: *abdicatio negotiorum semper praestat, quum sit consentanea conditioni nostrae.*" Sed aliam habet, me iudice, vim vox परिष्वेद्, quam demonstrare utile erit, propter silentium sive potius reticentiam Wilsonis, qui hoc vocabulum exhibet quidem, verum solam ei tribuit significacionem divisionis, qua libri in partes suas distribuuntur. *Divisio* certe vis propria est huius vocabuli, quod ad libros minime est restringendum, sed ad res in universum pertinet, ita ut sit earum discriminatio, distinctio, distributio in classes suas, qua facta cuiusque naturam et proprietatem intelligimus; unde ad hunc *Bhavabhútis* versum (Mâl. et Mâdh. I, 24.) परिष्वेद्व्यक्तिं भवति पुरःयेऽपि किष्ये : «discriminatio non cernitur ne in re quidem ante oculos obversante» scholiastes परिष्वेद् interpretatur per निश्चय. Paullo ante परिष्वेदातीत dicitur de re, quae discriminationem ita egreditur, ut comprehendendi et definiri nequeat. Ad nostrum ut revertar, कार्यपरिष्वेद् talis est discriminatio negotiorum, ut perspiciamus, quid pro cuiusque conditionis diversitate sit faciendum.

Dist. 140. b. नित्यमरोगिता ed. Ser. qua scriptura metrum omnino perversunt sapientes isti homines, qui et mox परिष्वेद् scripserunt.

Addunt edd. hoc distichon:

परिष्वेदो हि पापित्यं यदापन्ना विपत्तया ।
अपरिष्वेदकर्तृणां विपदः स्युः पदे पदे ॥

Ed. L. hoc mutavit in - यदापन्नोऽविपत्तया । prius: आपन्नो, nisi fallor, haud male; posterius: अविपत्तया, stulte; sensus enim esse deberet: quum invaditur homo a mala fortuna; अविपत्ता foret bona fortuna, a qua invadi dici non possumus. Sed corrigere तदा pro तया et construe: यदा विपद् आपन्ना तदा परिष्वेदः पापित्यं । आपद् enim verbum est neutrum. Cf. Rosen. s. v.

Dist. 141. d. स्वात्मार्थे S. omisimus pronomen, h. l. otiosum, et hiatus vitandi caussa intrusum.

Dist. 142. om. S. et Pp., nec non J. Versum posteriorem ex P. P. 52. dedimus; L. = हस्य कण्ठलग्नोऽपि वातं खादति वासुकिः ad sensum nil differt, sed istud concinnius est dictum. In hem. b. P. exhibitet, अनुसारि च.

Dist. 143. b. खादानं L. male. — Pro वा Pp. च, quod ferri h. l. P. 53. omnino non potest.

Lin. 9. अहं om. P. — निर्जनं ex Pp. pro निर्जन.

Dist. 144. Omitunt codd. et J. — b. भेजनं in fine S. Inest huic versui licentia poetica in constructione, quae, si cetera respicis, sic procedere debebat: तृणश्चाया; et facile compositum loco idoneum inveniri posset scribendo तृणाधिश्चाया; sed concedendum est aliquid poetis.

Lin. 12. ततोऽप्यस्मात् S. et mox पुण्यबलोदयाद् S. — पुण्योपचयेन P. qui comma proxime sequens, dist. 145. et verba मन्यर उच्चाच omittit; tribuit igitur muri slocum 146; minus bene, ut nemo non videt. Quae autem h. l. omittit, infra post dist. 146. ponit. — च post अधुना recepimus ex Pp. cui etiam verba पुण्यपरंपरया et अयं (l. 13.) debemus; edd. hoc omittunt, pro illo exhibent: पुण्यबलोदयाद्, quod variatio est paullo ante obvii vocabuli पुण्योदयात्, haud bona quidem illa; dubitare enim licet an solitum sit dicere पुण्यबल, quanquam bene Sanscrite componitur तपोबल et योगबल; sed scribere haud dubie si non voluit, tamen debuit पुण्यफलोदयात्. De परंपरा cf. notam ad Bhag. Gît. IV, 1., ubi exponitur discriminem, quod interest inter परस्पर et परंपर; tertium est vocabulum परावर, ab utroquo diversum, cuius vis optime explicatur ad hanc dictionem परावरा विद्या in Mundaca p. 1. obviam: परस्मात् परस्मादवरेणाकरेण प्राप्ना.

Dist. 145. b. Pro एव S. अत्र; stulte. — Pro मधुरे कले Pp. et S. रसवत्तले; L. हे कले चामृतोपमे. Secuti sumus cod. P. qui post dist. 146, ut mox videbimus, locum (l. 12. et dist. 145.) quem omissum esse supra diximus, reiecit. — — d. ख्वजनैः Pp. — सुजनैः S. Sequitur in ed. L. hic slocus, quem inter ceteros W. solus agnoscit:

संगमः केशवभक्तिर्गङ्गाम्भसि निमज्जनं ।

असारे खलु संसारे त्रीणि साराणि भावयेत् ॥

Lin. 16. distichon 146. abest a codice Pp. qui post verba मन्यर उच्चाच statim pergit: युष्माभिः etc. vid. l. 20.

Dist. 146. a. वेलोपमं P. qua lectione convenientia similitudinis perit. b. *init.* आशुव्यं S. — केण mendose scripsimus pro केन. — ज्ञीवितं S. — c. नि-

P. 33. नित्यतमति: S. — d. pro हतो S. हुते minus bene. — परिगतः S. sed de senectute melius dicitur परिषातः. — Quum लोल et चपल pariter adiectiva sint, explicandum compositum hunc in modum esse videtur: जलविनुवत् लोलं चपलं च। Ceterum satis frequens est apud poetas Indicos haec comparatio, qua rerum humanarum fluctuatio cum guttis aquae confertur. Auctor Môhamudgarae v. 4. नलिनीदलगतजलमिव तर्लं। तद्वारीवनमतिशयचपलं।

Lin. 20. Disticho 146. subiungit P. अभुना etc. ex l. l. 12-13; sequitur tum dist. 145., quod excipiunt deinde verba: मन्यर उवाच। युष्माभिः etc. — Edd. post virgulam तस्यां दोषः।

Dist. 147. a. Pro विज्ञानां Pp. अर्थानां; P. वस्त्रानां. Distichis 147. et 148. interponunt edd. hosce versus:

यदधोऽधः क्षितौ वित्तं निचखान मितंपचः ।
तदधोनितयं गतुं चक्रे पन्थानमयतः ॥

Interpretatus est W., sed paullo infra, versus laude sua haud privandos.

P. 34. *Dist.* 148. a. Edd. निज्ञानानो quod eis reliquimus.

— 149. a. दानमोग P. haud magnopere interest, sed mox idem male: विहीनस्य. — c. भवामः किमु तेनैव S. भवामः किन्न तेनैव P. भवामस्तेन किनैव Pp. Nostra scriptura, quam ante oculos habuit etiam W., se ipsa omnino commendet; codd. et ed. S. sensum praebent nimis ieunum.

Distt. 150 et 151 huc traximus; quo ipsa sibi locum assignant; edd. exhibit infra Lib. II, prius post dist. 7, alterum ante dist. 9.; neque audaciae nos accusabit, qui experientia facta edoctus fuerit, quam pa-rum aptis locis disticha in hoc libro nonnunquam ponantur; in notas ad istum locum reiiciendum fuisset utrumque distichon, si huc tracta non fuissent. Ceterum ed. Lond. dist. 150. a. praebet: विहीनाश, et hemist. c. भवैव mendose. Codd. omittunt omnino hunc slocum.

Dist. 151. d. क्षितेन्द्रियः स्यात् P. contra metrum.

— 152. b. धने emendavimus pro धनं, et hem. d. recepimus e P. ज्ञायते pro गम्यते; hoc ideo, quod गम्यते minus usitatum nobis visum est in hac iunctura; istud, quia corruptela est manifesta. Divitiae cnim non parem facere possunt eis, qui opibus careant, avarum, etiamsi divitiis non utatur; sed aequalitas est avari, qui non utatur, et pauperum, qui careant, in divitiis; postulatur igitur locativus; neque eadem ratio atque huius loci, est istius dist. prooem. 25., ubi verba सामान्यं पशुभिर्नराणां nomi-

nativum sibi adiunctum habent; res enim quae ibi enumerantur aequaliter faciunt hominem animalibus. P. 55.

Dist. 153. Desideratur in codd. ed. Ser. et interpr. Jonesii; retinimus tamen versus satis semetipsos commendantes.

— 154. b. च शौर्यं L. et codd. refragante metro. c. विन्दे त्यागनियुक्तं S. patitur metrum, sed aegre caret oratio h. l. copula. — d. veram lectionem P. debemus. Pp. et L. एतच्चतुर्थं ज्ञाति; pariter S. sed pro ज्ञाति exhibit लोके. Omitto, hanc variationem metri, *drya* dicti, qua uterque versus eundem numerum morarum syllabiarum continet, quaeque *Giti* dicitur, rarissime usurpari; id sufficit animadvertere, ut nostram scripturam vindicemus, चतुर्भुक्तं exquisitius esse vocabulum, quod haud facile a librario inveniatur.

Lin. 15. एतदस्मि addidimus ex codd.

Dist. 155. c. et d. . . . संचयशीलेन धनुषात्मा निपातितः Pp. scriptura haud indocta, in qua tamen hoc displicet, quod non satis diserte dicatur, ad quem pertineat fabula, quae hoc disticho introducitur.

Lin. 17. init. S. et L. तावाह्युः pro quo P. हिरण्यकोऽब्रवीत्। Pp. सोऽब्रवीत्. कटके वास्तव्ये S.— कटके, omisso वास्तव्ये L. Sed optime se habet hic usus vocabuli वास्तव्य, quo significat: *habitans*; unum exemplum sufficiat, Māl. et Mādh. prolog.: नानादिग्नतवास्तव्यो महाद्वनसमाजः।

— 18. Pro स चैकदा P. सदा; minus convenienter h. l. -मांसलुभ्यः omittit S. substituit Pp. पापाद्विलुभ्यः. — सत् recepimus ex codd., est enim, ut supra iam monuimus, ex huius libri loquendi more talis verbi substantivi additio, qua utuntur praeterea semper fere scholia ut casus, numerum et genus aliorum participiorum melius designent. A vetustioribus auctoribus ἐνεργητικῶς tantum adhibetur hoc verbum, cuius vim tali contextu positi colligere potes ex hoc Bhartriharis disticho:

सति प्रदीपे सत्यां सत्यु तारार्वोदुषु । विना मे मृगावाच्या तमोभूतमिदं जगत् ॥

Si Hitopadesam spectas, सत् cum particip. aor. pass. praecedente vim habet prodosis, coniunctiones temporales *quum* vel *postquam* continentis, ex. gr. चलितः सत् i. e. postquam profectus est. Exempla leguntur infr. p. 86, l. 6. p. 100, l. 10. p. 111, l. 13. p. 115, l. 1. p. 116, l. 7. p. 128, l. 18.— मृगमविष्यमाणो retinuimus ex ed. S. hisce enim verbis aegre careret narratio, eis omissis iusto brevior; eandem caussam habuimus recipiendi ex ed. L. धनुरादाय l. 19.— यथं abest a S. et P.— गतवान् S.— pro तत्स्तेन P. तेनैव, Pp. तेन.— समाग्रहता P.

P. 55. *Lin.* 20. महान् addit P. post धोराकृतिः. — Sequens comma hunc in modum in codd. se habet: ततस्तेनैव मृंग --- प्रेरणा ताडितः । P. — ततस्तेन मृंग संस्थाप्य स शूकरेणाहतः । Pp. postrema verba, ut nemo non videt, corrupta sunt. Mox (l. 21.) pro स S. व्याधः । — L. pro - हुम इव praebet: - हुमवन्. Cod. P. = ततः शूकरेणापि प्रलययनद्योर्गर्जिनं कृत्वा व्याधो मुक्तदेशो हतः । ततोऽसौ छिन्नहुम इव भूमौ पपात । शूकरोऽपि श्रारथातेन मृतः । Pp. = शूकरेणाप्यायागत्य धनद्योर्गर्जिन (sic) कुर्वाणेन स व्याधो - हतः । स छिन्नहुमवहूमौ पपात ।

Dist. 156. a. अग्निर् L. et Pp. corrupte. — c. लुद्व्याधिः Pp. contra grammaticam. — d. प्राणान् विमुच्ति; S. sed praestat omnino passivum.

Lin. 3. आस्कालनेन L. quod nihil est. Totum hoc incisum omittunt codd. qui etiam in seqq. serpentem omnino silentio praetermisserunt. — अथान्तरं S. qui et mox: दीर्घवारो नामा (sic), male lecta scriptura Bengalica, quae littera ब et र saepius confundit, quam distinguit; नामा est vitium in hac editione satis frequens, quod evitare quum vellet editor L. incident in contrarium: दीर्घवावनाम. — नाम omnino abest a Pp.

— 4. परिश्रान्यन् P. aequa recte. — मृतान् desideratur in codd. qui सर्व etiam, ut mox enotavi, omittunt. — Edd. in fine अपश्यत्.

— 5. आलोक्य omittunt S. et P.: addentes verbo proxime sequenti copulam. — अहो om. codd. et L. — से abest a P.

Dist. 157. a. अचिन्त्यानि च Pp. — c. idem: तथैवान्ये pro तथा मन्ये mendose.

Lin. 8. तद्वत् S. et P. — मातमेकं समधिकं यावद्वौवनं मे भविष्यति । uterque codex; sed male, निःखल्यत् fallor, ज्ञौवनं eodem sensu dictum est atque भोजनं; de यावत् postposito, praecedente accusativo supra monitum est ad p. 20, l. 19.

Dist. 158. desideratur in Pp. — Versibus hisce praemissum est in P. निःखुकोऽचिन्त्यत् importune repetitum. In hemist. c. S. यत् minus bene.

Lin. 11. तावद् om. edd. — Verba इमानि - विहय recepimus ex P., — S.: इदं निःखादु कोदण्डलानं etc. L. corrupte: इदं निःखादुकं दण्डलानं etc. — Pp. इदं निःखादु कोदण्डाटवीलग्नस्त्रयुबंधं खादयामि; अट्वी quanquam ipsum corruptum lectio-
nem cod. P. confirmat.

— 12. तथा कृते सति छिन्ने S. — L. non h. l. tantum peccat scribendo चिन्ते. — छिन्नस्त्रयुबंधेन, omitted धनुषा, P. — बन्धने edd. qui paullo post हुतं omit-
tunt. निर्मितः P. निर्मितः S.

Dist. 159. c. मृंग च P. male.

— 160. Repetendum curavimus hoc dist. ex ed. Ser. praeter quam

solus exhibet J. — Emendavimus: ददासि pro ददाति et अद्दासि pro अद्दाति; tum P. 55. शेषं pro सेव्यं.

Lin. 19. यातु किमिदानीं S. — यातु agnoscit etiam P.; usurpatur hic imperativus, pariter atque भवतु tanquam particula concedentis; Graece dicitur εἰειν. Exempla infra invenies p. 127, 8. p. 128, 9. — उपर्युक्तेन P.

Dist. 161. c. आपसु नैव minus bene Pp.

Lin. 22. तद्यस्य सर्वदोत्साहेन भवता भवितव्यं P. quocum in primis verbis consentit Pp. attamen mox सर्वदा omittit et pro भवता exhibit त्वया.

Dist. 162. d. Pro अरोगं P. अरोग्यं; L. et Pp. शान्तिं.

P. 56.

Lin. 5. शान्तिः कर्तव्या Pp. — P. totum comma hunc in modum variavit: तदन्न दशाविशेषैरुत्साहः कार्यः । Post hoc comma in alia omnia discedunt libri.

S. pergit: एतदप्यतिकष्टं त्वया न मन्तव्यं । यतः । राजा कुलबधूर्विप्रा मन्त्रिणश्च पयोधराः । स्थानभ्रष्टा न शोभते दत्ताः केशा नरा नखाः । इति विज्ञाय मतिमान् स्वस्थानं न परित्यजेत् ॥ कापुरुषवचनमेतत् । यतः ।

sequuntur deinde disticha nostra 95. et 96.; ad quem locum de hac re iam dictum est; ceterum observandum est, distichon quod praeterea h. l. exhibit S. melius convenire loco, quo a nobis supra No. 94 collocatum est. Luserunt poetae in varianda sententia, quorum tentamina cumulata sunt in ed. S. Qui पयोधर् scripsit, is iocum haud admodum facetum affectavit, duplice vocis स्थान significatu usus. Disticha ternorum versuum, quale hoc foret, ab omni poesi Indica aliena sunt; qua de re disputare non huius est loci. Sed ad Ed. S. revertor, quae deinde, inverso tamen ordine, praebet slocos nostros 164 et 165.

Editor Lond. qui supra iam conservaverat dist. 94. eiusque rei (mirum dictu) minime oblitus fuerat, omittit h. l. versum priorem (स्थान etc.) et post verba: शान्तिः कर्तव्या pergit: इति विज्ञाय etc. nil omnino varians ab ed. Ser. Codices parum differunt ab edd. P. हिरण्यक उवाच । एतदपि न मन्तव्यं । यतः । राजा कुलबधूर्विद्या नारीणां च पयोधराः । स्थान - नखाः । इति - परित्यजेत् । मन्यरोऽवदत् । पश्य कापुरुष etc. ut edd. देशान् tantum scribens in dist. 95. hem. a. pro स्थानं. Pp. in eo tantum a P. differt (variationi levioris momenti enotandae supersedeo) quod versum istum interpolatum: राजा etc. exulare iubet. Ceterum fateor me caussam huius transpositionis omnino non assequi.

Dist. 164. a. Pro सेवेद् P. सेव्यं.

- P. 36. *Dist.* 165. a. सपुक्ताः L. vitoise. — c. सोदोगं समुपायान्ति P.
— 166. b. Pro अयुक्ते P. et S. अस्तकं; Pp. idem voluit, scribit tamen
अश्वकं, mendose.
— 167. a. Pro धीरः S. et Pp. minus bene वौरः. — b. initio Pp. परिष्वज्ञते
insolentius; P. परियुक्ते contra metrum. — c. in fine P. विषमां, contra sensum.
— 168. a. मदो मे S. quod ferri potest, quum in seqq. scriptum sit
उपयामि, pro quo Pp. et L. mendose scribunt उपयाति. — d. हि inserit ante
मनुष्याणां P. contra metrum. Pp. et L. prorsus aliud praebent hemist. भवति
संपदो मनुष्याणां वेतान्ते metro. Ad sensum comparari possunt hi versus
Bhartriharis (p. 47.) पतितोऽपि करुणातैरुत्पत्तयेव कन्दुकः । प्रायेण सामुद्रवृत्तीनामस्थायिन्यो विषवृथः ॥
— 169. b. नवप्रस्था च मेदिनी Pp.
— 170. a. नामिचेष्टते Pp. male.
- P. 37. *Lin.* 1. Pro vocabulo सखे S. praebet अपि च सखे; L. autem substituit
haec verba: इति शुत्वा लघुपतनको ब्रूते । धन्योऽसि मन्यर् सर्वथा ग्राह्यगुणोऽसि । iubentibus
ceteris libris haec verba infr. p. 38, l. 1. collocavimus.
Dist. 171. d. Pro ते Pp. मे; sed illud omnino praestat.
— 172. d. शुभाक्षहः Pp.
— 174. c. Pro मत्स्यै: Pp. नक्तैः, quod satis placet.
— 175. b. कुडनात् S.
— 176. b. किंन Pp. male. — c. et d. संपत्यतो et mox यच्चेका Pp. संपत्तिरो et
यच्चेका P. prius in utroque codice mendosum est, posterius defendi poter-
rit. अतः (hem. b.) est अस्तात्, cui vocabulo respondent in seqq. यतः et यत्,
utrumque eodem sensu positum: «quinam dolor maior est quam hic
quod desideriorum expletio nulla sit et quod desideria nunquam nos
relinquant.» Si यत्र legitur, यत्र et यतः referri debent ad जन्मनि: «in hac vita,
a qua abest desideriorum expletio, e qua desideria non recedunt.» Sed
इकांसंपत् एकम् est vocabulum compositum et eius quidem ordinis, quem
Tatpurusha dicunt grammatici. पद् c. सं proprium est vocabulum de
votis explendis: सर्वे मत्समीहितसंपादनाय प्रवर्तनां । Mâl. Mâdh. Prolog.
- Lin.* 14. अवच्छ भ्रातः शृणु om. codd.
Dist. 177. b. *fin.* रच्यति (sic) S. — d. एतात् mendose Pp.
— 178. a. *init.* तृष्णैव P. haud male; quanquam हि affirmativa potest
esse particula. — S. तृष्णां चेह परियुक्ता, forma gerundii insolita, nec tamen
inaudita. Cf. Ind. Bibl. III, p. 107. — d. च समुपस्थितं P. minus concinne.
च exquisitus h. l. positum est et apodosin ducit; idem est atque ततो दास्यमपि ।

Dist. 179. b. निर्वर्तते codd. contra sensum huius loci. — d. pro यतो P. 37. edd. ततो, male; postulat enim सः relativum, quod sibi respondeat. — Pp. totum versum posteriorem hunc in modum corrumpit: प्रोच्या यतो न स निर्वर्तते।

Lin. 20. Secuti sumus Pp. ad quem P. proxime accedit: मैव पक्षपातान्मया सहात्र etc. — S. = मम पक्षपातेन मैव etc. — L. pro पक्षपातात् substituit विश्वमालापैः quae locutio iam supra p. 25, l. 17. exstat atque inde, nisi fallor, ab editore L. aut librario quodam huc tracta est. पक्षपातात् exquisitus est dictum, neque tamen sensus dubius esse potest: «meas partes amplectendo.» Alia exempla addent fortasse peritiores.

Dist. 180. a. आरम्पान्ताः P. quod sensum quidem praebet, sed parum ad mēntem auctoris accommodatum. — c. परित्यागाच्च संगानां निःसंगाः P. संगानां glossema est quod e margine in textum irrepit. — d. pro भवन्ति हि P. संभवन्ति. तत्क्षणं mirum tironibus videbitur vocabulum, quum तत् quodammodo otiose additum esse suspicari possent. Sed habet hanc vim, ut significet *eodem* momento, sc. quo nascuntur irae. Eodem modo vim vocabulo पर् addit pronomen demonstrativum quum dicatur ex. gr. श्रोकतत्पर. — Vulgatum esse debet, praepositionem आ, nonnullaque alias, contra morem, qui in lingua Indica praevalet, separatim nomini praemitti, interdum etiam postponi posse, casumque certum regere; आ autem, talem in modum praeponi tantummodo et ablativum regere, nonnunquam etiam accusativum; significationem tum esse *inde a*, vel: *usque ad*. Exempla habebis Bhag. Git. VIII, 16. Rāmay. I, 5, 1. Manu X, 64. V, 88. II, 264. II, 22; vid. praeterea notam Haughtonis ad II, 101. Comment. de Pentap. Ind. p. 90. Ind. Bibl. III, p. 67 seqq. Rariora sunt apud recentiores exempla, inveniuntur tamen; vid. Megh. Dut. v. 11. Sāṅkhyā Sūtr. v. 55. तत्र जरामरणकृतं दुःखं प्राप्नोति चेतनः पुरुषः । लिङ्गाविनिवृत्तेस्तस्माद्दुःखं स्वभावेन । — Accusativus quamvis rarer, est tamen legitimus. Mund. Upan. p. 2. आ सप्तमांस्तस्य लोकान् हिन्दितः; et alibi. Usum ipsum hunc docent Paninis T. I, p. 102 ed. Calcutt. et Amara-Sinhas XXVIII, 1. ibique Colebr. p. 362. Est omnino antiquus hic usus in Indorum lingua, quo praepositiones eodem modo atque in aliis linguis, usurpan- tur, neque ad praepositionem आ restringendus; vid. Panin. l. l. p. 114. Immo Homericae istius licentiae, qua praepositiones a verbis, quibus praefixa sunt, interiectis aliis vocabulis seiunguntur, exempla aliena non omnino sunt a vetustissimis Indorum libris. Kath. Up. p. 2. प्र ते ब्रह्मौ-

P. 37. मि. — Kath. p. 4. श्रेयो हि धीरोऽभि प्रेयसो वृणीते । — *ibid.* 3. अति मा सृजैनं Adde exempla in Rosenii Spec. Rigved. obvia. Postponi. in dialecto Vedorum posse praepositiones docet Paninis, I, IV, 80 et 81 ते (उपर्साः) प्रामाण्यातोः ॥ छन्दन्ति परे ५ पि ॥ Exemplum affert हन्ति नि सुषिता i. e. निहन्ति । Seiunctionem praep. permittit Paninis §. 82. व्यवहिताश्च । exempl. आ बद्धैर्न्द्रियैर्निर्याहि । i. e. आयाहि । Casuum frequentiam in caussa fuisse, cur hoc loquendi genus obsoleverit, satis erit peritoribus indicasse; video enim totam hanc rem a nostro loco esse alienam; restat ut dicam, आ quanquam praefixum vocabulo, quod cum alio compositum sit, tanquam h. l. आपत्त्यान्त, eandem potestatem *usque ad* servare posse. Eodem modo dictum est Ram. I, 1, 12. आज्ञानुबाहुः.

Addunt W. et L. distichon hocce:

सर्वत्र जन्मोनियमात् पततश्च समुच्छ्याः ।
संयोगाश्च वियोगाश्च मरणातं हि जीवनं ॥

Corrige नियमाः.

P. 38. *Lin.* 1. Omittit hanc lineam L. utpote quam supra p. 37. l. 1. collocaverat. — इति शुभा om. codd. — सर्वथा S. — आश्रणीयगुणः P. प्राप्यगुणः S.

Dist. 181. b. आपत्त्याहेतवः et c. लग्नानां Pp. neutrum male.

— 182. om. codd. et S. sed interpretatus est uterque interpres.

— 183. b. in fine. सत्पुरुषवतश्च Pp. idem praebet P. sed versum excēdens addit inscite स एव सः । — d. pro विभंगाः L. विभिन्नाः ।

Lin. 8. तदेकं L. अथ तदेकं S. — एवं om. P. et mox एते pro ते exhibit. Pronomini ते addit Pp. तत्र. — सुखमनुभवन्ति P. कदाचित् ex eodem.

— 10. Pro भयहेतुं S. सृगं, male. — आकलयामि = ज्ञानामि Git. Gōv. III, 7. L. et P. अवलोक्य, minus bene, quum nil videant, sed suscipiēntur tantum. Melius S. अवलोक्य भयं संचिन्त्य. Pro गतः P. गतवान्, L. et Pp. प्रविष्टः parum eleganter repetito verbo paullo antea obvio. — उड्डीय P. et S.

— 11. वृक्षं S. ex quo contra आद्वदः recepimus pro गतः. — लघुपतनकेनापि P. — भयहेतुर्न कोऽप्यायातीत्यालोचितं ।

— 12. पश्चात् तद्वचनादागत्य S. qui et mox: तत्रैवोपविष्टाः quod negligere non debebamus. P. पश्चात् ते सर्वे पुनरागत्य तत्रैवोपविष्टाः । — भद्रं om. P. भद्रं Pp.

— 13. Pro कुशलं S. स्वागतं P. स्वागतं ते । P. mox: स्वेष्टाहारोदकं सुखिनासुमूर्षतां । अत्रावस्थाने etc. sed locativus huc non facit. — 14. अहं om. Pp.

Dist. 184. Om. codd. S. et J.

Lin. 17. ततश्च om. codd. et S. — सत्यं pro मित्रं S.

P. 58.

— 18. सहयद्रनिष्पन्न एव भव Pp. seiungendum foret, si hanc scripturam defendere quis vellet, मित्रं; sed vel sic sensum commodum omnino non praebet. Hiranyaci verba in P. haec leguntur: मित्रं सिद्धं भवतु! — S. सह भवता यत्वेन मिलितं! यत्वेन vero inscite divulsum est a vocabulo praecedente et मिलितं मित्रं nescio quid sit.

Lin. 21. भवता inserit post अत्र S. — P. pro तद्वा scribit मित्र, reiiciens अत्र post निर्विशेषण. — निर्विशेषं P. ferri potest adverbium. Pp. विशेषण, male. — सामन्दः स्वेक्ष्या कृताहारश्च P. quod ad idem redit; huius autem codicis scriptura freti emendavimus ed. L. et Pp. qui कृतः scribunt; puncto gemino deleto legitimum evadit compositum, ad huius loci sensum egregie aptum. P. सामन्दो भूत्वा स्वेक्ष्याहारं कृत्वा. — *Lin.* 22. जलावसन् Pp. contra sensum. — द्वायां Pp. et L. mendose.

Dist. 186. desideratur in ed. S. et codd. — Emendavimus, iubente P. 59. ipsa sententia, adstipulantibus interpp. इष्टका pro इष्टका, quae scriptura nihil est; इष्टक ad masculinum genus restringitur a Wilsone, at femininum tuetur h. l. versus. Notanda est praeterea constructio huius loci, qua plura nomina generis diversi excipiuntur a praedicato, singulari numero posito; neutrum genus legitimum est tali verborum nexu, sed pluralis solitus est numerus; vid. supr. ad prooem. d. 26. Singularem tamen h. l. ab omni dubio immunem esse censeo; nam res istae coniunctim non cogitandae sunt, sed singulatim: atque hoc in causa est, cur sequatur singularis; neutrum autem genus positum est aut propter diversitatem generis, quae in nominibus antecedd. obtinet, aut quia neutrius generis nomen ultimo loco legitur; prior tamen ratio, nisi fallor, magis ex grammatica Indica est.

Lin. 3. अय abest a P. — केन त्वं P. — Confundit ordinem verborum P. मृग एतस्मिन् निर्जने वने केन त्वं त्रासितः कदाचित् etc. — निर्जनवने L. et Pp.

— 4. किं om. P. — 5. नरपतिः S. — स च om. S. et mox: दिविजयव्यापार-क्रमेण, nimis abundanter. नदी ante तौरे inserit S. — कटक orationis illustrandae causa recepimus ex S.

— 6. अत्र om. codd. — 7. pro अवगम्य edd. et Pp. आलोच्य. — 8. यथावस्तुर्कार्यं S. — तथा retinuimus ex ed. L. quanquam abesse potest; verum minus frequentia sunt exempla omissae huius particulae in hac iunctura: यथा - तथा, praesertim in oratione soluta.

- P. 39. — 9. ततो हिरण्यको विहस्याह । S. minus apte. पुनर् om. S. —
 — 10. प्राप्ते om. P. — गङ्गाः को विधिः L. गङ्गाः का विधा Pp. prius hue non
 facit, posterius ferri potest.

Dist. 187. c. स्वभूमि: श्वापदादौनां S. sed praestat nostra scriptura, quam
 praeterea tueruntur interpp. — d. pro सैन्यं S. मन्त्री; P. राजा सौमन्त्रयां बलं; sed
 acquiescendum est in vulgata.

- 14. Pro भविष्यति S. भवितव्यं, per se haud male. P. = - उपदेशेन यद्युत्तं
 भविष्यति तच्छृणु ।

Dist. 188. b. Pro स्तनं S. कुच. — c. ex coniect. dedimus भवत् pro
 भवेत्, quod prorsus nulla idonea ratione defendi potest. P. = - पुत्रोऽन्तिमः
 खोब एt mox d. तवैव त्वं. In qua scriptura इव in primis displicet.

Lin. 18. वीरनामि P. — नगरे निवसति तेन तुरंगबलो नाम S. (pro तेन initio com-
 matis substituit तत्र) male intrusum est istud निवसति, ut nemo non videt.
 तुरंगबलो praebet etiam L. et J. W. uti nos. Pro भोगपतिः substituit ed. L.
 युवराजः; Pp. exhibit भोगपतिः ।

- 19. एकदा ante स्वनगरं inserunt edd.

— 20. बणिकपुत्रों P. et deinde: अवलोकयामास । — स्वर्हर्म्यतलं P. — स्माकुलमतिः
 S. praestat participium, quia h. l. de certo quodam tempore sermo fit.
 Subiiciunt edd. post virgulam hoc Bhartriharis distichon, quod exhibeo ex editione principe p. 34. posthac enotaturus peccata edd. Lond.
 et Ser. Abest dist. a codd. et interpp.:

सन्मार्गे तावदास्ते प्रभवति च नरस्तावदेवेन्द्रियाणां ।
 लज्जां तावद्विधिते विनयमपि समालम्बते तावदेव ।
 शूचापाकृष्टमुक्ताः अवणपथगता नीलपदमाण एते ।
 यावल्लीलावतीनां न वृद्धि धृतिमुपो दृष्टिवाणाः पतति ॥

a) Pro च नः edd. पुरुषः, sed praestat additio copulae. b) लज्जा तावद्वि-
 धिते S. absurdam lectionem repetivit L. d) Pro धृतिमुपो edd. फरिणा, inepte,
 nisi probari posset, hoc participio designari sagittas uncinatas; quod
 tamen dubito. मुष्, proprie *furari*, usurpatur hoc sensu translato;
 vid. Nal. V, 7. quem locum excitavit Rosen. s. v. Ut cetera expedia-
 mus, monendum est, oculorum intuitum cum sagittis comparari; oculo-
 rum autem sagittis pennae sunt cilia; arcus est supercilium; ex hac me-
 taphora omnia sunt explicanda. आकृष् verbum proprium est de inten-

tione arcus, quae fit *nervo attracto*, ज्याकृष्णा, ut Indice loquar. (Vid. P. 59. Amar. Satac. v. 1.) A nervo autem attracto et deinde manu misso impellitur sagitta; शूचापाकूलसुक्त् est igitur: शूचापे आकृष्टो मुक्तश्च वाणः। Sequens vocabulum अवणापथगत intelligendum est de oculis transversum intuentibus, de oculis limis, cuiusmodi obtutum proprio vocabulo कटाक्षः appellant Indi; कटाक्षोऽपाङ्गदर्शने Amara Sinhas s. v. vel ut definitione utar poetae (*Chaura Panchásika* v. 5.): अजापि तां सुरतजाग्रथूर्णमान - । तिर्यक्वलतरलतारकदीर्घनेत्रां । . . . स्वरापि ॥ Addendum, proprium hoc esse Indorum, oculos habere praelongos, aures versus porrectos; अवणायताक्षीं puellam suam dicit Chauras; cuius epitheti explicationem hanc praebet scholiastes: अवणापर्यन्तं आयते हीर्भे अक्षिणीौ लोचने वस्त्राः । neque fere unquam in virtutibus puellarum canendis oculorum hanc longitudinem silentio praetermittunt poetae erotici, inter quorum versus hoc facientes, quos laudare possim sexcentos, hisce solis locum in hoc commentario tribuam: Amarū Sat. 51: इयमसौ तरलायतलोचना । गुरुसुन्नतपौनपयोगता । पूषुनितम्बभरालसगामिनीौ । प्रियतमा मम ज्ञीवितहारिणीौ ॥ Cilia denique, cur nigra sint dicta, nullo eget commentario.

Lin. 21. तद्वलोकनादेव P. — *Lin. 22.* प्रभृति om Pp. — S. sedes mutare iussit vocabula चित्रं et हृष्ट्य; male.

Dist. 189. Pro hoc disticho, quod supra post dist. 109. exhibuerat, P. 40. substituit ed. L. hosce versus, a ceteris libris alienos:

असत्यं साहृसं माया मात्सर्यं चातिलुब्धता ।
निर्गुणवमशौचवं स्त्रीणां दोषाः स्वभावजाः ॥

Lin. 3. अहं पतिव्रता, Codd. omissis cett. usque ad finem commatis. — Ed. Ser. haec substituit verba: अहं पतिव्रता । कथमेतस्मिन्नधर्मे पतिलङ्घने प्रवर्ते ।

Dist. 190. Legitur in episod. Bhārateae de Sacuntala VII, 37. ed. Chézy.

— 191. Secuti sumus codd. qui hosce duos versus uni disticho tribuunt; divellunt edd. posteriorem versum a priori, alias quosdam versus inserendo, quos hic repetere debeo. — Post dist. 190. pergit igitur ed. Lond.

- a. न सा भार्यति वक्तव्या यस्यां भर्ता न तुष्यति ।
- b. तुष्टे भर्तरि नारीणां संतुष्टाः सर्वदेवताः ॥
- c. कोकिलानां स्वरं दृश्यं नारीदृश्यं पतिव्रता । [व्रतं]
- d. विद्या दृश्यं कुदृश्याणां क्षमा दृश्यं तपस्विनां ।

P. 40.

e. भर्ता यस्या गुणान् ब्रूते शीलधर्मसमन्वितान् ।

f. अग्निसाक्षिकर्मयादो etc.

S. distichon medium sive versus c. et d. omisit. Jon. quatuor horum versuum exhibit et hoc quidem ordine: a. f. c. d., b. et e. omissis; W. eosdem quatuor versus exhibit, eodemque ordine; unde satis superque appareat, duos versus b. et e. ex editione Seramp. in Londin. migrasse neque ulla alia auctoritate frui; versus praeterea, quem littera e. insignivimus, omnino non cum ceteris componi potest. Restat igitur singularis versus b., qui per se optime se habet et nisi fallor in Rameide nescio quo loco legitur, qui tamen heic locum sibi vindicare nequit. Versus c. et d. distichon sane efficiunt; sed eam solam ob rationem hoc tractum, quod ad vocabulum पतिवृत् dist. 190, d. aliquis adscriperat hosce versus, quos si textui inserere velis, locum eis dare debebis inter dist. 190 et 191. — Ceterum recepimus Dist. 191, a. विष्वाता e codd. pro वक्तव्या.

अग्निसाक्षिकर्मयादः ut explicem, primo loco aliud exemplum in auxilium vocabo: सख्यं अग्निसाक्षिकं dicitur Rām. I, 1, 59. «amicitia coram igne vota»; अग्निसाक्षिका र्मयादा est coram igne votum officium (sc. uxoris erga maritum); अग्निसाक्षिकर्मयादः est maritus, cui coram igne fidem spondet uxor, quae ignem testata est, se officia sua esse expleturam. Cf. p. 28, l. 14. कुलम-
र्यादा.

Lin. 9. ने om. P. — तत् semel tantummodo ponunt edd. et P. qui quidem सर्वं praebet pro एव. — तत्तत् परं Pp. prius recepimus propter prae-
cedens यथत्, hoc omisimus utpote sensu h. l. cassum. आविचारितं perperam
S. — दूसरुं S.

— 10. सत्यतम् et in responso Lavanyavatidis शुक्रं सत्यमेतत् S. Istud abundat, hoc elegantius exprimitur addita particula एव. — एव ante दूसरा om. Pp. recte nisi fallor. ततो दुतिक्या (sic) गत्वा तत्तत् सर्वं तुरंगबलस्याये निवेदितं S. Pro दूतिक्या (sic enim corrigendum est, quod vix monendus est lector) Londin. editor दूसरी posuit, retinens tamen in fine commatis निवेदितं; pro तत्तत् quod ex linea 9 huc tractum esse videtur, L. melius तत्; in cett. a S. haud differt. अग्ने sexcenties praepositionis more addi in prosa recen-
tiore, qua compositae sunt fabulae populares, *Vetalapanchavinsati*, *Sin-
hāsanadvatrinsati*, *Sukasaptati*, observavi et exemplis probare possim, si

operae pretium sit. De nominis diversitate, qua edd. Turangabalum P. 40. dicunt nostrum Tungabalum, supra iam monitum est. —

Lin. 11. Pro निवेदितं P. आवेदितं । — तच्छ्रवा om. Pp. समानीय P.

Dist. 192. d. वर्मनि L. Ne quis arbitretur, locativum praeferendum esse, apponam hunc Rameidós locum: I, 36, 5. एष पन्था मयोद्धिदृष्टे येन वान्ति महर्षयः । dicitur etiam गद्धति पन्थां, अध्वां etc. vid. l. l. 33, 20. Unaquaeque autem harum constructionum verborum eundi, cum locativo, instrumentalī vel accusativo vim habet sibi propriam neque una pro altera poni potest, quod non huius loci est fusius demonstrare.

Lin. 16. अस्ति om. Pp. perperam. Idem mox: ब्रह्मपुराणे.

— 17. महद्वत्ती P. dubito tamen, an महत् poni possit in compositis pro महा, nisi sequens vocabulum a vocali incipiat, veluti Rām. I, 12, 11. महदावासा: । — आलोक्य codd. — यथायं Pp. minus bene.

18. मार्यते ex P. ceteri मियते. — तद्य देहेनास्याकं मास - etc. P. — स्वेद्धा om. S. स्वेद्धा P. — भवति Pp. male. Pro ततः edd. तत्र; P. तद्, hoc male, istud secus. एकेन conservavimus propter consensum librorum. वृद्ध om. Pp. — प्रभावेण P. pro एतत् edd. अस्य, Pp. एवैतत्.

— 20. कर्पुरं L. sed peccat semper fere in hoc vocabulo ista editio. — समीयं edd. — अष्टाङ्गपातेन P.

— 22. पशुभिः ante मिलिक्वा addunt edd. — भवत्सकां om. Pp. युष्मदन्तिकं substituit P. — Pro यद् in fine paginae P. यतो.

Lin. 1. Pro युक्तं P. युज्यते Pp. नायान्ति Germanice sic loquimur, haud scio P. 41. an Indice. — अभिषेचितुं Pp. सर्वं om. P. — स्वामी Pp. perperam, quia compositi pars est. Ceterum animadvertendum est, infinitivum h. l. mutuari vim passiyam a participio निश्चिप्तिः, a quo regitur. Notum hoc est de ग्रन्ति, ad quod verbum minime restrictus est hic usus: chartae parciturus pauca tantum exempla addam: Mudrā - Rāx. Act. V. fol. 46. cod. Par. प्रारब्धाः प्रणायाय मांसवद्द्वाहो विक्रेतुमेते वयं ॥ infr. p. 49. l. 10. कारवितुमारब्धः । Sāvitry-upākhyān. V, 15. अईः - उपनेतुं ।

Dist. 193. a. कुलाचारजनाचारैः L. et Pp. cui obstat praecipue quod सः in seqq. aegre carere possit praenomine relativo antecedente. अभिज्ञनं prae-
terea melius huc quadrat quam ज्ञनं, neque aliud est, si in partes suas dissolvitur compositum nostrum, quam कुलाचारैरु अभिज्ञनाचारैश्च, — d. स्वामि mendose. L.

P. 41. *Dist.* 194. c. लोकेषु P.

Dist. 195. a. पर्जन्ये Pp. mendose etiamsi neutro genere efferri posset hoc vocabulum; religiose enim observant auctores Indici hanc regulam, ut apposita atque comparata eiusdem generis sint atque ea nomina, quibus apponuntur vel quibuscum comparantur. Dicunt अयोध्या पुरी, nunquam: अयोध्या पुरं et vice versa: कांचनपुरानामि नगरे (infr. p. 63. l. 5.) Non potest tamen non fieri, quin interdum discedatur ab hac regula, quotiescumque vocabulum fuerit adhibitum, quod unius tantummodo generis esse possit; quod in comparationibus saepius accidere debet quam in appositionibus. Ad hoc exceptionis genus pertinent vocabula मित्रं, प्रमाणं, प्रधानं. Totam rem, quam breviter h. l. indicare tantum volui, fusius enarrandam relinquo ei, qui aliquando exstiterit syntaxis Indicae conditor. — Pro पर्जन्य scribunt S. et P. पर्यन्य. Utraque scriptura a Wilsone agnoscitur, quamquam certissimum est, posse unam tantum esse veram, qua de re non huius loci est dicere.

Dist. 196. a. Pro विषय P. विष, contra metrum et sensum. — b. शान्तवृत्तिः in fine P. — c. कृशमपि edd. male, propter eiusdem particulae repetitionem in hemist. sequente atque eadem versus sede. — नियतविषयवर्ती i. e. नियतं विषयेषु वर्तते यः स। talis autem homo, qui et साधुवृत्तः dicitur, difficilis est repertus in hoc mundo, qui tantum poena inficta in obedientia contineri solet; construo igitur: अस्मिन् ज्ञाति प्रायश्चो दण्डयोगात् पर्वते; quae quanquam paullo durior mihi metipsi videtur constructio, sola, nisi fallor, est, quae ad hunc contextum quadret. Probare enim vult poeta, sine rege vivere non posse homines, qui, nisi metu poenae continerentur, omni libidini sese tradituri forent; poenarum autem dispensator est rex. Interpretationem quam proposui tuetur quodammodo altera distichi pars, in qua दण्डयोगात् respondet दण्डयोगात् antecedenti; femina autem quae marito se tradit, पर्वता est, sicuti orbis (यगत्) in obedientiam redigitur (पर्वतं fit) eandem propter rationem, atque illa. — Ceterum कुलनारी, sicuti कुलस्ती, plerunque per mulierem *castam* reddi solet; quod falsum. Mulier est *nobilis*, quae super ceteras feminas pro excellentia originis suaे castimonia excellere debet; quanquam secus nonnunquam accidisse apud Indos, omnium regionum et aetatum experientia minime improbabile reddit.

Lin. 13. विचलति S. minus bene. — देवेन abest a codd.

— 14. जम्बुकः ante चलितः inserit P.

— 15. ततो हस्तिनोऽं P. ततस्तेन हस्तिना etc. edd. — सखे om. P. qui et महापंके P. 41. पतितोऽहं omittit. — महा abest a Pp. et S.

— 16. — निषतितोऽहं S. quae editio sola addit: मिये परावृत्य पश्य. — पुश् Pp. male, quia पुश् a seq. composito seiungi debet. — S. corrupte: पुश्का-वलंवनं. L. aliter: मम पुश्याये हस्तं दत्वा.

— 17. तत्युक्तमेतत् omittit codex uterque, quod eo magis miror, quo minus intelligam, quomodo prodosis ista यस्य etc. sine apodosi stare possit; iusto enim durius foret, referre haec verba ad antec. मम. In prorsus diversa discedit S. यस्य मद्विधस्य व्रचसि त्वया प्रत्ययः कृतः तदनुभूयतामप्सरणं दुःखमिति। quae verba prorsus sunt sensu cassa, nisi in priori positione corrigatur यद् pro यस्य; attamen vel sic minus bene huc convenient.

Dist. 197. a. यदा L. — निरतो codd. et S. pro रहितो, sed निरत est *contentus*, quod huc non facit. Voluere विरतो. — c. pro यदा S. तथा male; Pp. अय, melius quam S. neque tamen bene.

— 20. Verba ततो — भक्तिः om. codd.

— 21. तं abest a P. — चारुदत्तं S. et P. — Nomihi proprio addit P. लाक्षण्यवतीप्रियं। Pro ए in fine lineae P. अस्तौ; omittit hoc pronomen una cum nomine mox sequente Pp. अस्तौ autem tuentur mox init. incisi subsequenti libri omnes, a quo loco praeterea haud bene removeri potest propter additum aliud pronomen तेन; अस्तौ pro ए nominī राजपुत्रः praemissum reliquimus cod. P. —

— 22. नियोजितः edd. नियुक्तः P. qui etiam praecedens कार्य singulari numero effert. Sed praestat h. l. praesens, quia sermo est de actione saepius repetita, vel potius continua; cui rei designandae saepius in lingua Indica inservit praesens.

Lin. 1. तचैकदा P. — स्नानोपस्थितेन S. — pro अलंकार P. रस्तः; ambo haec P. 42. vocabula cumulavit S. — प्रोक्तं S. तस्योक्तं P. — In seqq. seuti sumus L. et Pp. inser se conspirantes; P. प्रतिरात्रं minus bene ante मासं collocat omisso मया; S. omittit pariter मया, eius loco exhibens seq. अग्रात्म्य, pro quo तदत्र legitur. — एकां repetimus, suadente Pp. quanquam repetitione non opus sit h. l. quum distributiva vis iam insit adverbio प्रतिरात्रं. — एकां omnino omittit P.

— 3. सा च P. — विधिना omittit Pp. यथोचितालंकारेण P. — इति commati subiungunt codd. — स deest P.

— 4. Pro तरुणीं P. कुलीनां, S. नवयुवतीं; hoc male; invenitur saepius नवयौवन; sed नवयुवती nullibi me legere memini. — सर्वपर्याति edd. — प्रदत्तः सन् S.

P. 42. — 5. द्वादशालंकारगच्छन्तैः edd. Secuti sumus codd. — अलंकरणैः Pp. quae forma inusitator certe est.

— 6. तत्त्वाणां ex codd.

— 7. Pro चेत्सा edd. मनसा difficile est dictu, quodnam vocabulum melius huc conveniat, sed si usum respicis poeticum, nil fere interest. — Codd. scribunt लोभाकृष्णे चेत्सा, quod minus bene dictum est, quia alias instrumentalis iam praecedit. — Edd. स्वब्रूः लौलाकौमानोय समर्पिता : absurdam scripturam enotasse satis est. — Pro राजपुत्रः S. तुरंगबलः.

— 8. किन्नाय edd. — संस्कृमयुत्याय om. Pp. priorem vocem etiam P. qui mox निर्दयं et आलिङ्गय inverso ordine exhibit. Pro निर्दयं S. निर्दयं. — उम्मीलित praebent L. et Pp. quod minus ex huius loci ratione esse videtur. Confirmat cod. P. lectionem editio S. ubi आनंद omissio, exstat: निमीलिताक्षः ।

— 9. निष्टाद् codd. — तत्स्तद् P. — Lin. 10. मूलश्च P. copula ferri potest. In fine commatis S. उपगतः, L. उपागतः, Pp. आगतः. — इतिर्कर्तव्यता pro uno vocabulo accipiendo est, cuius vis tamen nondum satis perspecta mihi set. इति कर्तव्यं quum notet: «sic faciendum» nomen hoc significare potest praesentiam animi, qua praeditus homo intelligit, quid sit faciendum; aut inopiam consilii, quum homo aut nesciat, quid sit faciendum, aut serius quam par sit perspiciat, hoc facere se debuisse; postrema interpretatio melius huc quadrat. Desideratur vocabulum in Wilsonis lexico, a quo huiuscemodi nomina haud sine magno nostro impedimento absunt, quum sola coniectura saepenumero definiri nequeant et rarius inveniantur, quam ut comparatione diversorum locorum vis atque potestas eorum appareat. — Reperi posthac *Sāvity - Upākh.* III, 7. hunc versum: तस्य सर्वमभिप्रायमितिर्कर्तव्यतां च तां । सत्यवनं समुद्रदश्य सर्वमेव न्यवेदयत् ॥ ubi significatus est: *propositum, consilium.* Sic interpretatus est etiam *Boppius.* इतिर्कर्तव्यतामूळः nostro loco reddi potest: *consilii capiundi inops.* — चित्रलिलित si eodem sensu h. l. accipiendo est, quo comparationes cum rebus pictis frequentius ab Indis ponuntur, idem est atque *immobilis.* Conf. Urvasi Vicram. Act. I. चित्रारम्भविनिश्चलं हयप्रिरस्यायमवज्ञामरं ।

Lin. 11. भवितव्यमिति libri; expunimus otiosam particulam. — ततः omitt. codd. et S. — अवधार्य L. et P. Male.

— 12. — मुखितः ex Pp.; om. L. substituit S. विमुखः, P. मृतः — जलाश्रयं L. et P.; तं जलाश्रयं S. ubi transponitur: मंथरश्चलितः । — तत्स्ते P., qui mox अनुययुः — S. fusius: हिरण्यकादयः स्मेहादनिष्ठं प्रक्षमाना (l. प्रक्षमाना) मंथरमनुगद्धन्ति ।

— 13. स्वले गद्यन् om. codd. — काननं S. वनं om. P. — त् om. S. — P. 42.

— 14. ततस्तं गृहीत्वा P. च addidimus ex Pp. — अमन् addunt post बद्धा Pp. et S. परिभ्रमन् P. Pro धर्माकुलः P. अमाकुलः; S. क्लेशात् क्लृप्यिपासाकुलः; sic etiam L. omisso tamen क्लेशात्. — स्व om. codd. — प्रयातः ex P. ceteri चलितः; sed legimus hoc verbum iam l. 12.

— 15. ते om. S. — मृग om. P. pluralem deinde exhibens; मृग omisso, dualem ponere debuisset, ut nemo non videt. — गद्यन्तः S. गतवंतः codd. अनुगद्येयः Pp. perperam. — तत्र om. Pp. ततो scribunt edd. (S. ततः) Praestat तत्र. quod idem est h. l. ac तेषु.

Dist. 199. a. स्वभाविकं तु S. स्वभावादेव Pp. — b. भाष्येत्रैव हि Pp. भाष्येत्रैव हि P.

Dist. 200. d. यादृक् recepimus ex Pp. pro यावत्, quod ferri posset, si masculino genere positum esset; subintelligitur enim विश्वासः; sed यादृक् omnino melius respondet antecedenti तादृशः!

Lin. 1. इति initio praemittunt edd. expunximus auctoritate codd. P. 43.

— मे desideratur in S. et P.

Dist. 201. a. संताप vitiōse S. — b. कालान्तरावृत्ति L. quae scriptura e cod. Wilkinsii fluxit, qui in notis ad interpret. suam p. 307. vernaculis literis exscribendum curavit hoc distichon; etiam in seqq. editor Lond. hunc amplexus est patronum. Praestat autem adiectivum आवर्तिन् ideo, quod h. l. sermo fit de re quae continua sit, non de re praeterita. — c. मयेक mendose S. — d. दशाफलानि, edd. contra sensum.

Lin. 4. अथवा इत्येवैतत् Pp. et S.

Dist. 202. b. Pro परं Pp. mendose परं. a. संनिहितोपायः S. absurde. Repetunt codd. interpp. et S. hoc distichon infr. libr. IV, inter distt. 62 et 63, sine ulla variatione.

Lin. 6. कुनर्विर्मृश्याह om. P. कुनः om. Pp.

Dist. 203. a. परित्राणां Pp. quod sensum non praebet, nisi corrigatur परित्राणं; ceterum vix monendum est, a त्राणं pendere tria nomina praecedentia et inter se compositum eius ordinis efficere, quem *Dvandva* appellant grammatici. — b. pro भाजनं P. काणं haud male, quamquam nostra scriptura praestat. De भाजन hoc sensu monitum est ad p. 19. l. 2.

Dist. 204. a. आनन्दकं Pp. — c. ये नान्ये Pp. sensu cassum. — d. आवास्तु Pp. contra grammaticam. — यत्रं mire positum esse primo aspectu videri posset; attamen optime se habet, neque alio sensu h. l. est accipiendum, quam quo etiam alias legitur. Construe: मित्रं — यत् मित्रेण सह सुखदुःखयोः पात्रं

P. 45. भवेत् । पात्रं autem मित्रेण सह est सहपात्रं मित्रस्य, amicus, qui una cum amico participat res secundas aequae atque adversas. Hoc solummodo insolitum est, quod पात्रं etiam ad rem inoptatam refertur, quum semper fere de rebus bonis et iucundis dicatur, de honoribus, confidentia, similibus, quibus aliquis dignus iudicatur.

Lin. 12. Pro simplici वृु Pp. वृुक्षिधं. Idem mutat ordinem interlocutorum; द्वितीयकं — आहतुः । et deinde l. 13. verba तावृच्छुः omittit. — एव post वाक्ये ex codd.

Lin. 13. न om. L. minus bene, quanquam hunc admittere potest वाक्ये sensum, ut significet *dum*.

Lin. 14. initio. यथा कार्यं P.

— 15. निश्चेष्टं additum ex P.; om. edd. — Pp. vitiose: निश्चेष्टं. दर्शयितुं P. दर्शयितु Pp. utrumque mendose. — काकोऽपि P. उपरिस्थित्वा edd.; omisimus verbum h. l. otiosum, suadentibus codicibus; aliam huius omissionis rationem nos minime habuisse, diserte moneo, ne quis suspicetur, nos in eorum opinionem abire, qui उपरि praepositionum numero excludant, et verbis praefigi non posse credant. Si significationem respicis, उपरि est prapositio eodem iure atque परि, प्रति, aliae, neque obstat quod cum casu construitur उपरि, quo minus locum ei inter praepositiones concedamus; hoc enim de plerisque praep. valere, supra expositum iam est ad dist. 180. Casus autem, cum quo plerumque iungitur उपरि genitus est: cf. infr. p. 66. l. 17. p. 68, l. 9. p. 69, l. 4. p. 73, l. 18. p. 75, l. 11. Cum accusativo rarius inveniri videtur; legitima tamen est haec iunctio cf. Pan. VIII, 47. उपर्युग्मि ग्रन्थं Sancar. ad Mund. p. 13. l. 8. देवानां पतिरिद्धः सर्वान् उपर्यथिवस्ति । Sine casu et cum-nomine composita est praep. उपरि Arjun. Sāmag. VII, 4. अपतदू मद्रयोपरि । Geminatur interdum उपरि (cf. Nal. I, 2 et infr. II, dist. 2.) sed hoc in caussa esse nequit, cur praepositio उपरि dignitate sua exuatur. Geminantur etiam प्र, सम्, उप (Rām. I, 4, 26.) उत्, अधि. Pan. l. 1. Quaero igitur, quasnam habuerit *Paninis* rationes, hanc voculam inter praepositiones silentio praetereundi, quum अन्तर् diserte eis annumerat, hac ex parte haud nactus sicuti debebat, sectatores inter eos, qui linguis nostris vernaculis Indicae orationis leges nos docere aggressi sunt; neque ideo vituperandus, quod आनि huc refert; haec particula enim vel aliis verbis praeter धा et नह praesigitur; quod ex ipso Grammatices Indicae conditore discere poterit qui hoc negavit

Vir cl. *Boppius* (Lehrgeb. p. 77.) Restat ut exemplum addam haud du- P. 43.
bium praepositionis उपरि ad modum ceterarum verbo praefixae: *Gît.*
Gôv. III, 5. चिन्तयामि तदानन् कुटिलशु कोपमरेण । प्रोणपव्वमिकोपरिभ्रमताकुलं भमरेण ॥ Add.
Mêgh. Dût. 49. उपरिविलसत्. — Sed redeo ad propositum; pro लिखतु *S.* लि-
खितु. — ततो नून् *P.* — लुब्धकेन om. *P.* —

Lin. 16. तत्र om codd. — *Lin.* 17. post केत्यामि pergit *S*: समाहिते लुब्धके
भवद्वां पलायितव्यं । — अथ additum ex *P.* — सति omissio तथानुषितेन *Pp.*

— 18. स om. *Pp.*

— 19. कर्त्रिकां et mox सुहृष्टमना: *Pp.* — तत्रान्तरे *S.* अनंतरं *P.*

— 20. आगत्य मन्थस्य बन्धनं क्षित्यं । स कूर्मः etc. *S.* — प्रविष्टः *Pp.* et *L.* — मृगश्च *P.*

— 21. विलोक्य edd. — उत्त्याय om. *Pp.* — लुब्धको यावत् edd. असौ omissio. —
तरुतं *Pp.* male.

— 22. तावत् तं *P.* — मया *Pp.* perperam. — ममासमीक्षकार्णिणः om. *P.* — अस-
मैच्य कार्णिणः *S.* Notum est, post litteram ज्ञ a librariis pro lubito feie addi-
vel omitti semivocalem ग; neque accuratiores hac in re esse editores Ser.
quam quemlibet librarium, luculentis exemplis demonstrari possit,
si operaे sit pretium. Omitto igitur plerumque talem scripturae diver-
situdinem; h. l. tamen enotavi, eo tantum consilio ut monerem, editores
Serampurenses h. l. ipsos haud dubie doctrinae suaे ignaros, protulisse
lectionem doctam, cuius aliud exemplum ab omni suspicione longe
remotum infra exstat Lib. IV, dist. 97; ubi hac de re amplius dicam.
Hoc loco nulla erat ratio, cur magis insolitum loquendi genus obtrude-
remus orationi pedestri.

Dist. 205. b. च सेव्यते *Pp.* च inopportunum est, passivum contra P. 44.
grammaticam. — d. एव च recepimus ex *Pp.* Ceteri एव हि; sed particulae
caussali nullus hic est locus.

Lin. 3. ततो om. *Pp.* — असौ व्याधः स्वर्कर्मवशान्त्रिराशः *P.* quae scriptura sen-
sum praebet nostrae prorsus contrarium, quem tamen non patitur locus;
est praeterea अवश्य semper adiectivum tantum, quam ob caussam acqui-
escendum erat in scriptura edd. et *Pp.* — Ed. Ser. corrupte: — वशान्त्रि-
वशकटकं । Mirabitur mecum lector stuporem hominum, qui vitia scri-
pturae Bengalicae tam obvia haud animadverterint; in Bengalica isti edi-
tionem suam instituere, in Europa nostra qui prima stipendia meruere
tirones sciunt, in omnibus codicibus saepissime omitti spiritum finalem,
in Bengalicis autem libris frequentissime confundi litteras ग and र; quae

P. 44. negligentia tam late patet, ut in eodem libro, immo vero in eadem pagina eiusdem libri punctum diacriticum quo distingui solent istae litterae, promiscue addatur atque omittatur tum litterae च, tum litterae र.

Dist. 206. om. Pp. et W. — hem. b. रुग्मानि वनानि च । edd.; sylvas impervias facientes reliquimus sapientiae Serampurensium atque Hayleyburiensium.

Lin. 6. च addit primo incisi vocabulo Pp. — मुक्तापदः L. त्यक्तापदः S. त्यक्तं huc non quadrat, quod multis probare operae pretium haud erit.

— 7. सानन्दचेतोमि; omissio उक्तं S. — Sequens incisum in Pp. et L. sic se habet: तत् सर्वे ते सुखिनः संपन्नास्तत् सिंहं etc. सर्वे ते, omissio pronomine primae personae वाणं, non sine elegantia dictum est; sed addi debet, tali ellipsi posita, aliud personae indicium, id est verbum finitum, personae signo praeditum; quod quum ab ista scriptura absit, durior est constructio, quam ut admitti possit. तत् praeterea initio prorsus est otiosum. — S. = सर्वे तत् श्रुतं । सर्वे ते सुखिनः संपन्नास्तस्मात् सिंहं, quae verba quanquam ab initio melius se habent quam in Pp. et L., eodem vitio in seqq. laborant atque in illis. Sequentे praeterea statim संपन्न, inelegans evadit repetitio.

Lin. 8. एतावता S. — In comm. seq. Pp. अपरमार्थः संपादयन्तु । in quo hoc castigandum est, quod आर्थ de discipulis suis usurpat Vishnusarman. — P. responsum Vishnusarmanis hunc in modum in brevius contrahit: एतत् तावद्वयतु भवतामभिलापितं । quod per se haud male se habet, verum suspicor, rad. लष् producta syllaba radicali sensu desiderandi poni non posse.

Dist. 207. a. जनपदैः edd. male. — समालम्ब्यतां Pp. समालम्ब्यतां L. uterque peccat, sed more diverso. — b. धर्मे स्थिताः सर्वदा P. Lectionem admittit metrum. — c. मानसंतुष्ट्ये L. contra sensum atque metrum. — In fine pro वः Pp. सा.

In titulo finali codd. प्रथमः

P. 45. *Lin.* 1. मित्रलाभः श्रुतस्तदस्माभिः Pp. et L., idem praebet S. tantum तावद् pro तद् varians; peccat utraque scriptura contra constructionem in oratione pedestri legitimam.

— 2. सुहृद्देहं om. Pp. — तावत् शृणुत S. male repetito adverbio.

Dist. 1. b. शृग्नविषयोर्वने Pp. mira corruptio. — c. pro अति S. अपि, male.

Lin. 5. दक्षिणपदे L. perperam. — सुवर्णनाम (sic) Pp.

— 6. महाधनो om. edd. — Pp. महाधने, male; collocat praeterea inopportuno loco ante निवसति। — प्रतिवसति P. — भूपतेरपि वित्ते Pp. corrupte. — Pro प्रभूते S. प्रचुरे.

— 7. बन्धूत् om. P. — समीक्षा pro अवलोक्य S.

Dist. 2. b. नोपज्ञायते P. — d. दरिद्रता Pp. perperam.

Inserunt post hoc distichon libri omnes aliud, quod apud nos Lib. I, 119. legitur.

— 3. d. उपगृहीतुं edd. et codd. Emendationem flagitabat metrum.

— 4. c. असंतोषो ed. L. et codd. contra metrum et sensum. Qui sorte sua contentus est, ad maiora nunquam erigitur. — अतिभीरुतं edd. et cod. P. Vetat metrum.

Dist. 5. a. Conspirant libri omnes in scriptura hacce: संपदा सुस्थितं मन्यो, quae quum nullum omnino praeberet sensum, ad coniecturam confundendum erat; eam quam recepimus validis rationibus defendi posse arbitror. संपदा, ut ab hoc incipiam, mutari vetebat sequens स्वरूपया; vitium igitur in सुस्थितं मन्यो haud dubie latet; notum est, ab inscritis librariis saepius superscribi signum nasalis mutabilis litterae य sequenti, quod h. l. factum esse satis est probabile; puncto igitur hoc deleto evadit सुस्थितमन्यो, quod quum nihili sit, neque improbabiliter intrusa littera य fuerit propter similitudinem cum seq. मन्ये, luculentam habuimus rationem huius य expungendae; मनो autem stare non posset in hac sententia, nisi in seqq. positum fuisset यस्य, genitivo casu. भवति यः praedicatum flagitat nominativo casu positum; scripsimus igitur सुस्थितमना. — In hem. d. Pp. pro तस्य praebet यस्य perperam. — मन्ये । dixi supra ad prooem. dist. 4. primam hanc praes. singul. personam rad. मन् orationi inseri sine ulla constructionis mutatione; cuius rei exempla tum per hunc librum, tum in aliis inveniuntur; ex. gr. infr. dist. 155. III, 138. Rām. II, 57, 20. Mēgh. Dūt. 82. Affirmat haec vox non simpliciter, sed interdum sicuti Latinorum credo, continet ironiam; quae vis cernitur tum in hoc versu, tum infra 155. et Rām. I. l. et observata iam est a grammaticis Indicis: PANINES I, 4, 106: प्रहसे च मन्योपपदे मन्यतेरुत्तम् एकवच्च ॥ Notionem satis illustrat exemplum, a schol. ad h. loc. prolatum: एहि मन्ये शोदनं भोक्ष्यसे । भुक्तः सोऽतिथिमः । Quin etiam accentum vocabulo मन्ये hoc sensu proprium Panines tribuit VIII, 1, 46.

Dist. 7. b. *fin.* अवक्षयात् S. अवेक्षया Pp. — d. निःक्षिपेत् edd. et Pp., pun- P. 46.

P. 46. ctum geminum, quod sexcenties perperam omittunt, h. l. inopportune intrudentes. तीर्थे विनिक्षिप्ते P. Legitur dist. Man. VII, 99.

Addit post hoc dist. Ed. Lond. distichon nostrum I, 150. q. l. cf.

Dist. 8. Paullo audacius versati sumus in emendando hoc disticho, quod miserrime se habet in libris nostris.

L. = अलब्धमभीपितोऽनुयोगादर्थप्राप्तिरेव ।

लब्धस्याप्यरक्षितस्य स्वयं भवति विनाशः ॥

S. = अलब्धमिहतोऽर्थयोगादर्थस्य प्राप्तिरेव ।

लब्धस्याप्यरक्षितस्य निधेरपि स्वयं विनाशः ॥

Pp. = अलब्धमनिहतो अनुयोगादर्थप्राप्तिरेव च ।

लब्धस्याप्यरक्षितस्य स्वयं भवति विनाशः ॥

P. = अलब्धमलिपितो etc. ut L. ।

लब्धस्याप्यरक्षितस्य धनस्य स्यात् स्वयं विनाशः ॥

Vides omnes hasce scripturas peccare contra metrum (*ārya* vocant Indi) neque sine coniectura medelam afferri posse; nos quidem rationem habuimus, quantum fieri potuit, codicum, in quibus omnino plus fiduciae est ponendum quam in editis. Ceterum non defendam ab omni parte coniecturas nostras, in quibus quae haud sine magna veritatis specie reprehendi possint, ipse video; sed faciundum aliquid erat in loco desperato, quem si quis lenioribus remediis sanare poterit, eius ingenium primi laudabimus.

Lin. 8. Pro hisce verbis, oratione soluta conceptis, haec praebet verba ed. Ser., more distichi disposita: अवर्मानशार्यः काले चल्पव्ययोऽयञ्चनवत् ज्ञयमेति । अनुपमुद्यमानश निष्प्रयोजन एव तः । Sequitur tum dist. quod nos posuimus I, 151. Hoc excipitur a dist. 10, cui additus est slocus noster I, 150. His absolutis soluta oratione pergitur (ap. nos linn. 13 et 14) tum denique pervenitur ad dist. 9, cui subiunctum est 11. — Eodem fere ordine in ceteris libris se habet h. l. narratio, modo omnes prosam linn. 13 et 14 obviam reiiciunt post dist. 10 cui praemissum est 9. Ordo igitur hic est l. 8, dist. I, 151. - distt. 9. 10. ll. 13 et 14. dist. 11. Distichon istud fluctuans, quod apud nos editum est I, 150, quodque in ed. L. post

dist. 7, in ed. Ser. post dist. 10 legitur, a Pp. omnino omittitur, a P. P. 46. post 10 collocatur, sicuti in ed. Ser. — Disticha quae h. l. omisimus et libro primo adiudicavimus, ab hoc contextu omnino sunt aliena; agunt enim de divitiis sine usu otiosis; heic autem sermo est de divitiis acquirendis, atque propter diminutionem inevitabilem semper augendis.

Hisce duobus igitur dimissis, moneo, dist. 9 statim post prosam l. 8. collocandum esse probari vocabulo श्वन्, quod quasi vinculum est, quo annexitur ad praecedentia. Turbae autem unde originem traxerint, haud difficile est commonstrare. Addiderat aliquis in margine verbis istis अवर्धमान - एति l. 8. quae docent, divitias nisi augeantur continuo, sensim evanescere, observatiunculam suam, divitias nisi eis utaris, otiosas atque inutiles esse: अनुभूद्यमान et quae seqq. Quae verba quum speciem versus prae se ferrent, in errorem facile inducere potuere librarios, eis partem effici distichi posteriorem, priorem autem contineri verbis अवर्धमान etc.; quae ratio vel propter hanc solam rem falsa est, quod verba posteriora ad leges distichi epici exacta sunt, priora si omnino in metrum qualemque redigi possint, ad epicos modos certe sine maximis mutationibus accommodari nequeunt.

Solito perspicacius h. l. egit editor Hayleyb. qui quanquam utrumque comma retinuit, ad versuum modum tamen non dispositus; errorem ceterum commisit gravem: अवर्धमानश्चार्थश्च स्वव्ययोऽप्यञ्जनवत् ज्ञयेति । अनुपमुक्तधनश्च निष्प्रयोजनं एव च । Addam nunc varietatem lectionis in codd. obviam: P. अवर्धमानश्चार्थः कालेनाञ्जनवत् ज्ञयेति । अनुपमुद्यमानश्च निष्प्रयोजनं एव ॥ Pp. वर्धमानश्चार्थश्च स्वव्ययोऽप्यञ्जनवत् ज्ञयेति । अनुपमुद्यमाणश्च निष्प्रयोजनं एव च ॥ Hisce expositis dimittere possem haec verba tam longa disputatione iam nos occupantia; sed addenda esse video nonnulla eorum potissimum gratia, qui diversam suscipere partem et in ea persistere sententia fortasse malint, distichon metro quodam compositum istis verbis contineri. A qua ratione quanquam ipse sim longe remotus, exemplo tamen demonstrabo, propter inopiam remediorum minime nos in aliam discessisse sententiam. Qui versum reficere velit, is aut retinere debet alterum comma, priore ad idem metrum redacto aut prius comma quantum fieri poterit conservaturus, ad metrum Arya omnia ista verba accommodare; alterutrum praferenti satisfaciā; scribat aut; अवर्धमानस्यार्थस्य कालेनाञ्जनवत् ज्ञयः । अनुपमुद्यमानश्च निष्प्रयोजनं एव सः ॥

P. 46. aut alio metro: अवर्धमानशार्यः स्वल्पव्ययोऽस्त्रवत् क्षयमेति हि । धनमनुपभुद्यमानं तान्निष्प्रयोजनं एव स्थात् ॥ vel (hemist. d.) मन्येऽप्रयोजनं.

Dist. 9. b: Pro तु codd. et S. च. — d. कर्मणा P.

Lin. 13. नियुक्ति Pp. et edd.

— 14. परिपूर्ण P. — बाणिज्ये Pp. बाणिज्यार्थं L. — चलितः Pp. et L. — गतः काश्मीरं प्रति S. —

— 17. ततो om. Pp. अय substituit S. — पर्वते om. S.

Dist. 12. a. करोति P. minus bene.

— 13. a. विस्ययश्च सहा हेयः Pp. voluit सदा. — d. साध्य Pp. Compositum ferri potest. cf. proem. v. 1.

P. 47. *Lin.* 1. ab init. विचिंत्यैतत् P. — तत्र om. P. — स वर्धमानः Pp. वर्धमानः पुनः स्वयं धर्मपुरं edd.; sed auriferam urbem praefert haud dubie mercator. — वर्धमानः पुनश्चलितः; ceteris omissis, Pp.

— 2. महाकायं om. P. — एकं addunt. edd. — आनीय P. पुनः om. edd. — संज्ञीवकोऽपि codd. et S. Sed अपि non habet quo referatur. — S. initio commatis ततः addit. — कथं कथमपि Pp. et S.

— 3. त्रये edd.

Dist. 15 — 17. om. codd. et interpp. — 15. abest etiam ab ed. Ser.

— 15. c. अपि inseruimus, flagitante metro.

Lin. 12. स्वेहाहारपयःपानेन P. स्वेहाहारविहरं कृत्वा S. ubi statim अरण्यं.

— 13. च om. edd. et P. — *Lin.* 14. pro आस्ते edd. निक्षति; de verbo आस् idem valet, quod supra de स्था observavi; induit haec radix quodammodo naturam verbi auxiliaris, quod continuationi actionis indicandae inservit. Alia exempla eaque satis luculenta infra leguntur. Cf. p. 67, l. 18. 87, 15. 91, 1. 122, 19. 127, 15. 129, 15.

Dist. 18. c. वित्तस्य codd. pro रात्यस्य.

Lin. 17. पिङ्गलकः पिपासाकुलितः सन् P. — अगदत् S. — यमुनातोरमवातरत् P.; qui init. commatis seq. च omittit.

— 18. अनुभूतपूर्वकं L. अनुभूतपूर्वं P. अनुभूतं पूर्वं S. omnes absurde negationem omittunt. Pp. aeque absurde quanquam aliter: नानुभूतपूर्वकं; न enim semper ad verbum quoddam referendum est, अ privativum, sicuti particulae सु et दुस्, nominibus tantum substantivis et adiectivis neque non nominalibus verbi formis praesfigi potest; (i. e. infinitivo, participiis atque absolutivo, quem modum alii gerundium appellare malunt). Haec est ratio,

cur Bhag. Git. III, 12. legendum est cum codd. अपदाय; vid. not. SCHL. P. 47. ad locum. प्रलयकालधनगर्जितं P. पूर्वकालधनगर्जितं S. — Pro नर्दितं Pp. निनदं, quod vocabulum neutrius generis esse nequit; fraudem fecit librario अश्रावि, quod pro activo accepit.

Lin. 19. चासौ P. — सचकितः S. — परिवृत्य edd. — इति om. P. — आलोचयन् S. et P.

— 20. तुष्टिं S. mendose. — स च S. et P. — अस्य om. L. — शृगालाभ्यां om. Pp. जंबुकाभ्यां substituit P.

— 21. Pro अवलोकितः edd. दृष्टः unde mox oritur ingrata eiusdem vocabuli repetitio. — तथाविधं च दृष्टा P. तं तथाविधं दृष्टा edd. किमिति om. Pp. किं substituit L. ubi transponitur: सखे अयं किं, करुणकं omissio.

— 22. सचकितो ante मंदं inserit S. cf. l. 19. — मन्दमन्दमित्र P. — Pro मित्र in fin. P. सखे.

Lin. 1. अस्मन्मतेन S. unde L. fecit: मम सन्मतेन. — Pro सन्मतेन P. मतेन. — P. 48. Pro अस्य S. स्वापि. — अस्माकं addit commati S. haud male; de constructione supra dictum est ad I, dist. 13.

— 2. अतो L. यतश्च S. — राजा विनापराधेन चिरदिवसमवधी० S. Otiosa verborum accumulatio. — चिरं om. Pp. et L.

Dist. 20. b. सहन्तो ये परास्मृताः P. sensu cassum. — L. et P. peccant in ये pro यान्. — c. तदर्थेनापि L. तदर्थेनापि Pp.

Dist. 21. d. कै unanimo librorum consensu defenditur, unde a corrigendo manus abstinenda erat, quanquam particulam कै sensu conditionali positam nullibi praeter hunc locum legere me memini. — Subiungit sola ed. L. hosce versus:

क्रीडते भुजंगैः साईं रमते परयोषितः ।
राजानमपि सेवते अहो साहसिको नरः ॥

Lege hem. a. भुजंगैः

Dist. 22. c. Pro ग्रह Pp. et L. सुब. ग्रह praebet etiam Vetalapanch. fab. IV, ubi hoc distichon itidem laudatur. — Vehementer errant qui docent इहि et एहि duas esse formas 2. pers. sing. imperat. act. rad. इ. Wilkinsius recte इहि solam formam exhibuit; gramm. p. 160. Boppius formam एहि addit, asserens augmento minori (*Guna*) praeter regulam auctam esse vocalem radicalem. (Lehrgeb. §. 346.) Quid multa? एहि est आ + इहि, *adveni*; quod vel hanc ob rem manifestum est, quod opposita

P. 48. sibi sunt h. l. एहि et गङ्ग. Quod si vir eximius sibi a me persuaderi haud patietur, in auxilium vocabo auctoritatem Sancarae Acharyae, qui haec verba Kathac. Upan. p. 4, l. 10. श्रेयश्च प्रेयश्च मतुष्यमेतः in scholiis p. 29, l. 10. enarrat: पुरुषं आ इतः एतः प्रापृतः । — Sed errorem suum perspexit Boppius ipse. Cf. add. ad l. l. p. 356.

Dist. 23. a. सुख्यैर्यथलाभाय Pp. minus bene.

— 24. a. प्रकृत्येव edd. vitiose.

Dist. 25. et 26. transponit S. — 26. omittunt codd. 26. a. pro मूर्खः editum est in ed. Bhartriharis, qui auctor est huius sententiae, p. 49 मूर्खः, et hem. c. धृष्टः पार्षदे स भवति जनो । मूर्खः tuetur praeterea Vetal. Panchav. fab. III, cui inseritur hoc distichon; ibid. hem. c. hunc in modum variatur: धृष्टः पार्षदे वसति विचरन् दूरगोऽपि प्रमत्तः quae varietas nil habet quo se commendet.

Lin. 22. नैतत् वाक्युचिं P. absurde, quia animo loquela nec tribui potest, nec tribuitur ab Indis; animo autem ascribunt actionem; Bhag. Git. V, 11. कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि । योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्तात्मगुद्ये ॥ quod quomodo intelligendum sit, non huius loci est exponere.

P. 49. *Dist.* 27. a. कर्यं त्वया न सेव्यन्ते L.

— 28. b. Pro उद्घृत L. et P. उद्घृतः; sic etiam ut videtur Pp. — d. आहिनी libri omnes; quod quum cum antec. construi omnino non possit, emendavimus वाहनाः, ut sit adiectivum et epitheton ad संषदः. Epitheton autem hoc aggregativum in duas partes distribuendum est, caesura prioris finem indicat. Hoc interest inter binas epitheti partes, quod in posteriori tres enumerantur res, quibus prosperitas hominis extrinsecus manifestatur; in priori quarta additur, cui duo epitheta praemissa sunt. उद्घृतः insolentius est vocabulum, optimae tamen notae; उत् enim particula, nomini praefixa notat porrectionem, elationem, interdum etiam eruptionem. Sic dicitur Ram. Lib. I, LVI, 23. उद्घृष्ठ, armis porrectis, sublatis; Amarū Satac. 11. उद्घृष्टः lacrymis prorumpentibus (उद्घृतवाप्तः schol.) उद्घृतः, Râm. II, 39, 10. उन्निद्रः Mêgh. Dût. 87.

Lin. 5. यतः । अव्यापारेषु edd. et Pp. Delevimus particulam cum P. Manifestum est, versum sequentem ab eodem vocabulo incipientem in errorem induxisse librarios.

— 6. सर्वया न कर्तव्यः P. minus eleganter.

Dist. 29. c. त तथा Pp. Male.

P. 49.

Lin. 10. शुमद्दत्तनाम्ना कायस्येन विहारः etc. Pp. Sic etiam ed. Ser. ubi pro कार्यं legitur कर्तुं, minus apte. Ed. Lond. verbum caussativum ponit, sed vitiōse neutro genere exhibuit विहारं et आरब्धं et perperam ante postremum vocabulum inserit मेडं, ex glossemate, nisi fallor, textui obtrusum. De infinit. vid. not. ad p. 41, l. 1.

Lin. 11 et 12. Retinuimus quantum sieri potuit scripturam edd. in quibus primum एकस्तम्भस्य editum est vitiōse, tum कीलकं निधाय सूत्रधारेण स्थापितं (ed. S. pro hoc participio धृतं) legitur; attamen neutrius generis esse nequit vox कीलक, unde patet emendandum esse sicuti fecimus. निधाय expunximus, quia otiosum est sequente alio verbo eandem rem indicante. — Pp. = तत्र करकातपत्रे दायमाणैककियद्वारस्फाटितवपश्चायमध्ये कीलकं निधाय धृतं । P. = तत्र करपत्रविर्यमाणैः स्तम्भस्य कियद्वारपाटितकाष्ठदयस्य मध्ये कीलं निधाय धृतं; in utraque scriptura praecipuum est vitium, quod निधाय sine ullo regimine positum est; alia minus bene dicta lectorum iudicio relinquendo invenienda.

Lin. 12. अथ तत्र P. — सायान्त्रे ex P. — Pro बनवासो ed. S. बलवान्. — महावानरयूः Pp. et L. — Errat Wilso, in Lex. suo huic voci वृश्च solam neutrius notam apponens. Amarasinghas diserte probat generis masculini usum: वृश्च तिरशां पुनर्नपुत्रकं । SCHL. .

— 13. आगतः । तेषु om. S. — दण्ड om. P. et S.

— 14. Pro तत्य S. तत्र. — खण्ड om. P.

— 15. स च om. codd.; त तamen ante त restituit P. आकृष्टे च तस्मिन् P. आकृष्टे च कीलके S.

— 16. काढायां om. codd. et S. — सहसा पञ्चत्वमगमत् P.

— 18. एव om. S. et P. — सर्वस्मिन्नुधिकारे य एव नियुक्तः S.

— 19. सर्वया न S. सर्वापि न P. qui et mox कर्त्तवीया.

Dist. 30. a. पराधिकारे P. — c. चित्कारात् Pp. et L. Omisit Wilso vocabulum; legitur Mål. et Mādh. prolog. v. 1. eadem variatione in quantitate particulae चित् v. चीत्; explicat scholiastes per त्रासधुनिः ।

Lin. 1. — वयःस्या सह P. ad idem redit; sed proprium est nomini- P. 50. bus in अस् affixum क. महोरस्क Ram. I, 1, 12. अतपस्क Bhag. Gīt. XVIII, 37. Sic enim rescribendum esse monuit me ipse v. cl. Schl.

Pro कान्तया S. वृद्धा. — चिरं निधुवनं कृत्वा S. Modestius et castius vocabulum est केलि; haec est ratio, cur de Deo Crishna canat Jayadevus: श्रीवासुदेवरतिक्तिकथासमेतं । एतं करोति जयदेवकविः प्रब्रंघं ॥ Contra de lucubrationibus suis ama-

P. 50. torii Chauras: (v. 4.) अयापि तां निधुवनक्षमनिःसहायीं । आपाएङ्गएउपतितालककुन्तलालीं । प्रदृन्नपापकृतमन्तरिवावहर्तीं । कण्ठावसक्तमृदुवाहुलता स्मरामि ॥

Lin. 2. निर्भर्मालिंग्य edd. — तद्गृहद्वयाणि हर्तुं S. तत्य गृहद्वयाएयपर्तुं P.

— 3. उपविष्टोऽस्ति S. — pro तव S. भवतः ।

— 5. भद्र मम S. et pro किं minus bene न. — Post alteram virgulam. न ज्ञानासि L. किं न ज्ञानासि S. —

— 6. यथा तत्य, omisso अहं, edd. — अहनिंश्च om. codd. Pro ततो S. यतो absurd. — चिरनिर्वृतो P. चिरान्तिकृतो Pp. et L.

— 7. यों Pp. — अपि ad अधुना transfert S. omittit omnino P. qui कृतः commati addit. —

— 8. Pro विद्युर् L. विद्यर्, P. विद्युषः; illud culpa operarum, hoc absurde. न ante स्वामिनो inserit P. — उपजीविषु S. रे om. Pp. — Post vocem वर्बर् subiungit L. haecce verba, in ceteris libris non obvia: स्वभावतः प्रवजातिःसृष्ट्यः । पुनर्यि सेवकज्ञातित्वं पश्य । sequitur tum distichon 31.

Dist. 31. Insolitum est unicum distichon inter duas personas distribui, unde occasionem arripuisse videtur aliquis, unicuique versui alium addendi, ita ut prius distichon ab asino recitetur, alterum a cane. Hanc rationem secutus est editor Londinensis: याचते . . . सुहृत् । तस्मैन् कार्ये विनष्टेऽपि भृत्येन सुहृदा किम्. Versus sensu est cassus. Ed. Ser. alium praebet eius loco: अकार्यकार्यकर्ता यस्त्वनादिष्टोऽप्यसौ सुहृत् । hactenus bene; sed tum pergit: कुकुरो बूते । Respondet deinde canis uno versu, qui in codd. quem secuti sumus, alteram distichi 31. partem constituit. Slocos unius versus ne canes quidem proferre decet. Editor Lond. huic incommodo medelam allaturus, versui isti solivago socium hunc invenit: सर्वथा किं न कर्तव्यं पोषणं भृत्यदार्योः ॥ In codd. et ed. S. hemistichium c. dist. 31. hunc in modum foedatum est: भृत्यान् संभावयेत्स्तु; sed negatio omnino non abesse potest.

Dist. 32. b. *fin.* चिन्तने L. male. — d. pro न सन्ति Pp. वसन्ति. In *fin.* L. प्रतिहृतकाः ।

Lin. 13. ततो om. Pp. Idem mox pro यद् exhibit यतः et voci उपेक्षां addit particulam एवं. —

— 14. तद्वत् P. — भवतु तावत् S. — यथायं स्वामी P. — जाग्रिष्यति S. praeſens usitatius est futuro in hac iunctura. — तत्या S. et P.

— 17. न om. S. न अतीव L. — चौकारं प्रब्दं P. — चित्कारं, omisso प्रब्दं Pp. — ततः om. L. — चौकारप्रब्देन, omisso तेन P.

— 18. Pro विर्द्ध edd. भंग; minus exquisitum vocabulum. — Edd. P. 50.
addunt: तेनासौ पञ्चत्वमगमत्; P. गर्दभः पञ्चत्वमागतः।

— 19. Pro अस्मन् L. अस्माकं, S. एवासन्; voluit एवास्मन्. — सा स्वनियोग etc.
Pp. haud male.

— 20: Pro तयापि edd. तया चर्चया. — किं तव प्रयोजनं Pp. — Pro यतः S. ततः,
L. तत्, utrumque male. — आवयोस्तावत् codd. — भक्षितप्रोषः, omissio आहार P.

— 21. प्रचुरतरोऽस्ति Pp.; — अस्ति pro तिष्ठति etiam edd. — मात्र omissio S.
pergit: भवान् केवलं राजानं सेवते। एतद्युक्तमुक्तं त्वया। L. comma ponit post भवान्;
tum pergit: सेवकेन एतद्युक्तमुक्तं; quocum in omnibus consentit Pp. excepto
अयुक्तं, pro quo exhibit नयुक्तं.

Dist. 34. a. सुहृदामयुपकार् etc. Pp. contra metrum.

P. 51.

Interponunt edd. distt. 34 et 35 hosce versus:

जीविते पस्य जीवन्ति विप्रा मित्राणि बान्धवाः।

सफलं जीवितं तस्य आत्मार्थं को न जीवति॥

Omittunt hoc dist. pariter codd. et interpp. nec sine optimo iure; para-
phrasis enim est dist. seq. haud magnopere elegans.

Dist. 36. b. पुराणः S. absurde.

*Dist. 37. d. Pro स किं ed. L. et codd. सोऽपि, male; nec commodus
inde elici potest sensus, nisi interrogandi vim particulae अपि tribuas;
quam tamen quum habeat, sententiae praemitti debet.*

*Dist. 39. Legitur apud Bhartrih. p. 48. Praemittit S. haec verba:
तथा हि स्वल्पमयतिरिच्यते। quae nulla quod videam commendatione gaudent. —
Hem. a. अल्पस्त्वाणु वसाच्चमेदमलिनं L. quam scripturam praebet etiam Pp. quamvis
aperte corruptam; quid enim est चर्वेद? num voluerunt अवर्वेद? — S. स्वल्पस्त्वाणु
वसावशेषमलिनं. अवसेक recepimus utpote exquisitus ex P., haud memores, apud
Bhartriharem etiam legi अवशेष. — स्वल्प exhibit quoque P. स्वर्वं scriptum
est in ed. princ. quae scriptura vera est, me quidem iudice; referendum
est ad अस्तिकं, स्त्राणु ad sequens compositum relato. — hem. b. ज्ञाता ed. pr.
et L. Admittit metrum. In ed. princ. praeterea legitur: न च तत् तस्य haud
male.*

Lin. 15. पश्य post अन्तरं reiicit S.

Dist. 40. ex Bhartrihar. p. 54.

*Dist. 41. a. जीवन्ति edd. absurde. — b. विज्ञात Pp. male. — d. बलिश्च
vitiose L. — Addit ed. Ser. sola hosce versus:*

P. 51.

अपरं च । यो नात्मना न च गुरुं च भूत्यर्गे ।
दीने दयां न कुरुते न च बन्धुवर्गे ।
किं तस्य जीवितफलेन मनुष्यलोके ।
काकोऽपि जीवति चिरं च वलिश्च भुक्ते ॥

Corrige वलिं च; ceterum furatus est auctor quisquis ille fuerit ultimum suum hemistichium e disticho antecedente; neque magna laude digna sunt cetera. Primo hemistichio inhaeret vitium grave; quod quomodo tolli debeat, fateor me nescire.

Dist. 42. b. श्रुतिसमये: S. श्रुतिसमये Pp. Casus tertius requiriatur a verbo composito वहिष्कृ; vid. Episod. Bharateae ad calcem libelli de Pentap. Indic. v. 5., quanquam ablativum poni etiam posse, ex verbi significatione probabile est. — तिरस्कृतस्य S. निष्कृतस्य L. contra metrum. — d. गुरुपश्चोः edd. et P. च addit Pp. omisso tamen seq. पश्चोश्च; prius च vel ex coniectura restituendum foret, flagitante metro. — कोऽपि न विश्वेषः Pp. recalcitrante versu.

Lin. 22. तदायाक्योः edd. तदायाक्योः Pp. neutra particula huc facit.

P. 52.

Lin. 1. Pro गुराह ed. Ser. ब्रूते. — अमात्यपथानतामपथानां लभने P. Melius S. अमात्यः sed cetera ut P. inserto praeterea suo loco वा. Pp. mendose: अमात्यः प्रथानतां वा लभेत ।

Dist. 43. d. Pro नयन्ति Pp. प्रयान्ति, mendose.

— 44. b. यथा गत्वेन भूयता Pp.— Idem mox pro ज्ञापेन praebet सुखेन.

— 45. om. codd. atque interpp.

Lin. 9. भर्त् edd. male. Pro स्वयत्सु Pp. प्रयत्सु.— क्यात्मा सर्वस्य, omisso उत्कर्षः S. in qua scriptura vocabulum आत्मन् more minus usitato positum est. Eandem tamen scripturam praebet P. उभयत्र प्रयत्नायत्रो क्यात्मा सर्वस्य ।

— 10. तावत् om. Pp. et L.— कुतो pro कुतोऽपि L. et Pp. interrogacionem huc non facere e statim seqq. patet. Pro भयात् S. कारणात् et mox सचकितः ।

— 11. Pro तत्र S. et P. तत् त्वं, minus bene; तत्र est तस्मिन्नर्वे.

— 12. प्रजाक्तां om. codd. et S. inserto अत्र ante अविदितं.

Dist. 46. a. Pro बुध्यते edd. गृह्यते; utrumque vocabulum habet quo se tueatur. — b. pro देशिताः P. योजिताः. — Addunt edd. hosce versus, interpretibus et codd. ignotos, e Manu VIII., 26. desumtos:

P. 52.

ग्राकारैरिङ्गितीर्गत्या चेष्टया भाषणेन च ।
नेत्रवक्त्राविकारेण लक्ष्यते ऽन्तर्गतं मनः ॥

Lin. 16. तद् sine अत्र S. — भयप्रस्तावेन L. Pro हन् P. एवं. — S. transponit: . . . वलेनाहमेन स्वामिनामात्मीयं करिष्यामि । — प्रक्षाप्रभावेण et mox करोमि P.

Dist. 48. a. et b. Emendavimus hunc versum; libri omnes: अनाहृतो विश्वेषस्तु अपृष्ठो बहु भाषते । (In primo vocabulo L. अनाहृतो, imperite).

Dist. 49. b. यत् शुन्दरमुन्दरं P. — Emendatione egere videtur prior P. 55. versus, ne addita particula अपि vim interrogationis tollat. Fortasse: किमि-हास्ति. — SCHL.

Dist. 51. c. अवितर्ण Pp. et S. adverbium praestare visum est.

— 52. abest hoc loco a codd. et S.; Anglice redditum ab interpp. Inserit ed. Ser. infr. p. 58, l. 18. ed. nostr. In P. legitur loco distichi II, 104.; in Pp. subiicitur dist. II, 103.

Dist. 53. a. अल्पेत् L. mendose. — d. स राजवक्त्रात् वसेत् S.

Lin. 11. अनवसरप्राप्तं Pp.

— 12. अस्त्वेवं S. Uterque modus in hac formula, quae a particula restrictiva किंतु nonnunquam excipitur, usurpat. — स्वामितान्त्रित्यं S.

Dist. 54. b. तत् कापुरुपलक्षणं S. — c. pro आतः Pp. तात.

— 55. b. असंस्कृतं pro असंगतं ex Pp. — d. pro भवति edd. वसति.

Lin. 18. अथ om. L. — तत्र om. Pp. — किं वक्ष्यते भवान् S. — भद्र तत्र गत्वा किं वदिष्यसि P. — किं ante अनुरूपे om. L. —

— 19. वा pro वापि edd. — मयि om. Pp. et P. — स्वामी ज्ञातव्यः (omissio omnino particula disiunctiva) P. — तात् commati addit Pp.

— 20. शृणु om. Pp.

Dist. 56. b. संप्रस्त्रे सादरो भृंते edd. male.

— 57. a. et b. तत्त्वेवकेनायानुरक्षितानं प्रतिविवर्धनं । L. contra metrum et syn- P. 54. taxin; अनुरक्षिः (compositum enim quod exhibit ed. L. huc non facit et operis tribuendum est) cum casu septimo construitur; tertius casus syllabam supra numerum legitimum addit. ज्ञानं vitium est aut librarii, qui male pinxit hanc figuram द्वि, ita ut pro द्वि legi posset (quod Bengalis saepius accidit) aut editoris L. qui litteras istas male legerit; ज्ञानं scriptum est etiam in P. तत् init. versus male intellexisse videntur editores Seramp. unde occasionem arripuerunt versum suo modo emendandi i. e.

P. 54. foedandi: तदेव । असेवके चानुरकिर्दनं सप्रियमाषणं । Sed optime se habet scriptura nostra; तसेवके compositum est et explicandum per तस्य सेवके; favor patroni, qui etiam extenditur ad servum *illius*, i. e. hominis, cui ipse favet. — c. pro इश्वर ed. L. ईश्वरा, sensus idem, sed corruptitur metrum; quod quum non fugeret sagacitatem Serampurensium, ediderunt: अनुरक्तेषु चिह्नानि. Pro चिह्नानि P. लिंगानि. — d. pro संग्रहः P. कीर्तनं.

Dist. 58. c. लिंगानि iterum P.

Lin. 5. यथा चायं edd. — ममानुरक्तो भवति स्वामी P. — भविष्यति edd. — कर्त्त्यामि pro वच्यामि S. —

Dist. 59. a. विपत्तिषु P. metrum restituitur legendo विपत्तिष्वयाय etc. sed refragatur sensus. — d. परिस्फुरन्ती P.

Lin. 8. अप्राप्यप्रस्तावे Pp. prius vocabulum omittit P: अप्रस्तावे. Idem mox बहुं नार्हसि; minus bene. Particula enim negativa न praemittenda est vocabulo, in quo praecipua negationis vis vertitur; in quonam huius commatis vocabulo posita sit, ostendit sequens distichon voce ब्रुवन्.

Dist. 60. c. प्राप्नोति ब्रुद्धिहैमत्वं P. —

Addit L. hoc distichon, in ceteris libris h. l. omissum, in P. infr. post dist. 128. obvium et desumptum e Rām. III. (cf. Codic. Schl. fol. 51. recto.).

सुलभाः पुरुषा राजन् सततं प्रियवादिनः ।

अप्रियस्य च पथ्यस्य [in Rām. तथ्यस्य] वक्ता श्रीता च दुर्लभः ॥

Lin. 11. वदिल्यानि S.

— 14. वदि च edd et P. — प्राप्नावस्त्रेणापि edd. आप्नावस्त्रे, omissio मया, P. प्राप्नावस्त्रोऽपि, मया post न reiecto, Pp.

Dist. 61. Inseritur prior huius distichi versus infra ante dist. 118. coniunctus cum altero qui eundem sensum praebet atque ille, quem h. l. legimus, sed aliis verbis conceptus est. Disticho isto infra omissio, alter versus h. l. exhiberi debet: कल्याणवचनं ब्रूयादपृष्ठोऽपि हितो नः । Sic edd. Aliter codd. अपृष्ठोऽपि हितान्वेषी ब्रूयात् कल्याणभाषितं ।

Dist. 62. a. कल्पयते L. वृत्तं L. — b. येन लोके, omissio च, P. — c. च abest a Pp. — d. रक्तणीयः Pp. रक्तश्च P. संरक्षः edd. quod nihil est, nisi legatur संरक्षः. — वर्धनीयश्च P. Constituimus textum iuxta leges metri.

Lin. 17. तद्वारा । अनुजानीहि मां गमनाय । P. — ब्रूते om. codd. cuius loco P. commati addit: इत्युवाच । — यथाभिमतं L. यथाभिलयितं S. ubi hisce verbis praemittitur: शिवास्ते पंथानः; quod additamentum aegre caret impera-

tivo सन्तुः । — इति addunt sermoni Carataci edd. otiose, quum antea P. 54. ब्रूते positum sit. Ceterum a Carataci nomine occasionem suinam ex V.V. D.D. quaerendi quomodo factum sit, ut nulli quadrupedi hoc nomen tribuant lexicographi Indici, (cornicem esse docent) dum hyaenam quam vocat Indicam ita appellatam esse docet Porphyrius: de abstin. III, p. 218. ed. Rhoer. ή δ' Ἰνδικὴ υἱαινα, ἦν Κροκότταν οἱ ἐπιχώριοι καλοῦσι; alii scribunt Κοροκότταν, rectius, si Indicum nomen respicias.

Lin. 18. विस्मित इव edd. सविस्मयभाव Pp. ex nostra scriptura corruptum.

— अथ om. L. —

— 19. इष्टः om. Pp. et S. ubi transponuntur inter se राजा et सादरं. — अष्टांगपातं L. male. — Pro पातं S. प्रणिपातं.

— 20. Eadem fere verba sed alio ordine exhibent edd. यद्यपि मया सेवकेन श्रीमद्भूदेवपादानां न किंचित् प्रयोजनं etc. — श्रीमद् om. codd.

— 21. तया pro तथापि male P. अवश्यं ad प्राप्तकालं transfert Pp. — इत्यालोच्यागतोऽस्मि Pp.

Dist. 63. et 64. et Lin. 5. omittunt codd. et S. — 64. Jonesius non interpretatus est, cetera reddidit. W. cum ed. L. et nobis consentit.

— 63. b. मानांगतुंगसुरभिः L. sensu cassa scriptura, quam interpretatione P. 55. Jonesii quamvis falsa (*the earth abounding with sweet scents and lofty elephants*) ducti emendavimus; patet enim Jonesium legisse मानंग. W. scripturam ed. L. secutus est, quam vereor ne difficile sit validis argumentis defendere. Ceterum in ipsius epitheti explicatione haereo; neque video, quid h. l. sibi velit सुरभिः, odorifera quum terra nil habeat, quo aut bellatorum fortitudo in ea sub potestatem redigenda magnopere conspicua fiat, aut quo victoriam reddat magis arduam atque difficilem; simile tamen quid h. l. desideratur. Admitti praeterea nequit constructio, quam posuit Jonesius; si altos elephantes ex hoc epitheto eruere quis velit, legere debet तुंगमानंग. Hac igitur interpretatione reiecta alteram proponam, ad grammaticam quod attinet certe legitimam, quamvis sensus quem praebet, mirus quodammodo vel mihi videtur; proponam tamen, meliorem a doctioribus edoceri desiderans. तुंग quum voci मानंग postpositum sit, explicandum est: मानंगबत् तुंगा सुरभिर् यस्याः सा भूः । सुरभिः vacca est, sub cuius imagine terra ab Indis figuratur. Sensus igitur hic eruitur: terra, cuius vacca altitudine elephantes aequat; sed fateor, mirum in modum tali epitheto extolli magnitudinem orbis terrarum. LASS. —

P. 55. Ut poetam a culpa inepta comparationis liberem, pauca monebo. Primo loco cogitandum est de elephantis orbem universum sustinentibus, दिग्नान्, de quibus cf. RAM. I, cap. 41, sl. 13 — 22. Cum horum statura apte comparari poterat vacca ista abundantiae, solennis terrae imago, propter secunditatem. Cf. *Bibl. Ind. nostra*, II, pag. 288 sqq. Quod autem utraque सुरभि dicitur, *bene olens, odorata*, id non ad florum et aromatum copiam spectat, sed altioris est indaginis. Omnes philosophi inter Indos, quotquot novi, quinque rerum elementa statuunt, quorum singulorum vim et effectum ad animantium sensus referunt: aetheris ad auditum, ignis sive lucis ad visum, aëris ad tactum, aquae ad gustum, terrae ad olfactum. Propria igitur terrae virtus est odor: गन्धगुणा भूमि: Cf. *Manūs Cod.* Cap. 1, sl. 75 — 78. Terra denique, in quam bellatorum tela incident, describitur tanquam vacca, vulneribus confossa. Sic omnia inter se cohaerent. SCHL. — Pro अर्जिता ed. L. अर्पिता. Cf. I. Ram. 5, 1. सामारान्ता मही घेवासीद्वीर्यार्जिता किल।

Dist. 64. a. बिदूषां L. — b. वरसुरतसमागमस्वीपां id. — c. द्रुषित id. certissimas emendationes suppeditat metrum.

Lin. 5. हेतुकेन ex emend. pro हेतुना.

Dist. 65. Pro राज् Pp. चापि, minus bene repetitur haec particula disiunctiva. — b. *in fin.* चापि P. — d. पाणिकता Pp. contra grammaticam, quae docet affixum वत् iis tantum subiungi vocibus, quae in vocalem अ terminentur. Dubitans, an कि eodem sensu poni possit atque किंयुनः, suspicor legendum esse: किंवद्द इति etc., metro non refragante.

Lin. 8. *initio.* यद्यपि P. quod ferri potest, seq. तद्; यद् enim coniunctionis partes agens, sicuti Romanarum *quod*, flagitat demonstrativum तद् ad quod referatur; praemittitur autem in lingua Indica यद् una cum sententia, in qua quasi agmen dicit, secundum eandem legem, quae in causa est, cur sententiae relativae praecedant praecipuam enunciationem; qua de re supra dixi ad p. 15, l. 13. — यद्यपि excipitur h. l. a तन्, elliptice posito; similis est ellipsis in formula चेन्न, de qua supra egi.

— 8. स्वामिना om. codd.; substituit S. देवपादैः, quod alio loco, ante ये collocat. — Pro विनाशः codd. et S. नाशः. — Addit in fine commatis L. मन्त्र्यः! Ferri potest additamentum hocce, sed longe praestat nostra scriptura, cuius elegantiam editores istos fugisse omnino non miror; eiusmodi enim locutiones ad penitiora linguae Indicae pertinent. Transpo-

suimus distt. 66. et 67., quod tum ipse orationis nexus requirit, tum P. 55. vox शंकनीयः, quae dist. 66. cum praecedenti oratione coniungit. Suasores nobis praeterea exstant editores Serampp. —

Dist. 66. Bhartriharis est. Cf. ed. Ser. p. 56. — a. कर्त्तर्थितस्यापि Pp. S. et ed. pr. *Satacorum*. Si nostra lectio admittitur, कदा et अपि licentia poetica seiuncta sunt vocabulo interiecto. Construe न कदापि i. e. न कदाचित्. Veruntamen haud scio an minus prudenter egerimus in reiicienda scriptura ed. S. कर्त्तर्थस्ति legitur in hoc Bhartriharis disticho (p. 41. l. 4. infr.): किं कंदर्ष करुं कर्त्तर्थस्ति किं कोदण्डकंकार्त्तैः । रे रे कोकिल कोमलं कलरवं किं त्वं वृथा भाष्टे । LASS. — Sine dubio कर्त्तर्थस्य est vera lectio, siquidem अर्थित pro अर्थित् possum admitti nequit. Verbum hoc denominativum कर्त्तर्थस्ति significat *vilipendere, parvi facere*. Compositum est cum particula कत् themate obsoleto pronominis किं, quod et ipsum cum significatu contemptus vocabulis quibusdam praeponitur. Amarasinhas: किं पृश्नायां ब्रुगुप्सने । SCHL. — हि pro च recepimus ex codd. et ed. pr. quamquam durior sane est repetitio eiusdem particulae in eodem versu. — c. तनूपातो scribunt libri omnes; nos thema vocis तनूपाद् esse contendimus; utramlibet enim originem vocabulo tribuas, a तनूप + अद्, vel: तनु + ऊन + पाद्, (tertia quam addit Wilso, a तनू + न + ऊन, admitti nequit) scriptura eadem manet. — d. यान्ति P. quod ferri etiam potest.

Dist. 67. c. यथैवास्तु तथैवास्तु Pp. यथैवास्ति तथैवासि P. (voluit haud dubie तथैवास्ति); यथैवास्ते तथैवास्तां S. — Prorsus aliam scripturam eamque haud malam praebet L. क्रयविक्रयवेलायां. — आस्ते huc non facit, verumtamen confiteor, ex mea sententia aut praesens aut imperativum repetendum esse; mallem tamen praesens.

Addunt L. et W. hosce versus:

यस्य ये च गुणाः सत्ति विकशन्ति न ते स्वयं ।

न हि कस्तूरिका मोदं सुपयेन विभाव्यते ॥

Wilkinsius reddit: « *Those who are possessed of good or bad qualities are not sensible of it themselves. The good traveller doth not perceive that the Kastūrikā hath any enjoyment of her precious perfume.* » कस्तूरिका accepit Vir clar. pro ipso animali, ex cuius vomica extrahitur muscus; quod secus esse nunc scimus. Cf. Wils. s. v. Animali nomen est गन्धमृगः dicitur etiam पुष्कलक, quod vocabulum a Wilsone omissum eruit Vir cl.

P. 55. SCHL. ex Siddh. Kaumud. fol. 81. recto: चर्मणि द्वौपिं हन्ति दत्तयोर्हन्ति कुंजरं । केशेषु
 चमरैं हन्ति सीम्नि पुष्कलको हतः ॥ addit Bhattôxes: सीमाएउकोग्राः । पुष्कलको मंधमृगः । —
 Ceterum si eadem verba atque illa quae in ed. Lond. exstant, ante oculos habuit Wilkinsius, in interpretatione eius omnia fere non possum
 quin reprehendam; neque enim vero in versu priori विकाश significare
 potest conscientium esse rei, neque ad यस्य referendum est ते, sed ad हे; neque
 in posteriori सुपथेन bonum viatorem notat, sed bonam viam; sed omitto
 haec, ne Viro de his litteris meritissimo culpam, cuius insons sit, suscipiendam obtrudam. — In priori versu विकाश vel potius विकास cum sibilo
 dentali est verbum proprium de floribus oscitantibus, quod luculentis exemplis si opus sit, probare possim. Cf. Wils. s. v. विकसित. Sensus
 igitur est: virtutes quae cuiusque (hominis) sint, non ipsae per se
 patescunt; quae sententia ut recte intelligatur, revocabo distichon Lib. I,
 18. in quo docetur, hominis स्वभाव, indolem innatam et propriam, in
 fronte quasi versari (मूर्ध्नि वर्तते), idem autem non valere de ceteris qualitatibus (इतरे गुणाः ibid.). De hisce qualitatibus igitur secundariis quoddammodo et ab ista primaria, innata atque immutabili hominis indole
 diversis loqui videtur auctor distichi interpolati, (interpolatum enim esse,
 statim ostendam); quas in lucem protrahi significat non sua sponte,
 sed occasione quadam data et aliqua caussa extrinsecus accedente. Hoc
 prioris versus sensu demonstrato primum patet, totum distichon ab hoc
 contextu esse alienum; sermo enim hic versatur in demonstrando, rem
 vere pretiosam, inferiori loco quanquam ponatur, non pretium suum
 amittere, atque eodem modo hominem re vera capaci ingenio praeditum
 nulla fortunae adversitate posse eo exui. Deinde secundo loco appetat,
 in versu altero legendum esse स्वपथेन, quo vel स्वयं vers. prior. nos deducit;
 omitto in libris Bengalice exaratis figurās स्व and सु nunquam posse bene
 distingui; flagitat emendationem similitudo, quae inter utrumque ver-
 sum intercedere debet, more quem sententiarum talium auctores apud
 Indos sequuntur, ut priori versu placitum quoddam in medium profre-
 rant, altero eius illustrandi gratia imaginem addant, quam non compara-
 rationis loco ponunt, sed adiecta particula caussali हि tanquam rationem
 sistunt, qua demonstretur praecedentis placiti veritas. Eodem modo हि
 legitur infr. dist. 70. et supr. I, 81. Restat मोदं, quod corruptelam esse
 demonstrat significatio vocis, *laetitia*, haud minus quam genus; mascu-

linum enim est, neque accusativo ullus hic est locus; sed in promptu P. 55. est emendatio कस्तूरिकामोदः. — आमोद् est suaveolentia. Cf. Wils. s. v. et Mâl. et Mâdh. Act. I. Intelligendus videtur versus de musco, vomica inclusio, unde nisi extricetur, facultas eius occulta remanet.

Lin. 13. तत् सर्वया, S. ubi haec sententia disticho 67. praemittitur; ibidem mox विशेषज्ञेन.

Dist. 68. a. निर्विशेषं Pp. Adverbium ferri potest. — b. सं Pp. et S. de quo idem valet. — c. उच्चमः S. sinistre.

Dist. 70. a. हि युज्यन्ते L. et Pp. — d. नूसुरं शिरसा कृतं S. et P. quod ferri potest; cf. III, 24. — Pp. prorsus aliud hemistichium praebet: प्रभावान् इति बुध्यते || omisso पादे, relicto tamen spatio ad lacunam explendam. Eandem scripturam ante oculos habuisse videtur Jonesius, verum minus recte eam interpretatus est.

Dist. 71. b: प्रतिबुध्यते mendose pro प्रणिधीयते P. — c. शोभते, omissio वि, edd. contra metrum. न चाति न शोभते P. Repetitio negationis ferri non potest; utrum अति extra verbum compositum et separatim poni possit, necne, dubito; memini in Durgamahâtmyo haud semel ita poni hanc praepositionem; sed valde erraverit, qui istud carmen vetustis et classicis Indicae poesis monumentis annumeraverit. विरु i. e. *tintinnare*, quae significatio optime huc quadrat, ut nemo non videt; nulla igitur erat caussa, cur cum Wilkinsio statueret *Rosenius* meus, radicem र्, praemissa praepositione वि, induere sensum *querendi*. Subiungunt edd. hunc slocum, in codd. et interpret. Jonesii omissum; neque W. eum in exemplari suo legisse videtur, quanquam interdum difficile sit discernere, quaenam dist. ille re vera ante oculos habuerit; nimis licenter enim nonnunquam in versibus per Hitopadesum dispersis interpretandis versatus est:

मुकुटे रोपितः काचश्चरणाभरणे मणिः ।
न हि दोषो मणोरस्ति किंतु साधोरविज्ञता ॥

ताथु, quod feneratorem notat auctore Wilsone, hoc atque aliis locis (cf. p. 65, l. 10.) negotiator gemmarius est. In versu priori subintelligendum esse videtur वादः.

Dist. 72. b. अयं शूर इतो भयं । S. quae ita intelligenda sunt, ut duo P. 56. ultima verba significant अयं भेतव्यः; nam इतो idem est atque अस्मात्. — इतेभ-

P. 56. यमना ज्ञनः P. quibus vitium inest in crasi इतोभय pro इत् उभयः voluit fortasse इहोभयमना, quae scriptura tamen posthabenda foret nostrae.— d. भृत्यैः संयुक्ते नृपः । L.— S. नृप. Sed nominativo opus est.

Dist. 73. a. ग्राह्यं च ग्राह्यं च Pp. contra metrum.— c. हि ex coniectura addidimus ad metrum explendum.— d. भवन्त्ययोग्या योग्याश्च L. et P. Obstat metrum, sensus idem est.— Pp. veram scripturam praebet, sed peccat scribendo आयोग्याः ।

Dist. 74. b. प्राक्तानुपकारिणा Pp. mendose.

Dist. 75. a. Pro राज्ञो S. प्राज्ञो mendose.— b. . . . तत्प्रामाण्याङ्कवति न edd.— तत्प्राधान्याङ्क भवति P. त्वप्राधान्याङ्कसति न Pp. quam scripturam secuti sumus, posito tantum तत् pro तु et omisso alpha privativo.— c. भवति न हि codd. qua lectione metrum quidem non turbatur, sed minus convenit haec positio negationi.— d. Pro अवर्णं S. अबलं male.

Dist. 76. Praemittit Pp. अपरं च देव.— Pro नित्यं P. सर्वं.— Conservavimus ज्ञनपदा correpta prima syllaba propter consensum librorum, licet in promptu foret coniicere ज्ञानपदाः; verum edocendi potius hoc loco sumus, ज्ञानपृष्ठः interdum poni pro ipsis regionis cuiusdam incolis.

Dist. 77. a. गृहीतव्यं ex editione L. in nostram irrepit; scribendum गृहीतव्यं propter infinitivi formam गृहीतुं, a qua semper pendet hoc partici-
pium.— c. रवेरविषयं Pp. male. Est septimus casus absolutus.

Lin. 15. अस्यदौय pro अस्यांकं S. et Pp.

— 16. Pro कियन्तं S. et P. इयन्तं; L. एतावत् hoc male; nam addito कालं adverbialiter non poni potest एतावत्. कालं यावत् S. et P.; sed यावत् ab hoc contextu alienum est.— कुतश्चित् om. L. कुतः substituit Pp. interrogatio neque huc quadrat, neque continetur vocabulo कियन्तं.— कुतोऽपि S. quod haud magnopere differt a कुतश्चित्.— Pro पिशुनवचनात् P. खलवचनात्; quod in खलात् corruperunt edit. Serampp.— कुपितः ex P. ceteri om.— Inserit P. ante इदानीं hoc incisum: तत्कालमेव दुःखमनुभवामि ।

Lin. 17. किंचित् तदुच्यतां om. Pp. तद् abest ab edd.

— 18. किमिति codd. et S. quam particulam recipere debebamus.— विस्मय Pp. mendose. Neque pro uno vocabulo haberi possunt verba: किमिति विस्मय.— आगातस्तिथिति L.

— 19. et 20. Secuti sumus edd.; — aliter codd. P. = भद्रसुकं किमस्यांकं सोऽस्ति यस्य रहस्यं कथयते । ग्रृणु कथयामि । बनं etc.; Pp. भद्रं किमुकं किं रहस्यमुकं । कथश्चिद्वि-

श्वासभूमिरस्ति । शृणु कथयामि । et quae seqq. In utraque scriptura sunt quae P. 56. displiceant; neutra nostraē praestat.

Lin. 20. संप्रति वनं etc. edd. Otiosum adverbium abest a codd. — त्याज्यं । अनेन हेतुना विस्मितोऽस्मि । तथा च श्रुतः etc. edd. Omisimus, codd. suadentibus, incommode insertum incisum. — तथाविधः pro तथा P.

— 21. अपि post त्वया om. P. — मयापि महानपूर्वशब्दः । edd. — Cum codd. faciunt interpp. त्वया igitur maiore auctoritate gaudet, quam ob caussam a nobis praelatum est; quanquam aliquid in hoc loco me offendere haud dissimulabo. Non enim pro certo affirmare potest leo, a thoe etiam auditum fuisse sonum illum; interrogationem ponunt interpp. optime; sed ut hanc verbis vindicemus, legendum erit अपि श्रुतस्त्वया श्रूर्वः शब्दो महान् । omissio तथाविधः. Scriptumne fuit: अश्रुतपूर्वस्त्वयापि?

Lin. 21. Pro अस्य P. तस्य, Pp. च तस्य. — महता बलेन, omissio अपि edd. शुभ्रहता Pp. —

— 22. देव अस्ति edd. et P.; praemitti debet cum Pp. verbum substantivum, quia Damanacus leoni suffragatur, dicendo: *est* sane gravis caussa, ob quam timeas. तावत् h. l. est particula concedentis et affirmantis. — महाभयहेतुः L. minus bene. Diserte enim h. l. indicandum erat, adiectivum महत् ad हेतु, non ad भय pertinere.

Lin. 1. init. स शब्दः S. haud male. — Pro आकर्णितः Pp. श्रुतः । — स्वभूमि - P. 57. P. Pro युद्धोयोगं et seqq. edd. पश्चाद् युद्धं चोपदिशति अपरं च अस्मिन् कार्यसंदेहे भूत्यानां etc. Pp. पश्चात् omittit, pro अस्मिन् कार्यसंदेहे substituit देव, pro एव ज्ञातव्यः in fin. ज्ञात एव. P. युद्धोयोगं (unde nostra emendatio युद्धोयोगं), tum in seqq. cum nobis facit, modo अपि voci भूत्यानां subiungit et एव post उपयोग omittit.

Dist. 78. a. भूत्यज्ञीवन्युवर्गाणां P.

Lin. 5. भद्र मे महती ग्रंका वर्तते Pp. — सिंहः सभयमाह । भद्र मां प्रति महती ग्रंका उत्पन्ना P. — Sequens incisum hunc in modum vitiant edd. दमनकः पुनराह स्वागतं । S. दमनको (sic) चिन्तयामास स्वागतं L. De स्वागतं, vocabulo poesis dramaticae supra dictum est; neque non notum nunc esse debet Hitopadesae lectoribus, verba *dicendi* omitti posse post haec vocabula: स्वागतं et प्रकाङ्गं ।

Lin. 6. Secuti sumus L., quocum conspirat S. omisso tantum male कथं । — Pp. अन्यथा किं त्वां राज्ञसुखं (sic) परित्यज्यात्रागत्य मां संभाषते, cuius scripturae vitia per se patent. P. = अन्यथा सर्वकार्यं परित्यज्य अस्मान् संभाषते; desideratur sane particula interrogativa.

— 7. किंतु om. Pp. male. — आश्रवस्त्रां P. mendose.

P. 57. — 8. आपत्काले प्रतीकारे Pp. आपत्यतीकारे, omissio काल P. आपत्यतीकाराय L. आपत्यतीकाराले S. ex quibus scripturis nostra concinnata est.

— 9. महा om. P. Pro महाप्रसादेन S. et Pp. सर्वस्वेनापि; favore leonis haud dubie contenti fuerunt theos. Pro पूर्वितौ P. पुरस्कृतौ; sed hoc verbum in tali contextu quod sciam nunquam ponitur. — परिज्ञाय प्रचलितौ Pp.

— 10. स प्राक्यप्रतीकारोऽयं P. स sinistre est additum. — अयं praebet etiam Pp. in edd. male omissum. भयहेतोः L. insulse.

— 11. न ज्ञात्वा edd. minus bene. — भयोपशम्ये, omissio प्रतिज्ञाय, Pp. male. — भयोपशम्यार्थं प्रतिज्ञाय P. — कथमयं महाप्रसादो edd. कथमयं प्रसादो P. — यतो om. Pp.

— 12. उपायं Pp. — च om. edd. ; ad राजः trahit Pp.

Dist. 79. et 80. desumta sunt ex Manu; cf. VII, 8. et 11. In ed. L. et P. 79. a. pro श्रीः leg. अस्ति; in Pp. et S. आस्ते. — d. pro हि सः ed. L. नृपः । — 80. c. Pro श्वेषा P. पूज्या.

Lin. 17. Pro आस्यतां P. आस्य Pp. आगच्छ; utrumvis absurde; hoc, quia तूष्णीौ adverbium est, illud, quia radix आस् eiusmodi formam producere nequit; voluit: आस्व, 2. pers. sing. imper. med.

— 18. नदनं P. — चैतत् P. हि तत् Pp. तत् edd. unde fecimus खेतत्. — अपि om. P. male. —

— 19. Pro तदा Pp. तावत् quod adverbium ab hac iunctura alienum est. Pro किं priori S. किं पुनः, male; irrepsit पुनः e mox antecedentibus. किं hoc om. Pp., alterum solum exhibens. Pro किं altero edd. किमिति haud male. At geminatio interrogativarum particularum a lingua Indica haud aliena est. Cf. aliud exemplum supr. lin. 10 — 11.

— 20. Ex codd. — स्यत् a P. omissum retinuimus cum Pp. et edd. — Utraque editio repetitionem intolerabilem praebet: यदि स्वामित्रास्ततत्रैव मुच्यते तदा कथमयं महाप्रसाद् etc.

— 21. शृणु ex codd. adiectum.

P. 58. *Lin.* 1. उत्तरापये post अस्ति addunt edd. Suspectum est hoc vocabulum, quod ad analogiam vocis दक्षिणापय formatum est; omittunt h. l. etiam interpp. Conservavimus infra p. 111. l. 14. auctoritate codd. moti.

— 2. दुर्दान्तो नाम महाविक्रमः ed. S. sola. — Pro कुहरं edd. कल्दरं minus exquisite. — अधि om. L. male. Pro प्रत्यहं codd. सर्वदा; adverbium temporis omnino omisit L.

— 3. कश्चित् om. L. et Pp. — Transponit S. कश्चिन्मूषिकः. प्रत्यहं.

— 4. Pro स सिंहः edd. ततः — Pro लूँ P. क्लिं नूँ; नूँ ortum est a

male lecto लूतं, cui glossema किन्तं additum fuerat. — Pro दृष्टा P. ज्ञात्वा. — P. 58. तं abest ab edd. किमत्र विधेयं om. edd. — P. addit hisce verbis: भवतु । एवं शृणते, quae verba excipiuntur a dist. 82.

Dist. 82. a. यस्य pro यस्तु L. — आहन्तुं edd.

Lin. 7. तेन सिंहेन om. L. सिंहेन tantum S. Pro ग्रामं L. नगरं. — दधिकर्णानामानं विडालं मांसाहारादिता संतोष्य विलसमीपे स्थापितवान् । L. Post ग्रामं गत्वा pergit S. विश्वासं कृत्वा दधिकर्णानामा विडालो यत्नेनानीय मांसाहारं दत्वा स्वकन्दरे स्थापितः । — P. = दधिकर्णानामविडालस्य कन्दरे मांसाहारं दत्वा प्रयत्नादानीय धृतः । Pp. = दधिकर्णानामा विडालः स्वकन्दरे मांसाहारं दत्वा यत्नादानीय धृतः ॥ Scriptura nostra ad codd. proxime accedit.

— 8 - 10. Pro ततः edd. अनन्तरं — मूर्खिकोऽपि edd. absurde, quum nullum aliud animal praeter murem proserpere dicatur. — Pro न बहिः S. विलान्तः. — मूर्खिकस्य प्रबद्धं Pp. — यदा et तदा semel tantum posuerunt codd. minus bene; यदा यदा quotiescumque. — विशेषं मांसाहारेण ते etc. codd. Quod ad sensum vocabuli विशेषः attinet, optime hic quadrat, sed haud scio an adverbium esse possit, nisi addatur affixum तसि vel praefigatur स.

— 11. बहिः संचरन् edd. — विडालेन codd. qui mox tertium verbum subiungunt: जादितश्च । — स सिंहोऽपि om. h. l. codd.

— 12. कदापि, omisso चित्, Pp. Suspecta mihi est iunctura कदाचिदपि, quia utralibet particula, चित् et अपि, interrogationem iam sola tollit. In versu Bhartriharis (p. 59. fin.) अपि non cum कदाचित् iungendum est, sed cum यदि ita ut efficiatur particula conditionaliter concedentis यदपि. Versus hic est: यदि नाम दैवगत्या ज्ञानदर्शेण कदाचिदपि ज्ञातं । अवकरनिकरं विकिर्ति तत् किं कृत्वाकुरिव हंसः । परिचरितव्याः संतो यद्यपि कथयन्ति न सदुपदेशं । यास्त्वेषां स्वैरं कथास्ता एव भवन्ति शास्त्राणि ॥ Prorsus aliam protasin praebent edd. अनन्तरं स सिंहोऽनेककालं यावन्मूर्खिकं न पश्यति तत्कृतरावभवति न शृणोति तदा et quae seqq. — Pro उपयोगाभावात् edd. तस्यानुपयोगात्; तस्य inopportuno loco positum; referendum enim foret demonstrativum ad sequens विडालस्य; unde recte Pp. उपयोगाभावात् तस्य; idem voluit P. ubi scriptum est: उपयोगाभावात् तस्य.

Lin. 13. init. विडालस्यापि S. — Proximum comma ततो . . . अभवत् ex codd. inseruimus; चिरात् ante दुर्बलः exhibit P.; om Pp. cui paruimus.

— 15. Pro तत्र codd. ततः, minus bene. — तस्मूले Pp.

— 16. *init.* Edd. संज्ञावक्तसमीयं गत्वाब्रवीत् pro तं वृं एतc. quae repetitio est intolerabilis. — एषोऽहं S. absurde. — एष त्वा, omisso in seqq. त्वा, L. — आज्ञापयति codd.

— 17. न चेत् edd. male. — अस्मात् pro इतो edd.

P. 58. — 18. ते विरुद्धं फलं भविष्यति edd. glossam sapit. — Post haec verba ed. Ser. sola hunc in modum pergit: न जाने कुङ्कुः स्वामी किं विथास्यति । तच्छ्रुत्वा संज्ञोवकश्चायात् । आज्ञाभङ्गे etc. [cf. supr. dist. 52.] ततो देश, etc.

— 19. साटाङ्गपातं करूकं edd.

Dist. 83. b. तदभावे Pp. minus bene.

Lin. 22. सप्तकं Pp. et L. non dubitabat bos, sed timebat. मया किं P. तदभिर्योगां om. codd.

P. 59. *Lin.* 1. Pro अत्र codd. अस्मिन्, अरण्ये pro कानने, et mox आज्ञा वियते pro इहा वर्तते. Pro enuntiatione conditionali S. praebet: वृषभ अत्र कानने तिटसि । अस्मद्दूदेवपद् etc. — अमिदूदेवपद् codd. — गता प्रणाम codd.

— 2. तदभयवाचं मे यह गवामि edd. minus bene. L. perperam अभयं वाचं. — प्रयह मे codd. — तदा गवामि ex Pp. om. P. In edd. sermo Carataci incipit ab hisce verbis: शृणु रे बलौवङ्ग।

Praemittunt edd. disticho 84. aliud, ab interpp. et codd. omissum:

प्रतिवाचमदत्त केशवः शपमानाय न चेदिभूमृते ।

अनुकुरुते घनधनिर्न हि गोमायुरुतानि केशरी ॥

In hem. c. deest syllaba longa post अनु; metrum restituitur legendo अनुकुरुते, sed dubito, an omnino hae duae praepositiones tali ordine positae radici praefigantur. Sed a coniecturis omnino abstinere possum, postquam contigit mihi, genuinam auctoris manum reperire. Distichon legitur in carmine *Māghae*, cui inscribitur *Sisupāla-Badha* lib. XVI, 25. Versus posterior hunc in modum est legendus: अनुहुकुरुते घनधनिं न हि etc. In versu priore lege cum ed. princ. भूमृते. अनुहुकुरुते explicat scholiastes per प्रतिगर्जति. Ex scholiis ad versum priorem hoc appono, eorum maximie gratia, qui putent abiiciendum omnino esse indigenarum grammaticorum studium atque perfectam linguae Indicae cognitionem ex ipsorum ingeniis hauriri posse pro sapientia sua gloriantur. Eos igitur summopere rogo, ut hoc scholion aut falsum esse ostendant, aut, scholio legitimate explicato, demonstrent, quomodo tandem se habeat res ista, ad quam alludunt haec verba: शपमानाय क्रोप्तते । स्वरित्वादात्मनेपदं ॥

Dist. 84. b. *fin.* सर्वतः L. — c. तर्ण्; ita grammatica et orthographia pro more neglectis.

Lin. 6. किण्डुद्दरे S.

— 7. अवलोकितौ Pp. quod spernere haud debebamus. चौपविष्टौ P. haud

displacet च. Copula posita duae efficiuntur sententiae, ad quarum priorem tantum pertinet राजा; in nostra scriptura unica est positio, in qua राजा ad उपविश्टौ trahi nequit, quanquam melius me iudice flueret oratio, si posita esset forma caussativa उपवेश्टिं sc. राजा. Sed hoc argutius fortasse disputatum est. — Pro दृष्टः जन्मुः edd. त्वया स दृष्टः i. e. a te conspectus est ille, quod scire non potuit leo; ponenda igitur erat interrogatio, ut sit in codd. ordine verborum inverso; दृष्टः स जन्मुः; quod idem est atque आपि दृष्टः स जन्मुः; alias enim participio, verbi finiti partes agenti, locus est in fine sententiae. — Pro दमनको ब्रूते codd. तावाह्नुः.

Lin. 8. किंतु om. codd. et S. — Pp. देव post sequens किंतु reiicit; P. utroque loco exhibit. — Ed. S. post किंतु pergit: यदूदेवेन ज्ञातं तत् तथा महान्नेवासौ देवं द्रष्टुमिहति; किंतु महाबला (sic) ऽसौ; ततः सज्जी इत्य. Male, ut vides, confusa sunt verba. — यथा देवेन ज्ञातः; codd. यथा देवेनाज्ञातं L. Praestat scriptura codd. masculinum ponens, licet haud prorsus inauditum foret neutrum tali iunctura poni; praestare etiam videri posset h. l. ज्ञातः pro आज्ञातः, quanquam haud inficias ibo, discrimin utriusque verbi me haud satis esse assecutum. Quum autem praestare dicam masculinum ज्ञातः, respicio scripturam ed. Lond. in seqq. तथाव्यसौ देवपदं इत्य. A तथाव्यसौ nova sententia oritur, et verba यथा - ज्ञातः ad antecedens incisum महाबलोऽसौ trahenda sunt: «verum magni roboris est ille, prout a te agnitus est; nihil tamen minus (haec enim vis est particulae तथापि) tuam maiestatem adorare cupit.” Hanc interpretationem secutus est Jonesius; et patet, optime pro partibus, quas agunt, ad thoes eiusmodi loquelandum quadrare. Restituendum igitur censeo तथापि, siquidem persuasum habeo, तथैव eodem sensu omnino non posse poni. Aliam viam ingressus est W. आज्ञातः vel potius आज्ञातं vertens: sicuti iussum a te fuerat. Sed hoc sensu legendum foret आज्ञाप्य एवं interpungendum ante यथा; tum autem minus apte dictum foret किंतु. Sensus, quem ipse mox praferendum esse iudicavi, ex scriptura ed. Ser. levi emendatione facta et iusta interpunctione prodit: किंतु यदूदेवेन ज्ञातं तत् तथा। महान् एवासौ। (तथापि) देवं द्रष्टुमिहति महाबलोऽसौ। Ceterum cum antecc. etiam melius consensit interpretatio nostra; nil iusserat leo, iudicio Damacini omnem rem relinquens, dixerat (56, 21.) autem magni roboris esse istud animal ex coniectura sua.

Lin. 9. Pro देवपदं codd. देवं. — सः ex codd. — उपविष्यतां, omisso दृश्यतां, ed. L. — किंतु देव, omissa l. 10, P. — किंतु om. S. inserto एव post प्रावृद्धमात्रात्.

P. 59. Pro किंतु L. तत्र, praemissis praeterea huic commati versibus hisce, a loco prorsus alienis, nihilo tamen minus ab utroque interpr. redditis:

यतः । अम्भसा भिद्यते सेतुस्तथा मत्वोऽप्यरक्षितः ।
पैशुन्याद्विद्यते लेहो वाग्भर्मेद्यो हि कातरः ॥

Dist. 85. b. कुट्टिनीं गौरवं गताः P. कुट्टिनीगौरवं गताः P. Ex consensu utriusque codicis appareat, hoc non merum vitium esse, sed potius aliam scripturam, duriorem tamen quam ut admitti possit. Ad गताः subintelligi potest लोकाः. Hactenus bene; sed tum गौरवं explicandum foret non de auctoritate, qua quis fruitur, sed de ea, quae aliis tribuitur; quam significationem huius vocis quanquam minus usitatam haud prorsus inauditam esse reor. Compositum कुट्टिनीगौरवं praestat in hac iunctura gemino accusativo, qui tamen defendi fortasse poterit.

Lin. 13. Pro अभिधानं edd. आव्यं.

— 14. नरकं pro नगरं mendose Pp. — तच्चित्तरप्रदेशे S. — तत्र गैलशिखरे L.

— 15. सदा शूद्यते P. — चौरः स च व्याघ्रेण Pp. male; nam participia praesentis partes verbi finiti rarissime agunt et ne id quidem, nisi addatur verbum substantivum, ita ut conjugatio quaedam periphrastica efficiatur, attamen vel ea ad vulgarem sermonem restringenda esse videtur. Sanscritum exemplum prorsus nullum nunc memoriae obversatur, Pracritici memini initio Actus secundi Mālatī-Mādh. तुम् किंपि मन्त्रन्ती आसि । i. e. त्वं किमपि मन्त्रयन्ती आसी ।

— 16. खादितश्च abest a S. — तत्पाणिपतिता edd. — ते om. S.

— 17. अनुकृणं om. codd. Substituit Pp. वृक्षमारुद्ध. — ततो नगरजनैः edd. — त्वं om. codd. — मनुष्यः edd. — प्रतिदिनं L.

— 18. घण्टाकारं L. — घण्टारूपः S. utrumque male. — मनुष्यान् edd. मनुष्यं P. खादति घण्टां च वादयति इति etc. edd.

— 19. Pro नगरात् L. नगरं त्यक्ता; Pp. तन्नगरात्. — बहुषो विमृश्य om. edd.

— 20. स्वयं om. L. et P. — Otiosis additamentis oneratum est hoc comma in ed. Ser.: ततः करालया नाम कुट्टिन्या विमृश्य अनवसरोऽधे घण्टाकारादः तत् किं मर्कटा घण्टां वादयन्ति इति स्वयं विज्ञाय राजा etc. — मर्कटो pro वानरो (l. 19.) etiam L. धनव्ययः L. कियद्वयोपचयः S.

— 21. एन् om. codd., अहं et घण्टाकर्णं inter se transpositis. — तत्यै धर्मं दत्तं, omissa प्रस्थापिता, S. तत्सत्त्वै प्रचुरधर्मं दत्तं L. ubi mox pergitur: तत्सत्त्वं प्रविश्य etc. p. 60, l. 1. omissis quae intermedia sunt.

— 22. च post, चक्रादिभिः reicit Pp. सप्तन् S. viciose sicuti mox: चक्रार्थगौत्वं. P. 59.
मण्डलपूजा est celebratio rituum magicorum, in quibus circulus primarium
locum tenuisse videtur. Maxime huc facit locus ex fabulis *Sivadasi* in-
editis, quibus index est Vētālapanchavinsatī: cf. fab. 1. versus finem:
भद्रारकेणोऽं । कृष्णाचर्तुर्दशां रक्तपुर्वमण्डलं पूजयित्वा योगिन्यः पुण्यमेकं विदर्श्य भागं कृत्वा याकड़चयन्ति
तावस्या दृष्टाः ॥ — Vocabulum गणाचक्र me nondum satis exploratum habere,
ingenue confiteor.

Lin. 1. आदाय S. — आकोर्णानि S. praepositio आऽ huc non facit; recepi- P. 60.
mus अव ex scriptura codd. अवकीर्य दत्तानि । Aliter L.: . . . प्रविष्य तरुतले फलानि
तण्डुलानि च भूमौ निक्षिप्तानि । — घण्टां om. P.

— 2. — वानरैः घण्टां परित्यज्य L. सर्वे om. P. — कुट्टिनी च codd. et S. —
Pro आदाय edd. गृहीत्वा; transponit praeterea L. घण्टां गृहीत्वा कुट्टिनी. Pro समागता
S. नगरमागता, L. गृहं समागता. — ततः सा ex Pp. Om. ceteri.

— 3. सर्वजनपूज्या S. तदूदप्रपूज्या L. — Pro अभवत् L. आसीत्.

— 4. ताम्यां om. edd. — आनोय S. — राज्ञो om. S. — कारितं et in antecc.
संज्ञीवकं P. Scriptura quamvis docta falsa tamen. Quum enim dicatur
कार्यामि संज्ञीवकं राजदर्शनं, obiectum primarium est संज्ञीवक, quod hanc ob caus-
sam nominativo poni debet casu, verbo activo in passivum mutato. Ed.
L. = ततः संज्ञीवकमानीय दर्शनं कारितवन्तौ ।

— 5. क्षोऽपि om. Pp. in ceteris conspirant codd. quos secuti sumus.
L. = पश्चात् तत्रैव वने चिरमतिप्रियेण वसति । S. = पश्चात् तत्रैवाश्रिततया अन्योन्यं परमप्रीत्या चिरं
वसति । — Transponit P. अय तत्य आता कदाचित्. Nomini Stabdha carni addunt
codd. सिंहः otiose.

— 6. Pro तस्य codd. तद्. Compositum ferri potest. — तसुपविष्य edd.
उपविष्य codd. Factitivum ex emendatione est.

— 7. आहाराय edd. — पञ्चं S. — चलितः codd. et S. — अत्रान्तरे edd.

— 8. कुं मासं codd. — ततः abest ab edd. — Lin. 9. देव ज्ञायतां codd. —
Pro विहस्य S. विमृश्य.

— 10. व्यसितं pro व्ययितं Pp.

— 11. श्रीमत् om. codd. — अगोचर paucis erit explicandum. गोचर ab
origine pastorum est vocabulum, viam qua ad pascua aguntur boves
vel pascua ipsa, locos, bobus depascendis permissos, significans, posthac
in scholas receptum et ad nobiliores usus reservatum. Designat provin-
ciam, uniuscuiusque sensus perceptioni propriam eique obiectam, in
qua sensus quisque quasi in dominio suo versatur et regnat, quam

P. 60. quasi depascitur. Sic res visibiles provinciam constituunt visus; hoc sensu dictum est: षं च चेन्द्रियगोचरः। Bhag. Git. XIII, 5. Tum गोचर् proprietas est rerum diversarum, qua distinguuntur et percipiuntur a sensibus, veluti *color*, et *figurā* rerum visibilium, *sonus* rerum auditui obiectarum. Denique res omnis sensuum perceptioni proposita. Ad primam significationem pertinet sensus, quo posita est vox Mâl. Mâdh. p. 17. मनागवतीर्णोऽसि रतिरमणवाणगोचरं, paullulum delapsus es in spatium quod percellunt sagittae Amoris, quasi in provinciam sagittis eius obnoxiam. Eodem sensu dicit Bhartrihares p. 57. लोचनगोचर्, adiective, i. e. quod intra oculorum ditionem versatur, id quod cernitur. In वनगोचर Râm. II, 50, 30. aut respici potest originaria vocabuli vis: qui sylvam perambulat, aut quod magis est probabile, tralato sensu est accipendum: anachoreta (ताप्त) cui sylva provincia quasi est propria, cui in sylvis degenda est vita. Nostro loco अगोचर् est aut in *absentia* domini aut *sine cognitione* domini; hoc veri similius est propter casum tertium. Cf. praet. infr. p. 63, l. 20.

Pro अय किं Pp. किं. — अय किं particula est composita; valet *immo*, et per वाढ explicatur in scholiis ad Mâlatî - Mâdh. p. 29. Edd. pro hac particula, cuius vim haud perspexisse videntur, substituunt: मदीयागोचरे पौब क्रियते.

Dist. 86. d. ज्ञातीपते edd. minus bene. — नान्यत्र L. mendose. Obiter moneo अन्यत्र male omissum esse a Boppio gram. 339. inter praepositiones, ablativum regentes, quibus optimo iure annumerari potest. Cf. Bhag. III, 9. Kath. Up. p. 5. Râm. II, 12, 23. 4, 14. 66, 5. et alibi.

— 87. c. नृपते किं ज्ञापे मूर्खो S. नृपते किंक्षणो मूर्खो L. किं in compositis saepissime vim habet derogandi; cf. supr. ad dist. 66. किं quum dico, intelligo omnes pronominis interrogativi formas, quae a themate क्व vel क्षि originem trahunt. क्व superstes est in adverbio interrog. क्व. Omissa semivocali ab eadem stirpe antiquitus formabatur neutrum क्त् vel क्तु; unde, uti recte vidit Vir. clar. Boppius, componebatur particula कच्चित्; contemptum significat eadem forma in quibusdam vocabulis compositis, observante Schlegelio supr. l. l. Inde est etiam कति, et कथं pro कथा, quod in Vedis legitur. Vid. Pan. V, 3, 26. A क्षि, omissa itidem semivocali, neutrum किं formatum est contra analogiam, quae कित् requirebat. Formam genuinam praebet Latinum *quid*. A किं pro क्षि derivatum est क्रियत्, mutante similitudine antec. vocalis affixum वत् in यत्. Vid. Pân. V, 2, 40. Reiecta contra vocali et mutata semivocali in vocalem sibi affi-

nem nascuntur adverbia कुत्स्, कुत्र et quae saepissime derogandi sensu P. 60. praefiguntur, particula कु. Pro कु veteres interdum dicebant कव ए का. Pan. VI, 3, 108. कवयः । कापयः et कुपयः । का explicandum est e कत्, compensante vocalis productione omissam consonantem त्, veluti in यावत् et तावत्. कव e कु auctum est. Sin quaeritur, quomodo factum sit, ut pronomen interrogativum contemtum indicet, facile est observatu, hoc ex ellipsi ortum esse. किंनर् valet: quid? istudne animal homo est? Eodem modo alia eiusmodi vocabula explicanda sunt. Interdum dubius haerere possis, utrum कि re vera cum seq. vocabulo compositum sit, necne. Ex gr. in exemplo, quod affert Panines II, 1, 40. (कि क्षेपे) किंराजा यो न रचति । Si scribis कि राजा et supples न, legitimam habes enunciationem interrogativam et कि non compositum est. Sed assentiendum est veteri grammatico propter accentum vocis किंराजा, quem ille audivit, nos ignoramus. Pervenio nunc ad verba किंजणा et किंवराक, quae in nostro disticho leguntur. In his कि comtemtum quidem significat, sed aliter quam in किंराजा, किंनर्, कुपय, aliis. किंजणा enim non valere potest *momentum temporis malum*, sed est homo, qui *nihili facit momentum temporis*. Repetenda est haec vis ab ellipsi: कि मेऽस्ति ज्ञाणेन । इति यः सदा ब्रवीति स किंजणा: । —

— 88. a. Pro श्रेयो Pp. श्रेये, quod merum est vitium. Pro hoc hemistichio prorsus aliud praebent edd. qui versum priorem hunc in modum scribunt: स व्यामात्यः सदा श्रेयान् काकिनों यः प्रवर्धयेत् । Eandem scripturam ante oculos habuit uterque interpres; sed nemo non videt ex hemistichio b. sensum loco idoneum erui omnino non posse. — c. कोषः S. minus bene. को यं कोषो यतः प्राणाः Pp. idem voluit P. initio exhibens: कोषं, sensu cassum. Scriptura Pp. ita explicanda foret, ut कोऽयं कोषः pro quaestione accipiatur, ad quam responsum sit: यतः प्राणाः । Sed hanc oratio minus bene procedere videtur.

Dist. 89. a. Edd. et codd. कि चान्दैन कुलाचारैः । Hanc scripturam Anglice reddere conati sunt interpp. in quo negotio misere se torserunt, neque enim sana esse possunt ista verba. Primo aspectu appetet ex versu seq. धनहौनः a priori versu non abesse posse vocabulum *divitem* notans; appetet etiam hoc vocabulum धन्य fuisse, quod quum propter similitudinem sequentis अन्यैः omissum fuisse, ad versum ipsum tracta sunt verba disticho praemittenda कि च. Sed emendatio nostra, nisi fallor, ultra metam

P. 60. progressa est; retinendum esse arbitror न कुलाचारैः; homo dives veneracionem nanciscitur non moribus honestis, sed aliis remediis.

Lin. 22. एतच्च राज्ये प्रधानं भूषणं Pp.

P. 61. *Dist. 90.* a. अन्वेत्ता च S. — c. pro कोषाणां edd. सोक्षणं; Pp. धोषणं.

— 91. a. Pro कुर्तुं edd. लिंगं, quod ferri potest, si adverbii loco accipiatur et ad verbum अमणायते referatur. — c. pro अमणायते S. परिक्षीयते; L. परिक्षीयत् contra metrum et grammaticam.

Lin. 6. init. तदाकर्ष्य L.; verba ततः — श्लाघयित्वा om. S. — चिराच्छितामावेत्तो Pp.

— 7. कार्यं om. Pp. — कार्तिपौ च edd. et codd. Abundat copula. — कार्याद्यिकारौ omisso, pergunt edd. कदाचिदर्थाद्यिकारे न नियोक्तव्यौ ।

— 8. नियोगि Pp. — यन्मया श्रुतं तम्मया कथ्यते edd.

Dist. 93. c. init. सर्वस्तं S.

— 95. a. अधिकार्य्य L. pessime. — d. आविलुम्पति edd. Praepositioni आत् verbo praefixa et ipsi verbo nulla alia unquam interponitur praepositio.

— 96. a. सपाठक्रीडितो Pp. आपांशुक्रीडितो P.

— 97. a. Pro सदा edd. ज्ञाना. — Fabula, ad quam alluditur in versu posteriori, ignota mihi est. प्रकटारः est avis rapax. Cf. Haught. Gloss. Bengal. s. v. Desideratur vocabulum ap. Wils. Repetunt hoc distichon codd. interpp. et S. post dist. 140. Ibi codd. praebent तमायुक्तः ।

Dist. 98. a. सदामात्यो न साध्यः स्यात् edd. — Codd. uti nos, modo vitiose exhibent सदायात्यां, quod vocabulum ab hoc loco prorsus est alienum. — c. Pro आदेशः P. उद्देशः. — Repetunt edd. codd. et interpr. hoc distichon infra post dist. 123., eadem lectionis varietate.

P. 62. — 99. a. प्राप्तुर्यग्रहणं edd. quod vix sensum loco accommodatum praebet.

— b. परिक्वर्ता वरोधं L. sensu cassum. — d. भूषणं Pp. mendose.

— 100. a. नियोग्यनुग्रहोपायो Pp. नियोग्यार्थग्रहोपायो edd. — b. परिक्षणं edd. quae vox ab hoc loco abhorret. — d. धर्मविर्पयः P.

— 101. a. नियोडिताः edd. quae scriptura sensum prorsus contrarium praebet. — c. महीपते S. — c. दुष्टवृण Pp.

— 102. a. Pro बोधो L. बाध्या, quod sensum praebet quidem, sed a contextu alienum; melius S. बोध्या; sed appareat ex seq. hemistichio neutrum editorem sensum huius loci assecutum esse; editum enim est a S. बसुधाया महीपते, a L. बसुधाया महीपते: — c. सकृत् किं पीडितं edd. असकृत् haud semel, postulatur ab antec. मुहुः । — असकृन्नियोडितं codd. sensus idem, sed syllaba longius fit hemistichium. — d. pro बहूदकं S. हुतं पयः

- Lin.* 9. Transponit S. यथावसरं ज्ञात्वा male. — एवं et किंतु om. Pp. P. 62.
 — 10. Pro किंतु P. यद् haud male, si यद् pro coniunctione accipitur.
 — वचनकारिणौ S.
 — 10. एतच सर्वथानुचितं codd. — एतत् सर्वमनुचितं सर्वथा S. सर्वथा male additum ex praeced. 103 et 104. transponit Pp.

Dist. 103. a. क्षेमेत् Pp. vitiouse. न क्षेमेत् स्वसुतान् अपि edd. Haud scio an activum nunquam usurpetur. — c. et d. Secuti sumus P., emendato tantum in fine versus वा pro हि; confirmat scripturam nostram Pp. ubi tamen peccatur in hem. d. चिन्नगतस्य हि ॥ चिन्नगत est pictus; cf. infr. p. 64, l. 1. चिन्नगत nulla alia ratione defendi posset, quam si quis comprobaret चिन्नगत idem esse atque संकल्पित; de qua re tamen vehementer dubito. Ed. S. विशेषः कोऽनुरागस्य राजाचिन्नगतस्य च । L. विशेषः कोषदोषेण राजाचिन्नगतस्य वा ॥ quarum lectionum neutra ad hunc locum quadrat; L. sane sensu est destituta.

Dist. 104. Om. P. alio substituto, quod apud nos legitur supr. II, 52.; similitudo initio utriusque distichi (dico II, 52 et II, 103.) in caussa fuit, cur etiam in Pp. exaratum fuerit dist. II, 52. post 105. नष्टक्रियस्य ex Pp. — नष्टेन्द्रियस्य edd. minus bene. — d. प्रमत्तनिकरस्य prim. man. Pp. sed emendavit iam secunda manus.

Lin. 19. तद् abest ab edd. — सर्वदा P. — मद् pro अस्तद् L. Pro अय S. अपि; L. अत्याद.

— 20. अतः et paullo post च om. edd. — भोजनाधिकारे L. — एतद्वचनात् तथा etc. edd.

— 21. भूत्य addidimus ex codd. — परित्यागेन edd. Offendunt gemini casus tertii in eadem sententia a diverso regimine pendentes.

— 22. कर्त्तव्ये, omissa अति, P. — अतो pro ततो P. दाने edd. —

Lin. 1. तदाह् S. दमनक आह्, omissa तत्, L. — Pro कर्तव्यं L. विद्येयं; — मित्र P. 63. किं कर्तव्यं S.

— 2. कृतोऽपि edd. च om. Pp. — परिदेवनविनोदोऽप्यसुलभः codd. quae verba bene se habent, sed huc non convenire videntur.

Dist. 106. b. आत्मानश्च S. male. — c. स्वमणिं pro च मणिं S. Notum est, vcl esse sane debet, adiectiva a verbis desiderativis derivata et in सु desinencia casum accusativum interdum regere more atque vi participiorum. Exempla in legibb. Manūs passim inveniuntur. Cf. I, v. 8. etc. De सायु cf. ad pag. 55, l. 22.

P. 63. *Lin. 6.* वीरविक्रमो नाम राजा L.; नाम om. S.

— 7. साधुद्वितीयकेन S. Inusitatus sane est affixum क numeralibus ad-dere; de ipso hoc more loquendi cf. nott. ad Bhag. Gīt. XV, 7. Bopp: ad Ep. Bhar. p. 101. Pentap. p. 80. Pro व्याः S. हस्तव्यः.

— 8: ततो राजपुरुषः Pp. — Pro किमिति ed. L. किं.

— 9. ते आहुः Pp. et L. perperam. Sed in pedestri oratione inter-dum negliguntur euphoniae regulae tales.

— 10. द्वौपे S. minus bene. — सिंहलनामो द्वौपस्व Pp. — नाम in fin. om. edd.

— 11. *init.* अथ om. edd. — समुद्रस्य मध्ये Pp.

— 12. तते रत्नावलीकिरणकर्णुरप्यङ्के edd.

— 13. कन्या काचित् edd. — Pro अतो edd. ततो.

— 14. तत्रागतः edd. male. — Post virgulam तत्र गत्वा Pp. et edd. - गत्वा, omisso तत्र P. — पर्यंकेऽर्घमना edd. — Mox iidem तथैव सा, omisso मया. Post अवलोकिता deinde perguntः ततः सा सखीसमेता समुद्रमध्ये मग्नादृप्रयाभवत्। ततस्तत्त्वावप्य etc. — मयापि S. — मया प्राप्नुद्युध्या L. — तत्पश्चात् om. L. तत्पश्चात् तदुपरि Pp. Alterutrum glos-sema est. — प्रदत्तः S. male. — तदनन्तरं कल्पतरोः प्राबामाकृष्ण तस्याः कनकपत्रं L. Ceteri additamentum haud agnoscent; तदनन्तरं praebet etiam S.

— 16. कनकपत्रं गतोऽहं। तत् पत्रं प्राप्य etc. Pp. — सा om. S. — ad मया (l. 17) trahit Pp. — पर्यङ्के स्थिता S. पर्यङ्कस्या L. — विद्याधरिभिः L. mendose. — आलोकिता edd. haud male.

— 17. तया चाहं L. — *Lin. 18.* ततस्तत्स्वया च मया पृष्ठया edd.

— 19. प्रतिज्ञाविवाह्या ex coniectura est prorsus necessaria; libri enim omnes contra tenorem narrationis peccant; S. tamen ad scripturam nostram proxime accedit: प्रतिज्ञाविवाहिता सा विद्यते; sed विवाहिता h. l. falsum est, quia nondum nupta est; विद्यते melius abest — L. नाम। अनया प्रतिज्ञा विवाहितः यः कनकपत्रं etc. ex quibus verbis qui constructionem probabilem extor-
quere poterit, is magnus mihi erit Apollo. P. iusto brevius rem expe-
dit: ...नाम स्वयमनुभूयतां। इति तयोऽन्। अथ वृत्ते etc. (l. 21.). Vel maiorem lacunam praebet Pp. नाम। अथ वृत्ते etc. J. cum codd. facere videtur, W. cum edd. In tali librorum dissensu iudicio nostro uti non haesitabamus.

Lin. 20. गोचरेण L. cf. supr. ad p. 60, l. 11. मनसः संकल्पः om. L. et per-git: तदिमां गन्धर्वविवाहेन परिनीतवान्। sed praestat omnino scriptura ed. Ser.

— 21. अथ तत्र वृत्ते S. — विवाहे वृत्ते L. — गान्धर्वे P.

— 22. एव om. edd. — सहाहं, omisso in seqq. तत्राहं eiusque loco po-sito चिरं, L. — रमयाणोऽविष्टते (sic) Pp. — तत्रैकदा codd.

Lin. 1. सर्वदा खेल्या सर्वमिदसुफगोक्तव्यं L. — S. ut codd. et nos, in उपमो- P. 64. क्वयं tantum cum L. congruens. — किंतु abest a codd. et S. male.

— 2. न कदाचित् S. न कदाचिद्पि L. — स्पृष्टव्या libri omnes una voce defendunt, quanquam propter infinitivum स्पृष्टं dicendum foret खेल्या. Silent grammatici. — Pro पश्चात् L. ततः. — तद्वचनात् om. codd. et S. Transtulimus ex sola ed. L. verba narrationem egregie illustrantia.

— 3. खर्णरेखा स्तनमपउले स्पृष्टा L. खर्णरेखा खेलेन स्पृष्टा S. खर्णरेखायाः स्तने स्पृष्टा P. खर्णरेखास्तंस्पृष्टं (sic) Pp. Confiteor me nondum animo concipere potuisse, quid tandem in caussa fuerit, cur locum tam planum et intellectu facillimum talem in modum corruperint editores aequa atque codicum opifices. — च abest a codd. Pp. praeterea pro तथा mendose तथा. — तथा कृत्वा om. S. et P. — चरणार्पकज्ञाहतः L. — Pro आहतः S. ताउतिः, Pp. हतः.

Lin. 4. init. यथागत्य स्वराष्ट्रे पतितः L. et P. आगाय स्वराष्ट्रे पतितः S. यथाहं गत्यात्मराष्ट्रे निपतितः Pp. Sed formula haec यथागत्य, pro qua saepissime dicitur यथागतं adverbialiter, interdum etiam यथागतं adiective, huc omnino non facit, quia modo prorsus diverso ab illo quo advenerat rediit Candarpacetus. — Pro तदाभ्य Pp. तद्याभ्य; अय in epte insertum est. Edd. अय, nil amplius. — अहं om. P. — परिव्रजितः et परिप्राप्यन् S.

Lin. 5. Incisum, quod ab adverbio अत्र incipit, sine ulla varietate in codd. legitur, ed. Ser. in अय pro अत्र tantum dissentit. Ed. L. contra in prorsus alia verba discedit: अत्र चास्तं गते रवौ प्रविशन्नेवासन्नगोपाहे आवासं प्रार्थ्यत्वान् तेन च निझोहस्यैकदेशोऽनुज्ञातः। अनुज्ञाय च कथिता गृहिणी (i. e. गृहिणी) यावद्हमागङ्गामि तावदयं यथा भद्रेण तिष्ठति तथा करिष्यसि। इत्युक्ता गतः। अय तस्या भार्या पुंश्चली दूर्या सह मन्त्रयन्ती यावद्वतिष्ठति तावत् तस्याः पतिर्गोद्धारागत्य स गोपः स्वबधूं मंत्रयंतीं दूर्या सहापश्यत्। (l. 6.) In seqq. etiam haud parum dissentit, sicut mox videbimus, nunc ad alias libros revertar. — ततः in fin. l. 5. om. S. et P.; inseruimus haud scio an recte ex Pp. qui huic commati praemittit dist. a nobis supra exhibatum I, 17.

Lin. 6. प्रदोषसमये सुहृदां पालनं कृत्वा स्वगोहमागतो गोपः स्वबधूं दूर्या सह किमपि मंत्रयन्तीमपश्यत्। S. Summopere laudo amicitiae studium in pastore conspicuum; at probabilius mihi est, cordi magis fuisse pastori boves quam amicos. प्रदोषसमये गोपालः कश्चिद्दू (sec. m. कदाचिद्) आगतः। स गोप स्वबधूं Pp. in ceteris cum P. et nobis faciens.

— 7. Post verba mox exscripta pergit L. अपश्यत्। सा गोपी पतिमालोच्य अत्युपल्लमतिर्निवृत्ता मन्दिराभ्यन्तरे प्रवनायकल्पयत्। ततस्तां गोपः (sic) ताउतिवा etc. l. 7. —

P. 64. रुत्रे एतस्य नापितस्य बृद्धूर्दृतो पुनर्लां गोपीमुपेतावदत् । तव etc. S. — अस्तौ ex P., असाकेब Pp. — एतस्य नापितस्य बृद्धूर्दृतो P. sic etiam Pp. modo loco एतस्य; videmus nunc retinendam fuisse hanc scripturam, quam tuetur etiam S. एतस्य दैक्षिकाः dictum est de tonsore in praesentia agente. Cf. p. 63, l. 6. quanquam defendi possit scriptura L. a nobis recepta, एतस्याः referendo ad गोपीः. — आगता om codd.

Lin. 8. Pro वियोग S. विरह; dissolvit compositum L. वियोगाद्यनलदध्यो etc. minus bene. Usitatissima est haec metaphora apud poetas eroticos; unum exemplum sufficiat. Châur. Panchâs. v. 19.: अयापि तां विरहव्हिविपोडिताङ्गौं । — स्मरामि. Sed constanter वियोग, विरह, cetera eiusdem significatus vocabula aut cum ignis quodam nomine componuntur aut genitivo casu efferuntur; alio casu posito, prorsus fatuus evadit ignis. मुरुषुरिव om. P. इव om. Pp. et S. in qua editione vocabulo मुरुषः praemissum est: स्मरप्रारज्ञर्तितो; epitheton huic simile supra iam legitur p. 39, l. 22.

Lin. 10. वर्तते महानुभावः L. et P.

Dist. 107. abest a P. et W. — a. रजनीकरनायेन P. — d. दृद्धा मनोभावः बलु ॥ Pp.

Lin. 12. Inserit post dist. 107. S. hoc comma: तस्य तादृशीमवस्थामवलोक्य परिक्लिटमनास्त्वामनुर्वर्तितुमागता । तद्दमत्रात्मानं etc. — संतोष्य et mox: आगमिष्यसि S.

Lin. 13. स गोपः edd. — न यासि कर्यं, male collocata particula interrogativa, L. — Prorsus aliter S. इदानीं त्वां पापिष्ठां जारान्तिकं नयामि ।

Linn. 14. 15. ततो छिना ex codd. Dissentiunt edd. — S. pro न किंचिद्दति praebet न किंचिद्दपि द्रूते; tum: तदा कुछो गोपः दर्पान्मम etc., denique इत्युक्ता कोपेन तेन (ed. S. तेना) कार्तिकामादायास्या नासिका छिना । — L. = ततश्चेयं द्रूती न किंचिद्द ब्रवीति तदा दर्पादुत्तरमात्रं न ददाकोत्युक्ता प्रकुपितेन गोपेन तस्या नासिका छिना । Pro seq. inciso substituit L. पुनः शुषः nimis abrupte, praesertim quum mutata sit constructio; om. omnino codd.

Lin. 16. Pro अय L. अनन्तरं, अथ तथा Pp. — Pro आगता सा S. आगत्य. — दूति om. edd. — पश्य om. codd.

— 17. पश्य मां S. पश्य मे मुखं नासिकैव वार्तां कथयति L. कथयति S. quoque et Pp. — तथा कृत्वा आत्मानं बङ्गा S. nimis prolixo. — अवस्थिता pro स्थिता L.

— 18. तां om. P. et L., in qua ed. deest etiam इयं च. Pro गृहीत्वा codd. आदाय. — निजनृहमुपगतवतो विषादं भावयन्ती स्थिता L. — प्रातरेव Pp. et S.

— 19. जुर्माण्डे याचिते सति सा जुर्माण्डमदत्वा जुर्मेकं प्रादात् । L. nimis diffuse praeter morem huius libri. — स्वबध्यं जुर्माण्डं याचिता सती जुर्मेकं प्रादात् S. quae verba ipsi construant boni viri. — सा अस्तै जुरं etc. Pp. सा तौद्यां जुरं P. — Pro

हुणा L. प्रकुपितः । Verba prorsus diversa exhibet S.: ततोऽसमग्रमाएडे प्राप्ये समुष्वात्को- P. 64.
पोऽयं नापितः तत्त्वुरं दूरदेव गृहे चिपूवान् ।

— 20. *init.* जुरं दूरदेव गृहे प्रचिपूवान् L. — जुरं om. Pp. — अथ कर्तितनासिकेयं L.
अथ कृतार्त्तर्केयं S. राब *nunquam quod sciam*, de hominibus dicitur. Pro
स्वामिना L. अनेन. Sic etiam S. sed transposito: मे नासिका अनेन.

— 21. इयुक्ता धर्माधिकारि समीपमेनमानौत्कर्तौ । edd.

— 22. Verba pastoris इन्ना नासिका ते et mox seqq. इति निर्भर्त्य om. edd.
पुनः praeterea abest a L. — Pro पापर् S. गोप, L. et Pp. पाप. — को मां, in
seqq. omissio कः, edd.

Lin. 1. किम्यत् om. edd. — व्यवहारमकल्पयं edd.

P. 65.

Dist. 108. c. Hiatus in च उमे ab omnibus libris defenditur; itaque
nil mutavimus. — d. धर्मश्च edd. Legitur dist. in episod. de Sacuntal. ed.
Chezy VII, 27. levissima scripturae varietate.

Linn. 5. et 6. usque ad किं बहुना desiderantur in codd. Pro यद्है L.
ततोऽहं यदि. — परमस्ती S. Post hoc vocabulum in omnia diversa abit S.
nil omnino tamen bonae frugis suppeditans: परमस्ती स्यां त्वां विहायान्यं न ज्ञाने
पुरुषान्तरं स्वप्नेऽपि न हि भजे तेन धर्मेण इन्नापि मम नासिका अक्षिन्नास्तु मया त्वं भष्म (sic) कर्तुं प्रकृत्यते
(sic) । किंतु स्वामी त्वं लोकभयादुपेक्षते प्रश्न मनुष्यं etc. l. 6. — किं बहुना । मम मुखं पश्य ex
codd. est additum. — गोपः om. P.

Lin. 7. दीर्घं प्रद्वाल्य S. प्रदीपमादाय L. — तन्मुखमक्षतमपश्यत् L. तन्मुखमवलोकते S. —
तावदुन्नसं मुखं S. Adiectivum उन्नस minus apte nisi fallor h. l. positum, quam-
vis tale adiectivum formari posse (melius tamen me iudice diceretur
उन्नस a नासा) haud dubium mihi est. Cf. quae de praepos. उ॒ in eius-
modi compositis annotavi ad dist. II, 28. — Discrepat et peccat L.: तावदेव
क्षम्यतां ममापरार्थं इयुक्ता परिभ्रम्य हृष्टहृष्टयो बन्धनाद्विमुच्य तच्चरणयोः पतित्वोबाच्च । धन्योऽहं etc.

Lin. 8. तां बन्धनाच्च मुमोच्च । sermone pastoris omnino omissio, codd. —
S. contra verba mox laudata omittit et participio पतितः statim subiungit:
धन्योऽहं यस्येदप्नो भार्या परमस्तीति एतद्वान्तं शुत्रा etc. inseruntur scilicet satis inop-
portunē h. l. verba, quae cum codd. infra l. 17. in fine totius fabulae
exhibuimus q. l. cf. — Sermoni pastoris additur in ed. L. hoc distichon
a ceteris omnibus praeter W. omissum; W. praeterea exhibit h. l. etiam
alios versus, a nobis supra I, 114. editos:

मधुरसश्च वाचि योपितां द्वृदि द्वालाद्वलमेव केवलं ।

अत एव निपीयते धरो द्वृद्यं मुष्टिभिरेव ताद्यते ॥

P. 65. Peccavit ed. Lond. secundum morem suum contra metrum in hem. a. Corrigat vitium ab isto commissum ipse distichi auctor, Bhartrihares, qui scripsit: मधु तिष्ठति वाचि etc. vid. ed. Seram. p. 39. निपीयतेऽधरः audacius est dictum, sed eleganter neque aliis poetis eroticis inaudita est talis loquela: Chauras sl. 3: अथापि तां यदि पुनः कमलायताच्चौं । पश्यामि पीवरपयोधरभारविल्लां । संपोद्य वाहुयुगलेन पिवामि वक्त्रं । उन्मत्तवस्थुकरः कमलं यथेष्ट ॥

Lin. 9. Pro यश् S. यदि, stolide; tum कथयामि pro शृणुत. — L. = ततश्च साधोर्कार्ता शृणुत यूँ राजपुरुषाः । — निःसृत्य L. निर्गतो S. — द्वादशमिः L. et Pp.

— 10. वाणिज्यं कूल्वा om. codd. et S. — नाना दुर्लभानि रत्नानि L. नाना indeclinabile est adiectivum, quod, si bene memini, a nomine, quocum coniunctum sit, nunquam seiungitur alio vocabulo interposito. Neque huic sententiae obstat locus Kath. Up. p. 9. नानेव पश्यति, ubi adverbialiter प्रसिद्धम् esse videtur नाना, sicuti paullo ante नेह नानास्ति किंचन, ubi patet नाना idem esse atque पृथक्; in priori loco explicat scholiastes per भिन्न. — Pro अनुप्राप्तः L. अगतः ।

Lin. 11. च om. edd. — Pro तस्या L. ततः male; तत्र codd. quod ferri potest. — व्रतित L. vitiouse.

— 12. मूर्धनि S. — अत्युकृष्टं L. — तद्वत्तलुब्धेन codd. अनेनैव P. idem voluit Pp. ubi mendose खरातुम् est अनेनै. — L. = तद् दृष्टाऽर्थलुब्धेन (sic) साधुना, omissio अनेन.

— 13. हस्तौ प्रसार्य यदा रत्ने हस्तौ दत्तौ Pp. — P. mutat ordinem: रत्ने हस्तौ यदा. S. = रत्नं गृहीतुं यत्नः कृतः, perperam omissio: यदा. — यदा, omissio एव, S. — तेन om. P. — सूत्रसंचारितेन वाहुभ्यां, codd. संचारितः L. — परि abest ab edd. et P.

— 14. अयं चकार S. — साधुपुत्र L. अरे पुरुष codd.

— 15. सर्वथा सर्वरत्नानि Pp. — प्रयद्वास्यै S. अस्यै nulla alia ratione defendi potest, quam si ad वेताल referatur; melius tamen abest. न चेद् L. male.

— 16. चेटकस्तज्जात्वा etc. (vid. lin. 18.) P. perperam omissis quae interiecta et sunt et esse debent. Inseruntur tamen eadem prorsus verba infra post fabulam absolutam; scilicet adscripserat in margine librarius verba a se omissa, et posthac inopportuno loco ab alio quodam sunt inserta. कृतः om. edd. quo facto locus magnopere depravatur. — Pro ततो Pp. अतो. — Pro अधुना च S. यथा, quod sensum praebet haud malum, si explices यथा per ita ut. — अपहृत S.

Lin. 17. अस्यामिः L. अस्यात् समागत्य मिलितः S. inepte repetitis verbis idem

fere significantibus. — न्याये धर्माधिकारी प्रवर्तितः S. न्यायः प्रवर्तितः L. — Seqq. usque P. 65. ad अतोऽहं om. edd., nos codicibus debemus.

— 20. Pro तत् S. अय, L. ततः, prius inepte, posterius ad idem redit atque तत्. — अपि नोचितं codd. नोचितं S.

— 21. सद्व्य abest ab edd., corruptum P. in सहः स. Pro एव तयोः P. एतयोः. Edd. यथानयोः सौहार्दं मया कारितं.

— 22. मया कार्यः edd. minus eleganter repetito vocabulo मया.

Dist. 109. c. सम pro समे Pp. Ceterum vix opus erit annotare निष्ठोन्- P. 66. तानि compositum esse copulativum (dvandva) pro निष्ठानि उन्नतानि च।

Dist. 110. a. Pro अपि codd. च. — d. ज्ञारद्वयं तथा Pp. vitiōse.

Lin. 5. fin. पूर्णं edd. mendose; nam thema est पुरी, cuius vocis prima syllaba nunquam omnino produci potest; पुर, vocabulum a Wilsone non enotatum, nominativum solum producit: पूः।

— 6. च post सा om. edd. — Pro ग्राममौख्येन edd. ग्रामस्य; P. ग्राममोक्षेण; Pp. prima manu ग्राममौक्षेण; sed emendavit secunda. ग्राममौख्य est quod ad ग्रामसुख, vicum urbanum, oppidulum, pertinet, veluti h. l. eiusmodi loci magistratus.

Dist. 111. a. . . . तथाति . . . Pp. inepte.

— 112. Inest huic disticho ellipsis hunc fere in modum explenda: . . . न ग्राम्येण नियम्यते स्थियः। किंतु सर्वया विषयाः सन्ति। — Omisit hunc slocum J. Subiungit L. duo disticha, ceteris ignota praeter W. qui tertium, in ed. L. omissum, hisce duobus interpositum, addit, initium tantum interpretatus, ne, ut in notis confitetur, castas mulierum Britannicarum aures offenderet:

यतः । गुणाश्रयं कीर्तिमन्तं कातं रत्नं विधेयं सधनं रतिङ्गं ।

विह्वाय शीघ्रं वनिता ब्रजति नरान्तिकं शीलगुणादिहीनं ॥

In hem. d. legendum est नरान्तरं; gravioribus vitiis laborat versus prior, quem si hunc in modum reficias, metrum certe restituitur: गुणाश्रयं कीर्तिमन्तं रत्नं पतिं विधेयं सधनं रतिङ्गं। Alterum distichon sic se habet:

अपरं च । न तादशि प्रीतिमुपैति नारी विचित्रशयां शयितापि कामं ।

यथा हि द्वार्वादिविकीर्णभूमौ प्रयाति सौख्यं परकातसंगत् ॥

Suspicio mendum in hem. b.; श्री cum accusativo haud facile construiunt. *Lass.* — Expungenda videtur littera nasalis, ut sit compesitum. *Schl.*

- P. 66. *Lin.* 12. अथ कदाचित् सा S. अथ सा कदाचित् L. — Pro पुत्रेण L. सुलेन.
— 13. रत्नं तत्रागतः S. — . . . नायकमायानं दृष्टा तत्पुत्रं etc. intermediis omissis, L. — तमायानं दृष्टा S. — कुशुले hic et infr. l. 18. mendose S. — Pro धृत्वा edd. नायिकः; oportebat saltem scribere निलिय. — Pro सम् S. et Pp. सह. — क्रीडति S.
— 14. भर्ता गोपो edd. गोपः exhibitent etiam codd. sed om. गोपात्. — गोप्योक्तं । किमधुना विशेषं । दण्डनायक त्वं etc. codd.
— 15. Pro याहि S. गद्. — तथा तेनानुष्ठिते, reiecto सति, S. तथा कृते L. ubi statim pergitur: गोपेनामत्य पत्नो पूष्टा (sic).
— 16. गोपेन S. ubi mox त्वं desideratur. — Deest अत्र in Pp. et S.
— सकोपः समागतः L. समागत्यात्र स्थितः S.
— 17. कार्येण pro कारणेण S. minus apte. — Pro मार्यमाणः L. पलायमानः.
— 18. *init.* अत्यन्तं S. Particulae अपि hic nil est negotii. — ततो om. edd.
— तत्पित्रा S. — अविष्यात्र L. et P. अलिष्यात्र S. vitiose. — गृहे desideratur in S.
— 19. अत एवायं S. एव per se optime huc facit, sed displicet repetitio eiusdem particulae. अयं दण्डनायकः Pp. nomen retinet P. pronomine reiecto. — कुछः edd. et P. Retinuimus कुपितः quia कुछः mox antecesserat. — Pro अवतार्य S. बहिष्कृत्य; sed minime h. l. convenit verbum बहिष्कृत्; cf. quae dixi ad Pentap. Ind. p. 80.
— 20. स्वामिन् ex codd.

Lin. 1. Pro अस्त्वेत्वं edd. अस्त्वेत्वं; quanquam haud magnum est inter
P. 67. utramque formulam discriminem, est tamen et, nisi fallor, hoc quidem;
अस्त्वेत्वं est affirmantis, अस्त्वेत्वं est concedentis, sed ita ut ad aliud argumentum pergitur, priori dimisso.

— 2. महान् निर्मा॒ः स्न॑हं Pp. absurde. महास्न॑हः P. महानिर्मास्न॑हः L. nostra scrip-
tura concinnata est ex ed. S. महानन्योन्यनिर्मास्न॑हःतस्न॑हः ।

— 3. Pro चिन्तनीयः S. क्रियतां.

Dist. 114. c. et d. काक्या . . . सर्वे निपातिः S. — d. . . . अताउथत् codd.

Lin. 7. च abest a L. — तत्त्वं etc. L. — तत्कोट्यावस्थितानि S. तत्कोट्यावस्थित
etc. codd.

— 8. वायसी वायसमाह S. — Pro स्वामिन् S. नाथ. — अत्रैव तस्मात् L. अत्रावस्थितकृष्ण-
सर्पेणावयोः etc. S.

— 9. आवयोः कदाचिदपि प्रजावृद्धिन् भविष्यति L. आवयोः संतातिः सततं भव्यते । S.

— 12. एतस्य मया P. — महापराधः edd. et Pp.

— 13. Pro निग्रहीतव्यः edd. पुनर्न जनतव्यः । — Pro अनेन S. et P. एतेन. —
विग्रहितुं S. विग्रहीतुं P.

P. 67.

— 14. Pro समर्थः Pp. प्राक्तः

Dist. 116. b. अबोधस्य S. निर्बोधस्य L. — Pp. prima manu ut S., secunda uti P. atque nos. Hiatum hunc tolerari posse supra iam monitum est.

— d. fin. निवासितः P.; voluit haud dubie विनाशितः ।

— 17. Pro अभिधने edd. नाम्नि; iidem aliud leonis nomen exhibent दुर्गान्त. W. nobis suffragatur; in ed. opp. Jonesii mendose exaratum est दर्गान्त; legit Vir clariss. in exemplari suo sine dubio दुर्गान्त.

— 18. च abest a P. — सर्वदा पशूनां वधं कुर्वन्नास्ते edd. — Nos secuti sumus codd. तत्र receptum est ex Pp.

— 19. स स्थिंहो edd. — Pro उच्चेद् Pp. छेद्. In diversa abeunt edd. L. = किमव्य सर्वपशुचेदः (sic), omissa स्वामिन्. S. = हे मृगेन्द्रः (sic) किमयनेकदा पशुयातः ।

— 20. यदि प्रसादो भवति तदा वयमेव etc. S. nimis prolixo. — आहाराय pro आहाराय S. — Pro उपठौक्यामः L. दास्यामः; P. उपठौक्यामः; quaenam littera praeferenda sit, ignoro; cf. Rosen. s. v. टौक. Per उपठौक्यन् explicatur उपहरणा Amarū Sat. dist. 13. Cf. scholl. p. 19. — ततः स्थिंहेन S. — एवमस्तु L. pro भवत्वेत्. Aliter S.: यथेतदभिमतं भवतां तर्हि भवतु नाम ।

— 21. पशुं भज्यन्नास्ते L. पशुमुपकल्पितं भज्यन्नास्ते । S. — कदाचित् कस्यचित् P.

Dist. 117. a. त्रासहेतोर्विनीतिस्तु edd. — d. Pro मे L. वा.

P. 68.

Lin. 3. तन्मन्दमन्दं codd. उपग्रामि L. ग्रामि S. Sequens incisum desideratur in codd. — Pro उपग्रामि Pp. उद्ग्रामि. — Pro अय edd. ततः — तमालोक्य om. edd.

— 4. तमुवाच edd. — विलम्बागतोऽसि Pp. विलम्बादगतोऽसि P. Secuti sumus ed. Ser. nisi quod pro समागतोऽसि cum codd. scripsimus आगतोऽसि । Verba prorsus diversa substituit L. किमागमने विलम्बकरणं । — नाहमपरादः L. देव नाहमपरादः S. utrumque contra usum loquendi.

— 5. आग्रहन् ante पथि ins. S. — अवलोकितः ante बलाद् ins. L. — सन् ex codd. receptum. Inserit S. ante पुनर् haec verba तस्याये; sic loquentem sexcenties observavvi auctorem Vētālapanchavinsatidis, unde persuasum mihi est, ad popularem loquendi morem referendum esse hunc vocabuli अये usum, quo septimo casu et praepositionis loco positum nulli alii rei inservit, quam casui cuidam designando; sic राजाये कथितं in isto libro nil aliud valet quam राजः कथितं.

— 6. आगतोऽस्मि edd. — श्रुत्वा सकोपे P. — तं दर्शय codd. (in P. vitiose scriptum est तदूदर्शय), unde duae sententiae constituendae sunt, commate post दर्शय ponendo.

P. 68. — 7. Pro अस्ते codd. et S. स. — श्रावकः post गृहीत्वा reiciunt codd. — दृष्टं abest ab edd.; in Pp. inscite exaratum est दृष्टं. — कृतं दर्शयितुं गतः S.

— 8. Pro अत्र S. तत्र. — Pro पश्यतु L. पश्य, absurde, quum subiectum sit स्वामी. — स्वयमेव पश्यतु S. — तस्मिन् omisso, कूपान्तर्गते L. Utinam ex mortuis resuscitare possem bonum virum Hayleyburensem, ut ex eo discerem, quid sit कूपवहिर्गते; si enim istud in rerum natura locum habeat, hoc etiam reperiri debebit; sed scribere voluit: कूपतलस्य अन्तः। — एव a तस्य ad सिंहस्य trahit S. तस्मिन्हस्य L. sed तद् hunc in modum componi nequit.

— 9. 10. Pro अतो edd. ततो. — दर्पधातः कोपात् L. क्रोधाध्यातो दर्पात् S. — निःक्षिप्त S. et Pp. mendose. Post तस्योपरि pergit L.: पयात ऊर्ध्वपदः अथग्निरा (sic) तद्वाले मनः पञ्चत्वमगमत्.

— 11. सर्वं श्रुतं। संप्रति यथा कर्तव्यं तदुपदिष्यतामिति L. श्रुतं यथा सर्वं। संप्रति यथा कर्तव्यं तदूबूहि S.

— 12. प्रत्यहं om. Pp. सततं substituunt P. et L. — समागत्य Pp. — Pro स्नानसमये Pp. ततः. — अवतारितीर्थशिलानिहितकरसूत्रं edd.

— 13. Pro धूता edd. विधृत्य. — धरिष्यामि Pp. — Librarius, qui cod. Pp. exaravit, male transposuit sententias अथ — व्यापादितव्यश्च atque अथ कदाचित् etc. Similitudo initii fraudem fecit librario. Eandem transpositionem praebent edd. in hoc tantum discrepantes, quod दृष्टो व्यापादितश्च legunt, quod bene se habet, si ipse auctor narrationem excipit et ad finem perducit.

Lin. 14. Pro राजपुरुषैः P. पुरुषैः। — तत्र तद्वारे edd.

— 15. Incisum तथानुष्ठिते om. edd.

— 17. *init.* तर्हि गङ्ग भवत् S. Qui vocativum vocabuli भवत् loco nulli dubitationi obnoxio confirmare potuerit, is vel ingens Sisyphi saxum volvere non recusabit.

— 18. आत्यधिकं वचनमकुप्रालं मन्यमानः L. आत्यधिकं किमपि महाभयकार्त्तिकार्यं मन्यमानः S. Nostram scripturam tūtentur codd. — समागतः edd.

Dist. 118. Praemittunt huic disticho edd. codd. atque interpp. aliud, cuius versus prior haud differt ab alio, supra edito et No. 61 insignito; ad quem locum de hac re dictum est. — c. Scripsimus cum codd. परिद्धुंसात् pro परिद्धुंसौ।

P. 69. *Dist.* 119. c. — अवाप्तिः Pp. mendose.

Lin. 4. अथं तावत् om. S. substituens देत्. — असदृशव्यवहारी edd. Praefixo adiectivo substantivum व्यवहारं adiectivi loco haberri potest, non opus igitur est suffixo इत्. Addit huic vocabulo S. इत् लक्ष्यते। — Pro मत् edd. अस्मात्;

sed modestius haud dubie locutus est Damanacus. Pp. सततसंनिधान्, quod P. 69. corruptum esse videtur ex scriptura cod. P. स मत्संनिधान्. — एव abest ab edd.

Lin. 5. Pro स्वामिनः edd. श्रीमद्भूरेवपादानां.

— 6. स्मयः P. — आश्र्वय Pp. male; neque enim sine praefixo स, vel sine addito signo accusativi neutrius, adverbialiter poni potest आश्र्वय. मत्वा ante तूष्णीं inserit S. otiose.

Lin. 7. त्वया abest ab ed. L. — S. = एक एवायं यस्त्वया सकल etc. et mox स एव दोषः quod sensu cassum est, nisi scribatur यत् pro यः. — Pro कार्य Pp. राज्य.

Dist. 120. desumptum est ex dramate Mudrâ-Râxasa, Act. IV. fol. cod. Par. 36. verso.

Dist. 121. a. राज्ये प्रमाणं S. राज्ये प्रधानं L. राज्यप्रधानं P. — b. मोहाप्रियते P. मोहाप्रियते Pp. — d. स्वातन्त्र्यं Pp. mendose.

Dist. 122. a. विषदिग्धस्य omissio च S. — विद्वन्नस्य च L. — b. . . . गलितस्य. L. absurde. — d. उड्हरणं सुखं S. उड्हरणं वरं L. Disticho 123. subiungunt edd. et codd. neque non interpp. aliud quod supra iam exhibitum est No. 98. q. l. cf.

Lin. 19. स च abest a S. — . . . कर्ये L. — स्वेद्वा यतः Pp. quod h. l. nullum praebet sensum. Notum esse debet, affixum तस् saepius loco terminationum, quibus ablative casus indicatur, usurpari et nisi fallor memoria, hoc in femininis in आ longum desinentibus potissimum locum habet et quidem praecipue, quum casu ablativo caussa, ex qua proficiuntur actio quaedam, significetur. — Pro एतज्जानामि L. ज्ञानाति, neglecta virgula, quasi ad स्वामी referendum esset verbum; at de constructione vocabuli प्रमाण supra iam dictum est. Ed. Ser. verbum tertia persona effert, एतत् tamen servat; pronomen demonstrativum ad sententiam statim sequentem spectat, ut nemo non videt.

Dist. 124. a. Pro राजन् edd. लोके. — b. श्रीयं S. vitium horrendum. — c. pro रम्यां L. भार्यां — d. सादरं S. — In fine retinuimus च कः cum ed. L. haud scio an recte; minus apte coniungit copula च pronomē interrogativum cum relativo. Scripturam, quam amplexi sumus, suspectam praeterea reddit discrepantia ceterorum librorum; S. ऋकः, quod melius est; sed tum legendum erit लोके, sicuti posuerunt edit. Serampp. Codd.: ऋकः, quam veram esse huius loci scripturam, facile mihi persuadeo propter similem iuncturam अथ किं, quibus voculis affirmativa efficitur particula, ut supra commonstravi; अथ कः vi quadam peculiari

P. 69. interrogare suspicor, ita ut haud dubium esse possit, quid responsum sit futurum.

Lin. 22. विमृश्य edd. — संज्ञीवके मम महान् स्नेहः Pp. संज्ञीवकेन सह मम महान् स्नेहः edd. — Secuti sumus cod. P. correcto tamen यहा pro महान्.

P. 70. *Dist.* 125. c. Pro अनेक edd. praebent अशेष.

126. c. सारोऽपि Pp. inscite.

Lin. 5. पुनरेव S. — अतिदोषः edd.

Dist. 127. b. आरोहयति edd. — d. आच्चियते codd. male. — नः in fine. Pp.

— 128. a. अद्वियस्यापि edd. — b. परिनामः codd. et edd. quod contra auctoritatem Paninis peccat. Cf. p. 1179. ed. Calcutt. Sequitur in P. distichon, a solo Jonesio h. l. Anglice redditum, de quo verba feci ad dist. 60. hac sola discrepantia, quod hemist. b. sic se habet: वक्तारोतुविसन्ति ये । quod legi etiam potest, uti monuit, qui ipse cod. Par. contulit, *Schlegelius*, वक्तारोत्त्रिसन्ति ये । Enotavimus supra post dist. 60. hoc distichon ex ed. L. ubi hem. b. hunc in modum scriptum est: सततं प्रियबादिनः । qua scriptura recepta facilis intellectu evadit versus; defendit eam praeterea Jonesius vertens: «*Men who speak only;*» nisi is forte legit केवलं pro सततं, quamquam huic rei minime insisto; permulta enim in ista interpretatione perperam redditum sunt. Verum patet, aliam omnino scripturam ante oculos habuisse librarium P. quae qualis fuerit, mihi non liquet: inventiet fortasse alius.

Lin. 10. अयं om. Pp. — आगन्तुः P. — Deest कृतं in P.

— 11. पश्य ex codd.

Dist. 129. a. मूलभूत्यान् परित्याज्य S. vitio correcto sensus idem remanet, sed nostra scriptura concinnior. उपराधेन Pp. contra usum loquendi. — b. नागन्तून् edd. et codd. — परिपालयेत् edd. — c. pro अयोऽस्ति edd. दोषो; codicum scriptura recepta, corrigendum fuit in anteced. आगन्तुः; diversi enim numeri haud facile hunc in modum coniunguntur.

Lin. 13. किमाश्वर्णे om. P. — Pro अयं S. यद्, quod ferri potest.

— 14. मर्त्यं कुरुण्ति S. — शृणु om. edd. देव quoque P. —

Dist. 130. a. विकृतिं P. नाज्ञवं S. — d. pro इव Pp. अपि; sed aegre caremus h. l. particula comparativa.

Dist. 131. c. युक्तो codd. et ed. L. Praetulimus cum S. मुक्तो, quod cum praeced. hemist. b. melius congruit; attamen युक्तो tuetur etiam W. Omittit hoc dist. J.

Dist. 132. a. वर्षयन् S. stulte. — Pro वाय L. चाय; P. नाय; posterius vix P. ७०.
h. l. admitti potest; neque enim abesse potest particula aut disiunctiva
 aut copulativa.

Dist. 133. Verba disticho praemissa om. Pp. — d. विपरीतसतोऽन्यथा edd.
 वैपरीतसतोऽन्यथा P. — Quae scriptura vix ferri potest. Quid enim aliud
 valet विपरीतसतः quam अन्यदस्मात्; अतः pro ablativo positum est; विपरीतं est di-
 versum, contrarium, oppositum; addito igitur अन्यथा, sub specie aliquid
 dicendi nil fere diceret auctor; est omnino huiusmodi mos nil dicendi
 a recentioribus inventus eisque relinquendus. अस्तां receptum est ex Pp.
 et se ipsum tuebitur.

Dist. 134. b. यार्थविधायिनी Pp. minus bene. — c. pro सुधौः edd: सुखौ. — P. ७१.
d. ... हितकाङ्क्षयत् Pp. ne prius quidem admitti potest, quia गित्र
h. l. necessario a pronomine relativo excipi debet, sicuti श्रौः, स्त्रौः, cetera
 quae antecedunt vocabula; neque exstat caussa, cur a scriptura edd. disce-
 dendum sit; कृत्रिम ignotum fortasse fuit librariis vocabulum; sed a Wilsone
 est enotatum et optimae notae.. Cf. Rām. I, IX, passim. Pro स पुरुषो P.
 कापुरुषो, quod sensu destitutum est, nisi deleatur in seqq. negatio; quod
 factum tamen non est. Vetat praeterea metrum.

Lin. 5. init. तद् desideratur in edd. — व्यसनादितौ Pp. quod quid sit,
 ignoro; quanquam suspicor, nil esse quam lapsum librarii, signum lit-
 terae caninae superne pingendae inscite iusto longius deorsum trahentis
 ita ut diphthongus श्रौ eum Rephae signo coniuncta in श्रौ abierit; quod
 in scriptura Bengalica facile accidere potest. — Pro तदा भृत्ये S. तदस्मादृशि भृत्ये;
 Pp. तद्भास्यस्य.

Dist. 135. b. खल्दः edd. Sed abverbium praestare videtur. — c. मान-
 धातः edd., दर्श plus est quam मान ideoque ad hunc locum accommodatius;
 धात nullum quod sciām habet sensum praeter primarium *flandi*; inflatus
 Indice dicitur आधातः.

Dist. 136. a. न परस्य प्रवादेन codd. न परस्यापरथेन S. hoc omnino disipli-
 cit, illud minus placet quam अपवाद. — c. आत्मनावगतं S. haud male; sensus
 idem est; eadem lectio ante oculos fuit librario Pp. finxit tamen mon-
 strum scripturae: यात्मनावगतं; num voluit: यत्सादवगतं? आत्मनावगमनं कृत्वा P.
 haud fert versus. — d. पूजयेच वा edd. et P. vereor ne difficilius sit, hasce
 duas particulas inter se conciliare.

Dist. 137. b. विधिवा ग्रहनिश्वरे P. विधिन ग्रहनिश्वरे S. विधिना ग्रहनिश्वरौ L. Nos se-

P. 71. cuti sumus Pp. ग्रहनिग्रहौ हु न फैट; नेके एनम अडिक्टिव एसे पोट अद गुणदोषौ, नेके अल्टरम अक्साटिव रेगरे पोट गेरुंडियम अनिश्चित्य; पोनेदु इग्युर एर अम प्प. लोकात्व; कम्पोजिटा अग्ग्रेगेटिवा (*dvandva dicta*) सिंगुलरि नम्बरो एला सति नोटा, अनुभाव ओमि हेक रेस, डोक्ट्रिनाम डिक्षो एक्सोप्शनिस, एक्कुरेटिव खाम एक्सुक्स फैक्टम एस्ट, ट्रैक्टरी डेब; मांगा एनम इंडिकेस एक्साटिस पार्स एक्सो कंटिनेटुर. चेटरम मोनेदु एस्ट, टोटम वर्सम प्रिओरम शब्दिक्टी पार्टेस ह. ल. एक्स्प्लेरे, अब एक्वे रेगि डाटिव स्वनामाव, जो पोस्टुस एस्ट ताद्यें; नेके ऑप्स एसे नोमिनेटिव विधिः, जो पोटियु तोटम लोकी कॉन्स्ट्रक्शेनेम एवरेटेरेत.

Lin. 16. तदा संज्ञोवकः किं प्रत्यादिशतां edd. किं अलियु एसे अलो, स्टेटिम सेक्के डोसेंट. — संसंश्मात् Pp. माल; cf. supr. ad dist. 14. prooem. — प्रियु ना om. L. — 17. एतावन्मंत्रो जायतां Pp.

Dist. 138. a. Pro गुरुं P. यन्मात्. Pp. पक्ष.

Subiungit ed. L. sola huic disticho aliud:

आदरस्य प्रधानस्य कर्तव्यस्य च कर्मणः ।
क्षिप्रमक्रियमाणस्य कालः पिवति तद्रसं ॥

tum pergit: तद्वश्यं समारब्धो महता प्रयत्नेन संपादनीयं । In verbis hisce aut legendum est समारब्धं, aut समारम्भो — संपादनीयः । Distichon istud a ceteris alio loco exhibitum est; h. l. et infra agnoscit W. qui etiam sententiam, a qua excipitur, Anglice reddidit. Post verbum संपादनीयं in ordinem reddit L.

Dist. 139. a. योथा हवाधीरः (sic) L. योवित् legit J. reddit enim per woman.

Lin. 22. Pro यद् L. यदि, quod ferri potest, अनुभाव यद् melius congruit cum seq. तद्. S. = यदा; disjunctione nil opus est h. l. — Edd. निवर्त्य, quod ita explicandum esset, ut दोषान् pro accus. plur. acciperetur, nisi fortasse आत्मानं supplere mavis (दोषादात्मानं निवर्त्य) quod in caussativis interdum locum obtinet; ex. gr. र्द्धयामास्त in Sāvitryupākhyāna ed. Bopp. p. 9, sl. 8. Bhag. Gīt. XI, 4. Sed optime se habet primitivum निवृत् cum ablativo constructum; cf. prorsus similem locum Bhag. Gīt. I, 39.

P. 72. *Dist.* 140. a. Pro तु codd. च. — c. स मृत्युरेव P. mendose. Inser. h. l. S. codd. et interpp. distichon nostrum II, 97. q. l. cf.

Lin. 3. किमयमस्ताकं L. — Disticho praemittunt edd. vocativum देव.

Dist. 141. Ad vocem अङ्गाद्विभाव cf. infr. l. 9. निरङ्गं et apud Wilsonem quartam nominis अङ्गं significationem.

Lin. 6. कदाचित् om. edd. अथ कदाचित् P. — दक्षिणास्मुद् etc. edd.

Lin. 7. Pro तत्र L. ततः.

P. 72.

- 8. योग्यस्थानं निभूतमनुसंधीयतां edd. — भार्ये नन्दिर् etc. S. — स्थानं प्रसूतियोग्यं L.
- 9. Pro एतद् L. इदं. — Transponit S. व्याप्ते स्थानमेतत्।

— 10. Pro अवस्थित Pp. द्वारस्थित, in ceteris cum P. consentit; sententiam mutilam exhibit S. omissis भद्रे, ac mox vocabulis, qui inter अहं et समुद्रेण leguntur; tum pro विग्रहीतव्यः praebet निग्रहीतव्यः। Aliam profert sententiam L.: भद्रे किमहं निर्बलः मम गृहावस्थितान्यएडानि समुद्रेणापर्हतव्यानि। quae verba propter sequentia stare nequeunt. Verum fateor, me in scriptura nostra etiam haerere et quidem in voce विग्रहीतव्यः; quod defendi nequit, nisi monstrari potest, विग्रह construi solere cum accusativo; verum dicitur विगृह्यामि तेन वेन वह, ita ut constructio passiva instrumentalem subjecti requirat. Aut corrigendum igitur erit विग्रहीतव्यं, aut ponenda forma causativa: विग्राहयितव्यः. Tum legendum esse videtur अवस्थितः; quo facto तेन adverbialiter erit accipiendum; च, uti plerumque fit, pro diversitate subjecti significatum mutat: «egone patrono careo? ideo in mea domo consistens ab oceano invadendus sum.» — Ita ut hisce verbis diceret maritus: videndum est, an me, patrono haud destitutum, aggredi ausurus sit oceanus; quod si fecerit, auxilium contra eum a patrono petam. Cf. variet. script. ad lin. 17. — स्थानिन् om. P. नाय substituit L.

Lin. 11. दिश्टिमोऽवदत् om L. et codd. neque aliter interpp. Sed retinenda erant cum S. ista verba propter sequens distichon, ex quo quamvis satis sit obscurum, hoc sane patet, ab uxore timoris plena id recitari non posse.

Dist. 142. Asterisco notavimus hosce versus, corruptiores, quam ut sine aliorum librorum manuscriptorum ope restitui possint. Scriptura quam exhibuimus, est codicis P. यः tantum pro च ex ed. L. incaute repetito. Ad hanc scripturam proxime accedit Pp. exhibens: अथ सा दुःखमात्मनः परिक्षेत्रुभेदं योग्यो न वेत्ति वा। etc. uti P. et nos. — L. = अथ वा। पराभवं परिक्षेत्रुं योग्यायोग्यं न वेत्ति यः। अस्तीह यस्य विज्ञानं स etc. S. = अथवा। दुःखमात्मा परिक्षेत्रुभेद योग्यो न वेत्ति यः। अस्तीह यस्य विज्ञानं कृष्णपापि न सीदति ॥ Interpp. nil certi afferunt. Particula praemissa अथ वा indicari videtur distichon h. l. excidisse, atque duo re vera in edd. leguntur, sed alterum, quod huc apponendum est, nostro subiunctum est:

P. 72.

**अनुचितकार्यारम्भः स्वजनविरोधो बलीयसा स्पर्द्धा ।
प्रमदाजनविश्वासो मृत्योर्द्वाराणि चत्वारि ॥**

L. प्रमद्, contra metrum et sensum; प्रमदा sensu mulieris आ suum longum etiam in compositis retinet; vid. Nal. I, 25, ubi प्रमदाक्वने minime reddendum est cum cl. V. *Boppio* «in voluptaria sylva;» est viridarium gynaecei. Cf. Amar. Kôsh. s. v. Attamen fatendum est, hoc distichon minus bene ad hunc contextum quadrare, in primis si uxori, non marito, cum L. tribuis. Persisto igitur in ea opinione, ante distichon 141. aliud quoddam, fortasse etiam nonnihil solutae orationis, librariorum negligentia excidisse, et totum locum in medio relinquendum esse reor, dum novis adiumentis instructi ad hunc locum reverti possimus.

Lin. 14. ततः सकृदेष श्वामि etc. L. Vocabulum a loco alienum e dist. antec. huc irrepsit. — श्वामिनो Pp. — Post virgulam pergunt edd. एतत् सर्वं श्रुत्वा समुद्रेष इति etc.; अपि omittit praeterea L. — तच्छ्वानि cod. uterque; quam scripturam quanquam in textu sequi non ausi sumus, digna est, quae commentario nostro consignetur. Nam sicuti adiectiva in सु a desiderativis verborum formis derivata, participiorum more casum regere possunt, eodem modo haud absurdum erit suspicari, nomina in सा, ab iisdem verbis oriunda, pro infinitivis posse usurpari; sed alia desidero exempla maioris auctoritatis.

Lin. 15. Pro अथ S. ततः — सग्नोका P.

— 16. Pro नष्टानि L. अपहृतानि; P. पतितानि.

— 17. Post समीपं pergunt edd.: गतः । तत्र गत्वा सकलवृत्तान्तं इटिटभेन भगवतो गरुडस्य पुरुतो निवेदितं । देव समुद्रेणाहं खगृहावस्थितो विनापर्यन्तैवं निगृहीतः । ततस्तद्वचनमाकर्ष्य गरुत्तमा प्रभुर्गवान् नारायणः etc. Constructio primi commatis postulat nominativos pro accusativis. Nos, codices secuti, auctori concinnam suam breviloquentiam reddidimus.

Lin. 18. fin. विज्ञप्तः edd. omissio तत्.

— 19. समुद्रमपउदानायादिदेश । — 20. इटिटभाय edd., om. P.

— 21. Absolutae fabulae hosce versus subiungit L.:

शास्त्रातिक्रममज्ञावा वैरमारभते द्विषः ।

स परमवमाप्नोति समुद्रमिव इटिटभात् ॥

Agnoscit praeterea W. qui pronomen relativum in versu priori aegre

desideratum interpretatione sua expressit ac vel sine eius consensu pro P. 72.
द्विषः corrigendum esset हि यः ।

Lin. 21. मया ज्ञातव्यः P.

— 22. यदासौ सर्वः शृंगाम् etc. edd. — चकितं edd. — इति in fine addunt
codd. —

Lin. 1. ततस्तं om. edd. — 2. ते deest in codd.

P. 75.

Dist. 143. d. . . ये राजसेवकाः L.

— 144. b. भूवि edd. contra metrum et grammaticen. — Pro नाम L.
वास्ति. — c. कालस्य भूजान्तरं न हि गतः S. भूज् inventum est Serampurensse. कालस्य
भुजान्तरं न च गतः L.

Lin. 10. किमेतत् desideratur in ed. Ser.

Dist. 145. a. निर्भज्जन् codd. insolentius atque haud scio an omnino
usitatum निर् cum radice मख् componere. L. = मज्जन्नपि पयोराश्रो. — S. totum
versum priorem hunc in modum vitiat: समुद्रे मज्जनं लब्ध्वा यथा सर्पाकलंबनं ।
c. init. नो codd. De hac particula cf. quae dixi ad p. 18. l. 18. चाधते edd.
male. — d. pro तथा codd. तद्दत्. — Pro मूळः edd. मुषः; dubito an usitatum
sit मुष eodem sensu atque मूळ usurpare; quod nisi ostendi possit, मूळ unice
huc facere concedendum erit.

Dist. 146. b. नश्यन्त्यन्यत्र बास्थवाः S.

Lin. 15. निश्चक्ष्य S. vitiose. — ब्रूते । भवान् अस्तकृतज्ञः । तथापि मित्र etc. S.
Transponunt codd. सुविस्तरं मित्र.

— 16. विषणा इव ex codd.

— 17. आगतः स्थितः codd. Participio स्थितः copulam addit S. quod sane
melius est. Nos vocabulum omisimus, nulla re h. l. commendatum. —
तत् ante मया om. L. — तन्मयात्र S. — प्रलोकहितार्थिना Pp. हित absurde h. l. est
insertum.

— 19. *init.* रहस्यमुक्तवान् edd. — इव abest a codd. neque opus est h. l.
particula hacce. — तर्पयामीति P.

— 20. उपगतः S. et Pp.

— 21 प्राप्तुकालं codd. quod adjective est accipendum. संजीवकः om. Pp.
— Pro उवाच L. आह; abest omnino a S. verbum, quod ut saepius iam
monitum est, ferri potest. — सुषु प्राप्तु खलु L. सुसुवात्.

— 22. Verba स्वगतं — प्रक्षयते edd. aeque atque codd. disticho 148.
praemittunt. Nos huc traximus, quia haud satis commode ea, quae

P. 73. dist. 147. continentur, coram thoē a bove proferri possunt; distichon praeterea 147. verbis, de quibus nunc agitur, subiungi debet. Varietas lectionis in codd. obvia haec est: किमेतद् विचेष्टिं न वेत्येतद्व्यहारानिर्णेतुं न श्रव्यते । P.; alter codex in hoc tantum differt, quod pro न वेति praebet न वेत्ति; quod sensum praebere quidem intelligo, si एतत् ad thoem referatur, वेत्ति ad leonem: quomodo fit, ut is (leo) eius (thois) agendi rationem non intelligat?" verum tamen hac scriptura recepta, ea quae post इति sequuntur, supervacua redduntur, imo prorsus inania; melius praeterea cum mente bovis congruit dubitare, utrum ea quae mox prodiderat thos, re vera ita se habeant, an molimina sint maligni animalis. Recepimus igitur scripturam edd. correcto न वेति एतद् pro न वेत्ति तद्, praecedente cod. P., omnino relicto व्यवहारं, quam scripturam sensu cassam exhibit L.

P. 74. *Dist. 147. a.* Pro अनार्यः Pp. आचार्यः, quae scriptura habet, quo se commendet; nam quo tandem modo vulgatam scripturam explices, hoc semper restat, quod ceterorum hemist. quodque unam eamque in se absolutam sententiam teneat, prius autem merum epitheton. Accedit quod ipsum hoc epitheton explicari quidem potest, habet autem aliquid inconcinne atque insolenter dicti; W. interpretatus est: «*Unworthy to be found by bad men*», quod concedere nequeo viro clariss. अनार्यै enim nunquam omnino eodem sensu ponitur atque अनर्है. J. totum distichon dissimulavit. Nullam aliam video explicationis viam, quam totum epitheton in duas distribuere partes; दुर्जनगम्य atque अनार्यः गम्य passivam certe significationem habet, et sensu huic loco cum prime apto in Lexic. Amara-Siniae p. 271. ed. Col. exhibetur: *accessibilis*. Haec hactenus; nam explicanda fuit scriptura edd. eorum caussa, qui ab ea discedere nolint; nunc ad Pp. revertor, ex quo quam enotavi scriptura optimum praebet sensum, levi tantum emendatione facta, eaque haud prorsus inevitabili, scilicet scribendo दुर्जनगमी (दुर्जनगम्याचार्यः) pro दुर्जनगमी; hoc auctoritate Wilsonis (cf. s. v. अनित्) defendere possem, illud locis sexcentis. Habes igitur quatuor optimas res, indigno loco collatas; doctrinam male ea utentibus communicatam; dignitates indigno viro tributas, divitias parcis, pluviam denique in montes atque oceanī ἀκάρπιστα πεδία demissam. — hem. b. प्रायेण पात्रभूत् Pp. contra metrum et sensum. — c. pro धने Pp. फलं male. — d. . . . गिरिजलधिवर्जी च (वर्णो apud nos operis est tribuendam) edd.

fert metrum: . . . निर्युपरिवर्णे च । Pp. Sed aegre h. l. mari carerem. देव P. 74. dicitur deorum princeps Indras, i.e. Iupiter pluvius, a veteribus iam hoc nomine appellatus: Strabo XV. σέβονται μὲν τὸν ὄμβριον Δία οἱ Ἰνδοί.

Eandem admodum sententiam alio disticho repetunt edd. ne Wilkinsium quidem sectatorem nacti:

नीचमाश्रयते लद्मीरकुलेन सरस्वती ।
अपात्रं भजते नारी गिरौ वर्षति वासवः ॥

Lege: अकुलीन्.

Lin. 5. Pro कथमेतत् P. किमयत्, Pp. तत् किमेतत्, L. autem haec verba substituit: तत्र विचिन्त्योऽन् । कष्टं किमिद्मापतिं । यतः । sequitur tum dist. 149.

Lin. 7. abest a S. — तद्यमश्चाक्यार्थः प्रमेयः । L. तद्यमश्चाक्योऽयर्थः प्रमातुं codd. in qua scriptura hoc potissimum miror, quod in utrumque codicem अयं istud otiosum irrepisit.

Dist. 150. c. ex emend. pro: अकारणादेवि मनस्तु यस्य, quod contra metrum peccat. — d. परितोषमेव्यति Pp.

Lin. 10. प्रकाशं ex Pp., quod vocabulum vel ex conjectura addendum fuisset propter praecedens खगतं. — अयता edd. अय ex codd. est. Melius convenire nobis olim videbatur huic loco particula continuativa atque quodammodo conclusiva. Sed अयता, quippe quae affirmet particula, optimo iure defendi potest. Cf. ad p. 23. l. 1. Pro निर्धारिति (sic enim scribere oportet) S. नित्य, minus bene. — Vocabulo . . . कार्याः copulam subiungit L., particulam हि S.

Dist. 151. a. Pro किंचित् L. कश्चित्, stulte. द्वेषितां P. Parum refert. — b. प्रौतितामेति सत्यं S. — c. चित्रं चित्रं किमय चर्तिं नैकमावाअयाणां edd. — d. idem hemistichium iam supra legitur dist. 26. d. atque in caussa fuit, cur totum dist. in edit. S. h. l. repeteretur; editum est enim post dist. nostrum 152.

Dist. 152. a. शुकृत् pro कृत् edd. Refragatur metrum. — b. अबुद्देषु L. Vetat iterum metrum. Idem mendum invenio in Savitryupâkhyâno, a V. clar. Boppio edito, p. 29, sl. 30. a. ubi flagitat metrum बुध् pro बुड्. — c. करेषु edd. et P. contra versum. Iidem eodem modo mox peccant ponentes अचेतनेषु.

Dist. 153. c. Transponunt edd. et codd. खला भोगेषु (P. solus singularem भोगे praebet). Transpositionem a nobis factam postulat versus. — d. न च om. S. अलं substituit L. utrumque vitiose.

P. 74. Repetivit deinde editor Lond. distichon hocce, desumptum e codice Wilkinsii, qui praeterea alium slocum exhibit, in omnibus nostris libris omissum:

मूलं भुजंगैः कुसुमानि भृङ्गैः शाखाः प्लवंगैः शिखराणि भष्टैः ।
नास्त्येव तच्चन्दनस्य पादपस्य यन्नाश्रितं डुष्टैः कुपङ्गैः ॥

Claudicat metrum in hemistichio quarto; corrigere: दुखतरणैः, nam mutatio litterarum dentalium in cerebrales hic locum non habet. SCHL. — Eandem ob caussam in hem. c. certa emendatione scribendum est चन्दनपादपस्य. Composita enim talia, in quibus nomini proprio epitheton vel apposito adiuncta sit, valida gaudent auctoritate. En aliud exemplum, Bhartrih. p. 37. काविनीकायकान्तारे कुचर्पद्धतिरुम्भिः । मा संचर मनःपात्य तत्रास्ते स्मरतस्करः ॥

Lin. 20. init. दमनको ब्रूते । अयं etc. L. et codd. Absurde, quum post l. 11. nulla alia persona fuerit locuta. — मा desideratur in edd.

Dist. 154. a. . . . पाणिवार्द्ध L. corrupte. — Non sunt in promptu exempla formae caussativae verbi शृं cum praepositione अ॒ compositae; sed, ut ex hoc loco patet, उत्सार्यति significat *vacuefacit*. Teste Wilsone उत्सारक est *ianitor*, nimirum quia homines importunos ab aditu arcet. Magnopere igitur differt प्रोत्सारित a प्रसारित quod supra legitur I, 46. Neque hoc mirum: nam quaecunque praepositio proxime antecedit, praecipue sensum verbi determinat. SCHL. — प्रोत्सारिताङ्कासन adiective dicitur de homine, qui alii dimidium sedilis, cui ipse insidet, cedit; प्रोत्सारितं अङ्कासनं येन तः; est autem, quod vix annotatione eget, ad विधिः referendum. Huius moris exemplum si quaeris, cf. Arjunasamāgama. a Boppio editum p. 97, sl. 56. ददावर्द्धासनं प्रोत्सारितः शक्तो मे ददतां वरः । — b. ददावरः edd. minus apte. — c. अन्तर्मूतविष्णे

P. 75. L. — d. pro अशूर्व codd. अतीव.

Lin. 5. पश्य ex codd.

Dist. 155. hemistichia a. et b. inter se transposita praebet S. — b. मदान्यकारिणां L. contra metrum. — b. दर्शेष्यान्यै edd. et Pp. Praestat locativus propter anteced. — c. pro यत्र edd. यस्य, quod ferri posset, sed melius huc convenit casus septimus. — d. pro मन्ये codd. प्रायो.

Lin. 8. Pro ब्रूते edd. पुनर्निश्चय; P. स्वगतं, omissio ब्रूते । Nos hoc vocabulum infra l. 11. collocavimus, ubi melius quadrat. Utroque loco om. edd. — Pp. शुगतं, commate praeterea post ब्रूते posito; quod cum statim seqq.

conciliari nequit. — निपातितव्यः edd. et P. mendose. सिंहे निपत्तिः Pp. quod P. 75. prorsus alium sensum praebet.

Dist. 156. omittitur in codd., in ed. S. et interp. Jonesii; satis tamen se ipsum commendat atque agnoscit W.

Lin. 11. न जाने ad finem commatis reiiciunt edd.

— 12. च et मोः एव om. edd.

Dist. 157. c. Pro एव Pp. एव mendose.

— 158. a. Pro तेजः S. भेदः, minus bene. — d. इतस्ततः || Pp.

Lin. 17. *init.* तत् codd. — संयामे L. — आश्रियतां Pp. perperam; pro hoc verbo L. वरं। — In fin. अयुक्तं edd.

Dist. 159. a. प्राप्त्यामि S. — b. श्रन्तुं हत्वा edd.

Lin. 20. युक्ते edd. minus bene; poni debuissest genitivus; vel huic anteponendum est cum codd. compositum.

Dist. 160. a. Pro मृत्युः Pp. नाशः — c. तं कालमेकं Pp. तं कालमेक P. एकयुक्त, si omnino dici posset, ab hoc loco sine ullo dubio esset alienum. Legitur distichon in codd. et S. infra p. 114, l. 13. Praemissum est ei ibi in S. *dist.* 161. Var. scripturae infr. haec est: 160. a. pro मृत्युः codd. नाशः; pro मृत्युं S. धूतः. — c. तं कालमेकं . . . S. — 161. a. अभियुक्तो यदा . . S.

Distt. 161. et 162. Desunt heic in codd. et S.; inserenda curavimus P. 76. ex L., utroque interprete adstipulante. — 162. b. मृते वापि ex coniect. pro मृतेनापि; quia particula disiunctiva in tali positione omitti non potest.

Lin. 5. ex codd. — Edd. pro प्रकाशं praebent: एतचिन्तायित्वा संजीवक आह। — कथय om. edd.; pro मया exhibent मां, इति denique omittunt.

Lin. 6. Pro पिङ्गलकः edd. स्तब्धकर्णः, quod cum seqq. conciliari nequit. Cf. infr. linn. 19. et 22. — Pro उन्नतचरणः S. सन्नतपादः, codd. समुन्नतचरणः. — तं पश्यसि 'S. quo quid absurdius excogitari nequit.'

Lin. 7. त्वमेव edd.

Dist. 163. c. . . . दीयते . . edd. inepte.

Lin. 10. एवं abest. a L.

— 11. Pro न आह edd. दमनकेनोक्तं, pro अयं in fine. असौ.

— 12. कोऽत्र संदेहः L.

Dist. 164. a. दुष्टानां edd. — b. कुप्यते को न याचितः || L. male.

— 165. a. धुर्तैः L. mendose. — b. हितेष्या S.

— 166. abest ab edd. et interpp. h. l. Cf. ad p. 120, l. 17.

Lin. 19. ततः om. S. — पिङ्गल Pp. — In fin. तत् Pp.

- P. 76. — 20. इत्युक्ता abest a P. — पूर्वोक्ताकारं L. — अथ om. L.
— 21. आगत्य L. सन् desideratur in edd. — विकृतिमापनं S. Eadem scriptura ante oculos fuit librario Pp. qui tamen alterum vocabulum omisit. — Pro दृष्टा S. अवलोक्य.
— 22. Pro महाहवे L. युद्धे, omisso वृत्ते. Transponit S. वृत्ते महाहवे, quod contra leges orationis solitae est. — पिङ्गलकः ad व्यापाय reicit L.

P. 77. Lin. 1. संज्ञीवके सेवकं L. — इव तिष्ठति । L. इव व्यातिष्ठत् S. ubi praeterea ब्रूते omissum est. Pro अवस्थितः P. आस्थितः । — ब्रूते च L. — मया निष्करुणेनास्तिशृणुपं कृतं । S. कर्म desideratur etiam in Pp.
Dist. 167. a. विज्ञ codd.
— 168. c. . . प्रणामं Pp. — d. नष्टापि edd. et Pp. हि unice huc facit. मूलोः L. perperam. In versu priori anacoluthon est, cuius aliud exemplum me nullum deprehendere memini.
Lin. 8. Pro नयो edd. न्यायो.
Dist. 170. a. धर्मार्थकामतन्त्वतः edd. — Pro नृः codd. अपि, minus bene, quum de regibus h. l. sermo sit, atque haud commode subiecto careat sententia. — c. pro अर्थं L. अन्तं atque mox भक्तिं pro रक्षितुं.
Dist. 172. c. Pro हि edd. et P. तु. — d. जीवोत्सर्गात् S. sed tum अपै etiam ablativo casu poni debebat.
— 173. d. त्याग्या अमी सप्त कृतं न वेत्ति यः । codd. et S.; L. in eo tantum differt, quod pro अमी praebet इमे. Emendationem flagitabat versus. Corruptela inde repetenda est, quod ab aliquo margini adscripta fuerit vox सप्त, quae quum in textum irrepsisset, ad finem versus reiectum est pronomen यः, omissa est copula, qua carere nequit haec sententiae pars, atque turbatum est metrum.
Lin. 19. Verba: इत्यं et quae seqq. desiderantur in edd.
Dist. 174. Auctor est Bhartrihares; vid. ed. Ser. p. 54. ubi pro रत्न editum est नित्य, pro वेश्याङ्गना autem वाराङ्गना; hoc vocabulum praebet etiam S.; retinuimus वेश्याङ्गना propter consensum codd. et L.; ad sensum nil refert. Pro रत्न codd. et S. मित्र; W. रत्न legit, J. मित्र. — नित्य ab hoc loco alienum est atque ex praecedente vocabulo intrusum videtur; praetulimus रत्न, quia melius cum antecedente नित्यव्याप्ता, cui oppositum esse debet, congruere visum est; si sequens वेश्याङ्गना tantum respicis, optime se habet मित्र.

Lin. 1. समुपविष्टः edd. qui mox अय omittunt. — Verba शुभमस्तु सर्वज्ञगतां P. 78. desiderantur in ed. S.

— 3. इति सुहृद्देदः Pp. — श्रुतस्तावद्विष्टः edd. — सद्वृत्ताश्च भूता वयं Pp. — Edd. aliter: भवत्प्रसादात् श्रुतः सुविनो भूता वयं ।

— 4. पुनरेवाल्लु P. sed subiecto इदं nequit carere locus. Edd. = अपरमपीदमस्तु ।

Dist. 175. d. कथारम्भे रथ्ये सत्तं etc. edd. Irrepsit prius vocabulum ex initio libri sequentis.

Lin. 1. कथारम्भे, omissio काले, P. — उच्चः, antecedente राजपुत्राः, edd. — P. 79. नः desideratur in Pp.

— 2. तदेव, om. L. एव tantummodo. S.

— 3. विग्रहः om. edd. male.

— 7. स च om. Pp. स्म substituit P. quae particula ad antecedens verbum referenda foret; sed omitti nequit pronomen स, quippe quo omissio caret subiecto sequens sententia.

— 8. राज्ये, omissio पञ्चि, P.

Dist. 2. b. प्रजाः Pp. et L. quod cum seq. singulari haud congruit.

— c. अकर्णधारो, L. vitiose. — d. विष्ववेत हि S.

— 3. a. . . रक्षति हि . . . P. — d. pro सद् Pp. तद्, quod nullum praebet h. l. sensum.

Lin. 13. Pro कमल S. कनककोमल, P. सुवर्णकमले, hoc ferri potest, quia aurei flores poetica licentia dici possunt; illud absurdum est, nisi fortasse Sriramapurae molle aurum effoditur. — स्व om. edd. — वृतः sine praepositione S.

— 14. Pro तिष्ठति Pp. आसीत्. Pro ते L. ततः, pro देशात् S. द्वौषित्.

— 15. Pro दीर्घमुखः edd. सः. Semel sit h. l. monitum, in seqq. libris nomina propria a nobis posita esse, quotiescumque aliquis librorum supeditaret, ne eis omissis narratio obscurior fieret; quod lectori edd. saepius contingere non haesitans contendō, ipse hanc rem experientia edocutus.

— 16. तां वक्तुं सत्वरमागतोऽहं । L. — आव्यातुकामः S.

Lin. 2. निकरसति edd. et P. — दग्धारण्यमध्ये edd.

— 3. असीति P. Particula इति, ut saepenumero in codd. manuscri-

P. 8o. ptis, prorsus est otiose addita. — Pro ततो edd. तदा. — अहं om. L. male. कर्पूद्वीप S. et codd. quod si secuti essemus, incommodum genitivorum geminorum concurrentiam evitavissemus. राजचक्रवर्तिनः L.

— 4. हंसराजत्य S. Quod una manu largiuntur edd. isti, altera eripiunt; quem mox fecerant imperatorem, eum nunc in regem commutant. — अनुचरोऽहं L. — आगतोऽस्मि L.

— 5. Pro एतत् S. et P. तत्. — Init. incisi seq. तत् omissio, pergit L.: अनयोः (sic) देश्योः को etc., minus bene. ततो desideratur in L.

— 6. अन्तरमनयोः Pp. — Prius द्वितीयः om. codd. et S.

— 7. स्वर्गायतिरिन्द्र इव S. — स्वर्गायतिरेव Pp. इव haud displicet. — तदू om. edd. — पतिक्वा S. et P. — यूँ om. P. et S. युँ L. mendose. किं यूँ Pp. — देशे L.; nominativus praestat, ferri posset accusativus, vitium est locativus.

— 8. ततस्तद्वचनं P. — ततस्तद्स्वद्वचनं Pp. — Pro ते पक्षिणः L. सर्वे.

Dist. 5. b. Pro तु Pp. च; male. — c. अथ pro अज्ञान् L. et Pp. — d. स्वानभाषा: L.

Lin. 13. पर्वतेष्यकार्यां abest ab edd.

— 14. प्राल्मलिस्तरः Pp. compositum, nisi fallor, in tali iunctura usitatus est. — निजचञ्चुनिर्भित S.

— 15. वर्षास्वप्य सुखं वसन्ति S. निवसन्ति सुखेन वर्षासु L. — अथ कदाचित् codd. — नीलपटलैश्चिक्षि edd. — जलधृपटलैः P. — जलधृपटलैः Pp. et S.

— 16. et 17. ex codd.; contra L. = ततो वानरांश्च तरुतले वस्तितान् प्रीताकुलान् कम्पमानान् अवलोक्य कृपया etc. S. = तत्र तरुतले वानरांस्तित्यतः प्रीतात्कम्पमानान् अवलोक्य etc.

Dist. 6. in S. praemittitur शूयतां, in L. शृणुत. — d. सौदत Pp. male.

Lin. 20. गर्भावस्थानसुखिनः S.

— 21. पक्षिणः abest a Pp. — तदू om. L. तावत् desideratur in S.

Pergit deinde post verbum उपशमः L. अनन्तरं एकवानरेषोक्तं।

शूचीमुखा डुराचारा मूर्खाः पणितमानिनः ।

अशक्ता गृह्णकरणे शक्ताश्च गृह्णभजने ॥

Versus haud optimae notae in nullo alio libro reperiuntur atque sine ullo damno reiici poterant, uti fecimus. Pro शूचीमुखाः legendum esse videtur शुचिमुखाः। *Lass.* — Mallem सूचीमुखाः, derisores qui ore quasi pungunt. *Schl.*

Lin. 22. पानीयवर्षे consensu librorum defenditur, quanquam negari nequit, mirum esse vocabulum. — वृक्षं edd. — तेषां पक्षिणां Pp.

Lin. 1. Verbis राजा हृतस्तः omissis statim ad sermonem Dīrghamu- P. 81.
khi pergit S. *Lin.* 2. Pro ततस्तः L. ततस्तैः किं कृतं। Verum formula ततस्तः
hominis est, impatienter aliquid ex alio quaerentis et saepenumero hac
vi in dramatis Indicis usurpata; neque semel in ipso hoc fabularum
libro legitur. — Pro पञ्चमिः L. तैः, quod pronomen deinde excipitur a
vocabulo कोणात्. — तब om. L.

— 3. राजा कृतः edd. — अपि abest a L. — Pro अयं ते S. शुभदीयं.

— 4. ते सर्वे S. — Pro ततः Pp. अतः — अपि ad सुविक्रमः trahit P. quod
falsum est; अपि enim postpositiva est particula, hoc autem loco oppo-
nuntur sibi ते atque मया, non हनुमुथाः atque स्वविक्रमः. Pro स्वविक्रमः L. सुवि-
क्रमः, male lectis litteris स्व et सु, quae quidem apud Bengalos facillime
confunduntur.

Dist. 7. a. पुस्तौ edd. qui etiam mox b. योषितां ponunt. — d. वैजात्यं edd.
et Pp. Frequens est commutatio litterarum न et न in libris Bengalicis
atque ab hodierna pronuntiatione orta. — सुरथेभिव Pp. stulte.

— 9. b. अयः प्रस्तं codd. अयः प्रश्नत्य् L. Displicuit comparativus अयः h. 1.

Lin. 11. विलासो नाम, priore nominis parte reiecta, edd.

— 12. अतिवाहनात् edd. अतिभाएवहः Pp.

— 13. अरण्यसमीपे L. — क्षेत्र om. S. क्षेत्रे, omissa मध्ये, L.

— 14. तं om. L. — आलोक्य S. — व्याघ्रबुद्ध्या तमवलोक्य codd. quae trans-
positio prorsus est inepta. Incisum स च et quae seqq. om. S.; substituit
L. गर्दभस्तश्चायमक्षणादूदिने दिने पुष्टाङ्गोऽभवत्।

— 15. अर्थैकदा S. — . . . रक्षकेण धूर्वेन Pp. — धनुःकाषडं S.

— 16. . . कृत्यैकान्तस्थितः, displicet compositum एकान्तस्थितः, nominativus
contra grammaticam peccat. अतिदूरे Pp. अदूरे P. — स गर्दभः Pp. et S. —
जातबलः om. L. amplificavit S.: यथेष्टश्चायमक्षणाजातबलः.

— 17. Pro मत्वा S. ज्ञात्वा, Pp. कृत्वा, illud falsum est, hoc sensu desti-
tutum. — उच्चैः प्रावृद्धं S. — स धावितः L. — धावितः S. et P. — ततस्तेन om. L. —
प्राप्त्यरक्षकेणa edd.

— 18. Pro ज्ञात्वा Pp. मत्वा, male. इति चौत्कारप्रबद्धान्वित्य S. — लौलयैव S.

— 19. राजा हृतस्तः । om. edd. — Pro पञ्चात् तैः edd. ततः.

— 20. . . कक्ष अस्माकं भूमौ चरन्नस्माकं edd. — इदानीं om. L.

— 21. अस्याभिः abest ab edd. — सकोपं P. — *Lin.* 22. स हंसस्तव राजा edd.

— राज्याधिकारः S. — एव desideratur in edd. — एकान्तमूदुः edd.

Lin. 1. स्वं pro गतं edd.

P. 82. — 2. किं तत् तत्य codd. quae verborum positio praestare videtur. तत् abest ab edd. — किंतु त्वं च edd. Alterutra particula abundat; praetulimus cum codd. च; copulam postulat etiam sensus, non adversativam particulam. — मण्डूकतमा L. quod quid sibi velit, haud assequor.

Dist. 11. c. et d. Pro hoc versu substituunt codd. alium: परोऽपि ग्रौषिङ्गनीहस्ते वारुणीत्यभिधीयते । eandem scripturam ante oculos habuerunt interpp. quanquam W. mirum in modum sententiam sit interpretatus. Consentient cum codd. etiam edd. In S. tamen exhibetur versus, quem nos propter priorem distichi versum, quocum egregie convenit, non poteramus quin praeferremus, statim post versum a nobis reiectum, cum annotatiuncula hac marginali, quae per se optima est, sed in ore gruis prorsus ridicule audit: कुत्रचित् पुस्तकेऽयं पाठः । Cf. Praefat. partis prioris, p. IX. In ed. L. interpositus est aemulis hisce versibus slocus integer:

न स्थातव्यं न गतव्यं क्षणमध्यस्तता सह ।
असतां संगमो मृत्युः सतां संगो हि भेषजं ॥

Prior versus ex dist. 22. a. et b. variatus esse videtur.

Dist. 12. b. निर्गुणो L. inepte. Verba आधाराधेयमाक significare videntur *facultatem in arctum spatium contrahendi*. Intellige speculum concavum.

— 13. a. व्यपदेशेऽपि edd. — d. fin. सुखमेधते Pp. et L. mendose.

Lin. 11. ततो मया codd. — अपि ante वर्षासु exhibit S. male; abest omnino haec particula a Pp.

— 12. कोऽप्युपाय L. inepte. कोऽप्युपायो S. et P. cuius vocabuli sensus est diversus, neque huc facit. Addit हि vim interrogationi. — जीवनाय om. edd.

— 13. *init.* नास्ति, omisso अत्र, edd. absurde. — निमज्जनस्थानाभावात् S. Pro अन्धा: S. मृतार्हाः, insulse. वभामः om. S. कृ यामः substituit L. Obiter moneo, scribendum esse hanc radicem per litteram initialem त्र, non per त्र; est enim verbum irregulariter per reduplicationem derivatum et corruptum a भ्रम, quasi pro ब्रम्यम, quae forma frequentativa legitur Mund. Upan. p. 14, lin. 12.

— 14. किं वा कूर्मः (sic) L. — किं कूर्मः कृ यामः (sic) S. — तेषां ex codd.

— 15. *init.* ततो दिनेषु गद्यत्यु S. — स्थिताः P. — गजयूथपदाहतिभिः L. — गजपादाहतिभिः S.

— Scribendum est omnino पाद्, quod praebent etiam codd. — कुद्धमाप्ताकाः S. quod vocabulum praeterea in fine sententiae collocat. — चूर्णिता व्यूक्तुः L. चूर्णिकृताः P.

Lin. 16. सर्वान् आहूय insertum est ex P. — विचारयामास ex coniectura pro P. 82. चिन्तयामास, quod huic loco minime est accommodatum, ut verba mox seqq. satis superque demonstrant.

— 17. एव abest ab edd.; praebent etiam अतो pro ततो. — चिन्त्यति S. — Pro अथ edd. ततः

— 18. मा विवेदत desideratur in P.

— 19. ततो pro इति S. male. — असौ om. L. — मया abest a S. ubi pro निकटे dictum est समीपे.

Dist. 14. Desumptum est ex Rameide. Cf. Lib. II, XXVI, 55. ed. Schl.

Lin. 1. *init.* अथ pro अतः L. male. — निवेद्यामि pro वक्ष्यामि L. संवाद्यामि S. P. 83.

— तेन तथा S.

— 2. Pro इतः S. प्रश्नकः. — भवदन्तिकं प्रेषितः S.

— 3. शृणु गजेन्द्र additum ex Pp.

Dist. 15. c. et d. सदैवाबध्यमावेन यथार्थस्य हि वाचकः || edd. Praetulimus scripturam codd. quia hoc praecipue inculcandum erat hoc versu, nunquam laedi debere legatum, vel ingrata proferentem. *Lass.* — Recte quidem hoc monuit Lassenius noster; sed hanc ipsam ob caussam neutra lectio mihi prorsus satisfacit. Nam यथार्थं significat *apte, accommodate*; cf. *Col.* ad *Am. Co.* Praeterea omnes, tum codd. tum edd. in genitivo conspirant; at vehementer dubito, an hoc vocabulum, quod ab Amarsinha inter indeclinabilia duntaxat recensetur, nisi aliud quid accedat, pro adiectivo usurpari possit. In nostra scriptura facile est supplere अ privationis: ते यथार्थस्य, et omnino sic scribere debebamus. Manet tamen contractio particulae अपि ante caesuram, paullo durior. Mallem legere: अयथार्थस्य वक्षापि त शब्दाध्यो भवादृप्तां। nisi haec foret nimia emendandi licentia. SCHL.

Lin. 6. *init.* तदा pro तद् L. male.

— 7. Pro न भञ्जे codd. न युक्तं, S. अनुचितं. — ततो Pp. male. प्रश्नकाः ante ते inserit idem, prorsus otiose. — S. = ते प्रश्नकाश्चिरमस्माकं रक्षिताः। omisso यतः. — L. = यतोऽस्त्रौयरचकाः, quod absurdum est; nam subiectum et obiectum in unum vocabulum compositum congregari nequeunt. — लोके ex P. — मम pro मे L. — Pro इति P. एव, male.

— 8. स om. edd. — आह ! प्रणिधेहि इदं etc. S. Significatio verbi प्रणिधा huic loco accommodata nulla mihi innotuit.

— 9. न गमिष्यामि L. Pro hoc verbo substituit S. कर्तव्यं. — यथेवं तदत्र etc.

P. 85. S. — प्रकृत्यमाणं Pp. Ingratam hanc praepositionis ए repetitionem evitavit L. scribendo कोपात् प्रकृत्यमाणं; utriusque vocabulo praepositionem demit S. भगवन्तं चन्द्रमसं L. भगवन्तं प्रश्नाद्वं S.

— 10. प्रसाद्य प्रणाम्य Pp. copulam omittit S. quoque, ordinem verborum ipso sensu commendatum servat. — तेन om. S. — तं नीत्वा Pp. यूथपतिं नीत्वा S. Utraque scriptura, ex studio perspicuitatis, ut videtur, orta, constructionem prorsus evertit, quum eiusdem vocabuli nominativus casus in eadem sententia sequatur. — तत्र om. codd. — सर्वे इले L. male. इले, omissio हृषि. S. — चन्द्रचित्रं P. et S. चन्द्रप्रतिचित्रं Pp. — च यूथपतिः Pp. — आज्ञानादेव Pp. Particula tolerari potest, praepositio haud item. — S. = कारितः । उक्तं च तेन । देव आज्ञानादनेनापरायः कृतस्तातः चक्ष्यतां नैवं वारान्तरं विधास्यते इत्युक्ता etc. S. Verbo प्रस्थापितः praemittit L.: तेन प्रश्नकेन स यूथपतिः ।

Lin. 13. अस्मत्पूरु राजहंसः S. — महाप्रतापवान् Pp. — Post अतिसर्वः sequitur in edd. ब्रैलोक्यस्यापि प्रभुत्वं तत्र युद्धते । Hisce verbis addit porro S.: किं पुना राज्यमिति । Pro अय S. तदा. — तैः om. Pp.

— 14. बदूषा abest a S. in qua editione interrogationi कथं praemittitur हुषः ।

— 15. पुरतः L. — उपदिश्य L. प्रश्न्यं S. — तैः ante प्रणाम्य collocant edd. — हुष L.

— 17. राजहंसत्य post nomen Hiranyagarbhi collocant edd.; omissio राजः, हिरण्यगर्भनामः S.

— 18. Pro तत्र codd. तत्य. — मुख्यो edd. — ततो मया codd. — सर्वशास्त्रार्थपार्गः सर्वत्रः etc. edd.

— 19. प्रयुज्यते Pp. — Pro ज्ञातः edd. इः ।

Dist. 16. a. कुलाचारे L. कुलाचारं S. Suspicor adiective non posse hoc vocabulum. — b. . . . अथवाशुचिं S. Quocunque modo verba haec disponas, absurdum est scriptura. — c. अस्त्रं codd. मन्त्रं S.

P. 84. *Dist. 17.* a. व्यवहारं edd. — b. मैत्रं L. Culpa est editoris inconsiderate legentis; न et ल enim in scriptura Bengalica haud facile distinguuntur. — c. प्रस्तं P. — Pro सम्यक् S. चैव.

Lin. 3. मन्त्रिषुकेन Pp. — देव om. codd. आदयोऽपि codd. — लघुद्वीपाः om. Pp. — लघुद्वीपान्तर्गताः P. Fraudem fecit librario vox द्वीप bis recurrens.

— 4. अत्रापि Pp. contra nexum orationis. — . . . पादानामेव S. Si quis particulam एव huic sententiae inserere velit, is eam adverbio तत्र subiungere debet. — अधिपतं L. male.

Dist. 18. b. प्रमादी edd. — धनर्घिता Pp. perperam. — c. अभि pro अपि

edd. et P. — d. . . . लभ्यते॑ पि यत् edd. प्राप्यते तु यत् P. Sic etiam Pp. prima P. 84. manu, secunda, uti nos.

— 7. मन्त्रेण edd. — अपि abest a codd.

— 8. अस्ति desideratur in codd. minus bene, quia h. l. affirmationi vim addit verbum substantivum. — उच्यतां om. edd.

— 9. तु abest ab edd.

— 10. तदा pro तदनन्तरे॑ edd. — प्रयास्यति S. प्रस्थास्यति L. — तत्र ex Pp.

Dist. 19. d. प्रतिभानवान् Pp. Disputabat de incerta huius vocabuli significazione Boppius V. cl. ad Indralôkâg. p. 92.

Lin. 14. गृध्रो वर्द्धति deest in codd. minus recte, ut seqq. docent. — एव दूतः pro एवंभूताः edd. qui mox pro तथापि praebent किंतु atque दूतः omittunt.

Dist. 20. a. प्रसारं edd. perperam. — b. . . . नामियाचते L. et P. नामिवाज्ञति S. Neutrius scripturae vim me assequi confiteor. — c. . . . कालकुट्ट्य edd. mendose. — d. नापैतीश्वरसंगमात् L. et P. Cum his facit S. ubi tamen mendose editum est मा pro न.

Lin. 17. राजा पुनराह ex Pp. desunt verba in ceteris. — एव abest a P.

— वक्तेन om. edd. et Pp. — तत्र deest in edd. — किंवेवंदुर्ज्ञः Pp.

— 18. तद् omissio, L.: दुर्ज्ञेन सह कूचिन्न गद्यामि.

Lin. 3. उज्जयिन्यां Pp. — वर्मिप्रान्तरे॑ S. — प्रान्तरे॑ om. P. — महान् omissio, पूज्ञतरः P. 85. pro पिप्पलवृक्षः S. पिप्पलो Pp.

— 4. पथि आन्तः Pp.

— 5. init. पान्थस्तत्र Pp. Pro तत्र L. तत्. — च om. edd. — संनिधाय edd.

— तत्काषे P. — तत्काषेन Pp. Pro ततः L. तत्र.

— 6. Pro अनन्तरं edd. ततः.

— 7. Loco तद् L. exhibit कृपया, quod verbum omnino abest a P. कृपया तद्वक्त्वा etc. Pp. . . . स्थित L. — पुनस्तत्र om. L. पुनस्तम्बुद्धे॑ S.

— 8. सुखेन L. — तेन om. P. अध्युगेन abest ab edd. — परं om. edd. pessime. Initium huius commatis usque ad तम्बुद्धे॑ desideratur in P. — स्वभावादौर्ज्ञेन Pp.

— 9. तत्य सुखे॑ L. तत्र सुखे॑ S. — यावद् abest a L. असौ a codd.

— 10. Pro सहस्रोत्याय S. पान्थ उत्थाय. L. om. सहसा. — Pro वृक्षाद्यं edd. et P. अद्यूष्म; pro निरोक्ते॑ L. पश्यति. Post तेन pergit P. हंसो॑ वलोकितः॑ काएडेन हत्वा व्यापादितश्च॑. Copulam Pp. omittit; recte, nisi legatur हत्वो. Nos secuti sumus S. addita tantummodo copula in fine commatis. L. = तावद्वंसो दृष्टसेन प्रारेण हत्वा व्यापादितः॑.

— 11. अतोऽहं ब्रवौमि et quae seqq. om. S. Post इत्यादि hosce versus ceteris ignotos inserit L.:

P. 85. यतः । त्यज दुर्जनसंसर्गं भज साधुसमागमं ।

कुरु पुण्यमहोरात्रं स्मर नित्यमनित्यतां ॥

देव वर्त्तक etc. L. — Pro वार्त्तां S. कथा.

Lin. 12. Mutat constructionem S. ए० भग० ग० वा० सर्वे पक्षिणः । — समीपया-
त्राप्रसङ्गेन Pp. idem vult P. praebens: ग्रन्तीयत्राप्रसङ्गेन; neutrum quid sibi velit,
nimis intelligo.

— १३. Pro प्रचलिताः L. et P. चलिताः, S. गताः. — Pro तत्र S. ततः male.
— गोपस्य L. गोपलकस्य P.

— 14. मस्तकावस्थितस्य P. शिरसि स्थित L. abest utrumque a S. — खायते edd.
खादितं codd. — दधि L. perperam; est praeterea inopportuno loco colloca-
tum, ante वारं.

— 15. Pro निधाय P. धूत्वा.

— 16. Contra consensum codicum et editorum pro खेदितः legendum esse censeo: खेदितः । Istud quidem est participium legitime formatum a caussativo radicis खिद्; sed significatio huc non quadrat. Verbum minus usitatum खिट facile a librariis corrumphi potuit. SCHL. — काकश्च Pp. qui mox प्राप्तः om. — Edd. = वर्जकः (deest च) खभावनिरपाधो मन्दगतिस्तेन प्राप्तो etc.

— 17. दुर्जनेन न ग-तव्यं इत्यादि Pp. sed cf. dist. 22.

— 18. श्रीमद्देवस्तया S.

— 19. एवमस्तु किंतु L. अस्त्येवं किंतु P. अस्त्येवं किंच S. किंच huc non facit; in formula hac, quae per se concessiva est, sed ita usurpatur, ut statim restrictio sequatur, praesens frequentioris esse usus videtur quam imperativus.

Dist. 23. b. संमितानि Pp. संमतानि L.

Linn. 21. et 22. दूर्जनत्वं (horrendum vocabulum iam in dist antec legitur) भवतो वाक्यादेव ज्ञातं यद् etc. S. — च om. P. — तत्र वाक्यव्यापारादेव Pp. — मया om. L. — यतोऽन्योः etc. codd. quod ad idem redit (utrumque enim, यत् et यतः, h. l. valet *quia*) sed in hoc praestare videtur codd. scriptura, quod ex ea constructionis ratio manifestius appareat.

Dist. 24. a. प्रत्यक्षेण कृते . . codd. — b. शान्तेन S. et P.

Lin. 3. यौवन desideratur in L.

— 4. एव om. edd. male. किंतु quoque S. *pessime*. Cetera verba praebent edd. alio tamen ordine eoque minus apto.

— 5. हि quanquam insolentius in hac positione propter auctoritatem utriusque codicis recepimus. — अहं om. L. — गमिष्यामि id.

- 6. लू ex codd. Dictum est de hac constructione supra ad p. 35. P. 86.
 1. 18. — खद्वातलं प्रविश्य L. खद्वायां, omissio gerundio, S. — निभृतं om. codd.
 — 7. Pro मम भर्ता S. et codd. रथकारः. — प्रजात P. — तथा om. Pp. —
 Brevis, sed minus bene L. = इति विश्वासात् ज्ञारः. S. = इत्युपज्ञातविश्वासः स ज्ञारः
 संध्याकाल एवागतः.
 — 8. एव desideratur in L. — हृतः sine praepositione Pp. — सह pro
 सम् L. — सा om. L. सा निर्भरेत् om. S. — क्रीडति L.
 — 9. खद्वातले किंचिद् etc. L. खद्वातलस्थितस्य भर्तुः किंचिद् etc. S. खद्वातलेन (corr.
 तले) स्थितेन तेन सह भूता किंचिद् etc. P. — स्वामिन् मायाविनमिति विज्ञाय S. — सा विषएणा
 L. et P.
 — 10. Pro किमिति L. किं, omissio त्वं — रमति L. Minus usitatum est
 activum huius verbi.
 — 11. विस्मित एव L. absurde. — प्रतिभासि P. stulte. — प्रतिभासि मे त्वं S. —
 अय तयोऽन् । शृणु नूर्ख योऽसौ मम प्राणेश्वरः etc. Pp. Aliam prodosin praebet S.:
 अनन्निज्ञोऽसौ मम प्राणेश्वरो येन गमाकौमारं सख्यं सोऽय एति etc.
 — 12. विना om. codd. et L. quo facto, तेन accipendum foret pro
 अतः, quod re vera eius loco praebet Pp. — अयं om. S. — ग्रामो मां प्रति अरण्य-
 वत् भाति S. ग्रामो मां प्रत्यरप्यवत् प्रतिभाति P. ग्रामस्तावन्मां प्रत्यरप्यमिव प्रतिभाति L. — किं भावि
 et quae seqq. usque ad virgulam desiderantur in codd.
Linn. 14. et 15. Post virgulam तत् किं etc. L. quem ceterum in hoc in-
 ciso secuti sumus. Codd. et S. in diversa abeunt: S. तव किमेवं स्नेहभूमी रथकारः ।
 बन्धकयवदत् । रे बर्बर किं वदति । P. = किं एवंविधः स्नेहभूमिः स ते रथकारः । बन्धकौ वृते । शृणु
 रे बर्बर किं त्वं ब्रवीषि । Pp. = किमेवंविधः स्नेहभूमिः स ते रथकारः । तत् कथमेवं करोषि । बन्धकौ
 ब्रवीति । शृणु रे बर्बर किं ब्रवीषि ।
Dist. 25. a. या प्रोक्ता S. — c. या L. मुखा P.
 — d. भाजनं P.
 — 26. d. तासां लोके सुखोदयः L.
 — 27. a. नार्याः edd. — c. . . हि रहिता . . Pp. — d. श्रोमनापि
 न श्रोमना edd.
Linn. 1. च ex codd. — ज्ञारः पापमतिर्मनो etc. S. — . . कर्दाचित् सेव्यसे कर्दाचिन्न P. 87.
 च S. — स च मे स्वामी Pp.
 — 2. विक्रेतुं om. P. — Pro वा edd. अपि, minus bene. — Pro सर्वयः S.
 ईश्वरः. — सर्वयः स्यात् L.
Dist. 28. Accidit nescio quomodo, ut hoc distichon in codd. et
 ed. Ser. prorsus fuerit corruptum, ita ut orationis solutae more scribe-

P. 87. *return*: S. = तस्मिन् जीवति जीवामि तन्मरणे चानुमरणं करिष्यामि इति प्रतिज्ञा वर्तते । — इति निश्चयः in fine Pp. cetera ut S. neque melius quidquam e P. erui potest. Recepimus igitur scripturam ed. L. emendato tantum hemistichio c. ubi editum est contra metrum: तन्मरणे चानुमरणं.

Dist. 29. a. . . . कोट्यर्हकोटी च L. corrupte; corruptius S. . . कोट्य०-दूर्दकोटी च. Tribuitur hoc distichon vetustissimo vati, Angirasi. Vid. RÉMUS. Mélang. Asiat. T. I, p. 393.

— 30. d. तेजैव सह मोदते । Pp.

— 31. Abest a codd. et interpret. Wilkinsii, qui tamen aliud ex suo codice protulit, ab editore L. receptum:

यस्मै दद्यात् पिता वेनां भ्राता चानुमते पितुः ।
शुश्रूयेन्नीवितं हि तं वृत्तं चानुशयेदिति ॥

Corrigendum est शुश्रूयेन्नीवितं तं हि et अनुशयीत च. — वृत्तं h. l. significat *mortuus*, quo sensu in legum codice haud semel reperitur. Ceterum in dist. 31, hem. c. editum est in ed. S. कृत्वामि पापं श्रातसंख्यमप्यसौ, quod propter particulam अपि bis in eodem hemistichio obviam et productam primam syllabam minus placet.

Lin. 12. सर्वं abest a P. — . . . रथकारोऽवदत् । धन्योऽहं यच्येदृशो प्रियवादिनो स्वामिकत्सला भार्या इति etc. S. — Pro सहजकत्सला L. स्त्रैहवती, cetera ut nos, modo च omittit l. 13. — P. pro एतादृशो exhibit ईदृशो, in ceteris cum nobis facit; neque dissentit a nostra scriptura Pp. nisi in eo, quod post धन्योऽहं inserit: इत्यभिधाय, quae varia est lectio mox seq. निधाय, alieno loco inserta.

— 13. जार् pro पुरुष Pp. — शिरसि pro मूर्धि codd. — Pro चिरं S. सानन्दं; abest a codd.

— 14. नृत्वान् P. — Pro ततः L. et Pp. अतः, quod vel propter mox praemissum अतः displicet.

— 15. . . . व्यवहारेण codd. — आगाङ्गेव आस्ते Pp. De आस् verbi auxiliaris partes agente dictum est ad p. 47. l. 13.

— 16. ज्ञात्वा pro विज्ञाय L. परिज्ञाय S. — अनुसंधीयतां S. इति ante virgulam inserit L. male.

— 16. Vox चक्रवाक् infra l. 21. recurrens fraudem fecit qui codicem. P. exaravit, ita ut omnia, quae hisce duobus vocabulis interponi debebant, oculos eius fugerent.

— 17. Pro वक्तेन Pp. एकोऽपि, prorsus absurde. — देशान्तरस्यि Pp. et S. P. 87.
Otiosa est particula. देव post किंतु inserunt Pp. et S. — Pro एष L. एव.

— 18. मूर्खाणां om. Pp.

Dist. 32. b. इति विज्ञस्य संमतं ॥ S. In Pp. primum distichi hemistichium tantum, adiecto इति, legitur.

Lin. 21. Omnia usque ad चक्रवाकः desiderantur in Pp. — Pro अलं S. किं, quod h. l. ad idem fere redit. — Pro अतीते L. अनेन.

Dist. 33. a. Pro वर्णा Pp. कर्णा; male. — प्रतिधूनैः edd. — b. pro गात्र edd. P. 88. वक्तु. — c. मनो धीरा: edd. et Pp. Addit ed. S. sola aliud distichon, W. etiam ignotum, verum a Jonesio, ut videtur, Anglice expressum: आकारैरिडितैर्गत्या चेष्टया भाषणेन च । नेत्रवक्तुविकाराम्यां ज्ञायते ॒ नर्गतं मनः ॥ Cf. ad II, dist. 46.

Lin. 3. Alterum ततः om. L.; utrumque S. — स्थितः S. minus recte.

— 4. एवं S. quod haud prorsus est spernendum. — प्रेरणाय edd. male.

Dist. 34. a. श्रीमान् codd. — b. व्यसनी च Pp. व्यसनीयः edd. per-
peram. — d. सद्दर्पो नृपतेज्जेनः (sic) S. corruptissime.

Lin. 7. Pro निरूपणैयं codd. चिन्तनैयं, omissio पश्चात् — यथा संप्रति यत् Pp. quod ferri potest, in primis si sequatur तत् तया. — Pro ब्रूहि S. निरूप्यतां.

— 8. Pro गवत् S. प्रहीयतां, L. प्रस्थीयतां omissio तावत्.

Dist. 35. b. . . . कार्यावलोकने edd.. Praestat विलोकन, quia praepositioni कि inest vis *distinguendi*.

Lin. 12. वक्तः om. edd. — द्वितीय codd. — Sequens incisum concinnatum est ex discrepantibus inter se librorum lectionibus: S. . . . स्वयं तत्रा-वस्थाय द्वितीयं तत्रत्यमन्त्रकार्यं सुनिभृतं निश्चित्य निगच्च प्रस्थापयति । Ad haec proxime accedit L. omittit तत्रत्य et निश्चित्य, pro निगच्च exhibit संपाद्य, pro praes. प्रस्थापयति futurum ponit. Codd. usque ad अनुष्ठाय cum nobis faciunt: deinde pergit P.: द्वितीयं कार्यं सुनिभृतं समुद्ध प्रस्थापयति । Pp. in fine tantum dissentit, प्रस्थापयति exhibens. Textus, qualis a nobis constitutus est, facile defendi potest; hoc enim in consilio erat, ut speculator cum comite suo communicaret, quae exploraverit, et nuntium eum ad regem de illis certiorem faciendum mitteret.

Dist. 36. a. तीर्थाश्रमपुरस्थाने L. तीर्थाश्रमे सुरस्थाने S. तीर्थाश्रमवज्ञाने P. तीर्थाश्रमसुर-स्थान Pp. Quae lectiones omnes contra sensum peccant; emendandi igitur necessitas nobis imposita erat. हेतुना h. l. accipiendum est eo sensu, quo frequentius invenitur व्याजेन, interdum, praecipue apud senioris aevi scriptores, द्वारेण, i. e. praetextu. — d. pro स्व Pp. स.

P. 88. *Lin.* 17. गूढचारश्च यो इले स्थले चरति ततोऽसावेक वक्तो नियुद्यतां edd. Praetulimus uti debebamus, scripturam codd. in qua emendatum est वेतनो pro वेतने. — युद्यतां, omissa praepositione P. — Post नियुद्यतां pergunt edd. एतादृष्टा एव कश्चिद्को द्वितीयत्वेन प्रयातु । तदृहं etc. quae nimis prolixie sunt dicta.

— 18. तदृहं लोकश्च तिष्ठतु P. तदृहे लोकश्च — तिष्ठतु Pp. Singularis ferri potest, गृहे atque गृहं aequae corruptum est; गृह igitur recepimus ex edd. cum quibus pluralem etiam dedimus, राजद्वारे eis relinquentes. देव एतदपि शुगुप्तं etc. edd. — देवः pluralis est maiestatis; tertium casum recte intelliges, si reputabis, in passiva constructione instrumentalem casum idem valere, atque in activa nominativum; nominativus autem cum tertia verbi persona e reverentia ponitur; haec eadem est ratio formulae sexcenties in dramatis obviae: यथाज्ञापयति देवः quod reverentius dictum est quam: यथाज्ञापयति देव । Similes dictiones ex linguis Europaeis pro doctrina sua quisque comparat.

Dist. 37. b. तथा प्राप्तश्च वार्ताया S. तथा गुप्तस्य वार्ताया L. Neutra lectio sensum commodum praebet; in nostra quoque nexus secundi hemistichii cum primo est satis obscurus. Supple भवितव्यं. Similis ellipsis est his posita in dist. 16. prooem. *Schl.* — d. . . . महोमुज्जा L.

— 38. a. Pro ए पि Pp. हि. — b. भवन्ति पृथिवीपते S. भवन्ति पृथिवीपते: L. Mendosum utrumque. — c. . श्रवन्ते Pp. Aegre desideratur, praemissō relativō, in apodosi demonstrativum.

P. 89. *Lin.* 1. मम pro मया P. — देव deest in S. — तदा pro तर्हि edd.

— 2. संग्रामविजयः S. संग्रामेऽपि इवः Pp. Male posita particula अपि; nam in quanam alia re quam in bello vincere voluit rex iste? verum id dubitari posset, utrum vinceret, necne. — प्रविश्य om. P.

— 3. शुकः om. Pp. — आलोकते edd.

— 4. कृतावासे तं स्यापय पश्चादानीय द्रष्टव्यः । L. तावदल्वावासे तिष्ठतु पश्चादानीय द्रष्टव्यः S. Sequens comma om. codd. Aliis verbis expressum est in S. प्रतिहारस्तमावासस्यानं नीत्वा गतः.

— 5. समुपस्थितः S. आगत्योपस्थितः P.

— 6. चक्रो बूते S. et P. Reperitur saepius, praecipue in P. haec forma चक्र pro चक्रवाक्, quae omni quod sciam auctoritate caret, atque ex compendio scripturae orta videtur. — देव प्राप्तेव विग्रहो न विधिः । S.

Dist. 39. abest a L. et Pp. — a. स किं भृत्यः स किं मन्त्री S. — d. . . . अविवार्यन् P.

— 40. c. Pro साधितुं P. विजेतुं . . . प्रयते चारीन् edd. sensu cassum. Ce- P. 89. terum abest hoc distichon a Pp. Pro duobus huius distichi versibus quatuor nobis venditant edd. hoc ordine:

- a. विजेतुं यतते चारीन् न युद्धेन कदाचन ।
- b. अनित्यो विजयो यस्मादृश्यते युध्यमानयोः ॥
- c. साम्ना etc.
- d. साधितुं et quae seqq.

Facile nobis erat intellectu, alterutrum tantum distichon esse retinendum, versusque a. et d. minima varietate inter se differentes in caussa fuisse turbarum. Praetulimus igitur versus c. et d. receptis ex aliis libris, quae magis placerent; cuius consilii ratio est obvia; h. l. enim de varia belli fortuna nondum disseritur, sed id inculcatur, alia in promptu esse eaque minus aerumnosa remedia ad hostem profligandum. Posthabuimus igitur iudicio nostro auctoritatem cod. P. et interpp. qui versus a. et b. agnoscent, c. et d. omittunt. Dum haec typis mandabantur, obliti eramus loci in legibus Manū exstantis, qui et veram nostri distichi scripturam et caussam turbarum indicat. Locus est VII, 198. 199. ubi haec duo leguntur disticha: साम्ना दानेन भेदेन समतैरथवा पृथक् । विजेतुं प्रयतेतारीन् न युद्धेन कदाचन ॥ अनित्यो विजयो यस्मादृश्यते युध्यमानयोः । पराजयश्च संग्रामे तस्माद्युक्तं विवर्जयेत् ॥ Vides, ut hoc primum absolvam, विजेतुं genuinam esse auctoris manum, pro qua in textum Hitopadesi irrepsit साधितुं, verbum ad hunc contextum satis accommodatum. Meminerat deinde doctus quidam lector legum codicis, et adscriperat in margine versum, qualis apud Manum legitur विजेतुं etc. Hic versus, in textum inscite inventus, loco suo depulit alterum dist. 199. versum (पराजयश्च etc.); nam utrumque distichon e Manu laudasse Hitopadesi auctorem, vel inde mihi persuasum est, quod arcto vinculo inter se coniuncta sint ambo atque prius miram exhibeat quodammodo sententiam, nisi altero quasi fundamento suo nitatur. Omissio isto versu a पराजयः incipiente, et eiusdem argumenti versu bis recurrente, non potuerunt quin orirentur turbae, quibus amovendis infelicem adhibuit manum is, qui dist. 198. reiecit, 199 retinuit depravatum, neque maiore laude dignus est is, qui ordinem distichorum invertit. Restituendi igitur erunt ex mea sententia duo sloci,

P. 89. aut si quis unum tantum malit, retinendus erit is, qui a nobis est receptus eas propter rationes, quas supra indicayi. Ceterum cave ne dist. 40. d. iungas न कदाचन; nam न opponit युक्तेन ceteris instrumentt. कदाचन ad verbum pertinet: «interdum non bello, sed etc. Aliter quidem sentit Culluca-Bhattas; sed refragatur usus loquendi; न कदाचन semper significat nunquam.

Dist. 41. b. तृनासादितविग्रहः edd.

— 42. b. प्राणिभिः edd. male; — in fin. L. तथा, pessime.

Lin. 15. तथापि विग्रहः समुपस्थित (:)। व्यवहीयतां P. corrupte. — विलोक्य edd. — व्यवहीयतां edd. et Pp. perperam.

Dist. 43. a. यथाकालं समारब्धा P. sic etiam Pp. prima manu, altera, uti nos. — यथाकालकृतोयोगात् edd. — c. pro चापि edd. देव.

— 44. a. . . . द्वे . . . L. contra metrum. — b. . . . गुरुता . . . codd. — c. pro च L. et Pp. हि. — लोको Pp. et S. — d. धौरतामनुग्रहति । S.

— 45. b. . . . प्रथमः किल । edd. — d. fin. भूतलं L.

Lin. 22. देव om. edd.

P. 90. *Dist. 46. d.* . . . सृत्युमावहेत् edd.

— 47. et 48. om. P.

— 47. d. . . पक्षोद्दमोपमः Pp.

— 48. b. . . . वर्जयेत् S. et Pp. Voluisse videntur वर्जयेत्. — c. संप्राप्त-काले . . . Pp. minus bene omissa particula adversativa.

Lin. 7. शृणु देव om. edd. देव abest a P.

Dist. 49. a. . . . अल्पे . . . Pp. अपि pro copula haud frequentatur, at commonstrat sequens versus अल्पे veram esse scripturam, unde sequitur, अपि h. l. idem esse atque तथा; respondet enim वृत्तं antecedenti महत्, तृण् autem अल्प; ad infinitivum subaudiendum est ज्ञमः — b. सम एव L. quod pro समे acceptum volueritne, an pro समः, parum liquet; neutra tamen ratio hoc quadrat; सम est: *aequae*.

Lin. 9. Variant in hoc commate libri: edd. अतस्तद्दूतोऽव्याख्यात्य तावद्वियतां यावद्दुर्गः (sic utraqne ed.) सङ्गीक्रियते । P. = अतस्तद्दूतोऽव्याख्यात्य प्रस्थाप्यतां यावद् etc. Pp. अतस्तद्दूतोऽव्याख्यातां यावद्. Primum sequenti narrationi (cf. p. 92, l. 20. 21.) hoc adversatur, dimissum esse legatum istum, antequam arx exstructa fuerit; ex consilio contra fuit, eum *retinere*; अप्यतां igitur scribendum erat cum edd. Praestat etiam addere तावद्; quo adverbio addito perspicuitati admodum consulitur. *Lass.* — In utroque codice negatio ante imperativum excidisse videtur. SCHL.

Dist. 50. d. . . . विशेष्यते codd. In legum codice VII, 74. unde de P. 90. sumtum est hoc distichon, pro श्रात् legitur दशा, et विधीयते pro विशिष्यते.

— 51. a. et b. सुर्गविषयो कस्य राजा (sic) परिभवास्पदं । L. quod ferri sane posset. अद्युर्गो विषयः कस्य नारे: etc. S. quod per interrogationem idem exprimit ac nostra scriptura. सुदुर्गो विषयः कस्य नारे: परिभवास्पदः P. quod absurdum est; idem valet de Pp. सुदुर्गो विषयः कस्य नारे: परिभवास्पदं । — c. अद्युर्गो (१) नाशयो राजा S. haud male. अद्युर्गो विषयो राजा codd. corrupte, nisi fortasse dicere voluerunt अद्युर्गोऽविषयो, ita ut posterius praedicatum sit, prius epitheton ad subiectum राजा referendum. — d. गोत्र pro पोता L. male.

Dist. 52. b. . . . सुन्ते edd. Deteriorem han̄c scripturam secunda quaedam manus codici Pp. obtrusit. — c. संयत्राणुजलं Pp. संयंत्रं सजलं S. संयत्रास्त्रजलं L. — ग्रैलं codd.

— 53. a. विस्तीर्ण चातिवैक्यं L. विस्तीर्ण चातिविषयं S. विस्तीर्ण इति वैष्यस्य Pp. Corruptae huic scripturae insunt vestigia verae, a P. suppeditatae. Adiectiva in edd. obvia a loco sunt aliena; flagitantur nomina, ut nemo non videt. — b. धनधान्यरसान्वितं edd. व्यसनानीन्धनगृहः P. व्यसनोन्धनगृहः Pp. (sic contra metrum). In desperato loco opus erat emendatione; in edd. scriptura hoc primum offendit, quod adiectivum praebat, propter quam solam rationem relinquenda fuisset. In codd. इन्धन speciem veri prae se fert atque in promptu fuit, इन्धनं scribere; compositum enim huius loci non esse, demonstrat primum vocabulum inflexum व्यसनानि, tum, quamvis ipsum corruptum, गृहः vel गृहः, singularis signo instructum. Pro hoc scripsimus गृहा, magis propter inopiam melioris emendationis, quam quia veram scripturam divinasse nobis fuerit persuasum. यावसानि pro व्यस० conjectura, quam praeter utriusque vocabuli similitudinem in sono, indicavit ipse Indorum legislator, arcem hunc in modum instrui iubens: तत् स्यादायुधसंपन्नं धनधान्येन वाहनैः । ब्राह्मणैः शिल्पमिर्यत्रैर्यवसेनोदकेन च ॥ — c. अप्रवेशप्रसादश्च S. *Lass.* — Inter septem commoda arcis munitae vix omitti potuit aquae copia. Rescribe in fine prioris versus: प्रहिः, puteus. SCHL.

Addunt edd. hosce duos slocos:

स्वाम्यमात्य(ः)मुहूत् कोषो राष्ट्रदुर्गबलानि च ।
परस्परोपकारी च [कारीणि?] राघ्यं सप्ताङ्गमुच्यते ।
दुर्गाध्यक्षो बलाध्यक्षो धनाध्यक्षश्च भूपतिः ।
द्रृतः पुरोधा दैवज्ञो भिषजो मत्तिणो मताः ॥

P. 90. Ex silentio interpp. apparet, ed. Seram. deberi haec disticha inscite h. l. intrusa. Corrige in tertio versu भूषते:, in quarto भिषक् च.

Lin. 18. Pro दुर्गा L. दुर्गपुरुष. — चक्रः S. et P. qua de re iam dictum est.

Dist. 54. b. तत्र तं L. — c. कार्येष्वदृष्ट . L. — Pro अः P. च, male. — d. . . . विमुक्तिः edd.

Lin. 21. सति om. P. — समागतं L. — आश्रवात्य Pp. आलोक्य edd.

— 22. भो सारस् S. — सत्वरं edd.

P. 91. *Lin.* 1. एव abest a codd. — किंतु om. Pp. किंत्र pro किंवेतत् S. — वर्ति S. — 2. Pro धान्य codd. et S. इव; cf. autem initium dist. seq. — कार्यतां S.

Dist. 55. c. निःक्षिप्तं Pp. मुखं P. utrumque mendose.

— 56. c. गृहीतं च . . . S.

Lin. 7. तं om. edd. et mox इदं. — अनुतिष्ठ S. — पुनः om. codd.

— 8. एष om. codd. — वायसः, omisso राज्ञः, edd.

— 9. द्वारि तिष्ठति pro प्रणामति edd. — पुनः om. codd. — . . . इष्टा च भवति। तद्वत्ति etc. codd. Displicet admodum repetitio. S. = काकाः पुनः सर्वज्ञा वहुदृष्टारश्च (sic) — दृष्टः pro इष्टा L.

— 10. देव — किंतु om. L. insertis contra post स्थलचरः hisce verbis: वर्ण नलचराः.

— 11. विपक्षपक्षे नियुक्तः P. विपक्षे नियुक्तः S. utrumque ferri potest. — विपक्षपक्षे निक्षिप्तं L. perperam. — संग्रहाः Pp. et S.

Dist. 57. a. . . पञ्चपरित्यागात् codd. et L. — b. . . पक्षे च L.

Lin. 14. अस्त्वयेष्ये कश्चित् श्रुगालः S. — स abest ab edd.

— 15. भ्रात्यन् नगरोपान्ते codd. — नीलपाचनभाएउत्खामिना L. — पतिः S. — ततः om. L.

— 16. संप्रदर्शय Pp. — नीलोसंधानभाएउत्खामिना L. — Seqq. iusto brevius in codd. expediuntur: . . . स्वामिनासौ दूरं नीत्वा धृतः । (l. 18.) S. brevis etiam est, verum aliter: . . . स्वामिना इति ज्ञात्वा तस्मात् समुद्याय दूरे नीत्वा अपसारितस्तस्मात् पलायितः । ततोऽसौ etc. (l. 18.) Recepimus scripturam L. inserto दृष्टा, correcto मृत् pro मृतं, post मत्वा omisso तदुत्याप्य, recepto denique ex codd. धृत्वासौ pro परित्यक्तः.

— 18. स्वकीयमात्मानं S. absurde.

— 19. इदानीं नीलवर्णं उत्तमवर्णः । तदात्मनः औत्कर्षं (sic) किं न साधयामि । L. — . . . उत्तमवर्णस्तदाहै स्वकीयोत्कर्षं किं न साधयामि । S. Pro उत्कर्षं Pp. उत्कर्षं. — विदधामि pro साधयामि । P. — Pro आलोच्य L. उत्कर्ष.

— 21. पश्यत यूर्णं, omisso तत्, L. Totum hoc incisum desideratur in S. — Pro अरुप्ये Pp. राज्ञे. — तदधारुप्ये स्मदाज्ञया व्यवहारः कार्यः S.

— 22. ततः शृगालाश्च Pp. — Transponunt edd. तं विप्रिष्टः। — अष्टाङ्गपातं sine P. 91. स codd.

Lin. 1. आज्ञापयसे S. — इति om. L. — ततो om. S. — अनेनैव codd. et S. P. 92. Recipiendam particulam esse arbitror. पशुषु स्वाधिष्ठां L. praebet स्व vestigium incaute omissi antecedentis vocabuli. — पशुषु om. S. — अर्थवर्तिषु om. P. अर्थवासिषु legitur in S.

— 2. तस्याभवत् om. L. — Pro अभवत् S. अभूव. — ततः etiam priori तेन praemittit S. — आधिकां S.

— 3. परिज्ञानवलोक्य शृगालांश्चावलोक्य codd. — Post प्राय addit S. सदसि. — अवज्ञाय om. P. अवज्ञाय L. — सर्वे दूरीकृताः edd.

— 4. शृगालान् om P. — केनचित् om. L. — . . . शृगालेनैव P.

— 5. मा विषीदत् यद्नेनानभिज्ञेन नीतिविदो मर्मज्ञा वयं स्वसमीपात् परिभूताः S. मा विषीदत् एवं चेद्नेनानीतिज्ञेन वयं मर्मज्ञाः परिभूताः । L. Nostra scriptura codd. nititur, in quibus tamen च post एवं inopportune est additum; मर्मज्ञाः om. P. Finem commatis hunc exhibuit Pp.: वयमवधीर्तिम् मर्मज्ञाः । — Non intellexerunt editores यावता, quod cum vi peculiari positum est pro यदेतादृशेन. Cf. p. 19.1.3. SCHL.

6. नश्यति edd. न पश्यति P. — तथा pro तत्, omisso मया S. — ततः pro यतः S. et codd. male. — Pro अमी L. अत्र.

— 7. Pro इम् Pp. इव. — परिचितो भवति S. — Pro तथा P. तत्. — तथाहं करिष्यामि Pp. परिचित i. e. *notus*, cf. Wils. s. v. परिच्य et initium dramatis *Mudrārāxasae*, ubi hic versus legitur: नामैवास्यास्तदेतत् परिचितमपि ते विस्मयं कस्य हेतोः । Ex participio colligi potest significatio ipsius verbi.

— 8. च om. L. — अनुष्ठेयं edd. — Pro यदा L. et codd. यत्, S. यतः; emendavimus यदा, quae coniunctio unice huc facit. — सर्वे om. L. — तत् om. S. et Pp. अस्य substituit L. — यूँ inserunt codd. post तत्संनिधाने. — Pro एकदैव L. एकं.

— 9. ततस्तत् शुत्वा P. — ज्ञातिस्वभावात् edd.

Dist. 58. Praemittit S. haec verba: ततस्तथोनुष्ठिते etc. l. 12.; male per se et contra ceteros libros. — 58. a. . . . यस्यात्ते S. Pro यः init. Pp. यत्. — b. स नित्यं S. — c. राजा pro भोगी edd. et P. — d. तत् किं नाश्वत्युपानहं (sic) S.

Lin. 12. ततः शृगालः शब्देनाभिज्ञाय etc. P. In proximo commate idem om. सति. Admodum variant edd. in hisce duobus incisis; S. posterius supra l. 9. collocat, hic praebet: ततः शब्दाभिज्ञाय स व्याघ्रेण हतः । L. = ततस्तथोनुष्ठिते शृगालो यं इत्यभिज्ञाय व्याघ्रेण व्यापादितः ।

P. 92. *Dist. 59. a.* चिं प्रो किं P. absurde. — Pro मर्त codd. कर्म. — b. . . . हि यो . . L. — d. शुकं S. et P.

Lin. 16. यदेकं तथापि दृश्यतां नावदयं द्वाराप्रयोगतः । edd. — Ut nostra scriptura recte intelligatur, monendum est अस्तो haud ad वायसः esse referendum, sed subiectum esse sententiae parentheticae, particula इति finitae et insignitiae. — Pergit post hoc comma P. ततो विग्रहे विचारः । etc. lin. 20. cetera igitur desiderantur. Nos debemus Pp. Edd. cum P. in omittendo consentiunt, sed pro verbis iam ex P. laudatis praebent: तत् संग्रहे विचारः कार्यः; similitudo verborum संगमे, संग्रहे et विग्रहे fefellit oculos librariorum. Operarum culpa factum est, ut omissum sit स ante वासितः । Sed vel hoc pronomine inserto aliquid desideratur; inserendum est aut चक्रवाकेण, aut scribendum वासितवान्.

Lin. 20. तत्र post बूते reiiciunt codd. Pp. tamen eius loco praebet ततः; neutram particulam agnosidunt edd. — प्रणिधितत्र Pp. प्रणिधिते P. corrupte pro प्रणिधितेतः.

— 21. Pro संप्रति edd. अतः, P. ततः. — Pro आनोय P. आलोच्य. Pp. समालोच्याश्वस्य. — प्रत्युत्तरं दत्ता ex Pp. ceteri om. — यतो देव et quae seqq. absunt ab edd. et P. retinenda tamen erant, in primis quum coloris quid narrationi addant; sensus autem hic est; dimittendum esse hostium legatum, quamquam explorandi caussa venerit, dicit consiliarius, hanc maxime ob caussam, quod ipsi, haud secus atque adversarii, exploratores sub legatorum nomine misissent. Deinde autem lacunam in codice esse, ex disticho seq. apparet; quae Latine hunc fere in modum expleri potest: «Cave autem, ne sine stipatorum praesidio legatum istum in praesentiam tuam P. 93. admittas.” Distichon ipsum spectat ad traditionem historicam, cuius mentio in dramate Mudrā - Rāxaso saepius iniicitur: Chānakyam a summis consiliis fuisse Chandraguptae, atque regem Nandam dolo interemisse, missa ad eum benefica. Quae omnia fusius exponuntur in ipso isto drame, ad cuius imitationem Anglicam ablegare possum qui plura hac de re edoceri velit. Variare in priore distichi versu codices et editiones, non mirabitur, qui librariorum ignorantiam, editorum sociordiam reputaverit. S. नन्दो जयान चानकयं तीक्ष्णादूतप्रयोगतः । P. मल्लं जयान चानकयस् etc. L. मंत्रजयो न चाशक्यस् etc. Pp. नन्दं जयान चाशकस्तीक्षणाश्राद्यप्रयोगतः । — hem. c. तद्यारान्तरितं . . L. तद्दूरान्तरितं . . S. ततश्चाराचितं . . Pp.

Lin. 3. ततः सभां कृत्वाहृतः शुकः काकश्च edd. ततः सभां कृत्वा शुक आहृतः काकोऽपि P.

ततः स राजहंसः समागत्य सभां कृत्वा स शुकस्त्रानीतः काकोऽपि । Pp. — राजहंस eo quo oportet P. 95. casu positum ex Pp. scripturae edd. addidimus; शुक आहूतः transposuimus suadente P. — तत्र om. edd. — शुकश्च Pp. — उन्नत edd.

— 4. दत्तासने उपविष्ट्य S. दत्तासनमुपविष्ट्य L. — चोपविष्टः । ततो ब्रूते । P. — महाराजाधिराज (sic) श्रीमचित्रवर्णस्त्वां S. Sic etiam L. omissis tamen भो भो हिरण्यगर्भ, et posito gemino puncto post . . अधिराज. — श्रीमत् om. P. — श्रीमान् legitur in Pp. additis hisce verbis: महानन्दिसमासावदनश्चित्रवर्णो मयूरराजः.

— 5. तव प्रयोजनं Pp.

— 6. न चेद् edd. male. — Nimis prolixo in h. l. versatur Pp. . . . प्रणम । त्वदर्पितस्य सकलकर्पूर्द्धोपस्य समस्तकरभागराजाहृष्टायानि धनधान्यान्यादाय त्वमस्मान् मिलिष्यसे । तो चेदवस्थातुं आत्मस्थानं त्राणं च चिन्तयिष्यसि । वयमपि तत्रागतप्राया एव । ततो हिरण्यगर्भो राजा सकोपं ब्रूते । etc. — Pro स्थानान्तरं P. स्थानं.

— 7. कोऽपि नास्याकमन्त्रेति । यो त्युमुं धातयति । तत् etc. P. — ततः om. S. — देव आज्ञापयसि दुष्टशुकं निहन्ति, omissis तावदसुं, Pp.

— 8. तावदसुं om. edd. — दुष्टं शुकं S. et Pp. — शान्तयन् (sic) ब्रूते S. अत्रान्तरे चक्रवाको राजानं प्रान्तयन्नाह । L. शान्तयति forma cst verbi, quae in catalogis radicum non reperitur, quanquam per se nulla obstat ratio, cur minus a part. शान्त, quam a gerund. शान्त्वा verbum derivetur. — युवां etc. om. L. शृणु तावत् S. et P. — मैवं युवां etc. Pp.

Dist. 61. b. . . . ये प्रवद्यन्तर्धर्मान् Pp. — d. . . . यद्यम . . . L.

Lin. 11. चैषः S. et codd. pro क्षेषः.

Dist. 62. d. नृपते: codd. et L.; hic genitivus nimium distat a vocabulo, ad quod unice referri potest; praestat vocativus. — द्विं L. mendose. — S. = दूतो वदति नान्यथा; quae verba ex dist. 15. huc invecta sunt.

— 63. a. et b. स्वापकर्षं परोकर्षं न दूतो मन्यते कूचित् । L. — स्वापकर्षं परोकर्षेद्यूतो-क्षैर्मन्यते तु कः । S.

Lin. 16. स्वां प्रकृतिं S. et Pp. — आपन्नः edd. — Pro च edd. अपि.

— 17. आनीय प्रबोध्य edd. — आदिकं om. codd. — शुकः om. edd. स्वदेशं abest a S. — Additamentis ceterum auctus est Pp. hunc in modum: . . . आनीय आतिथ्यस्त्वारं विधाय कनकालंकारं विधाय दत्त्वा संतोष्य शुकः etc. — Pro अथ in fine L. ततः. — S. शुकोऽपि, omissio ततः ।

— 18. स्वराजानं चित्रवर्णं L. — किंच्याचलराजानं, omissio गत्वा, S. perperam. — स ex Pp. — त . . चित्रवर्णं absunt a Pp. — मयूरो राजोवाच Pp. —

— 19. एव om. codd.

— 20. संप्रति युद्धोयोगं L. संप्रति युद्धोयोगः S. — स्वर्गैकाङ्गः om. Pp. स्वर्गैकदेशः edd.,

P. 93. interponentes praeterea huic vocabulo atque sequenti कथं haec verba:
राजा च द्वितीयः स्वर्गपतिः । cf. p. 80. l. 7.

— 21. ततस्तद्वचनं शुत्रा राजा सर्वान् आहूय codd. — सर्वान् शिष्टान् edd. — स आह L. male; आह च S. et P. quae scriptura ita intelligenda est, ut उपविष्टः pro verbo finito accipiatur. — Inseritur in cod. Pp. post शक्यते haec sententia: तिह्वासहस्रद्वितीयेनापि सर्वेष्वरस्तु स्तोतुं समर्थो यतः गुणः शाश्वा च तस्य का कथितव्या । Priora verba usque ad यतः ex libro primo (vid. p. 27. l. 7.) huc irrepserunt.

— 22. विग्रहविषये L. Recentioris usus est haec additio vocabuli विषयः, quo saepius nihil aliud exprimitur, quam notio, quae propria est casui septimo, ut ipso hoc loco: «quod attinet ad bellum instans.» — कर्तव्य-मुपदिश्यतां L. — . . . कर्तव्योपदेशं ब्रूत् S. — पुनर् om. L.

P. 94. *Dist.* 64. a. et b. Singulari numero omnia exhibet nomina Pp.; संतुष्ट et पार्थिव tantum P.

Lin. 3. ततः et मंत्री om. edd. et P.

Dist. 65. a. . . . सुहृद्वर्गः L. — c. . . . विपरीताश्च S. idem voluit L. ubi editum est: विपरिताश्च.

— 66. c. यदि तत् Pp.

Lin. 8. Haud paucae exstant huius loci variae scripturae in codd. et edd. unde consultius cum lectore actum erit, si primum ex unoquoque libro verba separatim apposuero. L. = राजाह । मम वचनादिदं तावदवलोकयतु मंत्री तदेतेषामुपयोगः केन वर्तनदानेन क्रियतां । तावदाहूयतां मौहूर्तिकः । S. राजाह । मद्वलं तावदवलोकयतु मंत्री तदेतेषामुपयोगो ज्ञायतामेवमाहूयतां मौहूर्तिकः । P. राजाह । मम बलानि तावदवलोकयतु मंत्री तदेतेषामुपयोगः किं केषामुपयोगः किं वर्तनदानमेवं तदाहूयतां मौहूर्तिकः । वर्तनमेव परं ततश्च मौहूर्तिकः शुभलम्पं etc. quae postea tractabimus. Pp. राजोवाच । मम बलानि तावदवलोकयतु मंत्री । तदेतेषामुपयोगः । किमेतेषां वर्तनदानमेव परमस्तीत्यभिधाय साटोयं पुनर्वाच । तदाहूयतां मौहूर्तिकः et quae mox enotabuntur. — Ut dispiciat lector, quasnam habuerimus rationes huius loci eum in modūm quo a nobis exhibitus est constituendi, dicendum erit, quid significant vocabula उपयोग et वर्तनः ab horum enim significacione omnia pendent. Quod ad posterius attinet, non est quod in eo moremur, est enim stipendium, quod militibus persolvitur; difficultius est prius desinire, quippe quod haud secus atque उपयुक्त् verbum, et उपयुक्त् participium in lexico Wilsoniano non sit enotatum; nam quod dicit उपयुक्त् valere *apprehendere*, neque huc facit, neque satis est probabile. *Rosenius* s. v. पुञ्ज् locum laudat Hitopadesi (p. 98, l. 14. ed. nostr.) ubi उपयुक्त् significet *utilis*, pro quo fortasse rectius dixerit *idoneus*. In hac

exemplorum penuria haud alienum erit ab hac annotatione locos laudare, quibus vocabulorum istorum significatus accuratius definiri possit. P. 94.
 Mēgh. Dūt. 13. लिन्नः लिन्नः शिखरिषु परं न्यस्य गन्तासि यत्र । ज्ञोणः ज्ञोणः परित्वयु पयः श्रोतसां चोपयुज्ञ ॥ Coniungenda sunt gerundia न्यस्य et उपयुज्य; «pede (nubem alloquitur) montibus summis imposito atque rivorum aqua perlevi assumta». Est h. l. primaria ut videtur verbi compositi vis: subiungere, sibi adiungere, apponere, assumere. Drāupadīpramātha IV, 19. न कै प्राज्ञा गतशीकं भर्तारमुपयुज्ञते । युज्ञानमुपयुज्ञते न मियः प्रक्षये वस्त् ॥ Reddit cl. Boppius उपयुज् h. l. per *amare*, quod nimis a vi verbi propria mihi recedere videtur; quanquam Vir. clar. auctoritate scholiastae probabiliter se tueri poterit; sed is sensum non significatum reddere voluit. Est potius *adiungere sibi* (medium est enim) quod pro istius loci sensu, non tam nubere, quam fidem praestare marito valere videtur; युज्ञान autem idem est atque युज्ञ, idoneus, dignus. A primaria ista significatione *adiungere* longius iam distat उपयुज्ञ, quum sit *idoneus*, quae translatio eadem fere est, quae in Latinorum *aptus* cernitur; *utile* etiam hoc participio designari, Rosenio omnino, non negaverim. उपयोग denique, si originem spectas, est adiunctio, qua res quaedam alii subiungitur; ex vi participii probabile est, eadem voce designari idoneitatem, si ita dicere licet, utilitatem; si alios Hitopadesi locos comparas, p. 50, l. 7. p. 57, l. 2. p. 58, l. 12. p. 99, 12. potius est *usus*, qui ex re quadam peti potest. Nostro loco est utilitas copiarum, quae alacriores reduntur dato stipendio. Aliam vocabuli vim ex hisce grammatici verbis eruere licebit (Pan. I, 3, 32.) उपयोगो धर्मादिकलको विनियोगः । E caussativa verbi forma est उपयोजन, qua significantur iumenta, quorum alia *iungebantur* curribus aliorum deorum. Vide Rigved. Spec. ed. Rosen. p. 7. Obiter moneo in hymno isto in Auroram verba वहन्ति सीम् अरुणास्तो रुग्नन्तो गावः non vertenda esse cum Rosenio meo: vehunt eam lucentes fulvi *radii*, sed v. eam l. f. *boves*. Id docent verba a Rosenio in nota allata. Enumeratis diversis animalibus additur: इति दशादिष्टोपयोजनानि ॥

Quae quum ita sint, iam patet per se ratio, cur nulli librorum obtemperandum fuerit, sed eligendum ex variis scripturis, quod loco accommodatius videretur. Longius foret ostendere, quid in quoque libro minus recte se habeat; id silentio praetermitti nequit, in cod. P. केषामुपयोगः notam esse marginalem cuiusdam, qui de sensu loci dubitaret. Ce-

- P. 94. terum video aliorum quoque librorum scripturam esse foedatam notis marginalibus lectorum, varie locum tentantium. — निर्णय ex S. — यात्रा P. male. — करोतु L. — Pp. = ... मौहूर्तिकः । सोऽस्माकं समरविजययात्रार्थं शुभलग्नं सत्वरमागत्य ददातु । *Lin.* 10. देव om. P. et S. देव तथापि L. — अयुक्तं L.
Dist. 67. om. Pp. — b. ये विशन्ति बलाबलं P. (ये विचार्य बलाबलं?)
Lin. 13. अस्मिन् सम यात्राभूङ् etc. codd. अस्मिन् corruptum est pro मंत्रिन्. — विज्ञिगेषुर् . . . आक्रमति (S. आक्रामति) तथा कथय । edd.
— 14. देव तत् कथयामि edd. — अपि ex codd. — अनुचितं codd. pro अनुष्ठितं, quod vocabulum moveri nequit propter distichon seq.
— 15. एव om. codd. — फलदं P.
Dist. 68. a. अनुष्ठानात् S. Alium versum substituunt codd. श्रुतेन मंत्रसिद्धिश्च भवेन्न पृथिवीपतेः. — — d. व्याधः श्रान्तिं Pp. mendose.
Lin. 18. च नाति० Pp. — इति om. S. — यथा श्रुतं तन्निवेदयामि S. यथा तन्निवेदयामि codd. — देव om. S.
Dist. 69. b. नृपः L. absurde; नृप S. — c. सेनानी Pp. et edd. — d. बहुतरैर्वलैः । L.
Dist. 70. d. कोष्मूतं L. कोषः फल्गु S. फल्गु a loco omnino est alienum.
- P. 95. — 71. b. . . . पार्श्वतो . . . edd. — c. . . . पार्श्वतो . . . L.
— 72. a. यथा P. perperam. — b. in fine. जैः P. male. — c. . . . सुभैर्युक्तः edd. — d. प्रतिवृत्यूपः P. प्रतिवृत्यूप बलं नृपः edd. —
— 73. a. समेऽश्वैर्विषमे नामैः codd. quae scriptura vix defendi potest.
— 74. c. तद्दुर्चतुरङ्गानां codd. sensu cassum. तदन्यचतुरङ्गानां L. itidem.
— 75. a. शैलेषु pro वनेषु edd.. — c. सुयोधे Pp. सुखयोधै (sic) P. — d. प्रयनं pro स्वपनं edd. — योग codd.
— 76. b. दुर्गैः L. — मर्दकैः S. utrumque male. c. . . . प्रवेशेन Pp. — d. . . आटविकान् . . . edd. perperam.
— 77. a. . . . ततःकोषाः S. — b. . . कोषान् S. — c. स्वभूयेभः edd. — d. . . दातुर्न युध्यते edd. Pro युध्यति P. स्वयत्ति, quod nihil est.
— 78. b. दासश्चार्थस्य . . . S. minus bene. — भूषतेः L. male.
— 79. a. . . . बुधेत P. absurde. — b. रचेचैव edd. — d. . . सैन्यस्य . . . codd.
— 80. a. पदातिश्च edd. stulte. Idem mox महीपाल pro assueta eorum negligentia. Legitur hic versus Man. VII, 175. exceptus ab alio, qui in Hitop. est 82, a et b. Praemissus contra versus 82, c d. est alii, ab Hitop-

desae compositore ut videtur omissio: समवस्कन्दयेचैव रात्रौ विवातयेत् तथा. — c. उपवधा- P. 95.
रातिमासीदू P. quod sensu est destitutum. उपर्यारातिमारात् Pp. quae lectio si
metrum respicis minus placet. आसीत् corruperunt edd. et L. quidem in
आसीत्, S. in आसीच.

- 81. b. अनुपे L. mendose. — c. वृते pro आवृते Pp. — Ex Manu VII, 192.
- 82. b. यवसान्नौदनेन्धनं Pp. Aqua haud libenter carebimus. — c. मिन्देचैव P. 96.
codd. perperam. — d. परिलांस्तथा edd. male.
- 83. a. जनेषु codd. — d. pro सृतः codd. च सः !
- 84. a. बलमध्यस्य codd. quae scriptura admitti nequit, quia
mentio fiat in priori versu equorum necesse est. — b. प्राकार् L. vitiouse.
- 85. a. युद्धमाना (sic) हयारोहा: Pp.
- 86. c. मार्गयोधग्रोधित्वं S. Pro विशोधित्वं — d. प्रचक्षते L.
- 87. a. . . . शूरसंत्रज्ञं codd. corrupte — b. . . . क्षितश्चियं Pp. Contra
sensum. — c. प्रसिद्धं L. — Pro प्रायं codd. प्राप्तं. Potestne प्राप्त् significare oriundus?
- 88. a. तथा Pp. male — b. युष्यते Pp. perperam. युष्यन्ते . .
मानवाः edd.
- 89. b. न कुर्यात् pro न बहुती S. — मुण्डमण्डली edd.
- 90. a. अप्रमादो Pp. vitiouse. b. देशानां codd. mendose ut vi-
detur. — c. . . . प्रतिकारः L. — d. तनुरेवात्र कारणं codd.
- 91. a. . . . प्रत्रोः edd. perperam. — b. . . . पोष्येत् edd. ab-
surde. अभिषेलयेत् Pp. — c. सुखसाध्यं L. सुखसाध्य S. — d. . . काल L. — प्रपीडनं Pp.
दैर्घ्यप्रायाणपौडिनं S.
- 92. a et b. P. praebere videtur (difficilior lectu est enim h. l.
codex) न क्योश्यस्त्याकर्षणे unde coniicio scribere voluisse aut
sane debuisse istum librarium: नास्ति योद्यो श्याकर्षणे द्विषां ! quod
transpositione tantum differt a scriptura codd. Pp. — Ed. =
मंत्री नास्ति भेदकरो द्विषां (S. मंत्रो). Sed nec मंत्रिन्, nec मंत्र ex hoc loco est.
- 93. a. . . . रात्रेन edd. perperam. — d. अग्नियोकुः स्थिराद्वलं P. अग्नियोकुं P. 97.
स्थिराद्वलं Pp. Neutra scriptura magnopere commendabilis, utpote obscurior.
- 94. Asterisco notavimus hunc slocum tanquam corruptum supra
quam ut sine aliorum codd. ope restitui possit. Exhibeo primum va-
rias librorum quorum consulendorum data nobis erat facultas, scriptu-
ras; indicabo deinde, ubi lateat corruptela: S. = कूरं मित्रं रणे चापि भङ्गं दत्ता
विवातयेत्। अथवा गोग्रहाकृष्टात् तल्लक्ष्याश्रितबन्धनात् ॥ — L. = देष्यं मित्रवैश्यापि भङ्गं दत्ताभिद्या-
तयेत्। अथवा गोग्रहाकृष्टः तनुत्यं प्रतिबन्धनात् ॥ — P. = दृष्यमिवलैश्यापि (sic) भङ्गं दत्ता विवा-

P. 97. तयेत् । अथवाएताग्रहाकृद्या तल्लच्यस्यातिवन्धनात् ॥ — Pp. = पुष्पमिन्नवलैश्चापि भङ्गं दद्या विद्यतयेत् । अथवाएताग्रहाकृद्या तल्लक्ष्यस्यातिवन्धनात् ॥ Denique ut omnia quae huc faciant, unum in locum congesta habeamus, interpp. verba ipsissima apponam: W. *And when a chief shall have given him an overthrow by means of his nearest friends, he may put his enemy to death.* Quibus verbis haec subiuncta est nota: «*This verse is defective in the original.*» JONES loco quo exhiberi oportet hoc distichon, haec verba habet, quibus quae subiecta fuerint Indica difficile est dictu: *He may even after having defeated the enemy destroy them, with troops eager for gain; or seize and carry off their cattle or even imprison their chief.* Ex hemistichio b. quod in omnibus libris admodum sibi constat, hoc primo adspectu apparet, sermonem esse de hoste fraude circumveniendo, quae fraus, ut ex eis, quae in hem. a. sana sunt, coniici potest, in eo consistat, quod discordia excitetur inter hostem atque amicos eius, quibus ipsis utendum sit ad eum profligandum. Quae quum ita sint, prior versus scribi potest, qualis a nobis exhibitus est neque haerendum est in चापि, quod multo potius huic disticho cum antec. coniungendo inserviat. Ista autem regula illustrata fuit simili, quod omnino obscuratum est culpa librariorum, ita ut vix huic versui probabilem opem afferre possimus; simile esse ex arte sagittandi petitum demonstrant vocabula वाण, आकृष्टि, लक्ष्य (i. e. scopus); sed corruptela in eo primum cernitur, quod omissa sit particula comparativa; hanc tamen facile restitues legendo यथा pro अथ. Hemist. d. porro sanum esse crediderim, praebet enim hunc sensum: sicuti propter scopum nimis alte colligatum, ita ut sagitta ad eum usque sursum mitti nequeat. Cum ceteris haec satis bene convenient; nam dicere vult auctor, hostem nimia potestate valentem quam ut vinci possit, adeundum esse insidiis, veluti sagittarius, qui scopum propter celsitudinem attingere nequeat, artificio quodam utitur; quodnam autem hoc sit artificium, id hem. c. contineri debet.

Dist. 95. a. . . . वा हरेद्रज्ञा codd. perperam. — b. . . देशावगाहनात् S. हरणात् L.

— 96. a. इयानि: Pp. et S. — c. इत्युरोकृत्य . . . L. तद्वौकृत्य . . . S. — d. वाच्सपत्वः Pp. mendose. — प्रतायते P. प्रभायते Pp. Neutrū quid sit, assequor. — ऊरोकृत्य (per उ longum enim effertur a Panine, I. 4, 61.) huc facere non videtur; nam ex praecedentibus regis verbis manifestum est,

hoc distichon eo consilio esse allegatum, ut admoneat, agendum esse, P. 97. non verba facienda. Hinc sequitur construendum esse दूरीकृत्य वाचस्पत्यं, (abiecta arte oratoria) कृतिभिः प्रतीयते; postremo verbo qui sensus h. l. tribuendus sit, accurate definire haud ausim. *Lass.* — तत् h. l. non est coniunctio caussalis, sed pronomen, quod referri debet ad द्यं. Attamen dubito, an तत् प्रतीयते dici possit pro: तस्य प्रत्यय उत्पायते. Praeterea suspicionem movet triplex variatio in ultima distichi voce. Denique nimis contorta est constructio. Mallem rescribere: तदूरीकृत्य कृतिभिर्वाचस्पत्यं प्रहीयते। SCHL.

Lin. 10. मंत्रिणा विहस्योऽन् सर्वमेतत् किंतु । L. मंत्रिणा विहस्येच्यते सर्वमेतत् विशेषतश्च उच्यते । किंतु etc. S. Praestat scriptura codd. a nobis recepta; सर्वमेतत् ex edd. est additum, haud scio an recte.

Dist. 96. b. . . वाचं . . . codd. male. — c. सामानाधि . . . edd. et Pp. सामान्याधि . . . P.

Lin. 13. ततः om. P. हुतं substituit Pp. — प्रहित omisso तत्र edd.

— 14. प्रणिविश्वरः edd. male. — गर्भसमीपवागत्य प्रणाम्योवाच । L. — समागतः P. समागतो, sequente प्रायः L. Hoc peius illo, neutrum bonum.

— 15. Pro उपत्यकायां S. अधित्यकायां. — कटक om. codd. — Hoc vocabulo una cum anteced. समावस्ति omisso, स्कन्धावरे L. — अनुवर्तते S. — दुर्गम्याधनं L. — दुर्गम्योधनं च P. Unde ortum sit hoc च, docet plenior codicis Pp. scriptura: तूया च देव बहुधानुरक्षणं दुर्गम्योधनं च मनु (sic) संधातव्यं, unde apparent च esse insertum; scriptum enim olim erat: - प्रोधनमनु - atque च inserto relicta est inopportune littera न, expressa iam per punctum litterae न superscriptum. च autem si additium sit, idem pronuntiandum est de अनुरक्षणं.

Lin. 16. *init.* Pro अनु L. अत्र. — Pro असौ codd. अयं. — किंच केनचित् सह तस्य विश्वास etc. edd.

— 17. Pro एतद् S. एव तद्. — इङ्गितं edd. — मया om. L. — Pro अनेन edd. एतेन. — प्रागेव om. L. — विनियुक्तः P.

— 18. तर्हि post देव inserit Pp. — असौ abest a codd. — राजाह desideratur in Pp.; consiliario igitur tribuitur regis sermo, cui praeterea haec verba adduntur in eodem libro: न तत्र युद्यते भवता । यतः शृणु । यथेवं etc.

— 19. तदा om. P. — Pro तेन Pp. अनेन राजहसेन शुक्ल्य etc. — अभिमवोद्योगः S. minus bene. — शुक्ल्य गमनात् codd. quod sequi nos oportet: »post eius discessum«. — Pro तत्र edd. तस्य, ad quod subintelligendum foret राजः; sed praestat तत्र intellectu facilius. — Sequens comma virgula distinguendum

P. 97. erat, ea omissa obscurior sit in edd. sermo; augent obscuritatem codd. omittendo ए, quod de cornice intelligendum est: «iste iam inde a longo tempore apud nos moratur.»

— 20. आगन्तुकः L. — सदैव ex Pp.

— 21. Post शंकनीयः । pergit Pp. आगन्तुः कदाचिदपि नोपकुरते यतः । तत् शुचा राजाह etc. — Incipit in Pp. sequens incisum a कदाचित्. — आगन्तुका हि edd. — उपकारः Pp. — L. = हितकरा दृश्यते कृचित्, omissio कदाचित्. — शृणु om. Pp.

P. 98. Dist. 98. a. . . . हि हितो . . . Pp.

— 99. b. शुश्रेष्ठस्य महीपते: L. — Pro महीभूतः S. महीभूतः; illud exquisitius. शुश्रेष्ठ etiam in seqq. repetit L.; veram lectionem esse a nobis receptam probat tum ceterorum librorum consensus, tum hoc, quod Sudraci nomen Indorum traditionibus sit celebratum; tribuitur huius nominis regi antiquissimum, quod exstet, Indicum drama. Eodem modo scribitur nomen in Vetālapanchavinsatide, cui libro inserta est haec de Vīravaro narratio. Cf. Wils. *Hindu theatre* Vol. I. Proleg. ad Mṛichchhakatim.

Lin. 6. Pro सह edd. महा (महानुरागवान्).

— 7. महाराजपुत्रः S. — द्वारि, omissio राज, codd. — राजद्वारसुपगम्य प्रतीहारसुवाच S.

— 8. उपगम्य L. — मां deest in S. — 9. मया abest a Pp. — 10. किं तव Pp. — 11. Pro टङ्ग L. सुवर्णः. — S. = प्रत्यहं सुवर्णश्रातानि पञ्च देहि :

— 12. द्वितीयश्च Pp. absurde. — दत्तुं om edd. — तत् pro एतत् edd. — प्रणम्य om. S.

— 13. Pro दत्ता codd. कूत्ता fortasse melius. — 14. अथ om. edd. Vix monendum est coniungendum esse अथ cum seq. वा — Pro तत्सत्त्वं S. इति ततो संत्रिक्वचनात्. — L. om. ततः, in ceteris ut S.

— 15. वौरवराय S. Om. L. — टङ्गङ्ग P. cf. Wils. s. v. टङ्गपति. — दत्तं codd. — कंच प्रातानि सुवर्णानि दत्तानि S. — L. = . . . दत्ता तदर्तनं दत्तवान्. Subiungit deinde hosce versus prorsus inopportune narrationis nexum turbantes, in ceteris libris omissos, e Wilkinsii codice petitos:

ताम्बूलं कदुतिक्तमित्रमधुरं ज्ञारं कषायान्वितं ।

वातम्बं कफनाशनं कृमिहरं दौर्गन्धिदोषापहं ।

वक्तस्याभरणं मलापहरणं कामाग्निसंदीपनं ।

ताम्बूलस्य सखे त्रयोदश गुणाः स्वर्गेऽप्यमी डुर्लभाः ॥

pergit deinde वर्तनविनियोगाच्च राजा सुन्दित्पूर्णं निकृचितः । In positemis verbis consentit P. 98. etiam S.

— 16. तदर्क्ष वीरवरेण, omisso posthac तेन, edd. — Pro अपरदूर्धे et quae seqq. S. स्थितस्याद्व दुःखितेभ्यः तदवशिष्टं भोज्यव्यव्यविलासव्ययेन । — L. = अपरस्तौयो भागो दौनेभ्यो दहः तदवशिष्टं च भोज्यनाय विलासाय च व्ययितः (sic) ।

— 17. व्यायेन Pp. mendose. — तथैतत्, omisso एव, P. — एतत् omisso तथैव edd. — च om. edd., et mox स.

— 18. राजम्, omissis ex nimia festinatione syllabis द्वारा Pp. — Pro सेवते S. प्रेरते. Invenerunt boni isti viri in codd. प्रेवते (nam व and र in codd. Bengalicis nulla certa regula distinguuntur) unde infelici coniectura fecerunt प्रेरते quod vel propter pluralem numerum reiiciendum est. — आदिशति Pp.

— 19. Pro उप edd. अपि. — अथैकदा कृष्णाचर्तुदृश्यां S. Sic etiam L. omisso tamen एकदा. — निशीथे स abest ab edd. — सकरुणां (L. सकरुणा) कल्पनवन्निं edd. — तं शुल्वा ex codd.

— 20. द्वारि तिष्ठति । तदा तेनोक्तं L.

— 21. Pro वीरवरोऽपि L. सोऽवदत् । S. — वीरवरः omisso अपि. — Pro यद् edd. यथा.

— 22. प्रणाम्य चलितः । codd. — ततः om. edd. — राजा च S. — कृतं(1)अयमेकाकी राजपूतो मया सूचीभेदे etc. S. Omissis न-कृतं pergit L. eodem modo atque S. अयं etc. sed mox monstrum vocabuli profert सूचीभेदे. Nos codd. sequuti, emendato यद्यं pro यतोऽयं. Pro सूची P. शूचि Pp. सूचि. Utraque forma, सूचि et सूची legitima est. Ne in vocabulo सूचीभेदे haereant tirones, haec moneo. Compositum est e सूचि *acus* et भेद, *findendus*, *fissilis*. Valet igitur: *quod acu perforari potest*. Comice h. l. vocabulum de tenebris ita densis, ut prehendi quasi et acu perforari possint, usurpatum esse dicerem, nisi invenirem Calidāsam eadem usum fuisse voce Megh. Dūt.

39. - रात्रौ । हृद्वालोके नरपतिपथे सूचीभेदैस्तमोभिः ।

Lin. 1. प्रणिथिः(2)प्रेषितः Pp. Pro postremo verbo S. प्रेतिः. L. प्रहितः. Addit P. 99. L. तदनुचितं, omisso तद् ante अहं. — Pro अहमपि गत्वा S. अनुगत्वा; sed licentia haec in usu formarum वा et वा poetica est et ne omnis quidem generis poetis permissa; frequens est in epica poesi antiqua, in Rameide, Bharat ea, et quorum dictio utrumque carmen presse imitatur, in Puranis; rario in legibus Manus; rarissima, si omnino obvia, apud epicos recentiores, scenicos et lyricos. Quae licentia quibus sit legibus circumscripta,

P. 99. nondum satis indagavi neque hulus loci esse docere. — किमेतदिति om. L.
verbo निरूपयामि adiiciunt codd.

Lin. 2. Pro तद्-क्रमेण L. तदनुचलितः — तत्र om. S. ततः substituit L. अथ Pp.
— Transponunt codd. च गत्वा.

— 3. काचित् त्वी post भूषिता reiiciunt edd. — Pro विलोकिता edd. दृष्टा.

— 4. का त्वं om. Pp. — इति abest ab edd. — Omissio ततः, pro तत्या
edd. त्विया — रजा S.

— 5. लक्ष्मी L. mendose. — महता om. Pp. — च ex Pp. — अन्यत्र om.
codd. — दुःखिता in fine incisi inserit L.

— 6. Post ब्रूते pergunt edd. यत्रापायः (L. यत्रोपायः) संमिति तत्रोपायोऽप्यस्ति (L.
तिष्ठति, omissio अपि) तत् कथं त्यात् पुनरिहावलम्बनं भवत्याः (L. भगवत्याः)। — Nos तत् re-
tinuimus ex edd. cetera ex codd. dedimus; in P. भवत्याः legitur.

— 7. त्वं om. P. त्वां Pp. perperam. — प्रक्रिधरं S.

— 8. तद् pro तदा Pp. mendose. — सुखेन et mox सा abest ab edd.

— 9. निरायमाना स्वबधूः प्रबोधितः पुत्रश्च edd.

— 10. उत्थाय om. codd. — Pro उपविष्टौ Pp. प्रबोधितौ, male. — च तयोः
समक्षं om. edd.

— 11. सामन्दः प्रक्रिधरः S. प्रक्रिकरः सामन्दः L. Illud ad idem fere quo scrip-
tura codd. redit; hoc ferri non potest, nisi corrigatur सामन्दः; in prosa
enim oratione epitheta praemittuntur nomini, ad quod pertinent, pau-
cis admodum locis exceptis, ubi aliud postulat orationis ratio. De ad-
iectivo, quum sit praedicatum, hoc non valet; quod vix me monitore
eget. — धन्योऽहं यदेवं etc. P.

— 12. एवंभूतो यत् स्वामिरक्षणं स्वोपाययोगः (sic) Pp. minus bene. — स्वामि om. L.
— Pro रक्षायां S. रक्षार्थः. — Pro यस्य P. सम्; S. यन्मम्. Optandum erat inter यस्य
et यत्; quod vocabulum in hac iunctura naturam coniunctionis induit,
sicuti Latinorum quod eodem modo in coniunctionem transiit. Praetul-
limus यस्य, quod exquisitius est et h. l. idem valet atque यन्मम्; uti editum
est in ed. Ser. Observavi hanc vim accedere relativo, quum praecedant
vocabula एतावत् et composita cum एवं, fortasse etiam cum तथा; quanquam
hoc dubium mihi est, quia ex linguae Indicae ingenio est praemittere
relativa, ita ut तथा plerumque ad antecedens यस्य referendum sit; quo
facto, constructioni, de qua hic agitur, nullus potest esse locus. Lu-
culentum huius constructionis exemplum invenies p. 11. l. 5. Haud
opus est addere h. l. सम्; nam praecedens अहं primae personae vindicat

etiam sequens यत्य. — Ed. Ser. habet: . . उपयोगः प्राप्तयः, additum fuisse vi- P. 99. detur verbum ex linea sequenti. — तत् om. L. — तावत् om. S. — अधुना abest a L. — विलम्बः codd. विलम्बस्य S.

— 13. कदापि तावत् om. edd. — एवंविकर्मणि codex uterque; quod miror, duntaxat non intelligo. विकर्मन् verbum est optimae notae; cf. Bhag. Gīt. IV, 17. Sed quomodo nomen esse potest, praemisso एवं? aut quomodo aliter accipi potest एवं? — एतत्य om. edd. — Addunt post प्राप्तयः codd. interpp. et S. slocum a nobis supra iam exhibitum I, 38. — Hem. c. S. सन्निमित्तं.

— 14. अस्त्वकुलोचितं om. codd. — केनाप्यनेन कर्मणा मुख्यस्य S. sed अपि interrogationem tollit. मुख्यस्य corruptela est ex अमुख्य orta; primam syllabam अ absorbuit praecedens vocalis; pro ष in nonnullis provinciis Indiae scribitur et effertur ष; मुख्य igitur factum est, quod quum minus bene cum seq. महावर्तन in unam coalescat vocem, emendatum est in मुख्यस्य. — तदा केनाप्येण कर्मणाम्. L. तत् केनाप्यनेन कर्मणामुख्य codd.

— 15. नहा om. Pp. वर् substituit P. — Pro निष्क्रयः L. निस्तारः et mox भवेत्. — . . मङ्गलायाः स्थानं S. सर्वे et गताः iuxta collocant codd.

— 16. विजयतां geminat S. — महाराजः edd.

— 17. अयं abest a S. — चिच्चेद् L. चिच्चेद्: (sic) S. — Pro अय edd. ततः.

— 18. तावत् om. edd.; qui mox कृतः pro भूतः — Pro अधुना L. संप्रति. — निष्पुन्नत्य S. — Pro विलम्बने S. अलं. In L. deest hoc verbum una cum seq. इति.

— 19. अपि om. edd. — शिरश्वेदः कृतः S. — चिन्तवान् (sic) L. — स्वामिषुनश्चोकार्तया तदनुषितं edd.

— 20. तताः स राजा एतत् सर्वं श्रुत्वा दृष्ट्वा च चिन्तयामास L. तत् सर्वं (omisso ततः) दृष्ट्वा साश्रव्यं चिन्तयामास S.

Dist. 100. a. ज्ञिवन्ति L. vitiouse. — b. ज्ञानवृद्धयः L.

Lin. 1. Pro त्यक्तेन P. मुक्तेन. — Mox. अस्ति om. idem. — L. = एतत्परित्यागा- P. 100. द्राघयेन मम किं प्रयोजनं। S. = तदैतेन परित्यक्तेन मम राघयेनापि अप्रयोजनं। — Pro इति edd. ततः. — शूद्रकेनापि S. शुद्रकेन राजा L. — चेतुं L.

— 2. खड्ग उत्पापितः L. खड्गः समुत्पापिं (sic) S. — Pro साक्षान्सूर्तिमत्या edd. भगवत्या; in L. tamen post मंगलया legitur प्रवक्ष्यभूतया. — रागहस्तः edd. unde fecimus राजा हस्ते; prius verbum sic scribunt codd. alterum omittunt. — उक्तश्च S.

— 3. पुत्र प्रसन्नास्मि ते एतावता साहसेन अलं (L. अलं साहसेन, om. एतावता) जीवनान्ते अपि तत्र राघवंगो नास्ति edd. — राजा च edd.

— 4 et 5. वा किं (conservato etiam priore किं) S.; ibidem deest अस्ति.

P. 100. L. = देवि राज्येन वा मन प्रयोजनं नास्ति। — In seqq. S. admodum differt: यद्यहमनुकम्पतीवस्तदा ममायुःप्रेषण अयं सदारपुत्रो वौरवरो ज्ञीवतु। — L. ab his in initio dissentit scribens: यदि मव्यनुकम्पा कियते तदा ममायुःप्रेषणाप्ययं राज्ञपुत्रः सपुत्रदारो ज्ञीवतु। — Nostra scriptura e codd. — ज्ञीवितुं। Pp. mendose; deinde hunc in modum pergit: अहं पुर्णमागमिष्यामैति। idem praebet P. quae scriptura, ut nemo non videt, emendatione eget; certam in promptu non habentes, recepimus scripturam edd. अन्यथा etc. *Lass.* — Fortasse rescribendum erat वयाप्राप्ति SCHL.

— 6 et 7. Ex codd. - पुत्र अनेन S. — ते सत्योत्कर्षेण edd. — सर्व om. L. eius loco in S. est तव। — तुष्टा edd. — इदानीं om. edd. qui et mox pro सदारपुत्रः praebent सपुत्रिवारः।

— 8 et 9. Ex L. omissa tantum तयैव ante गत्वा, et mutato पृष्ठः in गर्भः Ceteri narrationem invertunt: S. . . . अभवत्। ततो वौरवरः सपुत्रदारो गृहं गतः। राजापि तैरलक्षितः सत्वरमन्तःपुरं प्रविष्टः। अय etc. de quibus mox agemus. Codd. om. verba: दत्युक्ता . . . अभवत्; deinde pergunt: तथाभूते सति वौरवरः सपुत्रदारो गृहं गतः। राजापि तैरलक्षितः प्रासादगर्भं गत्वा तयैव सुप्त्वा स्थितः। अय etc. — *Lin.* 9. fin. पुनरु sequenti भूपालेन praemittunt codd., eius loco in S. legitur प्रभासे। Transponitur in iisdem libris: वौरवरो दास्यः। — दास्यः exhibit P. दास्यः Pp. hoc nisi Visarga addatur, mendosum est. *Lass.* — Auctor commentarii in Paninem, qui *Cāsikā-Vṛitti* dicitur, docet, spiritum finalem ante sibilantem, sequente consonante muta, legitime elidi posse: लर्परे प्रारि वा विसर्गलोपो वक्तव्यः। Eadem regulam repetit *Bhattoji-Dīxitas*. SCHL. — Pro पृष्ठः codd. दृष्टः। — आह pro उवाच edd. — अबलोक्य edd.

— 11. वार्ता विवते edd. — ततः et संतुष्टः absunt a codd.

— 12. प्राप्त्यः edd.

Dist. 101. a. . . कुर्याद् . . . S. — b. . . अपिक्यनः P. vitiose. — c. . . सत्यात् . . स्यात् L.

Lin. 15. शिष्ट om. P.

— 16 et 17. सर्वं Pp. — प्रसादात् तत्यै edd. — आग्नुजातिरिव दुष्टः() codd. — किंतु sequenti तत्त्वापि praemittunt iidem. — Pro संभवन्ति edd. सन्ति.

— 18. मंत्रौ ब्रूते codd.

Dist. 102. d. तन् प्राप्तेदकार्यतः edd.; quid sit प्राप्तेत्, videant ipsi. मन्दाश्चो न त्वकार्यतः codd. Initium hemistichii emendationem flagitabat, nostram certissimam esse censeo. Explicata est supra constructio वर...न तु। — तत्य (तन्त्राप्तः valet enim तत्य नाप्तः) referendum est ad नृप.

— 103. om. codd. et interpp. — कोशेभ्यः insolentius pro कोषैः।

— 104. c . . भिन्नुं महालोभान् edd. — d. सृतः P. यथा edd.; at P. 101.
verbo finito carere nequit sententia.

Lin. 3. उरि ex codd. Desideratur apud Wilsonem vox उरि, nom. औः.

— 4. . . मणिनामा Pp. — धनार्थिना edd. — चिरमाराधितः iidem.

— 5. Verbis ततः — प्राप्तवान् omissis, pergit L. तत्याज्ञया वक्तेश्वरेण स्वप्ने आदिष्टः।
यत् त्वमय et quae seqq. S. locum hunc in modum variat: ततः ज्ञीपापापोऽसौ स्वप्ने
दर्शनं दत्ता भगवदादेशादूयक्तेश्वरेषादिष्टः। यत् त्वमय etc. — आदेशप्रसादात् codd.

— 6. . . हस्तः सन् स्वगृहे L., लगुञ्ज हस्ते कृत्वा गृहे S.; द्वारि igitur omittitur
in utraque ed. sicuti mox सु.

— 7. ततो यद्यगतं भिन्नुकं, omisso sequente यं, L. ततोऽस्मिन्नेवाङ्गने भिन्नुं, यदा at-
que यं aequo reiecto, S. — पश्यसि edd. — एव om. S. — लगुञ्जप्रहारेण edd.

— 8. ततोऽसौ भिन्नुकः तत्काणात् सुवर्णपूर्णकलसः L. — स भिन्नुः om. S. — परिपूर्ण
om. S. et P. — एव in fine om. edd.

— 9. स्वेक्ष्या om. S. — Pro तदनन्तरं P. इत्यनन्तरं, Pp. इति तदनन्तरं; L. अय
तद् (mendose, nisi aut addatur अनन्तरं, aut corrigatur तस्मिन्, vel potius
तद् corruptum est ex तथा, quod deest); S. ततः. — सति repetimus ex L.;
ceteri om.

— 10. init. तद्वृत्तं edd. — तत्त्वं om. L.; तत्र substituit S. — .. करणाथा-
नीतेन edd. — तत्सर्वमालोक्य L. — आलोक्य etiam S. — Pro अये S. et Pp. अहो.—

— 11. तद् deest in S. — स om. S. — प्रतिदिनं post लगुञ्जहस्तः reicit
L.; प्रत्यहं praebet S.

— 12. तयाविधः edd. — प्रातः om. edd. — Pro भिन्नोः L. भिन्नुक. — उपेक्षते
codd. अपेक्षते L.

— 13. तेन om. L. — तथा om. edd. — Pro प्राप्तुः L. समाप्ताः. — भिन्नुकः
L. — हत्वा om. S. — Absurdam scripturam mox exhibit L. तेनापराधेन राजपुरु-
षस्ताडितः पञ्चत्वं गतः। Pro ताडितः पञ्चत्वमगमत् S. व्यापादितः insulse.

Dist. 105. c et d. स्यान्तिकारणो बन्धुर्वा किं वा edd.

Lin. 18. अनुसंधीयतां S. — चेत् चित्रवर्णः S. Particula conditionalis ab hac
sententia aliena est.

— 19. आगत् pro आयत् edd. — मवा शुतं edd. — Pro यत् L. तत्, male.
Omittit coniunctionem यत् Pp. यः praebet S., omittens verba mox seqq.
महायंत्रिणः — उपदेशे; perperam.

— 20. उपदेशः L. absurde, quum seqq. non mutata sint in अनादरीकृतः.

— Pp. चित्रवर्णो नाम देवः कृतः। inscite. — ततोऽसौ मूढो ज्ञेतुं प्राक्यः edd.

Dist. 106. a. . . कुरोऽवशः . . L.; in eadem ed. mox legitur भिन्नः, sed

P. 101. talia peccata silentio praetermittere praestat. — b. प्रमादिभिर्बस्थितः S. — c. pro शूः codd. नृपः. — d. . . भेदः . . . L.

P. 102. *Lin.* 1. ततोऽसौ यावदस्मद्दुर्गदाररोधं न करोति edd. Facile est perspectu, अवरोध corruptum esse in अररोधं (रुग्माररोध) quod quum nihili sit, inde factum est दाररोध. — Pro वर्त्मसु codd. दुर्गेषु.

— 2. नियुक्त्वनां edd. et P.

Dist. 107. Om. Pp. — hem. d.: . पिपासाहितक्षमं P.

— 108. a. प्रसर्तं . . . L. — b. . . . पीडने P. Prior huius distichi versus desideratur in Pp. — c. असेस्थितं : . . . edd.

— 109. a. Pro क्लिनं S. इन्नं, P. आकीर्ण — b. . . वर्त्मवर्जितं L. दस्युविकृतं tuentnr codd. et S.; interpp. nil certi praebent. Est autem compositum haud satis mihi expeditum; potest enim विकृतं vario modo intelligi; vero simillimum est vocabulum explicandum esse per दस्युवद् विकृतं, i. e. exercitus latrocinandi caussa hue illuc discurrens. — *Dist.* d. . . . विनाशवेत् L.

— 110. a. अवस्तक्तं Pp. — c. दिवा सैन्यं समाहन्याद् codd. समाहन्याद् legitur etiam in S.

Lin. 11. ते omissio, in fine commatis S.: दिवानिंश्च वृन्त्वस्त्वेनापतयः। — यथा कालं Pp. — वा ante घंतु inserit L. male.

— 12. Incisum a तथा incipiens iusto brevius contraxit L. in: बहवो निहताः। — S. = चित्रवर्पस्य सैनिकाः सेनापतयश्च बहवो निहताः। — ततः om. Pp.

— 13. Pro किं priori edd. किमिति, et pro किं वापि paullo post किं क्वापि; praestat omnino codd. scripture.

Dist. 111. d. Pro जरा Pp. राजा, e transpositione syllabarum orta corruptela.

— 112. In ed. Lond. more orationis solutae dispositum est hoc distichon neque dubito, quin editor iste metrum omnino non assecutus fuerit. a. श्रियं L. mendose. — b. कल्याणं P. minus bene et vetante metro. — अरोगी च S. अरोगी न च L. utrumque contra metrum.

— 112. d. Pro च विनीतः S. विनीततः male.

Lin. 18. देव शृणु edd.

Dist. 113. b. ज्ञानदुष्टोपसेवया L. — c. . . श्रियं L.

— 114. a. . . दूतं Pp. mendose. — b. . . भूषणं . . . Pp. — c. शृण्डायश्च . . . S. corrupte. — d. दूषणानि महोमुजां L. व्यसनानि महोमुजां S.

P. 105. — 115. a. Pro रस L. वशः; sed ponendum erat रस propter eiusdem vocabuli repetitionem l. 5. In codd. scriptum quidem est वश, sed hoc

potius legendum est रा, quoniam punctum 'diacriticum, quo in scriptura Bengalica distingui vulgo dicuntur litterae र et क, sine ulla regula certa a librariis ponitur, littera र autem rarissime vocabulo वर्ज tribuitur, atque constanter in nomine रस invenitur. — b. अन्तर् om. L. flagitat metrum. — c. प्रकृत्यमवाप्तुमूर्द्धिताः edd.; quam scripturam reliquimus hominibus istis. — एकान्त ऐdem modo alii nomini subiungitur quo अन्तर्, मात्र, अतिप्राप्य, alia eiusdem generis vocabula, quae in plerisque aliis linguis per adiectiva reddi debent; अन्तर् ex gr. per aliud; एकान्त per solum. Modo prorsus simili in lingua Arabica usurpatum vocabulum مُحَمَّد. Cf. supra I, 46.

Lin. 3: च excidit in edd. — Pro रसिकेन S. वसिना. — उपन्यस्तेषु edd.

— 4. Pro अवज्ञानं edd. अनवधानं.

Dist.. 116. d. स्वीकृताः edd. absurde. — Pro न Pp. नि (स्वीकृतानि) corrupte.

Subiungitur in edd. hocce distichon, quod ante oculos habuisse etiam W. videtur, quanquam pro certo haud affirmaverim, prorsus eadem verba, atque in edd. leguntur, in eius libro inveniri:

मुदं विषादः शरदं द्विमागमस्तमो विवस्वान् सुहृदः कृतम्भता ।
विशुद्धबुद्धिः प्रुचमापदं नयः श्रियः समृद्धा अपि हन्ति दुर्नयः ॥

In ed. Ser. legitur शुक्तं pro हुहृदः, quod placet; pro विशुद्धबुद्धिः editum est विशेषपत्रिः quae scripture Londinensi anteponenda esse videtur.

Lin. 9. इत्युक्ता तेन मन्त्रिणालोचितं । S. perperam. — राजा ex S. — नो चेत् et quae usque ad finem commatis sequuntur, ex S. desumpta sunt; L. mutillus est et sensu cassus: कथमन्यथा मम नीतिकथाभिर्वर्तयति । — Codd. alias scripturam praebent, quae mihi nondum satis est expedita, in primis quum variis legendi modos admittiat scripturae Bengalicae squalor. Cod. P. exhibet: नो चेत् नीतिप्रास्त्रकथा सुवासुएर्णाभिर्न्तर्यति । e quibus verbis sensus vix elici poterit. In Pp. scriptum esse videtur: नो चेत् नीतिप्रास्त्रकथा गुवागुर्णाभिर्न्तर्यति । Id certum est, कथं ab hac sententia haud bene abesse, unde suspicari fortasse licet, hunc in modum corrigendum esse locum: - नीतिप्रास्त्रकथां कथं खवागुलकाभिर्न्तर्यति । Sic legisse Ionesium, e verbis eius apparent: *consumes the dictates of sound instruction by the fire of his own words.*

Lin. 13. इत्यालोच्य तूष्णीं S. — अथ राजा edd. — अयं excidit in L.

— 14. इदानीं यवावशिष्टबलसहितं प्रत्याकृत्य विन्द्याचतुं गदामि तत्रोपदिशः । S. इदानीमवशिष्ट-

P. 103. बलसहितोऽपि विन्ध्याचलं यथा गमिष्यामि तदुपदिशा L. — यथाहमवशिष्ट etc. omissio in seqq.
यथा, codd.

— 15. Pro क्रियतां L. कर्तव्यः. — Pp. चिन्तयतमन्त्र, inscite omissis syllabis ति क्रियता.

— 18. मंत्री प्रहस्य बृते च । देव मा etc. S. Sic etiam L. omissio tamen च
et विहस्य praebens cum codd.

Dist. 119. a. मंत्रोणां L. *pessime*. — b. सन्निनपातिके S. *male*. — c. कर्मणि
प्रेत्यते प्रज्ञा S. कर्मणि युज्यते प्राज्ञः L. *hoc corruptissimum*. — d. सुखः L. *minus bene*.

— 120. b. in fine च pro ते edd. — d. तिष्ठति L. *mendose*.

P. 104. *Lin.* 1. तदत्र भवत्रतापादेव edd. — Pro त्यक्ता iidem भक्ता. — बल om. iidem.
— अविरेणैव Pp.

— 2. नेष्यामि edd. — Pro अभुना edd. अभुना; iidem तत् et संपयते.

— 3. दोर्घसूत्रता edd. — Pro सिद्धिः iidem सिद्धेः.

— 4. Pro भाविनी L. भावः, S. भावि लक्षणं. — Pro अथ S. सहसैव. — दुर्गदार-
रोधं करिष्यति Pp. दुर्गदारावरोधं (sic) विधीयतां P. दुर्गदाररोधो विधीयतां L. दुर्गावरोधः क्रियतां S.
Post hoc comma inseritur in Pp. राजाहंसो बृते । विधीयतां । — अथ abest ab edd.
— प्रहित om. codd.; deinde pergunt: प्रणिधिकेन; praetulimus scripturam codd.
quanquam talia composita minime sunt inaudita.

— 5. तत् om. codd. — एवायं edd. — चिन्त्रवर्णः excidit in codd.

— 6. -उपस्तम्भेन edd.; आगात्य om. iidem. — राजाह । S.

— 7. et 8. अभुना excidit in codd. — वदति देव दुर्ग etc. codd. — Pro
दुर्गदारबले L. स्वबले atque pro क्रियतां *praebet* विचार्य, quod quid sibi velit,
omnino non assequor. Hunc in modum enim procedit oratio: स्वबले
सारासारः विचार्य स्वर्णवस्त्रादिदानेन यथार्हं पूज्यतां । Quae verba ex ed. Ser. emendari
debent: स्वबले सारासारविचारः क्रियतां । तद्वात्वा स्वर्णवस्त्रादिकं यथार्हं प्रसादप्रदानं क्रियतां ।
Codd. agnoscent तद्वात्वा, quod ut otiosum reiecimus. Cetera, in quibus
a nostra scriptura variant codd. vix digna sunt quae enotentur: P. *praebet* सुवर्णं et प्रसादं दानं च;
postremum manifesta est corruptela. प्रसादहानं च
scribitur in Pp. quod ferri sane potest.

Dist. 121. b. Pro अन्विष्यते edd. समुडरेत्. — c. pro स्थानेषु edd. कालेषु; स्थान
i. e. occasio. — मुक्तहस्तस्य L. et P. quod vel ideo corruptum est, quod
caesura separatur compositum in duas partes, quarum altera (स्य) extra
compositionem nil valet.

— 122. c. . . नारौषु नरेणु बान्धवेष्व् S. — बन्धुषु L. et P. (in Pp. omissa
est ultima syllaba षु, ita ut sit बन्धु अति) Quod ad sensum attinet, eo-
dem redit; verum evitandus èrat hiatus. — d. अभिव्ययः P.

P. 104.

— 125. d. इव pro इव L. mendose.

Lin. 15. इदानीं pro इहसमये L. इहसमये pro vocabulo composito est accipiendo; significatio: *his rebus, hoc rerum statu;* saepius: *rebus tam aduersis valere videtur.* Utrum nomen sit per omnes casus flexibile, an ad locativum restrictum, ignoro; hoc coniicio propter particulam इह, quae notionem locativi vix exuere potest. Recurrit praeterea haud semel hoc vocabulum in seqq. — तथा चोक्तं codd. Haec tamen verba fraudem fecerunt librario, qui codicem Pp. exaravit. Transiluere enim oculi eius ad eadem vocabula disticho 124. praemissa, ita ut totum locum intermedium omitteret. — Hemistichium cuius initium laudatur, exstat supr. I, 36. et desumtum est e Manūs libr. VII, sl. 213. Originem trium ceterorum hemistichiorum, hoc dialogo laudatorum, ignoro. Vix me monitore eget, quatuor hisce hemistichiis effici slocum legitimum. Notus fuit Indis ingenii lusus, quo pars quaedam proponitur distichi, ab alio quodam explendi. Pars haec proposita proprio nomine dicitur समस्या vel समासार्था. Cf. Wils. s. v.

— 16. श्रीमतं P. — कुपिता L. चलते pro कुवते S.

— 17. पुनर् om. S. et P. — तदेवं L. — विमुच्य pro परिवद्य S.; ibidem transponitur: दानमानाप्यां स्वभट्टाः.

Dist. 124. a. संहृष्टाः S. — b. प्राणान् त्युं सुनिश्चिताः L. — c. कुलिनाः L. perperam. — द्विषद्वत्तं S.

— 125. a. स्वभट्टाः edd. — b. संभृताः Pp. संहृताः edd. — c. पंचशतं S. पंचशतं L.

— 126. a. अविशेषातः Pp. perperam. — c. न exhibent libri nostri uno P. 105. ore, quamvis in promtu foret omittere negationem, quae post किं पुनः abesse solet; verum tribuendum aliquid erat consensui codd. quorum scripturae metrum favet. — Pro hemistichio d. aliud prorsus diversum in edd. legitur: यश्चायात्मभर्निरः L. यश्चायात्मभर्निरः S.

— 127. a. Pro तथा edd. दया. — c. pro एतैः S. एमि: . — Pro मुक्तः L. त्वतः, Pp. युक्तः.

Lin. 5. Praemittit S. huic commati: इदृशि प्रस्तावे. — Pro तावद् L. इव; S. तावदेव. — अवश्यं om. edd. — पुरस्कार्याः Pp.

Dist. 128. a. प्रतिबुद्धः edd. प्रतिबन्धः Pp. quae scriptura habet quo se commendet; sed propter versum sequentem praestat प्रतिबद्धः; de प्रतिबन्धः enim dici nequit नियोजक्तव्यः. — b. उदयी व्ययी edd. Praestat scriptura codd.;

P. 105. copula enim च continetur composito aggregativo et vis affixi ad utrumque vocabulum extenditur: cuius rei supervacuum erit exempla addere. — c. शु pro स edd.

— 129. a et b. Substituitur in edd. versus prorsus diversus: धूर्णः हीवा प्रियुर्यत्य मंत्रिणः स्वर्महोपते: । (L. मंत्रीणः absurdum) Male procedit constructio. — d. . . . स निमज्जति edd.

Lin. 10. शृणु pro पश्य edd. — देवः (sic) S.

Dist. 130. a. यतो वस्तु Pp. mendose omissa alterutra lineolarum, quibus insignitur diphthongus शौ medialis. Pro hoc vocabulo edd. समौ, quod vix probum est. Si enim loca comparaveris, ubi सम eadem significatione atque h. l. legitur (*aequabilis*, *par* ea est), invenies, सम aut praefigi et dici per compositum समदुःखसुख (Bhag. Gīt. II, 15. VI, 8. XIV. 24.) aut separari a nomine, cui in composito praefigi solet, et locativum regere (समः सिद्धयसिद्धयः et similia cf. Bhag. Gīt. II, 48. IV, 22. IX, 29. XII, 18. bis.) qui locativus servatur etiam, quum सम pars sit alias compositi (ibid. IV, 18. समदर्शिनः शुनि द्वयाके च et his similia VI, 9. 29. 32. XII, 4.). In omnibus his locis de homine dictum est, de *rebus* etiam usurpatum reperio, sed de talibus, quae aequabili i. e. eodem loco ab homine haberi aut aequabiliter temperari possint. (प्राणायानौ समौ कृत्वा Bhag. Gīt. V, 27. सुखदुःखे समै कृत्वा etc.). Verum enim vero contendeo, सम nunquam dici posse omnino de *rebus*, quae tam inaequabiles sunt, ut aequabili loco neutinquam haberi possint, quaeque quum in hominem cadant, potius omnino sunt repellendae atque amovendae, quam aequo animo tolerandae. Quales sunt Indis ira atque exultatio. Aequa absurdum igitur fore, hominem appellare समक्रोधहर्षं atque iram et gaudium सम; quia homo, qui istis affectibus se tradat, ea ipsa re impeditur ab aequabilitate animi atque hi affectus ipsi inaequabiles semper manebunt. — b. कोषः स्वप्रत्ययेन च codd. Praetulimus scripturam L. siquidem प्रत्यय sensum huic versui aptum nullum vindicare posse nobis visi sumus. Habet tamen instrumentalis स्वप्रत्ययेन, quo in eo offendaris. S.: शास्त्रार्थे प्रत्ययस्तथा. — c. निति Pp. - भूत्यानपैक्षा L. falso. भूत्यानपैक्षा S. quae vox est nihil.

Dist. 131. b. Hemistichium novem syllabarum praebent editi libri ac manu scripti neque in promtu est certa emendatio. — अमात्याः; omissos te, S. male. — लब्ध्वा ex Pp. ceteri रुद्रा. — अवसन्ते suspectum est propter formam activam.

— 132. a. महीभुजः edd. — b. संकोष्ठस्येव दन्तिनः S. — c. ख्यलतो हि L P. 105.
mendose. — d. च्छुहृत् चिरचेष्टिं edd. Corruptela orta videtur e vitiosa
syllabarum transpositione, qua prima verbi सन्ति syllaba a corpore suo
avulsa vocabulo चुहृद् praefixa sit; चिर deinde mutatum est in चिर, seu
potius ab edd. isto modo lectum.

— 16. तथा pro अय Pp. — Pro एष युद्धार्थी S. इतनीं.

— 17. Post दुर्गद्वारि L. addit तिष्ठति, S. वर्तते. — च्छ om. Pp.

— 18 et 19. पादस्य codd. — Idem inciso addunt particulām इति. —

Prius ना ex P. — दुर्गाश्रवणस्येव S.

Dist. 133. a. अपि-(३चि) pro हि L. — b. . . . निर्गतोऽवशः S. — c. pro तत्य
S. शूरः.

Lin. 22. वायसो छूते देव etc. L.

Dist. 134. b. योधयेद्वलोकयन् edd. P. 106.

Lin. 3. Pro अनन्तरे edd. अय. — दुर्गद्वारि Pp. — महाबलं P. minus bene,
nisi pro कृतवंतः legitur दर्शितवंतः. — अपरेणुः L. mendose. — चित्रबर्णो गृष्मोवाच Pp.
quo modo haud semel peccatur.

— 4. तात om. Pp. — यत् प्रतिज्ञां तद्धुना पालय L. — Pro ताकत् L. देव
शृणु ताकत्.

Dist. 135. a. . . . अत्यल्य (sic) S. vox nihili est et operarum ne-
gligentiae tribuenda. — b. . . . नामकं Pp. perperam. — c. स्वगुप्तमीरुद्युमं च
P. चुगुप्तमीरुद्युमं च Pp. neutra scriptura sensum praebet idoneum. चुगुप्तं भी-
रुद्योधश्च S. contra sensum et grammaticam. अगुप्तं भीरुद्योधश्च L. Prius rece-
pimus, posterius grammatica respuit.

Dist. 136. a. . . . चिराबोधः S. corruptela orta est ex ambiguitate scri-
pturae Bengalicae, ut saepius. — b. . . . पौरुषः L. Vocabulum तौव्रपौरुष
in lexicis desideratur, sensus tamen manifestus est. Significat expugna-
tionem per vim apertam, in qua opus est militibus manu fortibus, in
qua cernitur viri fortitudo. Hinc patet, formam तौव्रपौरुष haud prorsus
esse spernendam.

Lin. 9. च om. S. — वक्ति pro प्रक्ति L. mendose. — क्रियते S. — युञ्ज pro
यत् L. — एवमेव om. L. ibidem mox pro ततः scribitur तत्र. Dubito, annon
hoc loco legendum sit एवमेवं, quam formulam in iunctura prorsus simili
usurpatam invenio in drame Mudrâ-Râxaso; dicit ibidem Chânakyas,
servum negotio quodam arcano instructurus: एवमेवं; praemissum est कर्णे;
in narratione, uti oportuit, additum est कथयति।

- P. 106. — 10. Post भास्करे addit L. प्रातः काले. — दुर्गद्वारेषु S. — वृत्ते युक्ते S. प्रवृत्ते युक्ते L. — दुर्गाध्यन्तरे गृहे गृहे L. — Post - गृहेषु addit S. एकदा. — मेववर्णं om. edd. मेववर्णकाकेनैव Pp. काकै: S. काकेन L.
- 11. निःक्षिप्तः Pp. male. — Alterutrum गृहोत्तं om. L. et Pp. — Pro अनेकगृहेषु S. सर्वतः.
- 12. पावकं प्रदीप्तं L. प्रदीप्ताण्णिं S. omissio sequente प्रत्यक्षेण. — राजहस्तैनिका दुर्गावासिनश्च S.
- 13. Pro वृद्धं L. जलं.
- Dist.* 137. a. सुमंत्रीतं L. pessime. — c. कार्यकाले S. प्राप्तकाले L. — d. कुर्यान्तं तु edd.
- Lin.* 16. सुखि desideratur in S. — द्वितीयश्च edd. male. — सेनापतिः Pp. corrupte. Voluit fortasse सेनापतिः, ita ut compositum sit [cum seq. कुक्कुटेन.
- 17. Pro राजा S. सारसं. — सारसं om. Pp.
- 18. आत्मानमधुना न व्यापादय codd. — Pro न S. कथं. — त्वं गन्तुं L. — त्वमधुना गन्तुं श्रक्तः S. male collocatis vocabulis. — Pro गत्वा S. कृत्वा; male. Alio modo peccant codd. तद्वद् दुर्गद्वारि गत्वा जलं etc.
- 19. प्रविश्च edd.; pergit deinde S.: आत्मानं परिरक्ष अस्मत् पुत्रं चूडामणिनामानं सर्वज्ञसंमत्या etc. — चूडाकर्णनामानं L. — सर्वसंगत्या P. सर्वज्ञसंमत्या Pp. — कार्यिष्यति edd. — करिष्यसीति codd.
- 20. एव P. — यावत् चन्द्रकौं दिवि तिष्ठतः edd. — तावत् om. codd.
- 21. Commate posito, scribi oportet देवः, ut praebent codd. requiritur enim nominativus. — अहं देव, omissio एव post पुनर्, P. — अहं देव, omissio पुनरेव S. पुनरेव Pp. Scribendum erat cum L. पुनरेव, nam particula एव sola praecedenti पुनर्, immo toti sententiae vim suam propriam impertit. — तद् om. S. et pro मम statum absolutum मत् ponit. — Pro दुर्गद्वारेषु S. दार्कर्मना, L. वर्त्मना.
- 22. अपरं च देव codd. अपरं च, omissio देव S. अपरं च et देव om. L.
- P. 107. *Dist.* 138. a. अर्थे pro ज्ञाने codd. — b. . . भाग्येन . . . L.
- Lin.* 2. Desideratur omnino in ed. L. — S.: राजाह। सत्यमेवैतत् किंतु।
- Dist.* 138. d. ज्ञाने भूत्येऽपि . . . S. mendose. भूत्यः खलु युद्धार्थः L.
- Lin.* 4. सारसो ब्रूते। श्रृणु देव edd.
- Dist.* 139. b. यूक्तं S. mendose. अन्यथा L. repugnat sensus. — c. एवं L. refragatur metrum. — d. सुधा om. codd. tuetur metrum. L. = सधा, quod nihil est. — क्रियते codd. et S. क्रियतां L. prius contra metrum peccat;

hoc etiam contra grammaticam. Emendationem nostram metrum requiri atque defendit. P. 107.

Lin. 9. देवत्वं च edd. — सर्वथा iidem. — In ed. Ser. praemittitur hisce verbis dist. 143. Nos servavimus ordinem a ceteris commendatum. — In codd. transponuntur distt. 141 et 142.

Dist. 141. a. . . . स्वामिन् त्याक्षा (sic) S. Repetit hosce versus S. infr. IV. ante dist. 58. correcto स्वामिना, at pro त्याक्षा aequo vitiose scripto त्याक्षा; tum ibi est गतायुषः. Repetunt eodem loco codd. sine ulla varietate.

— 142. a. नरेष्वे त्रीवल्लोकोऽयं S. — b. उमीलति निमीलति L. prorsus absurde. न मीलति न मीलति Pp. quod nihil est. न मीलति निमीलति P. negatio huc non facit; corruptela orta esse videtur ex inscientia librariorum, qui non viderint, alterutrum निमीलति (prius credo) locativum esse participii, cum नरेष्वरे coniungendum. — c et d. उदेत्युदीयमाने च रवाक्विव सरोहुं । S.

— 143. a. स्वाम्यमात्यं च . . . codd. Videant qui ita scripsere, an अमात्य neutro genere collective de omnibus regis consiliariis dici possit; equidem exemplum, quo id probem, habeo nullum. — c. राज्यगानि . . . L. mendose.

Lin. 16. Primum incisum desideratur in S. — ग्राहैरे abest a codd. — खरतरनवायातः edd.

— 17. ततः excidit in S. — राजा om. L. — Omisso अनन्तरं pergit S. . . राजा इले क्षिप्तः अथ कुकुटैन्वमुखप्रहरजारीकृतेन सारसेन कुकुटसेन बहुशो हताः (sic) । पश्चाद् et quae mox enotabuntur.

— 18. मुख om. L. — सारसेन deest in codd.

— 19. कुकुटोऽपि सेनापतिः L. कुकुटसेनापतिरपि codd. Genitivus सेनापतेः ex emendatione; dici enim debet, a quo occisus fuerit. पञ्चिभिः om. P. — Invertit ordinem verborum L.: पश्चात् सारसोऽपि भवुभिः (sic) पञ्चिभिः संभूय व्यापादितः । S. = पश्चात् सारसोऽपि चंचुप्रहारेण विभिय व्यापादितः ।

— 20. राजा om. S. et P. — Pro तद् edd. दुर्ग; sensus haud differt, sed nimis ingrata est repetitio.

— 21. श्रव्यैः edd. — Pro स्वस्कन्धावारं L. वहिः, ieunius. स्वस्कन्ध scribitur in codd. mendose, si fides habenda Wilsoni s. v. स्वस्कन्धावार.

— 1. *init.* अथ inserit S.; ubi mox राजा pro राजहंसः. — असौ सारसः पुण्यवान् P. 108. येन L. स पुण्यवान् सारस एव येन S. — एवं om. edd.

— 2. त्यागेन pro दानेन S. — Pro स्वामी L. राजा,

P. 108. *Dist.* 144. b. सर्वा एव S. — c. विषया Pp. mendose. — उन्मित्त codd. उल्लिखित edd.

Lin. 5. Pro क ताक्त् et quae seqq. substituit L. haecce: स्वभावतः स्वेदेहेन क्रोतानक्षयलोकान् विद्याधरीपतिज्ञोऽनुभवतु महासत्त्वः । S. omittit स्वसञ्चक्रीतान्—प्रायं atque l. 6. समन्वितः; in ceteris cum nobis et codd. consentit.

Dist. 145. b. स्वाम्यर्थे S. — c. कृताज्ञाश्च Pp. mendose.

— 146. a. यत्र तत्र edd. — b. . . . परिवारितः । L.

Lin. 11. Pro hisce verbis L.: विग्रहः श्रुतो भवद्विः । राजपुत्रैरुतं । श्रुत्वा सुखिनो भूता वयं । विष्णुशर्मात्रवौत् । अपरमयेवमस्तु ।

Dist. 147. b. न कदाचिद् L. contra metrum. नोदकाभिभवतां Pp. quae corruptela orta est ex transpositione litterarum क et र et permutatione labialium प et भ. — महीभूतां L. महीभूतां S. absurde. — c. समाहतां Pp. समाहतः L. quae peccata eo tantum consilio enotavi, ut commonstrem, quanta vitiiorum abundantia ubique sit in edd. aequa atque codd. — Pro संश्रयन्तु P. संप्रयान्तु.

P. 109. *Lin.* 1 et 2. Edd. = पुनः कथारम्भकाले राजपुत्रैरुतं । आर्यं विघ्रहः श्रुतोऽस्माभिः संधिरधुनामिधीयतां । विष्णुशर्मणोपोतं । श्रूयतां । संधिमिधि कथयामि यस्यायमायष्टोकः ॥ Pp. prima manu विधीयतां । :

Dist. 1. c. स्त्वराम्यां codd.

Lin. 5 et 6. राजहंसेन edd. — अर्यं deest in edd. — निःक्षिप्तः Pp. क्षिप्तः P. — Pro किं etc. codd. प्रायेण केनचिद् विषज्जप्रयुक्तेन ।

— 7. युक्तेन L. — मेववर्णोऽभिधानः (sic) Pp. — Edd. देव भवतो निष्कारणबन्धुरसौ मेववर्णः सपरिवारो न दृश्यते ।

— 8. -वारोऽपि Pp. — Mox S. pro एतत् praebet एव, addito in fine commatis इदं; L. eodem loco exhibit इदं, omittit एव.

— 9. एव S. — किंतु om. edd. — Pro दुर्देवं L. दुर्मायं.

Dist. 2. a. देवस्य S. — b. न पुर्वमन्त्रिषामयं edd. — c et d. . . सुविटिं यन्नात् दैवयोगाद्विनश्यति । L. Idem legitur in S. nisi quod pro यन्नात् cum codd. praebet क्वापि.

Lin. 12. एव om. L. et P. — तत् pro एतत् Pp.

Dist. 3. c. दोषांश्च edd.

— 4. c. कुर्मं L. in qua voce sexcenties peccatur ab editore isto.

P. 110. *Lin.* 1. मायविषये फुल्लाभिधानं P. मग्नदेशे फुल्लाभिधानं Pp. फुल्लं pro फुल्लं L. mendose; in eadem editione mox simili peccato अभिधानं.

— 2. चिरं S. Nomina anserum proferunt edd. haecce: संकटविकट L. P. 110.
संवटविकट S. praestare videtur scriptura L. — Testudinis nomen addunt
edd. कम्बुयोवनामा कूर्मश्च scribentes. — निवसति Pp. — अथ एकदा edd.

— 3. अग et अत्र locum inter se permutare iubent edd. यद् h. l. idem
valet atque Graecorum ὅτι, Persarum ए. — मत्स्यकूर्मादयः edd.

— 5. मया किं codd. atque sic legendum, quia praecipua orationis
vis in मया posita est; testudini enim difficilius erat, in alias migrare
sedes. — Pro विधातव्यं edd. कर्तव्यं.

— 6. Prius मा desideratur in edd. — Pro यतः et quae seqq. L.:
यद्गृह्णेत्वं तत् कर्तव्यं, quae corruptela orta est ex vitiosa prioris sententiae cum
hac confusione.

Dist. 5. d. Pro विनश्यति Pp. भविष्यति; male.

Lin. 9. अस्मिन् pro एतस्मिन् S. — Alterum एव abest ab edd.

— 10. अबलोचितं Pp. — Transponunt edd.: - नामैको मत्यः । — आलोचितं
pro उक्ते S. तेनोक्ते om. L.

— 11. Pro पुनर् edd. तावत्, omissa in seqq. hac voce. Pro गतः L.
प्रविष्टः. — च in fine om. edd.

— 12. भविष्यदर्थे edd. — कुत्र मया गतव्यं edd. — 13. तदुपम्ने वथा कार्यं तदनुष्ठेयं edd.

Dist. 6. d. प्रत्यक्षे गोपनं कृतः S. quod nihil esse arbitror. *Lass.* — Nisi
forte गोपनं significat praetextum, quo aliquid occultatur, tentare possis:
गोचरौकृतः । *Schl.*

Lin. 16 et 17. Pro अस्ति S. पुरा. — समुद्रनामा Pp. — वनिगस्ति (sic) S.

— 18. रदा om. codd. — Post रमते inserunt codd. distichon supra
exhibitum I, 189. Jon. totam fabulam IV. omisit. In L. haec leguntur
disticha, quae W. etiam Anglice reddidit, unde patet ex eius codice
esse desumta:

नैतावत् समवेक्षते न चावयवनिश्यं ।

सुरूपं वा कुरूपं वा पुमान् इत्येव भुजते ॥

शास्त्रं सुचिन्तितमपि प्रतिचितनीयं । आराधितो नरपतिः प्रतिशङ्कनीयः ।

अङ्गे स्थितापि युवतिः परिशङ्कनीया । शास्त्रे नृपे च युवती च कुतो वशिष्वं ॥

Hisce slocis interponit porro W. eundem, quem codd. et S. In prioris
distichi hem. b. mendum suspicor, emendationem ignoro.

— 18. का रत्नप्रभा S. et P.; prius vocabulum recepimus, posterius re-

P. 110. iecimus; utrumque om. L. अथ सा एकहा Pp. — सेवकस्य om. L.; ubi vitiouse mox legitur ददति. — तेन समुद्रद्वेन P. - आलोकिता L.

— 19. च abest a codd. — सा सत्वरं om. L. — S. transponit: सा बन्धकौ — उपागम्य Pp. गत्वा edd.

— 20. तावत् om. edd. — निर्वृतिः iidem. — Verba युष्मदर्थमश्नाति om. codd. S. hunc in modum pergit: यतोऽयं चौटिकोकृत्वा कर्पूरं लादतोति मयारय मुखमाद्याय ज्ञातं । तथा चोक्तं । आहारो द्विगुणः स्वीकारं हृत्यादि । तच्छुक्त्वा etc. l. 21. Distichon, cuius initium laudatur, legitur supra II, 113.

— 21. अस्य वदने कर्पूरगन्धो मवाद्यातः । L. Post verbum आद्यातः inserit P. ipsum illud distichon, cuius initium in S. laudatur, ut mox enotavi. — अपि ex codd.

— 22. यस्य स्वामिनो गृहे एतादृशी भार्या तत्र etc. edd. — Pro तत्र Pp. तत्यः; — ibidem pro यत्र legitur यतः, praemitto इति. — Edd. गृहीणी mendose; pro hac voce P. वधूः in Pp. vitiouse exaratum est वधूः.

P. 111. — 1. सन् ex codd.; om. S.; eius loco in L. legitur: ततोऽसौ; male; nam eisdem verbis incipit sententia. — प्रबोधानीय omissis pergit L. यन्नात् संतोष्य रक्षितः । S. eodem modo pergit post omissa ista verba, sed pro संतोष्य praebet प्रबोध्य.

— 3. Pro initio distichi laudati totum exhibet S. Legitur apud nos Prooem. 28. — Pro अथ edd. ततः. — सन् om. iidem; scilicet non assecuti sunt huius constructionis vim, quam explicui ad p. 35. l. 18.

— 4. संदर्शय edd. दर्शयित्वा P. — उत्पत्त्य codd. Sed ल्लु melius de piscibus dicitur, quam पत् — गंभीरनीरं P. गंभीरं जलं L. गंभीरं नीरं S.

— 5. अहं excidit in Pp. — 6. Pro तथा codd. तत्.

— 7. init. जलाश्रयान्तरे प्राप्ते तव कुशलं स्थले गद्यतसे को विधिः । edd. quae quamvis nimis verbosa, per se sensum satis bonum praebent; interpungendum est post कुशलं. — Pro कुतः P. कर्यं. — अपि deest in edd.

— 8. यामि pro गद्यामि edd.; et mox pro स उपायः substituunt तथा. — कथमुपायः संभवति edd.

— 9. Pro काष्ठं P. काष्ठसप्तं; obiter observo, एक h. l. non recentiorum Indicarum dialectorum more esse positum; idem enim lignum ab utroque ansere ferri vult. — कर्तव्यं codd. mendose. Edd. sic: युवायां चञ्चुभृतं काष्ठ-सप्तमेकं मया मुखेनावलम्ब्य गन्तव्यं युवयोः पक्षब्रलेन मयापि सुखेन गन्तव्यं ।

— 10. खण्ड Pp. mendose. — आलम्बनं P. perperam.

— 11. एव pro एषः L. et Pp.

Dist. 7. b. Pro हि L. अपि (अथ) *pessime*, sequente paulo post eadem P. 111. particula.

Lin. 14. पर्वतः pro गिरिः L. — नास्ति पर्वते S.

— 15. तत्रैव रेवातीरे L. Revam fluvium, utpote qui septentrionem versus collocari nequeat, ab hoc loco esse alienum, nulla eget demonstratione; ita tamen legit etiam W. qui nota sua ostendit, nominis significationem sibi esse ignotam. Reva aliud Narmadae sive Nerbuddae est nomen; cf. Wils. s. v. et ad Megh. Dut. p. 26. Alium in modum fluminis nomen corruperunt codd.: तत्रैवातीरन्यग्रेधे; verum praebet J. In S. लिमिनिस nulla omnino sit mentio: post पर्वते enim pergit: महान् पिष्पलवृक्षः । तत्रानेकवका निवसन्ति । — न्यग्रेधपादपे L. — तद् वृक्षस्याधस्तात् L. — तस्य वृक्षाधस्तात् S. corrupte. In eadem editione contrahuntur duo commata: सर्वे बालापत्यानि खादति ।

— 16. स च सर्पस्तोरां वकानां codd. — Pro ततः edd. अथ.

— 17. विलापं S. — केनापि Pp. — वृक्ष deest in S.; ibidem अभिहितं pro उत्तमं. — यूयं कुरुत P. कुरुत् L. mendose. — एवं न कुरुत् यूयं S. — Pro आनीय S. उपादाय.

— 18. आर्थ्य om. L.; substituunt codd. आगत्य. — एकैकशो मत्स्यान् om. S. — Pro धत्रि S. विकिरत्, L.: आस्तीर्य दातव्याः; absurde.

— 19. नकुलैरयमागत्य इष्टव्यः Pp. Nomen सर्पः omittit etiam P. nullo tamen substituto pronomine. — द्वेषात् S. — Post द्वेषात् L. pergit: सर्पविवरं दृष्टा प्रविश्य स सर्वे हन्तव्याः । — च in fine ex Pp.

— 20. L. om. तद् वृक्षं । अथ, post अनुष्ठिते addens: सति. — ततस्तत्र वृक्षे नकुलैः omissos: S. तैः; — ibidem रावः pro आरावः. — Diffusius L. post अनुष्ठिते सति pergit: तैनकुलैस्तद्विवरं प्रविश्य सर्वे सारितः । ततो नकुलैवृक्षोपरि पञ्चशावकानां रावः श्रुतः । अनन्तरं तद् वृक्षमारुत्यं पश्यतां वकानां प्रावका भक्षिताः । — पश्चात् तैवृक्षमारुत्यं वक्षप्रावकान् खादन्ति । (sic) S. — पश्चात् तैनकुलैस्ते प्रावका वृक्षमारुत्यं सर्व एव etc. codd.; quae verborum collocatio in eo peccat, quod वृक्षमारुत्यं positum est, quasi ad प्रावकाः referendum esset; quod contra contextum est.

— 22. एवं et च om. edd.; त्वां abest a codd. — दृष्टा pro अबलोक्य L. ubi in fin. commatis additur: आश्रयत्वात्; quod παρελθει.

Lin. 1. यदि edd. — दास्यसि S. — तव pro त्वत् L. — खलु om. S. भविष्यति P. 112. substituit L. — Pro इह edd. अत्र.

— 2. अप्रक्षः Pp. अत्रः P. prius mendose. — Sequens comma augent edd. his verbis praemissis: नाहमुत्तरं दास्यामि; deinde transponunt: किमपि न वक्तव्यं मया; S. om. मया. — वक्तव्यमिति ततस्तथा etc. P. — ततः praebet etiam Pp., verum om. तथानुष्ठिते. — अनुष्ठिते सति L.

P. 112. — 3. *init.* आकाशे नीयमानं तं कूर्म्, omisso तथाविधं, L. — आलोक्य edd. — Post वदन्ति च inserit L. अहो महदाश्र्यं पक्षिभ्यां कूर्मः समुद्दते ।

— 4. Pro यद्यं etc. codd. = अत्रैव पक्षा भोक्तव्योऽयं कूर्मः । — भोक्तव्यः ex codd. eius loco S. खादितव्यः, L. खादितव्यः मया. — Deinde S.: कश्चिद्ददति । अत्रैव दग्धा (l. दग्धा) खादितव्योऽयं । कश्चिद्ददति । गृहं नीत्वा भज्ञपीयः । Quae hunc in modum variantur in L.: कोऽपि निगदति खण्डप्रोऽस्त्रं कृत्वा नेतव्यः । कश्चिद्ददति । गृहं नीत्वा दग्धा भज्ञपीयः ।

— 5. एवं दुःसहं पुरुषवचनमाकर्णं L. इति तद्वचनं श्रुत्वा S. — क्रोध codd. — S.: कोपाविष्टो विस्मृत् etc. — अथ ex Pp.

— 6. तन् om. edd. — Pro अवदत् S. प्राह. — पतन्नेव codd. quod propter seq. पतिः ferri non potuit. — S.: वदन्नेव पतितस्तैर्व्यापादितश्च । L.: वदन् काढात् पतितो गोरक्षकैर्व्यापादितः ॥

— 7. च om. P. — In L. sequitur post इत्यादि hoc distichon, quod praeter W. nullus librorum agnoscit:

रक्षितव्यं सदा वाक्यं वाक्याङ्गवति नाशने ।
दुःसाभ्यां नीयमानस्य कूर्मस्य पतनं यथा ॥

cuius sententiae meminisse debebat ipse distichi auctor.

— 8. प्राक् प्रहितः om. edd. — तत्रागत्य edd. — तं om. S. et P. — निगदितं pro निवेदितं S.

— 9. यद् desideratur in edd. et abesse sane potest; amant Indi quae est linguae eorum in periodis formandis inopia, orationem directam. — हि प्रतीक्षणं S. — कार्यं codd. — अतस्तदनवधानस्य L. sic etiam S. omisso अतः. — इदं om. S.

— 10. अनुभूतं pro आगतं edd. इति addit praeterea S. — चायं abest a S. — मेघवर्णेन, omisso नाम्ना idem. — वायसराजेन P.

— 11. निष्प्रवर्त्य S. et P.

Dist. 8. b. विस्वप्राति L. mendose. — c. स सुप्तः Pp. — वृक्षागुत् edd.

Lin. 14. Pro इतः edd. ततः — तदागतेन प्रसादितेन चित्रवर्णराजोत्तमः । Codd. Irrepsit vox आगत e mox antecc.

— 15. अथमेव codd. quod placet.

Dist. 9. d. दिष्ट्या P. दृष्ट्वा S. neutrum huc facit; deest totum distichon in Pp.

Lin. 18. Verba देव-राजाह desunt in S. et codd.; Pp. om. etiam चक्रवाको द्वृते.

- 19. कवयति pro उच्चाच codd. haud male. — Pro उक्तं S. अभिहितं. P. 112.
 — 20. किमपि ante क्रियतां inserit S.

Dist. 10. a et b. Pro scriptura ed. Londin. quae unice in hunc contextum quadrat, codd. et S. praebeant: अविचारयतो मूषिकयन् तुष्प्रणेडन् । Quae scriptura me iudice sana non est; nostram ante oculos habuit W. neque non, si recte video, J. — hem. d. वालुकमिव . . . L. वालुकामिव मूत्रितं S. hoc procul dubio mendosissimum. Pro ultimo vocabulo scribere fortasse voluit सूत्रितं, uti legitur in Pp.

— 11. b. कदापि न कर्तव्यः, omissio altero versu, codd. et S. Solutam P. 115. igitur orationem ponunt. Consentient interpp. Ingeniosior tamen versus posterior visus est nobis, quam qui omitti deberet.

- 12. b. हन्ते pro लोप्तुं edd.

Lin. 5. Pro दूरदर्शी L. गृहः, S. मंत्री. — गोतमस्य S. — क्षेषः Pp. मुनेः L.

— 6. Pro मुनिः Pp. क्षणिः. — Pro प्रयेन L. काक. Longius abest S.: तत्र तेन मुनिना काकेन नौयमानो मूषिकशावको दृष्टः । ततः स्वभावद्यात्मना तेन मुनिना etc.

— 7. पश्चात् omissio, L.: तेन द्यायुजेन स्वकीयाहारविशेषैः पालितः । — तेन ante मुनिना inserit P. — सः deest in P. et S. — Pro पालितः S. संवर्धितः. — Pro ततो च S.: ततो विडालस्तं, omissio, ut oportet, in seqq. विडालः.

— 8. अन्विष्यन् Pp.; — मुनिना deest ibid. — Dissentit S.: खादितुमनुधावति । तमवलोक्य मूषिकस्तस्य मुनेः क्रोठे प्रविक्रेशः । ततो मुनिनोळं । मूषिक त्वं मार्जारो भव । ततः स विडालः कुक्कुरं दृष्ट्वा पलायते । ततो मुनिनोळं । कुक्कुराद् विभेषि त्वमेव कुक्कुरो भव । स च कुक्कुरो व्याघ्राद् विभेति । ततस्तेन मुनिना कुक्कुरो व्याघ्रः कृतः । etc. quae postea enotabuntur. — Verba ante तपःप्रभावात् hunc in modum variat L.: तं मूषिकं गोतमालोक्य तपः - etc.

— 9. Pro मूषिकः legitur in L. वलिष्ठः, quod epitheton foret sequentis विडालः, nec tamen hoc faciens nec recte scriptum. — च om. P. et L. — विडालः repetit post स L. — असौ om. P. असौ विडालः om. L.

- 10. सौऽपि व्याघ्राद् विभेति । ततोऽसौ व्याघ्रः कृतः । L.

— 11. तं व्याघ्रं S. — विशेषेण P. male. निर्विशेषं L. मूषिकोऽयमिति पश्यति । S.

— अतः सर्वे तत्रस्या ज्ञानस्तं मुनिं दृष्ट्वा वदन्ति । L. अथ तं मुनिं दृष्ट्वा व्याघ्रं च सर्वे वदन्ति । S.

- 12. अयं deest in S.

— 13. च व्याघ्रः Pp. स व्याघ्रः S. — व्यथितः सन् Pp. सव्याघ्रः deest in S. — स्थानव्यं pro जीवितव्यं S. — Pro इदं L. मम, S. इदं मे, omissio in seqq. मम.

— 14. Post पलायिष्यते S. addit मूषिकः; scilicet non intellexere edd. isti rariorem huius verbi usum, quo significat: cessare, abire. — समालोच्य et mox समुयतः L. — Pro उयतः S. गतः ।

- P. 115. — 15. मुनिना om. codd. — Pro ततो मुनिना etc. L.: मुनिस्तस्य चिकीर्षितं जात्वा.
— मूषिको भव इत्युक्ता desunt in codd.
- 16. सुक्रमिदमिति न मनव्यं edd.
- Dist.* 13. c. . . लौल्यात्मकः . . . Pp. — d. स मृतः कर्कटग्रहात् Pp. मृतः कर्कटकग्रहात् S.
- Lin.* 19. अस्ति मगधविषये पञ्चकेलिनामधेयं सरः । S.
- 20. वृद्धः S. — सार्थक S. mendose. — इव abest a L.
- 21. केन pro केनचित् Pp. perperam. — द्वारादेव om. edd. — भवान् अत्र edd.
- 22. त्यगेन S. — Pro उक्ते L. अभिहितं Pp. काकेनोक्ते, absurde. — जीवित Pp. — Pro ते L. mala repetitione: मत्स्याशात्रावश्यमेव प्रातः कैवर्तैः etc. Verba चावश्यमत्र desunt in S.
- P. 114. — 1. इति वार्ता, omisso posthac पर्यालोचना, edd. — Pro आकर्षिता S. शुता.
- 2. *init.* अतः S. तदितः P. — अभावादेव S. अभावेन L. — अहं deest in edd.
- ब्राह्मदरः S.
- 3. कृतः om. P. — तच्छ्रुत्वा सर्वैः om. edd. eorum verborum loco in L. legitur ततः — एवायं लक्ष्यते edd.
- 4. पृच्छतां L. absurde.
- Dist.* 14. d. लंजे edd. et Pp.
- Lin.* 7. भो वक कोऽत्र S. भो वक अस्माकं कुत्र L. — Pro रक्षाहेतुः repetunt edd. रक्षणोपायः .
- 8. Pro गमनं edd. आश्रयणं. — एकैकश्चो युमान् edd. male; dissimulare enim debet grus. — मत्स्या आहुः, perperam omisso भवात्, S.
- 9. दृष्टि om. S. — तावन्मत्स्यांस्तान् L. ताम्यत्स्यान् S. — Pro अभक्षयत् S. खादन्ति; post नौत्वा pergit L.: कस्मिंश्चिद्देशो खादित्वा पुनरागाय वदति ते मया जलाश्रयान्तरे स्थापिताः । अनन्तरं etc.
- 10. कश्चित् deest in edd. — In P. कुलीरश्चित् lapsu calami. — नयेति codd.
- 11. Pro नौत्वान् et quae seqq. edd.: नौत्वा स्थले धृतवान् । — In fin. कुलीरोऽपि edd.
- 12. मत्स्यकण्टकाकीर्णं भूमि दृष्ट्वाचिन्तयत् L. मत्स्यकण्टकाकीर्णं तत् स्थलमालोक्याचिन्तयत् S.
- 13. व्यवहरिष्यामि edd. — Post hoc vocabulum inserunt codd. et S. dist. I, 50. hac varietate: a. . . भयाद्विभेतव्यं S. b. तु pro च S. et codd. Pro दृष्टा S. वीक्ष्य. — d. गृहीतव्यमनीतवत् codd. — प्रहर्तव्यममीतवत् S. — Sequitur deinde in S. aliud distichon, quod apud nos legitur II, 161.; huic porro subiunctum est II, 160. Posterius praebent etiam codd. prius S. habet sibi proprium. Tria agnoscunt cum S. interpp.; nullum L. — इत्यालोच्य कुलीरस्तस्य (वक्त्य �addit L.) ग्रीवां चिह्नेद । स वकः पञ्चत्वं गतः । edd.

P. 114.

— 14. तं करेण Pp. insulse.

— 15. स atque राजा om. L. सुनः deest in P. — Confusa sunt inter se verba in S.: शृणु तत्त्विकर्पोऽवदत् । मञ्चिन् तावत् मया etc.

— 16. महामञ्चिन् L. — यद् om. L. — अनेन ante मेघवर्णेन inserit L. — मेघवर्णेन om. Pp.

— 17. वस्त्रानि तावन्ति pro इवाणि तानि L. Sic etiam S. sed male transpositis vocabulis: वस्त्रानि कर्पूरद्वौपस्योऽन्नमानि तावन्त्यस्माकं etc. — च om. edd.

— 18. महासुखेन S.

— 21. देवकीकटनगरे Pp. देवीकोटे नगरे L. — देवीकोटरनाम्नि नगरे S.

— 22. तेन महाविषुवसंक्रान्तौ श्रकुपर्णश्चार्थैकः प्राप्तः edd. — ततः excidit in S. — Secuti sumus codd. utpote duces maiore fiducia dignos, quanquam contentum est, in utravis scriptura quaedam inesse, quae haud satis expedita nobis sint; neque enim nimis patet, quid sit श्राव्यभूतः श्रावः, neque cur aequinoctii tempore tale quid potissimum acceperit Devasarman.

Lin. 1. कुम्भकारस्य S. — मण्डपस्य L. मण्डपवैकटेशो Pp. ex P. 115. quo composito exit forma vocis inauditae: मण्डपैब. मण्डप forma a Wilsone sola recepta est, sed inde legitimate derivari potest मण्डपिक, quo deducit scriptura cod. P. वै enim pro वै posita recentioris est corruptelae e depravata pronuntiatione ortae, loquelam vulgarem, Pracriticam dictam, iam pervadentis. Tertiam formam aequa legitimam मण्डपक ex Sinhâsani prooemio enotavi. — प्रायं चिपुदेहः L. quibus verbis et sequenti राजौ, omisso सन्, haec interponit: श्रकुरक्षार्थं हस्ते दण्डैकमादाय; quae verba agnoscit etiam S. praemissis praeterea hisce: रौद्रेणाकुलितः सुनः ततः श्रकुरक्षार्थं etc. quae cur omiserimus, in manifesto est.

— 2. इमं om. S. — कर्वद्वकान् P. — प्राप्त्यामि S. — तदात्रैव तैः कर्पद्वैर्यथावादिकमुपक्रीय, omisso seq. क्रिक्रीय, edd.

— 3. घटन् Pp. — तद्वैः S. — पूर्वव्यादैन् Pp.

— 4. Post उपक्रीय inserit L. तं क्रिक्रीय, S. क्रिक्रीय. — Pro उत्पाद edd. कृत्वा.

— Idem mox करिष्यामि. — Pro ततः S. अनन्तरं.

— 5. तासु सपल्नीषु इपयौवनवती या S. तासु या इपवती L. — अतीवानुरागं Pp. अधिकानुरागं edd. qui deinde करिष्यामि ponunt. — अनन्तरं जातेर्यास्तत् desunt in edd. — तत्पन्नः codd. absurde. Corrigi posset मत्पन्नः; सपल्नी suppeditabat S.

— 6. करिष्यन्ति edd. — तदा abest a codd. — पल्नीः et इत्यं om. edd.; साडविष्यामि iidem.

P. 115. — 7. उत्थाय om. edd. — तेन post क्षिपः reiicit S. — प्रक्षिपः L. — अतः om. edd. अथ P. — च deest in S.

— 8. ततस्तेन प्रवदेनागतेन edd. — Pro तदूदृशा स edd. तथाक्रिधानि भाएडानि अवलोक्य.

— 9. मण्डयात् omisso गर्भात्, edd. गर्भ eleganter ponitur pro interiori aedium parte; sic Mālatimādh. Act. I. p. 17. गर्भभुवनात्, e medio aedium; scholiastes explicat per मध्याकासात्.

— 10. गृह्णं मंत्रिणं पग्रह L. — तथोपदिश्म edd. उपादिश्म P.

Dist. 16. b. Pro इव P. एव.

Lin. 13. शृणु (om. L.) देव किमस्याभिर्बलदर्पादूर्गं भानं न किंतु तव प्रतापाधितेनोपायेन edd. In ultraque scriptura, codicum dico et editionum, aliquid corrupctelae suspicor.

— 14. तथादि P. — Pro तदा P. ततः

— 15. स्वदेशं गम्यतां L — स्वदेशो गम्यतां, omisso अधुना, S. — वर्षाकाले प्राप्ते edd.

— तुल्यबलेनानेन सह om. S.

— 16. Verba फुन्कियहे सति in edd. ante अस्माकं leguntur.

— 17. -शोभार्थ edd. — च ante संधाय legitur in codd. — दुर्गं भानं कोर्तिश्च etc. edd. minus bene pro orationis huius tenore.

Dist. 17. a. Pro धर्म Pp. सर्व. — b. भिन्ना Pp. male. — प्रियाप्रिये L. — c. pro आह Pp. आपि, omisso omnino verbo, quo carere nequit sententia.

— 18. c. : . . . दोलस्यं L. mendose. — Ceterum disticha haec 18—20. iuxta argumentum disposuimus; 18. in edd. ultimo loco legitur; et distichi 19 versus alter neque non dist. 20. priora duo hemistichia desiderantur. Praeterea observandum est, fabulam IX. totam desiderari in codd. et apud Jon.; neque sine caussa; vix enim quempiam vel paullo accuratius legentem fugiet, dicendi genus per hanc narrationem obtinens toto coelo distare ab oratione, quae in reliquis Hitopadesae fabulis regnat. Medium locum tenet, si dicendi genus tantum respicis, haec fabula inter simplicem Hitopadesae orationem prosariam et calamistica ista, quibus usi sunt plerique scenici poetae atque earum narrationum, quas चम्पू Indi vocant, auctores.

P. 116. *Dist.* 20. d. नष्टौ तुल्यबलौ न किं || edd. — Accusativus अन्योन्यं, quum neque a नष्टौ, neque a हस्तौ, regi possit, adverbialiter positum esse videtur. — Seqq. usque ad राजाह l. 19. omissa sunt, ut iam dixi, in codd.

Lin. 6. काय et राज्य om. S.

- 7. परितुष्टो वरं वृद्येथां पार्वतो याचित्प्रवेति मनसि कारितं यथावयोः etc. S. Deest iigi- P. 116.
tur totum comma 1. 8. positum.
- 8. अभिहितवन्तो pro अभिहितौ ex emendatione.
- 9. भवान् S. — 10. निमित्तिन वरदानस्य etc. S. perperam. — Pro विचारम्-
धयोः L. मूलतया च. — पार्वत्या इव प्रदायि S.; nominativo opus est.
- 11. तत्यामनुद्देप S. male. — लावण्या L.
- 12. पृच्छतां edd. mendose. — 13. Pro भर्ता S. भट्टारकः. — इपः S. —
इति e coniectura insertum. — पृष्ठतां L. mendose.
- 17. Ex coniect. pro ज्ञनप्राप्तानुगो युद्ध एव etc.
- 18. Pro उद्गा edd. कृत्वा. — समकालं S. — अतोऽहं-इत्यादि desunt in S.
- 19. तत् प्राप्तेव codd. — 20. हृं om. edd. इयं P. mendose. — Pro
तदा कि मम वचनं edd. मद्वचनं कि.
- 21. श्रुतं pro अवगतं edd. — तथापि iidem. — यतः e codd. — Pro संधेय
edd. साधु; Pp. संदेह qui lapsus est calami.
- 22. हिरण्यगर्भो राजा codd. — च e codd. P. 117.
Dist. 22. a. सत्यार्थी धार्मिकोऽनार्थ edd. — d. pro सत्य Pp. परि.
- 23. a. सत्येन L. अनुपालयेत् S. — b. pro संधितः codd. संहतः. —
c. प्राणब्राह्मे edd. प्राणब्राह्मे P. — d. याति pro आयाति codd.
- 24. a. अभिसुकरस्य S. mendose. — b. pro युध्यते edd. पूर्यते; perperam.
— d. दुःखोच्चेष्यः S. दुःखोच्चिष्यः (sic) P. दुःखच्छिष्यः Pp.
- 25. a. . . कार्या edd. mendose. — b. . . , नियते सति codd. — d.
कुर्यान्तं edd.
- 26. a. संहत्वा तथा . . S. absurde.
- 27. a. योद्धत्वा P. vitiose.
- 29. c. तत्प्रतापानतत्याषु codd. — d. . . आयान्ति प्रत्रवः || edd.
- Lin.* 17. तत्र तावत् pro तदत्र S. — रात्रिहंसः L.
- 18. Quae uncis inclusa sunt, a nobis sunt addita, postulante
simile quid narrationis perspicuitate. Adstipulatur J. in cuius interpre-
tatione haec leguntur: *When the Chakra had heard this conversation re-
peated by the spy.*
- 19. अधिगतं codd. — भो वक्त desunt in codd. — Pro विधिं L. विष्विं.
- इति in fine addunt codd. — S. brevius et peius exhibit hoc comma:
प्रणिष्ठे सर्वमवब्रज गत्वा पुनरागम्यसि। — Pro अय विरण्यगर्भः S. राजा.
- 20. Pro कति Pp. के तु. — अपि male omissum in edd.

P. 118. *Dist. 30. c. . . . भौरुक् . . . S. exquisitiorem formam e codd. dedimus.*
L. = . . . भौरुनको, mendose.

— 31. a. विक्रित् codd. विक्रित् S. quod est idem verbum aliter lectum; neutra scriptura placet. — b. pro अति Pp. अपि; perperam. — तक्षिमान् codd. et L.

— 32. b. तथा दैवपरायणः । S. दैवचिन्तक एव च । L. Rarissimi usus est affixum क in partic. praet. pass. in त; हत्क significatione tamen ab हता differre nequit.

— 33. a. द्विपु L. vitiose. — d. विंशति L. mendose. — अमी edd.

— 35. d. ज्ञातुं P. et S. quae lectio ob seq. बालिङ्गः haud prorsus est contemnenda.

— 37. c. त (i. e. ते) ज्ञातयः ; S. absurde, sequente statim in eodem versu eadem voce. — तत्र चैन् L. et, ut videtur, P.; facilime in scriptura Bengalica confundi possunt signa त्र et ए. — d. कृतेयस् pro ज्ञातयस् Pp. quod nihili est. — आत्मानिनः L. minus bene. आत्मसात्कृत expli- cari potest ex hoc Bhartriharis loco p. 74. ed. Ser. ज्ञातं ज्ञातमवध्यमाणु विवां मृत्युः करोत्यात्मसात् ॥ in quo loco significatus *sibi subiecti*, *sibi arrogandi*, manifestus est; unde participio accrescere potest vis *subiectus sibi*, i. e. qui tantum a studio omnia in usum suum convertendi regnatnr, ut sui sit quasi servus. Simili sensu usurpatur participium कृत in अहंकृत.

— 38. b. . . एव प्रणाश्यति S. — c. तैव भौरुनकः L. भौरुको भौरुगुरैः S. Scripturam codd. ut oportuit, praetulimus, emendato पुरुषैः cui emendationi munimentum est primum hem. c. dist. 30., deinde sequens तैः, cui in ista scriptura nullus est locus; nostra emendatione posita eleganter referatur pronomen तैः ad nomen, quod composito continetur. Cuius rei, si velim, exempla proferre possim permulta.

— 39. a. Pro असंविभागित्वात् S. आसन्नभागित्वात्, quod sensu est destitutum. — b. शुद्धन्ति L. minus bene. अनुयायिनः S. — c. लुभ्यानुजीवकैरेष S. लुभ्यानुजीवतैरेव codd. लुभ्यानुजीविकैरेषो (sic) L. Ansam praebuere codd. emendationi nostrae, qua nulla certior esse potest, nec magis necessaria.

— 40. a. त्याइयते edd. perperam. — b. विमुक्त एव संविभागित्वात् P. male. — c. . . . योद्यो edd. — d. प्रक्षिमान् L. et codd. contra sensum.

P. 119. — 41. a. तु S. et codd. — b. ऐयो भवति मंत्रिणा S. — d. pro कार्ये तैः S. कार्यतः; quod quanquam minus placet, sensum praebet haud ab hoc loco alienum. — समुपेक्ष्यते codd.

- 42. c. स्वेव pro स्वेष L. P. 119.
- 43 et 44. Anteponuntur in S. dist. 42. eorumque loco repetitur versus posterior distichi 40. hac varietate: सुखाभियोगेन भवति विषयेष्वतिसक्षिमान् ।
- 43. c. . . देवं . . . L. mendose. — d. आत्मानमपि चेष्टते । edd. absurde.
- 44. a. दुर्भिक्षो व्यसनी . . . Pp. male. — b. विसौदति S. अभिसौदति codd. neutra praepositio praestat h. l. scripturae L. अवसौदति. — d. वंत्रिशक्तिः S. quod quid sibi velit, haud assequor. — Pro विचरते edd. जायते ।
- 45. a. Pro हि Pp. आपि, minus bene. — b. in fine: हन्यते edd. — d. गजेण्ठं Pp.
- 46. a. Pro बहु L. भूते, stulte. — d. Pro असौ S. et codd. आशु.
- 47. b. Syllabae ते काल exciderunt in P.
- 48. b. संदध्यानं . . . S. — c. . संहितः codd. quod eodem reddit.
- Lin. 17 – 21.* Locus hic, qui e Manu VII, 157 – 168. illustrari potest, in edd. et codd. mala virgularum positione prorsus est obscuratus; accedunt scripturae vitia, quae breviter enotabo. l. 17. संश्यात् S. — दैधीभावात् codd. — षड्गुणाः L. — कर्मणा pro कर्मणां P. male.
- 18. उपायः Pp. perperam. — Pro संपद् codd. संमत् absurde. संपद् L. male omissio signo, quietis. पुरुषके इव संपद् S. quae scriptura e glossemate orta videtur. — अतिनिपातः प्रतीकारः S. अतिनिपातप्रतीकारः L. निपातप्रतीकारः Pp.
- 19. इति excidit in S. — In fine शक्ति om. L.
- 20. मंत्रशक्तिः desideratur in P. — उत्ताहप्रभुमंत्र इति L. vocabulo शक्ति ter ponendo omnino omissio. — Pro नौत्या P. नौपा, S. नित्य, L. नित्य.
- 21. Pro महान्तः codd. राजानः.
- Dist. 49.* c. Pro वेष्म, L. गेहे, S. पश्य. — d. Pro प्र codd. च. P. 120.
- 50. a समं विभक्तं pro च संविभक्तं S. — b. गुच्छ L. mendose. गूच्छः संनिभूतश्च . . S. — d. pro प्र Pp. स, male.
- Lin. 5.* देव deest in edd. — संधिः L. absurde. — न ante तथापि P. contra sensum repetita eadem particula. — राजा abest a codd. — तेन राजा om. S.
- 6. संप्रति om. S. — जयंकान्तं मन्तव्यं L. — अवमन्तव्यं S. — देव तदेवं edd. — असमित्रं ante जम्बुदीपे leguntur in S.
- 7. पश्चात्प्रकोपं P. पश्चात्कोपं S. et Pp.
- Dist. 51.* a. सुगुप्ति S. — सुसिंहतेन S. sensu cassum. — b. Pro वीरः codd. धीमान् — c. सुसंप्रतप्तस् codd.
- Lin. 10.* ततः om. S. — राजा edd. vitiose. — निगद् pro उक्ता S. — सुगुप्त edd.

- P. 120.
- 11. *init.* प्रहितः S. — सुनः om. S. — उक्तवान् L. — तत्र pro तत्रत्वं P.
 - 12. यदूरेव codd. et S. Cf. quae de यदू dicta sunt ad p. 110. l. 3.
 - संधेयगुणायुक्तः edd.
 - 13. राजा om. S. — ततोऽसौ समाहृय राजा पृष्ठः, brevius edd. — आहृय codd.
 - 14. वायस कौटुम्बः edd. — राजा om. S. — मंत्री वा कौटुम्बः edd. — वायस उक्ताच S.
 - 15. सः om. S. — युधिष्ठिर एव L. — सायवाकृ deest in S.
 - 16. Pro सदृशः edd. समः, omisso च. — आलोक्यते codd. — राजोदाचः कथमेतत् । Pp. quod est initium fab. X. desunt igitur quae l. 17. et 18. ed. nostr. leguntur neque non dist. 52. Fraudem librario fecit vox कथं. — Pro तदा P. तत्.
 - 17. Pergunt dein edd. et P.: विहस्य (om. L. et P.) मेवर्णो द्वृते । देव (om L) । विश्वासप्रतिपन्नानां वक्षने का विद्यन्धता । (विचित्रता L.) अङ्गमालै सुन्त हि हत्वा किं नाम पौरुषं ॥ शृणु देव तेन etc. Distichon supra iam legitur II, 166.; quo etiam melius facit. — चक्रवाकेण मंत्रिणाहं, omisso तेन, P. — प्रथमदर्शन एव ज्ञातः S. et P. Melius huc convenit विज्ञातः. Cf. quae de ज्ञान et विज्ञान docte disputata sunt in bibl. Indic. II, p. 350.
- Dist.. 52. c.* Pro तया P. एव. Particula एव ab hoc loco minime abhorret, sed opus est तया. Pro धूर्तः ibid. तेन; minus bene, solet enim auctor personas in fabulis partem primariam agentes hisce distichis indicare.
- Lin. 21.* गौडारप्ये S. गौतमस्यारप्ये L.
- 22. उदासीनः ante कश्चित् inserit S. — Pro सः Pp. स्व. — च यज्ञार्थं om. codd.
 - ग्रामान्तरात् et mox उपक्रीय स्वन्धे desunt in S. — Pro कृत्वा edd. नोत्वा.
- P. 121.
- 1. प्राप्य om. L. et P. — लभ्यते pro खाप्ते L. — S. = -धूर्ताः समालोच्य वृक्षत्रयतले etc. l. 2. unde patet, verba यथेष्ट et quae seqq. usque ad प्रान्तरे excidisse.
 - 2. ब्रह्मतले pro वृक्षत्रयतले P. — तले क्रोशान्तरेण तस्य ब्राह्मणस्यागमं प्रतीक्ष्य पथि स्थिताः । तत्रैकेन etc. l. 3. edd.
 - 3. Pro ततः. — Edd. transponunt: गङ्गन् स etc.
 - 4. तया om. edd. — किंतु यज्ञकामः, omisso अयं, edd.
 - 5. ब्रथानन्तरस्थितेनान्येन धूर्तेन तथैकोक्तं । edd. — तं om. iidem.
 - 6. Alterutrum सुहुः om. edd. — दोलायमानः, omisso मति L.
- Dist. 53. a.* सर्वं pro नूनं S. — c. चिमि: pro तामि: S. male. — चासौ pro अः त S. योऽसौ L. — d. Nomen camelii minus idoneum चित्रवर्ण legitur in codd. L. et W. verum praebent S. et J.; quod in seqq. ubique reposuimus.

- 10. मदोक्तोऽः L. sensu cassum. P. 121.
 — 11. सेवकाः pro अनुचराः S. जन्मुकः pro पृगालः ibid.
 — 12. सार्थादूभ्रष्टः om. L. — क्वागतः codd.
 — 13. तत्स्तैः, omissio च, edd. — सिंहेऽसौ edd. — च post तेन deest in edd.
 — 14. Post स्थापितः inserit L.: एवं कालो गद्यति। — वैकलात् Pp. — वैकुल्यात् S.
 — भूतातिवृष्टिः etc. codd.
 — 15. आहारमेव P. — Pro व्याकुलाः edd. व्यस्ताः. In P. huius vocabuli
loco व्यावृद्धयः; sed praedicato opus est sententiae. — तत्स्तैरालोचितं S.
 — 17. अस्माकं deest in edd. — Pro खीकृताः L. गृहीतोऽयं। S. अनुगृहीतः. — तत्
om. L.
 — 18. संभविष्यति । L. — काको ब्रूते S.

Dist. 54. a. . . , जुधार्णो महिलां रुपुं S. mendose. — b. भुजंगी L. contra
metrum.

— 55. a. . . . , चोन्मत्तः edd. et codd. Delenda erat copula a loco
omnino aliena. — b. आन्तः क्रोधी L. आन्तः praebent etiam S. et P.
Pro क्रोधी S. कुञ्जः; जुब्धः tuentur codd.

- Lin.* 1. सर्वे om. codd. — किंचित् प्राप्तं S. P. 122.
 — 2. Pro काको ब्रूते S. तैरुकं. — किंचिन्न प्राप्तं L. et P. न प्राप्तं किंचित् S.
 — 3. नाय खाधीन etc. codd. देव खाधीन . . S. — परित्यागात् edd.
 — 4. समुपस्थितः P. — कोऽत्राहारः, omissio खाधीनः codd. — कर्णे om. P.
 — 5. कथयते L. minus usitate. — ब्रूते च om. edd. — मयैतर्य om. S.
 — 6. प्राक् deest in edd. — अभयवाचं दत्वा गृहीते च कथमेवं युज्यते । L. अभयवाचं
दत्वा धृतोऽयमस्माभिस्ताकथमेवं संभवति S.

Dist. 56. a. . भू. . . . सुवर्णदानं S. न च भूमिदानं L. — b. . गो-
प्रदानं-तथान्नदानं । S. न पय(ः) प्रदानं L. — d. सर्वेषु दानेष्वभय . . S.

— 57. c. . . लभते सम्यक् edd.

Lin. 11. किंवस्माभिरेव तथा कर्तव्यं edd.

— 12. स्वयमेव om. edd. — स्वदेह edd. nec non P. Utroque posito nimis
abundat oratio. — अङ्गीकरोति est offerre, praebere. Bhartrih. p. 59. किंवङ्गी-
कृतमुत्सृजन् न मनसा प्राप्त्यो इनो लक्ष्यते । — तच्छुल्वा om. Pp.

— 13. असौ om. S. — कूटं कृत्वा edd. — Pro गृहीत्वा iidem आदाय. — सि-
हान्तिकं S. — आगतः L.

— 14. यत्नादपि om. codd. — Pro क्रिष्णः S. विन्नः.

— 15. Loco सर्वथा in edd. legitur इरानीं,

P. 122. Disticho 58. praemittitur in S. codd. et interpp. aliud, quod editum iam est III, 141. q. l. cf.

Dist. 58. a. एव pro एताः S. — b. . . संपत्तयः . . L. — c. अपि pro हि edd.

Lin. 18. भद्र om. edd. — ईरुणि (ईरुणे L.) कर्मणि प्रवृत्तिः edd. — ततः om. edd.

— 19. ततः deest in codd. — आस्ता deest in edd. — मा prius om. L. मास्तां मा मैयैं P.

— 20. एतत् pro एवं codd.

— 21. ज्ञातसंप्रत्ययः codd. ज्ञातविश्वासः S. — तथैव edd. haud male. — Pro आत्म P. ख. — आत्मानमाह S. perperam. — ततस्तद्वचनात्मेन S. Cum codd. facit L., omissio tamen ततः. — एवासौ codd. — असौ inserit etiam S. sed post व्याख्येण, pro quo verbo L. exhibit दीपिना. — प्रविदर्थं P.

— 22. च excidit in S. — इत्यादि in fine fabulae additum fraudem fecit librario cod. Pp., ita ut hoc epimetrum cum eisdem verbis fabulae proxime sequentis fini subiiciendis permutaret et omnia, quae p. 123. l. 1 — 4. usque ad verba राजाह leguntur, omitteret. — In brevius narrationem contrahit mox P. et quidem hunc in modum: तदनन्तरं तृतीयधूर्त्ववचनं शुत्रात्मानं निश्चित्य इति त्यक्ता स्नात्वा च गृहं यतोऽति. etc. (p. 123. l. 3.) — Similiter S. ubi खमतिश्रमं pro आत्मानं legitur; cetera, in quibus a P. dissentit, nullius sunt momenti.

P. 125. *Lin.* 1. उक्ते L. mendose.

— 2. चिन्तति post आकर्ष्य inserit L. abundat verbum hoc, sequente mox इति.

— 3. Transponunt edd. तैर्धूर्त्तेनिक्ता. — Pro भक्तिः P. लादितः.

— 4. मेवर्वर्णः S. mendose. — शत्रुमध्ये त्वया S.

— 6. Alterutrum किं om. edd.

Dist. 59. a. लोके Pp. absurde. — b. न excidit in L. — न मूर्धा दग्धमिन्दनं Pp. मूर्धा दग्धमिन्दनं P. यिरसा दग्धमिन्दनं S. — c. वृक्षांश्चिं edd. — d. नदीवेला edd.

Lin. 11. मन्दविसर्पो नाम सर्वः P. et L. sic etiam interpp. मन्दगतिसर्पो नाम सर्वः Pp. male.

— 12. आहारमध्यन्वेषुमक्षमः S. खाहारान्वेषणे॒॑ प्यक्षमः L.

— 13. द्वारदेव S. — क्षिमिति त्वं, omissio ख, S. et codd.; quod placet. — नान्वेष्यति L. नान्वेष्यति (sic) S. — इति addunt in fine commatis edd. et interpp. otiose.

— 14. भद्र deest in L. गङ्क in S. — ते om. S. reiecto किं post प्रसन्नेन. — वृक्षान्तं L. absurde; excidit hoc verbum in S. — Pro ततः S. स, post कौतुकः inserto स च. — संज्ञात् edd.

— 15. — कौतुकः स भेकः L. — कौतुकः स च भेकः S. — हत्याह् S. omissis ते सर्वं; P. 125.
quae verba non solum, sed etiam आह् desunt in L. — ब्रह्मपुरवासिनः edd.
omisso अत्र, cuius loco in S. legitur भद्रः.

— 16. खौपिडल्ल्यस्य Pp. खौपिडन्यस्य edd. sed ल et न sexcenties confunduntur in scriptura Bengalica. — नामः deest praeterea in edd. — देहीयः pro देशीयः, si bene legi, P. cf. Panin. VI, 3, 42. वर्जीयः edd. — दुर्देवान्मम नृग्रासस्वभावाद्दूरद्धः edd.

— 17. ततः post virgulam ponunt codd. — Nomen filii omittit S. post पुत्रं collocat L. — अबलोक्य मूर्खतः (sic) खौपिडन्यः पृथिव्यां लुलोठ । S. अबलोक्य खौपिडन्यः प्रोकेन पृथिवीतले लुलोठ । L.

— 18. वासिनः edd.

— 19. तस्य om. L. — Post उपक्रिदा: addunt S. et codd. dist. I, 67. — S. pro चैव hem. a. praebet युक्ते et in fine hem. b. राष्ट्रविष्णवे. Omisimus distichon utpote loco magis idoneo iam positum, qua in re antecessit editor L.

— 19. Pro तत्र P. अत्र, L. ततः.

Dist. 61. d. तथा edd. —

— 62. b. ख्व Pp. male.

P. 124.

Excipitur hoc distichon in codd. S. et interpret. ab alio supra edito ideoque neque ab editore L. neque a nobis repetito. Cf. I, 202.

— 63. d. विश्वीर्णाःसन् edd.

— 64. b. मृत्युजन्तोः S. मृत्योजन्तुः codd. quod propter versum seq. recipi nequit. — d. pro इव P. एव mendose.

— 65. b. . . . व्यय . . . Pp. male. — c. संवादः codd. — d. मुख्येन् edd.

— 66. c. . . . स्म P. Cf. Rām. II, 105, 24.

— 67. Deest in codd. et interpp. summa cum loci iniuria.

— 68. a. . . . निर्मिते . . . edd. — d. वेदना S. et Pp. minus bene.

— 69. a. तावतः Pp. mendose. — c. . . . अपि लिङ्गत्यन्ते edd. quod absurdius est absurdo. — प्रकु translate dicitur de moerore animum penetrante et hastae instar quasi vulnerante, sicuti eiusdem significatus verbum श्राव्य; unde repetendus est h. l. usus verbi निखन्, et oppositae protestatis उद्धृ de liberatione ab aerumna. Urvasi Vicrama Act. I. अविं एाम सो राष्ट्री उच्चे एो हिम्मत्सल्लं ॥ (= अपि नाम स राजर्षिरुद्धरेन्द्रो हृदयश्राव्यं ।)

Dist. 70. b. कस्यचित् केनचित् कूचित् । L. — d. किमुतान्यैः पृथग्गुणैः । L.

P. 124. — 71. E codd. inseruimus distichon hoc dignum omnino, quod hic locum obtineat. Sequitur in codd. aliud, quod e variatione distichi 68. ortum esse appetet:

पञ्चभिः संभूतः कायो यदि पञ्चवमागतः ।
कर्मभिः स्वशरीरोत्यैस्तत्र का परिदेवना ॥

— 72. Omissio priore huius sloci versu, alium exhibet L. post eum, qui in libris ceteris secundum locum tenet, collocatum: जन्मान्तरसहस्राणि विघ्नाः संगमं ज्ञाणं ॥ Hemistichium d. corruptum est.

P. 125. — 73. c. अपश्यानां edd. et pro अस्त्वानां S. अन्नानां, L. अन्धानां. — d. pro हि edd. अति.

— 74. E codd. receptum legitur Râm. II.

— 76. a. Pro लवः edd. परः; pro तु codd. हि. लव recurrit infr. sl. 99. Aliud exemplum est Mêgh. Dût. 22, d. प्रारंगास्ते जलजलवसुचः सूचविष्यन्ति मार्गं । लव nomen est, quod eodem modo atque अन्तर्, मात्र etc., alii nomini subiunctum notionem adiectivi nomini praefigendi continet; cf. not. ad III, d. 115. — d. . . . शुक्रि Pp. unde emendavimus शुक्रि a सूर्य procreatio; ceteri धुरि, quod vix h. l. probum est.

— 77. c. Pro असि Pp. अस्ति vel अनि, quod nihil est.

— 78. a. सत्कृतान्येव codd.

— 79. b. मनुषस्य L. contra metrum. — d. चर्व edd.

— 80. b. निवासी edd. mendose. — c. प्रयासः S. male.

Lin. 17. अतः pro अथ P. et S. haud male. ततः Pp. अविचार्यतां edd. in quibus mox एव deest.

Dist. 81. Libri nil variant; in interpretatione haereo.

— 82. a. Pro पत्र edd. पात. — b. अस्त्वाणां edd. — d. अचिन्तेक Pp. male. — महौषधं L. महौषधी S. — Una tantum me iudice patet via, quam in hoc disticho interpretando ingredi oporteat. अचिन्ता regit genitivum प्रहाराणां, nulla vulnerum, quae a profundo moerore oriuntur, cogitatio. Ad haec vulnera referenda sunt epitheta अकाण्डपत्रज्ञातानां et मर्मोदिनां; a मर्म pendet ग्रन्ताणां, intima membrorum pars; vulnera quae intimam medullam penetrant. अस्त्वाणां falsa est scriptura, quia de his non dici potest अकाण्डपत्रज्ञातानां. Taceo, viri sapientis quidem esse aerumnas fortiter pati, earumque, si possit, obliisci; levitatis et temeritatis foret, si quis opinaretur, se immunem esse ab impeitu fortunae adversae.

Lin. 1. निश्चाय edd. — प्रवृङ्गः Pp. perperam.

P. 126.

— 2. निवासो Pp. falso. वासेन edd. — वनमेव S. — गमिष्यामि codd. — कपिलः

पुनराह S.

— 3. b. गृहेषु, omisso अपि, P. — d. Ex emendatione pro निवृत्तरागाय.

— 34. e Manu, nisi fallor memoria, petitum.

— 35. c. . . . वचनार्थाय edd. — d. दुर्गाप्यपि तरन्ति ते edd. male. — . .

अभिवन्ति. P.

— 36. a. . . . संयमपुण्यतीर्थः (sic) S. — c. तत्र S. Desumtum est distichon ex libro nescio quo Bharateae.

— 37. a. वेदनभीरुपहुं S. ई productum mendum est; उपहुं per se haud malum. Dicitur enim proprie de portentis terrorem incutientibus; अभिप्लुत de inundatione. — c. pro इस्में edd. et codd. इदं — उत्पन्नं S. male pro अत्यन्तं, quod est adverbium ad असारं; ludunt perpetuo poetae Indici in असारं et संसारं.

— 38. a. दुःखमेवास्ति न सुक्ष्मं edd. et P. — b. . . . लक्ष्यते edd. — d. . . संज्ञाभिरीयते । Pp.

Lin. 15. एवमेवं Pp.

— 16. Pro कपिलो ब्रूते et quae seqq. L.: अय कश्चिद्द्रवाहण उवाच । कपिलोपदेशाद्विआनं ते हृदयं तथा हि शृणु ।

— 17. ते deest in Pp.

Dist. 89. b. च pro चेत् S.

— 90. b. स चोड़ातुं S. mendose. — c. स मोक्षं et d. स हि codd.

Lin. 22. कपिल om. codd. — प्रशान्त edd.

Lin. 1. ततः Pp. — बोहुं edd. — अहमत्र codd.

P. 127.

— 2. मण्डूकनाथस्याये L. omisso nomine regis. — जनपदनामोऽये S. nomen minus aptum. Pro असाचागत्य L. समागत्य.

— 3. नायस्य, omisso तस्य, uterque codex. — अधिष्ठितवान् pro आद्विवान् codd.

— 4. ततोऽपरेषुः codd. — असर्वः S. absurde. — किमव भवान् edd.

— 5. देव आहार edd. — 6. महा om. L.

— 7. स om. S. सादितवान् S. — स मण्डूकनाथोऽपि P. — 9. पुरावृत्ताव्यानकथं edd.

— 10. तामस्यामि: Pp. incaute omisis syllabis: वद्य.

— 13. अवतिष्ठते edd. — तं om. codd. et S. neque prorsus est necessarium.

— 14. गृष्मो ब्रूते, omisso स्वगतं, L. गृष्मः स्वागतमुवाच S. mendose. — मन्त्रिन् सर्वज्ञ साधु साधु S. मन्त्रिन् साधु, ceteris omisis, L. — साधु सर्वसाधु codd.

P. 127. — 15. तावद्यं तमेव गत्वा codd. — तावद्यं गत्वा तं L. तावद्यं गत्वा तमेव S. Quamvis haud rara sint exempla omissi pronominis primae aut secundae personae ad pronomina demonstrativa तत्, एतत्, इदं subintelligendi, ita ut dicatur स pro सोऽहं aut स किं, अस्य pro अस्य सम् aut अस्य तत्, nimis durum tamen h. l. est visum, quia primo aspectu nemo poterit non, quin अस्य ad regem Jambudvipi, potius quam ad vulturem referat; ideo emendavimus अहं.

Dist. 91. b. . . . गलगर्जितं S. quod sibi habeat. — d. न pro नो P. contra metrum.

— 92. b. . . रक्षातिगालिनः S. . . . विवादितः। L. — d. . . . नश्यते.. L. male; नश्यते enim ad quartae classis normam inflexa radix intransitiva est neque transitiva fieri potest, nisi ad decimam classem conformatur.

Lin. 20. किमिति P. et S. — यतः om. Pp. et L. — Pro तदा L. तत्. — अनेन om. L. न substituunt codd. — पश्चात्पकोपः unum est vocabulum compositum saepius per hunc librum obvium:

P. 128. *Dist.* 93. a. यो न तत्त्वमविज्ञाय S. absurde. — d. Pro यथा L. इव; male; इव enim significat tantum rem alii esse similem, ita ut comparatio quae-dam fieri possit; यथा valet rem eodem modo se habere quo aliam; translatus inde est usus, quo sensu mere comparativo ponitur; यथा est *sicuti*, इव *quasi*; hinc factum est ut इव inserviat interdum dictioni nimis figuratae vel impropriae lenienda; veluti quum de oceano dicatur saltare et rugire: Diluv. p. 5, sl. 41. रामुङ् । नृथमानमिवोर्मीर्जितमानमिवाभ्यता । Correxi propter metrum ऊर्मिभिः pro ऊर्मिभिः.

Lin. 3. Pro माधृः L. माधवः.

— 4. Pro ब्राह्मणः S. विप्रः. — . . . ब्राह्मणो प्रसूता वालापत्यरक्षायार्थं L.

— 5. अथ ब्राह्मणाय राजा: पार्विणाशाङ्क दातुं etc. S. idem praebet L. pro अथ substituto तस्मिन् काले. — Pro commate seq. codd. पश्चाद्विपश्चिन्तयामास ।

— 6. श्रुत्वा inserunt edd. ante आङ्क; codd. om. verbum आङ्. — गृह्णते P. mendose.

Dist. 94. deest in L.

Lin. 9. किंतु om. codd. et S. — वालस्य Pp. — चत्र P. अत्र om. Pp. — तत् deest in codd.

— 10. दातरक्षायार्थं P. वालकरक्षायार्थं edd. — व्यवस्थाय edd.

— 11. स तत्र om. edd. — Pro तेन P. तत्र. — आगङ्क्त् edd.

— 12. दृष्ट्वा व्यापाय कोपात् खण्डं कृत्वा खादितः। qualem verborum accu-

mulationem in simplici narratione abhorret noster. — दृष्टः et mox च om. P. 128.
S. — Codd.: दृष्टो व्यापादितश्च (च deest in Pp.) ज्ञादितश्च (hoc om. P.) — तथासौ
Pp. ततोऽसौ edd.

- 13. उपगच्छ Pp. उपक्रम्य P. — Pro तस्य L. ब्राह्मणस्य, S. तत्. — ततः स विग्रः S.
- 14. बालकोऽनेन खादितः S. — बुद्धा pro अवधार्य L. — नकुलं व्यापादितवान् । S.
- 15. L. pro उपसृत्य praebet आगत्य et om. ब्राह्मणः. — In S. deest असौ
et ante पश्यति inseritur अपयं.
- 16. तमुपकारकमेवं P. तदुपकारकमेवं Pp. तमुपकारकं, omisso एव, S. तदुपकारकं
L. — निरीक्ष्य pro निरूप्त्य S. भावितचेताः संतप्तः स etc. S. — Brevius L.: निरूप्त्य महानं
संतापमवाप्नुवान्.

— 18. देव om codd.

Dist. 95. a. मोहः S. — b. दमस्तया male transpositis
syllabis, Pp. — c. एव codd. — d. तस्मिन् codd. अस्मिन् S. — Pro
भवेत् codd. et S. नृणः.

Lin. 20. ते om. Pp.

Dist. 96. a. स्मृतिश्च परमार्थेषु edd. male; नप्त्रता nomen est unum, signifi-
catus: attentio, intentio animi.

Dist. 97. c. वृणुते edd: et P. contra syntaxin, quae pluralem flagitat. P. 129.
कारणं L. perperam. Rarissimi usus est, partem vocis compositae formari
gerundio; quod tamen non in caussa esse debet, cur de lectione dubites.

Lin. 3. यद् pro यदि S. — न क्रियते Pp. contra sensum.

Dist. 98. a. अपि omisso उपायाश्च चत्वारः codd.

— 99. Praemittunt huic dist. codd. edd. et interpp. slocum I,
86. quem nos utpote iam exhibitum repetere recusavimus. Distichon 99.
desideratur in interpret. W. Auctor est Bhartrihares, in cuius edit. Se-
ramp. p. 42. male editum est अशेषज्ञः. — c. ज्ञानलब्ध्यर्विदर्घं L. sine sensu. ज्ञान-
वलवद्विदर्घं Pp. mendose. — d. तं नरं edd. refragante metro.

Lin. 9. विशेषतश्चायां धर्मज्ञो राजा edd. — पूर्वं ex L.

Dist. 100. a. कर्मानुमेयाः edd. — b. परोक्तं L. — c. . . परोक्ते . . . Pp. —
वृत्तानां S. perperam. वृत्तिनां L. vitiose. — d. pro कार्यैः edd. फलैः. — कर्मानुभाव्यते S.

Lin. 13. अभिमतं pro अभिप्रेते L.

— 14. दुर्गादन्तरं चलितः L. महामंत्री तत्र यथार्हं कर्तव्यमित्युद्गा दुग्धाभ्यन्तरं चलितः S. —
Pro अव edd. ततः. — राजो हिरण्यगर्भस्य edd.

— 15. गृह्णो महामंत्री codd. — गृह्णोऽस्मत्समौपमाग्रहत् edd.

— 16. पुनस्तदनुसंधिना केनचित् etc. P. पुनस्तत् न संधिना केनचित् etc. Pp. पुनः संबं-

P. 129. धिना केनचित् L. पुनःसंधिना केनचित् S. Apparent primo aspectu duo: primum, regem, prius iam insidiis circumventum, timere, ne iterum fraus ei stratur; alterum, a lingua Indica alienam esse dictionem संधिना आगत्वं. Persona, quam admittere nolit rex, nominetur necesse est. पुनरत्तम्, quam scripturam tuetur codd. auctoritas, accepimus pro dictione elliptica: "en iterum istud" i. e. video insidias iterum mihi strui. अनुसंधि de persona vix dici potest; संबंधिन् sensum h. l. idoneum nullum habet; scripsimus igitur मन्त्रिणा, quod si sensum respicis, optime huc facit, si syllabas, vix dubito, quin genuina scriptura aliud sit vocabulum, quo contineatur nomen a radice ध derivatum, praepositione quadam auctum. Propono अभिसंधानिन् vel simile quid. अभिसंधाय, Mal. Madh. Act. I, sl. 7. explicatur per वंचयिका.

Lin. 17. न om. S. et Pp. contra loci tenorem.

— 18. Alterum comma a कदाचित् incipiens desideratur in edd.

Dist. 101. a. सर्ति सदृशस्तावदाख्येत् ज्ञानात् परवच्छितः । P. mendose. — Edd. separant श्वे ज्ञानात्; quod vitium ideo notandum est, quod facile aliquis in errorem possit induci, quasi ताराश्वे epitheton esset a सर्ति septimo casu rectum. — b. निशासुविचक्षणः edd. lectio minus idonea, quamvis sensu non destituta. — c. न दशति दिवा ताराश्वानिराश्रितमुपलं Pp. — पुनः om. P. — d. चलितः pro चकितः codd. mendose. — In fine edd. अपेक्षते. — अधि + ईज्ज्ञ in lexicis nondum enotata significatione e Latinorum *suspicari* illustrari potest. Subiungitur in edd. hoc distichon, quod ex ed. Ser. fluxisse, testatur silentium W. qui id non magis agnoscit quam codd. et J.

दुर्जनदूषितमनसः सुजनेष्वपि नास्ति विश्वासः ।

बालः पायसदग्धो दध्यपि फुकृतं भुक्ते ॥

In hemist. b. et d. vitiatum est metrum (Arya nomen ei est Indicum); in b. opus est tribus moris ad tertium pedem explendum: nempe syllaba longa, a brevi excepta aut tribus brevibus post नास्ति quod ex hoc scheme appareat:

vv — | vv — | v [— v] — — | — || aut: vv — | vv — | v [vvv] | — — | — ||

In hemist. d. exciderunt duae morae pedis secundi. Facile est in hem. b. inserere कोऽपि post नास्ति; haud scio an certum. Hem. d. legi posset: दध्यपि किमु फुकृतं.

P. 130. *Lin.* 1. सु om. L. — तथानुष्ठितेन, omissa seq. सति codd.

— 2. स deest in L. — चक्रवाकोपगम्य Pp. mendose. — उपगम्य om. L. P. 130.

— 3. दत्त्वासनोपवेशितः P. mendose. — चौपवेशितः edd.

— 4. सर्वं स्वेह्योपभुज्यतामिदं रायं edd. — In fine pro ब्रूते S. कथयति; male.

— 5. एवं deest in Pp. — बहुप्रवंचं, omisso वचनं, L. perperam.

Dist. 102. d. यथात्थेन codd. falso.

— 103. c. स्त्रीभूत्यौ S. mendose; dualis enim si poneretur, intelligendum esset compositum de muliere atque *uno* tantum servo. — दानमानाःया S. et codd. — d. . . . इतरे जनं Pp. vitiose. इतराज्ञनान् S. quam scripturam corrigere aggressus editor L. edi curavit इतरां जनां.

Lin. 10. Pro प्रस्थाप्यतां edd. गम्यतां. — अयं om. edd.

Dist. 104. b. . . नान्यप्रतिक्रियः S. quod voluit etiam L. ubi pro नान्य ab-surde editum est मान्य. न ad verbum finitum semper referri debet; quod si h. l. sit, omnis evertitur sententia. — c. अन्विष्ट् codd. miror concentum in scriptura vitiosa.

— 105. In textu distt. seqq. constituendo saepius dubii haesimus, quum totum hoc argumentum per se tum multitudine divisionum et distinctionum, tum nominum novitate et insolentia impeditum sit neque facultas nobis data esset librorum, e quibus materia iusto illustrari posset.

— 105. b. संधानः codd.; sed consentiunt in nostra scriptura cum edd. interpp. quorum uterque haec nomina Indice exhibuit.

— 106. a. आदृष्टन् P. — आदृष्टपुण्य J. — b. आत्मादिष्टः L. et W. आत्माविष्ट J. quod mendum editori opp. Jones. attribuere haud haesito. तथामिष्टः S. — c. परिक्रमः codd et edd. परिक्रमय veram esse lectionem, e sl. 120. apparent; corroborant praeterea interpp. तथाच्छिन्नः Pp. तथाच्छिन्नः P. तथोङ्नः edd. qui उच्छिन्नः scribere voluerunt, uti est apud W. उच्छिन्न hic et infra ex Jonesio summis (Uch'lanna editoris est culpa). — भूषणं mendose; referendum enim est vocabulum tanquam adiectivum ad संधिः.

— 107. a. स्कन्दोपनेय Pp. et W. स्कन्दोपनेयः L. स्कन्दपन्य J. quod prorsus nihil est. — b. पोउश्रैते परिकीर्तिताः edd. (in L. scriptum est सोउश्रा, perperam) — c. प्राह et mox विचक्षणः codd. — d. . . संधिविदो जनाः L.

— 109. a. संधान codd. quod vix cum ipsa quae in hoc versu datur P. 151. explicatione nominis conciliari potest. — c. तु post सङ्क्षिप्तः collocant edd. — d. ज्ञेयो बलसमन्वितः P. quod hemistichium inepte huc irrepsit.

— 110. a. प्रमाणं codd. — b. समानात्म . . . L. male. — प्रयोजनः P. quod ferri potest. — c. pro वा - वा P. च - च.

- P. 151. — 111. a. संगतः edd. et codd. perperam. — एवायं edd. इह valet h. l. तेषु sc. संधिषु. — c. pro अपरैः edd. तथाच्चैः male.
- 112. a. द्रव्यात्मकार्यसिद्धिं तु S. आत्मकार्यस्य संधिस्तु Pp. भव्यानेकार्यसिद्धस्तम् P.. — द्रव्यसिद्धिं समुद्रिदश्य L. ubi hem. b. sic audit: संधिंश्च क्रियते यतः। — Concinnavimus ex S. et Pp. lectionem probabilem. — b. उद्दिदश्य क्रियते तु पः P.
- 113. a. Pro अस्य L. अपि, male.
- 115. b. तिथति pro गढति P. — c. स संघतप्रमाणास्तु Pp. स संहतप्रमाणास्तु P. — स संहितप्रमाणास्तु L. — d. संयोगः स निगदते P.
- 116. a. मुखैः L. male.
- 117. a. et b. Pro hoc versu exhibit S. variationem versus 118. a. et b. यत्र भूम्येकदेशेन पणेन परिपूर्जितः; quod, ut nemo non videt, huc non facit. — c. यस्मिन् निगम्य प्रब्रूयात् P. quod vix sensum praebet. — यत्र प्रकं वर्णं कुर्यात् S. quae scripture prorsus est absurdā. — d. साहृषु Pp. quod nil est, nisi vitium a librario commissum. — उक्तृष्टपुरुषः . . . P. inscite. Subiungitur deinde in codd. hic versus: अपृष्टनरृष्टश्च सोकृष्टपुरुषः स्मृतः। qui versus e glossa quadam marginali conflatus videtur.
- 118. b. परेण न दिपुर्जितः S. पणेन दिपुर्जितः L. — c. . . . संधिरिति S. mendose. — d. स चादिष्ट उदाहृतः S.
- 119. b. आत्मादिष्ट उदाहृतः L. आनिषः स इति स्मृतः। S. — d. सर्वदा च स च ग्रहः Pp. vitiose.
- P. 152. — 120. a. कोषाग्रेनायकुयेन codd. et S. Cum L. facere videntur interpp. — c. शिष्टस्य प्रतिरक्षार्थं L. — d. परिक्रमः S. et Pp.
- 121. a. . . च प्राङ्गवतीनां तु P. perperam. Pro तु Pp. च. — b. In उच्छ्वला consentiunt h. l. edd. et P.; contra Pp. उच्छ्वला. — c. et d. सर्वभूमिसमुत्यानफलेन Pp. quae scripture minus placet, quam nostra, ex P. recepta. — भूम्यु (sic) त्यफलदानेन सर्वेण S. सर्वभूम्यर्थदानेन फलेन L. — In P. scriptum est भूम्याणः; qua de re supra dictum est.
- 122. a. परिहृन्न P. परिहृन्न Pp. — b. प्रतिस्कन्देन Pp. स्कन्दस्कन्देन P. — नीयते P. — c. स्कन्दोप Pp. — d. विचक्षणः L. et codd. quae scripture si proba esset, extare deberet forma विचक्षणः.
- Qui seqq. tres loci uncis a nobis inclusi sunt; solis luce enim est clarior, eos desumtos esse ex alia quadam eiusdem argumenti expositione, in qua quatuor tantum pacis faciundae formae enumerabantur. Adscriperat aliquis margini, unde in textum invecti sunt.
- 123. a. तु edd. — b. मैत्री S. मैत्रं P. — संबन्धज्ञः L. संबन्धाताँ

si recte legi, P. sensu cassum. — c. उपकारः Pp. mendose e versu praeced. P. 152. repetitum. — d. चैव pro त्वेव edd.

— 124. a. एष pro एक Pp. — तु pro च S. et codd. — b. . . एतमतं गुरोः P. . . एतमतं हि नः Pp. — c. उपहारस्य भेदास्तु P. उपकारस्तु भेदास्तु Pp. absurde. — d. सर्वे न्ये मैत्रवर्जिताः P. सर्वे ते मित्रवर्जिताः Pp. mendose.

— 125. a. अभिभक्ता Pp. inepte. बलीयस्यात् codd. inscite. अभियुक्तबलो राजा S. male. — b. अलब्धा न निर्वर्तते Pp. अलब्धाद् निर्वर्तते P. utrumque sensu est destitutum. — d. . . अन्योन्य वर्तते Pp. mendose.

Lin. 13. In P. desunt verba usque ad चक्रवाको ब्रूते; eorum loco legitur in Pp. सर्व(ज्ञो) ब्रूते । एवमस्तु । चक्र etc. — Alio modo dissentit W. cum cod. P. facit J. Satis bene in edd. libb. procedere videtur narratio; eos igitur sumus secuti. — महान्तः परिउताश्च S.

— 14. दूरदर्शी (मंत्रो S.) ब्रूते । आः किमेवमुच्यते । edd. — Melius huc quadrare visa est scriptura codd.: चक्रवाको ब्रूते et quae seqq.

Dist. 126. Praemittuntur huic disticho in codd. atque in utraque interpret. duo alia, quorum prius supra editum est: I, 64., posterius I, 12. Deinde pergunt: भवन्तश्च महापणिताः । (hoc deest in Pp.) तद् - उपदिष्यतां । (cf. l. 13.) मृज्ञो ब्रूते । किमेवं (किं मयि Pp.) उच्यते । tum denique sequitur dist. 126.

126. a. . . . परितापैः L. — b. . . . विनाशिनं L. absurde. — c. प्ररोगेषु Pp. mendose. प्ररोगं यः L. inepte. — d. धर्मेष्येतं edd. et Pp. stulte.

— 127. a. Cernitur h. l. in editione L. magnus nasalium horror; editum enim est: जलातश्चर्दचपलं :

— 128. a. मृगतृष्णोपमं L. — c. सज्जनैः S.

Lin. 21. Pro एतद् edd. तद्, Pp. एव तदेव.

P. 155.

Dist. 129. a. . . . सहस्राणि L. male. — b. . . . बृतं L. mendose.

— d. मयं S. pro सत्यं. Legitur dist. Rām. T. III, p. 31. ed. Seramp.

Lin. 3. पुरःसर्योः, omisso द्वयोः, edd. minus bene. — अभिधानसंधिः edd.

— 4. Pro गृधः codd. et edd. सर्वज्ञः. — राजहंसेन राजा ex S. — Pp. brevius: ततो रत्नादिना दूरदर्शी पूजितः । — वस्त्रोपहारादिना L. रत्न om. S.

— 5. प्रकृष्टमनाः S. हृष्टमनाः Pp. — राजो मूर्यस्य संनिधानं गतः S. et codd.

— 6. तत्र तेन राजा गृध्रवचनात् सर्वज्ञे मंत्रिणि बहुमान etc. codd. तत्र चित्रवर्णेन राजा सर्वज्ञो गृध्रवचनाद्बुद्ध्यानदानपुरःसं रं संमाजितः तथाविधं etc. edd.

— 7. तथाविधं om. codd. — Post स्वीकृत्य inseritur in P. शिष्टद्वितीयः, in Pp. द्वितीयः; haud satis assequor, quid in scriptura hac corrupta lateat. — राजहंससमीपं प्रस्थापितः edd. — कटकः Pp. mendose.

P. 153. — 8. Primum incisum (स-तिन्तु) om. edd. Sunt autem haec verba narratoris, fabulae personas dimittentis; eodem modo intelligendum est अनुभवतु l. 9. — Pro सिंहं Pp. संधि॑ं, P. सिंहि॑, utrumque sensu caret. — Pro नः codd. वः.

— 9. स्वत्यानमेव किंथाचलं edd. Post किंथाचलं inserit S. व्यावृत्य. — प्रति om. codd. qui in fine commatis इति inserunt. Sequens comma ab अथ incipiens e codd. receptum, reiecto in fine इति. यथासुखं deest in Pp. In edd. legitur: अथ सर्वे स्वत्यानं प्रायं मनोऽमिलाधिं कलं यथासुखं (deest hoc vocabulum in S.) अनुभवन्तीति । (S. प्राप्तुवन्मिति sic).

— 10. init. अथ codd. — संधिस्तावत् कवितः om. edd. — Sequens incisum अपरं etc. deest in codd. Pro तदुच्यतां S. कथयतां.

— 11. Pro राजपुत्राः codd.: ते. — आर्य om. S. — Pro त्वत् S. त्व, L. श्रीमत्. — सकल om. S. — सकलराज्य et अङ्गं omissis, codd.: व्यवहारो ज्ञातः । — Verba: ततः - वयं om. codd.

— 12. Edd. यज्येवं तथापि etc.

Dist. 150. c. Pro संस्थिता L. राजातां - d. भूर्मीर्वतीतवर्द्धिसहिता भोगाय वस्तिष्ठतु तु । L. Versus pessimus et isto editore prorsus dignus: तु abundat; sed fine, credo, opus coronare voluit iste. In S. noster versus legitur, hoc tamen mendo, quod posterius अहर mutatum sit in अहो.

Finem nunc opellae meae imponere possem, nisi librario cod. Pp. placuisse, distichon quoddam textui obtrudere, tali loco minime quidem dignum, sed exscribendum tamen:

अन्यद्यास्तु । प्रालेयाद्रेः सुता प्रणयिनि वसतिश्वन्द्रमौले: स यावद्
यावद्यक्षमीर्मुरारौ जलद इव तडिन्मालसेविस्फुर्ति ।
यावत् स्वर्णाचलोऽतौ द्वद्वृनसमो यस्य सूर्यस्फुलिङ्गस्
तावनारायणेन प्रचरतु चरितः संग्रहोऽयं कथानां ॥

Emendatione eget distichon, sed taedet chartam consumere in versibus tam parvi pretii.

SCHEMATA METRORUM.

A. *Slocus epicus, Anushtubh* proprie dictus, per Hitopadesam regnat; nimirum hoc metro utitur maximam partem prisca Indorum gnomica poesis, ad quam pertinent pleraeque sententiae fabulis intermixtae. Dixere de huius metri ratione post *Schlegelium* et *Boppium*, *Chézyus* et *Ewaldius* singulis libellis; a quibus viris quae prolata iam sunt, nil attinet nunc repetere.

B. *Monoschematica* metra ea dicam, quorum singulis versibus iidem pedes eodem ordine sine ulla variatione revertuntur; immo binae cuiusque versus partes plerumque inter se congruunt, ita ut totum distichon quatuor partibus invicem paribus contineatur. *Tetrasticha* tamen eiusmodi disticha cum Colebrookio appellare ideo minus aptum videtur, quod non eodem discrimine quo primum hemistichium a secundo, distinguuntur prior sloci pars a posteriori. Contactus enim litterarum (*Sandhi* vocant grammatici) caesuram, qua primum a secundo, tertium a quarto dividitur hemistichium, egreditur, nunquam autem inter secundum et tertium hemistichium intercedit. Accuratio igitur est ipsorum Indorum ratio, secundum quam totum distichon sive slocus primum in duas dividitur partes, *arddhaslocos* dictas i. e. slocos dimidios; arddhaslocus deinde in duo iterum hemistichia sive *pāda* dispescitur. Sunt praeterea etiam inter monoschematica metra, quorum arddhasloci quidem inter se congruunt, hemistichia autem arddhasloci differunt, ita tamen ut plerumque primum hemistichium tertio respondeat, secundum quartum. Arddhaslocum per versum solemus reddere, quamvis confitendum est, arddhaslocum in quibusdam metris iustum versus mensuram nimium quantum excedere. Sed haec hactenus. Nomina nunc et schemata proponam metrorum, quae ex hoc genere per Hitopadesam reperiuntur.

I. Ubi omnia paria sunt hemistichia, sufficit unius tantum exhibere mensuram, quam quater repetendo distichon efficitur.

1. *Trishtubh* i. e. metrum, cuius singula hemistichia syllabas continent XI. Ex hoc ordine duo genera in Hitopadesa inveniuntur:

a. *Indravajra*. Schema: $\text{—}v\text{— }vv\text{— }v\text{—}\text{—}$ |

Vid. prooem. d. 18. d. 24. d. 47. Lib. I, d. 162. d. 163. d. 166. d. 183. d. 198. d. 201. Lib. II, d. 59. d. 65. d. 66. d. 108. d. 120. d. 149. d. 168. d. 173. Lib. III, d. 61. d. 121. Lib. IV, d. 50. d. 51. d. 54. d. 56. d. 79. d. 80. d. 86. Not. ad I, d. 24. ad p. 27, l. 15. ad II, d. 112.

b. *Rathoddhata*. Schema: $v\text{— }vvv\text{— }v\text{—}v\text{—}$ |

V. Lib. III, 147.

2. *Jagatī*, cuius hemistichia dodecasyllaba sunt.

a. *Vansastha*: $\text{—}v\text{— }vv\text{— }v\text{—}v\text{—}$ |

Vid. Lib. I, d. 15. d. 19. d. 144. d. 151. Lib. II, d. 17. d. 46. d. 84. d. 150. Lib. III, d. 51. d. 115. d. 122. Lib. IV, d. 83. Not. ad p. 27, l. 15. ad III, d. 116.

b. *Drutavilambita*: $vvv\text{— }vv\text{— }vv\text{— }v\text{—}$ |

Vid. Lib. I, d. 28. d. 45. Lib. II, d. 71.

3. *Saccarī*. Hemistichio syllabae XIV. Una tantum species in Hitopadesa invenitur, *Vasantatilaca*.

Schema: $\text{—}v\text{— }vvv\text{— }vv\text{— }v\text{—}—$ |

Vid. Prooem. d. 50. Lib. I, d. 34. d. 76. d. 121. Lib. II, d. 40. d. 41. d. 55. d. 63. d. 104. d. 174. Lib. III, d. 116. Not. ad II, d. 41. ad p. 110, l. 18.

4. *Atisaccarī*. Hemistichio syllabae XV. Una species *Mallinī* sive *Nandimukhī*. Schema: $vvv\text{— }vvv\text{— }||\text{— }v\text{—}—v\text{—}—$ | Caesura minor est post syllabam octavam.

Vid. Lib. I, d. 196. Not. ad I, d. 17.

5. *Atyashiti*. Hemistichium quodque XVII. syllabas continet. Tres species: a. *Sikharini*: $v\text{— }—\text{—}\text{—}\text{—}||vvvvv\text{— }vvv\text{—}$ | Hypotmesis est post syllabam sextam.

Vid. Lib. I, d. 129. d. 167. Lib. II, d. 75. d. 135. d. 175. Not. ad prooem. d. 12. ad Lib. I, d. 129.

- b. *Mandacrānta*: $—\text{—}\text{—}\text{—}\text{—}||vvvvv\text{— }||\text{— }v\text{—}—v\text{—}—$ | Caesuræ sunt post syllabam quartam et decimam.

Vid. Lib. II, d. 26. d. 151.

c. *Harinti*: $v\ v\ vv\ v - \| \underline{\quad\quad\quad} v - \| v\ v - v - |$ Caesurae sunt post syllabam sextam et duodecimam.

Vid. Lib. IV, d. 101.

6. *Atidhriti*. Hemistichia syllabarum XIX. Una species *Sārdūlavicridita*: $\underline{\quad\quad} v\ v - v - v\ v - \| \underline{\quad\quad} v - v - v - |$ Hypotmesis est post syllabam duodecimam.

Vid. Lib. I, d. 46. d. 90. d. 96. d. 107. d. 128. d. 146. d. 204. d. 207.

Lib. II, d. 39. d. 121. d. 134. d. 144. d. 154. d. 155. Lib. IV, d. 130.

Not. ad prooem. d. 48. ad p. 98, l. 15.

7. *Pracriti*. Hemistichium syllabarum XXI. Una species *Sragdharā*: $\underline{\quad\quad} v - \| v\ v\ v\ v\ v - \| v - v - v - |$ Caesuris in tres dividitur hemistichium partes syllabarum numero pares.

Vid. Not. ad p. 59, l. 20. ad Lib. IV, d. 150.

II. Monoschematica metra, quorum hemistichia inaequalia sunt.

1. Metrum, cuius nomen ignoro, ex hemistichiis decasyllabis et hemideasyllabis alternatum hunc in modum:

$v\ v - \quad v\ v - \quad v - v - \| v\ v - \quad v\ v - \quad v - v - |$

Vid. Lib. II, d. 54. d. 83. Lib. IV, d. 97. Not. ad p. 59, l. 2. ad p. 65, l. 8.

2. *Pushpitdgra* metrum, cuius primum et tertium hemistichium XII, secundum et quartum XIII. syllabus continet:

$v\ v\ v\ v\ v\ v - v - v - - \| v\ v\ v\ v - v\ v - v - v - - |$

Vid. Lib. II, d. 42. Lib. III, d. 159.

C. *Aryā*. Hoc metrum ad ea pertinet, quorum pedes non numero, sed pondere syllabarum mensurantur. Singuli pedes quaternis moris efficiuntur; syllaba brevis unam moram continet, longa duas. E varia morarum dispositione magna oritur pedum varietas, quum aut duae longae syllabae pedem constituere possint, aut quatuor breves, aut una longa cum duabus brevibus varie coniuncta, ita ut pedis mensura esse possit: —, v. v v —, v. — v v, v. v v v v, v. v — v. Verum omnes hae pedis formae non unicuique versus sedi permittuntur. Totum distichon in quatuor commode dividi potest hemistichia. Primum et tertium ternis pedibus continetur, secundum et quartum quinis catalecticis. Pes secundi hemistichii tertius, qui est sextus prioris arddhasloci, amphibrachys esse solet, potest etiam esse proceleusmaticus. Amphibrachys contra excluditur a sede primi et tertii pedis in hemistichio primo et tertio,

nec non a sede secundi et quarti in hemm. secundo et quarto. Pes tertius ultimi hemistichii unica brevi syllaba effici dicitur; mirum sane dictu, sed consentit usus. Pedes catalecticci una constant syllaba, quae quum brevis sit, producitur iuxta legem Sanscritae linguae metricam. Haec sunt, quae Colebrookio auctore ab Indis de hisce versibus docentur; quibus addere possem nonnulla, si pateretur disputationis huius brevitas. Video plura praecoccupata iam esse a *Benario*, qui docte et ingeniouse rem tractavit in praefat. ad edit. *Nalodayæ*. Proponere sufficiet eas cuiusque pedis formas, quae in Hitopadesa cernuntur.

Hem. 1. et 3.	Hem. 2.				Hem. 4.				Hem. 4.			
1.	2.	3.	1.	2.	3.	4.	5.	1.	2.	3.	4.	5.
— —	— —	— —	— —	— —	v — v	— —	—	— —	— —	v	— —	—
— vv	— vv	— vv	— vv	vv —	vvvv	— vv	—	— vv	— vv	— vv	— vv	—
vv —	vv —	vv —	vvvv	vv —	vv —	vv —	vv —	vv —	vv —	vv —	vv —	vv —
vvvv	vvvv	v — v	v — v	v — v	v — v	v — v	v — v	v — v	v — v	v — v	v — v	v — v
v — v												

Proceleusmaticus omnino abhorrere videtur a pedd. 3. hem. 1. et 3., nec non a pedd. 4. hem. 2. et 4.

Vid. Prooem. d. 14. Lib. I, d. 75. d. 86. d. 130. d. 132. d. 140. d. 154. d. 168. d. 182. Lib. II, d. 3. d. 4. d. 8. d. 15. d. 25. d. 62. d. 64. d. 75. d. 147. d. 152. d. 153. Lib. III, d. 112. Lib. IV, d. 99. Not. ad I, d. 28. ad II, d. 142. De distt. II, 3. et 8. cf. addend.

INDEX.

- आग्निसाक्षिक I, d. 191.
 आग्रे p. 40, l. 10. p. 68, l. 4.
 आङ्ग, आङ्गिन् II, d. 141.
 आङ्गोकरोति p. 122, l. 12.
 आङ्गलिं बहू prooem. d. 14.
 आतिरिच् I, d. 15.
 Attractio I, d. 132.
 आय कः II, d. 124. आय कि
 p. 60, l. 11.
 आय वा p. 25, l. 1.
 Adverbia pro casibus I,
 d. 5.
 आपीच् IV, d. 101.
 आनुवध् I, d. 88.
 आनुसान I, d. 61.
 आनुष्ठा, आनुष्ठान p. 4, l. 12.
 आनुसरण, आनुसार p. 9, l. 8.
 आनुहुक् p. 59, l. 2.
 आन्तर् p. 43, l. 15.
 आन्यत्र II, d. 86.
 आपि p. 15, l. 11. I, d. 107.
 p. 43, l. 5. II, d. 37.
 p. 81, l. 4. III, d. 49.
 Appositio I, d. 195.
 आभिसंथा p. 129, l. 16.
 आर्य, आर्ये I, d. 36.
 आवलोक p. 9, l. 7.
 आराध्याह I, d. 131.
 आस्थयनं, आस्थेवं p. 15, l. 12.
 p. 53, l. 12. p. 67, l. 1.
 p. 85, l. 19.
 आ (आश) I, d. 180. II,
 d. 85.
 आकलयति p. 38, l. 10.
 आकृष् p. 39, l. 20.
- आचर्व, आचर्वा p. 17, l. 4.
 आत्मन् omittitur p. 71,
 l. 22.
 आत्मसाक्षरोति IV, d. 37.
 आधाराधेयमाव III, d. 12.
 आधात II, d. 135.
 आपामग I, d. 61.
 आप्ये p. 25, l. 2.
 आमोद् II, d. 67.
 आलोक p. 9, l. 7.
 आश्र्वा p. 17, l. 4.
 आश्रित p. 15, l. 13.
 आस् p. 47, l. 13.
 आहुस् prooem. d. 4.
 इति p. 12, l. 15. p. 17,
 l. 20. p. 80, l. 3.
 इतिकर्तव्यता p. 42, l. 9.
 Exemplis addendum
 esse Manu VII, 61,
 monet me Schlegelius.
 Infinitivus passive po-
 situs p. 41, l. 1.
 Interrogatio geminata
 p. 57, l. 19.
 इव IV, d. 95.
 इष्टका I, d. 186.
 इह I, d. 46.
 इहसमये p. 104, l. 15.
 इहि II, d. 22.
 ईय affix. prooem. d. 34.
 ईर्षा, ईर्षित I, d. 107.
 उ, उत् particul. prooem.
 d. 10.
 उत् II, d. 28.
 उत्तराप्य p. 58, l. 1.
- उत्तरोत्तर p. 21, l. 3.
 उत्सारयति II, d. 154.
 उपदोक्, उपठोक् p. 67, l. 20.
 उपद्रुत IV, d. 87.
 उपयुत्, उपयुत्, उपयो-
 ग्न p. 94, l. 8.
 उपरि p. 43, l. 15.
 उपादान, उपादेय p. 4, l. 12.
 उपालम्भ I, d. 27.
 एक p. 10, l. 8. p. 111,
 l. 9.
 एकान्त I, d. 46. III, d. 115.
 एतावत् p. 11, l. 5.
 एव I, d. 8. d. 121.
 एवमेवं p. 106, l. 9.
 एहि II, d. 22.
 क affix. p. 50, l. 1. IV,
 d. 32.
 कर्द्यति II, d. 66.
 कदाचिदपि p. 58, l. 12.
 काकतालीय prooem. d. 34.
 काकोलूकीय prooem. d. 34.
 काल I, d. 46.
 किं II, d. 65. किमन्यत् p. 22,
 l. 3.
 किमपि p. 4, l. 6. किं च
 p. 4, l. 6. p. 15, l. 8.
 p. 24, l. 4. किं कार्य I, d.
 13. किसु, किसुत prooem.
 d. 10. किं तु p. 11, l. 6.
 किमिति p. 27, l. 16. किं
 पुनर् I, d. 6.
 कु, किं, कद् praefix. dero-
 gat. II, d. 87.
 कुदृष्टी, कुदृष्टणी p. 29, l. 16.

INDEX.

- कुल p. 7, l. 20. कुलस्ती I, d. 196.
 कृतिम II, d. 134.
 कलि p. 50, l. 1.
 कमेण p. 9, l. 8.
 खेदित p. 85, l. 16.
 गञ्जन I, d. 122.
 गणन prooem. d. 14.
 गतायुस् I, d. 69.
 गन्धमग II, d. 67.
 गमिन्, गम्य II, d. 147.
 गर्भ p. 115, l. 9.
 गुण, गुणक, गुणन, गुण्य prooem. d. 14.
 गुप्तदण्ड p. 29, l. 18.
Gerundium cum adiectivo compositum IV,
 d. 97.
 गोचर p. 60, l. 11.
 गौरव II, d. 85.
 ग्राममौख्य p. 66, l. 6.
 च I, d. 178.
 चतुर्भूमि I, d. 154.
 चिकार, चीकार II, d. 30.
 चित्रगत II, d. 103.
 चिर I, d. 43.
 चेत् - न prooem. d. 28.
 cf. न et नो.
 जनपद II, d. 76.
 तत्सत्त्वः p. 81, l. 1.
 तत्त्वणा I, d. 180.
 तत्पर I, d. 180.
 तत्परता IV, d. 96.
 तथापि p. 59, l. 8.
 तदेव I, d. 121.
 तनूत्पाद् II, d. 66.
 तन्म p. 55, l. 8.
 तस् pro ablat. p. 69, l. 19.
 तादर्थे prooem. d. 6. I,
 d. 5. II, d. 137.
 तावत् p. 11, l. 5. p. 15,
 l. 18. p. 56, l. 22.
 तीव्रपूर्ण III, d. 136.
- त्वा gerund. p. 99, l. 1.
 दीर्घ I, d. 43.
 दुर्धर्ष prooem. d. 5.
 द्वर I, d. 43.
 दृष्टि I, d. 61.
 देव II, d. 149.
 Desideratt. adiectt. in सु
 cum casibb. II, d. 106.
 desiderr. nomm. in सा
 an pro infinitivis ponit
 possunt? p. 72, l. 14.
 द्रव I, d. 93.
 द्वारेण III, d. 36.
 ध्यात II, d. 135.
 न p. 10, l. 3. p. 15, l. 13.
 p. 47, l. 18. p. 54, l. 8.
 IV, d. 104.
 न चेत् p. 18, l. 18. न च =
 न हु prooem. d. 15.
 न करावन III, d. 40.
 नहु I, d. 76.
 नाना p. 65, l. 10.
 नामन् p. 9, l. 6.
 निन् p. 30, l. 2.
 निखुबन p. 50, l. 1.
 निपा p. 65, l. 8.
 नियत p. 32, l. 9.
 निरङ्ग II, d. 141.
 निवृत् p. 71, l. 22.
 नो p. 18, l. 18. नो चेत्
 प. 18, l. 18.
 पञ्चपात p. 37, l. 20.
 परपूर्व I, d. 129.
 परंपरा p. 32, l. 12.
 परस्पर p. 32, l. 12.
 परावर p. 32, l. 12.
 परिचित p. 92, l. 7.
 परिवेद् p. 32, l. 22.
 Partic. praes. act. pro
 verb. finn. p. 59, l. 15.
 पलाय p. 113, l. 14.
 पलित I, d. 104.
 पल्लवग्राह I, d. 131.
- पश् p. 10, l. 8. पश्य I, d.
 116.
 पश्चात्यकोप p. 127, l. 20.
 पञ्च p. 19, l. 2. I, d. 204.
 पुंकुल I, d. 41.
 पुनर् I, d. 6. पुनर्सत् p. 129,
 l. 16.
 पुर p. 66, l. 5.
 पुरस्कृत I, d. 90.
 पुष्कलक II, d. 67.
 पूर्ण I, d. 107.
 प्रकाश p. 10, l. 17.
 प्रतिभान III, d. 19.
 प्रत्यक्ष I, d. 61.
 प्रत्यक्षिका p. 14, l. 20.
 प्रबन्ध p. 21, l. 13.
 प्रभू I, d. 82. d. 90.
 प्रमादावन p. 72, l. 13.
 प्रमाण p. 8, l. 13.
 प्रमाणयति I, d. 9.
 प्रसव, प्रसवन I, d. 107.
 प्रसारयति I, d. 46.
 प्रोत्सारयति II, d. 154.
 Pronom. relativ. prae-
 miss. p. 15, l. 13.
 omiss. I, d. 62.
 Pronom. personale omis-
 sum p. 127, l. 15.
 Praepositt. postposit. et
 separatt. I, d. 180.
 Plural. maiestatis p. 15,
 l. 10.
 Plural. reverent. p. 88,
 l. 18.
 Plur. neutrius cum sin-
 gular. variii generis
 prooem. d. 26. I, d.
 186.
 फल p. 21, l. 13.
 ब्र, बंधम p. 82, l. 13.
 बहिङ्कृ II, d. 46.
 बाहुल्यात् p. 21, l. 13.
 भवत् p. 68, l. 17.

- भवितव्य supplendum III,
d. 37.
भास्त्र I, d. 203.
भी I, d. 50.
भीत I, d. 27.
भूमि p. 19, l. 2.
मण्डप, मण्डपिक, मण्डपक p.
115, l. 1.
मण्डलपूजा p. 59, l. 22.
मन्ये prooem. d. 4.
महद् p. 40, l. 17.
मुष् p. 39, l. 20.
य gerund. p. 99, l. 1.
यन्त्रद् prooem. d. 22.
यथा IV, d. 93.
यथागत p. 64, l. 4.
यथार्थ III, d. 15.
यद् coniunct. p. 24, l. 11.
p. 55, l. 8. p. 99, l. 12.
p. 110, l. 3. p. 120, l. 12.
यदा यदा p. 58, l. 9.
यदि I, d. 42. यदि - अपि p.
58, l. 12.
यद्यद् prooem. d. 22.
यात् p. 11, l. 5. p. 35, l. 19.
यावत् p. 20, l. 19. p. 35,
l. 8. p. 43, l. 13. p. 92,
l. 5.
यूथ p. 49, l. 12.
राव p. 64, l. 20.
- रेवा p. 111, l. 15.
लक्षण I, d. 17.
लब् IV, d. 76.
लिङ्गित p. 42, l. 9.
व prooem. d. 10.
वञ्चन I, d. 122.
वञ्चितव्य I, d. 72.
वत् affix. I, d. 1. II, d.
65.
वरं - न I, d. 120. d. 127.
वास्तव्य p. 35, l. 17.
विरक्मन् p. 99, l. 13.
विकाश्, विकस् II, d. 67.
विग्रह p. 72, l. 10.
विद्धुत् III, d. 109.
विधनता I, d. 128.
विनोद् prooem. d. 48.
वियोगान्तिल p. 64, l. 8.
विरल I, d. 28.
विरुद् II, d. 71.
विषय p. 93, l. 22.
Verba denominativa. I,
d. 9.
Verba eundi constructa
I, d. 192.
Verba dicendi omissa
p. 18, l. 12.
वै partic. condit. II, d. 21.
व्यक्तिगणित prooem. d. 14.
व्याज् III, d. 36.
- प्रकटार् II, d. 87.
प्रंकु IV, d. 69.
प्रब्ल I, d. 61.
प्रल्य IV, d. 69.
प्रान्तवयति p. 93, l. 8.
श्वेनकपोतीय prooem. d. 34.
अवणायतात्त्वी p. 39, l. 20.
स् euphonic. p. 17, l. 4.
संख्यार् prooem. d. 7.
संलापित I, d. 72.
संश्लिष्, संश्लेष p. 14, l. 22.
संयुक्ति I, d. 90.
सन् p. 35, l. 18.
सम III, d. 130.
समस्या p. 104, l. 15.
समासार्थी p. 104, l. 15.
संपद् I, d. 176.
संपूर्व I, d. 67.
साध् p. 55, l. 22.
सुमित्र I, d. 67.
सुरभि II, d. 63.
सू IV, d. 76.
सूचिभेद p. 98, l. 22.
स्या p. 23, l. 7.
स्यान् I, d. 46.
स्यायन् I, d. 45.
हि I, d. 80. II, d. 67.
Hiatus: prooem. d. 20.
d. 44. I, d. 116. d. 121.
d. 141.

CORRIGENDA ET ADDENDA.

- P. 15, lin. 9. Not. ad p. 7, l. 12. lege गानिनां pro गानिनां
- “ 17, “ 21. — ad p. 9, l. 8. Exemplis adde दिव्यवक्त्रमेण p. 59, l. 5.
- “ 22, “ 22. — ad dist. 9. Adde III, p. 103, l. 10. तिमिति, obscurat.
- “ 23, “ 17. — ad d. 12. लोदृ pro लोष ex edit. Londin. in nostram irrepsit.
- “ 25, “ 12. — ad dist. 17. Lege: राङ्गणा
- “ 52, “ 11. Not. ad p. 27, l. 7. lege सर्वः pro सर्वः
- “ 65, “ 1. In margine lege P. 34. pro P. 35.
- “ 73, “ 3. Not. ad. p. 39, l. 20. Admonet me *Schlegelius*, probabilius legendum esse आकृष्टि pro आकृष्ट, ita ut explicetur: भूचापत्य आकृष्ट्या मुक्ता ये वाणास्ते।
- “ 83, “ 8. Not. ad d. 3. Suspecta est tamen nostra emendatio उपग्रहितुं própter metrum, cuius legibus amphibrachys ab hac sede excluditur. उपग्रहितुं cum metro consentit, sed talis infinitivi huius verbi forma inaudita est.
- “ 86, “ 2. Adde: Sed video, minus commode Aryae metro adaptari posse verba ista.
- “ 98, “ 2. Pro *Bhattóxes* lege *Bhattójes*.
- “ 109, “ 9. infr. Pro *hanc* lege haec
- “ 114, “ 1. Lege रात्रौ
- “ 115, “ 18. Not. ad 65, l. 5. lege पश्य pro पश्य
- “ 134, “ 2. Lege *quos* pro *quod*
- “ 158, “ 7. Lege कदाचित्
- “ 171, “ 21. Not. ad p. 107, l. 17. Lege प्रहर् pro प्रहरा
- “ 172, “ 13. Lege commonstrarem pro commonstrem.
- “ 176, “ 8. infr. Lege वृक्षायात्.
- “ 177, “ 5. infr. Lege व्याघ्रः pro व्याघ्रः
- “ 196, “ 4. Not. ad p. 133, l. 8. Adde: Corrige in textu इदानीं pro इदातीं.
-

1/2 ABN

